


प्रतिनृगुणी॥ शक्तिरूपा॥ आकृ

यामरेगलवृद्धयाविर्भव
 तोनामामरंमरामः शीरुरु
 नादिन्द्रियेषु इति श्रुतिलिप्त
 नम्यन्द्राविनिविस्त्रेत्कथायाम
 नीकं यामारं पादनन्दिष्ट
 नामामारयं कं एत्यनामेव
 कथायामेवं लाप्तायकाम
 वायगत्र वद्यु उत्तरनिषेष
 नेकामं यं मं मं वाय
 मां मि लं लं यं यं
 यामिर् विलं यं मं यामेव
 विकलं यं यं वेणायेव
 कुः भवनिकारं शामनविल
 लविकरं यं यं लयमन्ये
 यहां जात्यामः लं वायीवनामेव
 विकलायाविनिकामेविकु
 भवनामरथामायविनिकुथाम
 गाग विनिकुमाय विनिकुथाम
 वेनविक्यामेविकिहितामः मामुजनाम
 विकलामामेविकिहितामः मामुजनाम





परम पावन उत्तराध्ययन सूत्रनां
केटलांक साधनासूत्रों पर
स्वाध्याय

प्रभुना। हृषीता। क्षीक

आचार्य यशोविजयसूरि

श्री लोकप लैन संघ

આચાર્ય શ્રી ઊંકારસૂરીશ્વરજી શાનમંદિર ગ્રંથમાલા (સુરત)નું પ્રકાશન

પ્રભુના હક્કેતાંકીએ

પ્રથમ આવૃત્તિ

: વિમોચન :

વિ.સं. ૨૦૬૩, વૈશાખ સુદ ૩.

આચાર્યશ્રી ઊંકારસૂરિ આરાધના ભવન, વાવપંથક ધર્મશાળા, પાલીતાણા

મૂલ્ય : ૭૦/૦૦

પ્રાપ્તિસ્થાન :

- આચાર્ય શ્રી ઊંકારસૂરિ આરાધના ભવન,
ગોપીપુરા, સુભાષચોક,
સુરત - ૩૮૫૦૦૧.
- આચાર્ય શ્રી ઊંકારસૂરિ આરાધના ભવન,
વાવ પંથકની વાડી, દશા પોરવાડ સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭.
- સરસ્વતી પુસ્તક ભંડાર,
હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.
- નવભારત સાહિત્ય મંદિર
ફટાસા પોળની સામે,
ગાંધી રોડ, અમદાવાદ-૧.
- નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ-૪૦૦ ૦૦૨.

મુદ્રક : કિરીટ ગ્રાહીકાસ,

૨૦૮, આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧. ફોન : ૨૫૭૫૨૬૦૨.

: ગ્રન્થ રચનાની તારક છાયા :

શ્રી વાવનગર મંડન દેવાધિદેવ શ્રી અજિતનાથ ભગવાન
શ્રી બેણાપતીર્થમંડન દેવાધિદેવ પરમતારક શ્રી શાન્તિનાથ ભગવાન

: દિવ્ય આશિષ :

પૂજ્યપાદ, વચનસિદ્ધ યુગપુરુષ આચાર્ય ભગવંત

શ્રીમદ્ વિજય સિદ્ધસૂરીશ્વરજી મહારાજા

પૂજ્યપાદ, નિઃસ્પૃહ શિરોમણિ

મુનિપ્રવર શ્રી વિનયવિજયજી મહારાજા

પૂજ્યપાદ, ભક્તિયોગાચાર્ય, સંયમેકદદ્ધિ આચાર્ય ભગવંત

શ્રીમદ્ વિજય ભદ્રસૂરીશ્વરજી મહારાજા

પૂજ્યપાદ, વિદ્વદ્ધર્ય મુનિપ્રવર શ્રી જનકવિજયજી મહારાજા

પૂજ્યપાદ, સંયમેકનિષ મુનિપ્રવર શ્રી હ્રીકારવિજયજી મહારાજા

પૂજ્યપાદ, તપસ્વિરલ મુનિપ્રવર શ્રી વિલાસવિજયજી મહારાજા

પૂજ્યપાદ, શાસનધૂરીણ આચાર્ય ભગવંત

શ્રીમદ્ વિજય ઊંકારસૂરીશ્વરજી મહારાજા

પૂજ્યપાદ, વર્ધમાનતપોનિધિ આચાર્ય ભગવંત

શ્રીમદ્ વિજય ભદ્રકલસૂરીશ્વરજી મહારાજા

: આશિષ :

પૂજ્યપાદ, પ્રશાન્તમૂર્તિ આચાર્ય ભગવાન

શ્રીમદ્ વિજય અરવિનદસૂરીશ્વરજી મહારાજા

પૂજ્યપાદ, આગમપ્રજ્ઞ શુતસ્થવિર

પ્રવર્તક મુનિપ્રવર શ્રી જંબૂવિજયજી મહારાજા

પૂજ્યપાદ, આરાધનારત મુનિરાજશ્રી જિનયંદ્રવિજયજી મહારાજ સાહેબ

પૂ. સાધીજી કલ્યાણાશ્રીજી મહારાજ (માતુશ્રી મહારાજ)

ફિ..ષ..યા..ગુ..ક..મ..

અનુ. વિગત	પેજ નં.
(૧) સાક્ષીભાવ : ત્રણ ચરણો	૨
(૨) સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી	૧૬
(૩) ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા	૩૦
(૪) નિર્મળ હદ્ય	૪૬
(૫) અપ્રમાદ - યાત્રા	૫૮
(૬) નિરભ નભ સું ચિત્ત	૭૮
(૭) પ્રીત કિયે દુઃખ હોય...	૮૮
(૮) વિકલ્યોને પેલે પાર : આત્માનુભૂતિ	૯૮
(૯) પ્રજ્ઞા વડે તત્ત્વનિશ્ચય	૧૦૮
(૧૦) અષ્પ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા	૧૩૩
(૧૧) ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય	૧૫૭
(૧૨) અપ્રતિબદ્ધ દશા	૧૭૧
(૧૩) પ્રભુનાં ઘારાં વચનો	૧૮૦

શ્રી બેનાતટ નગર ઈતિહાસની અટારીએથી

(શ્રી બેણાપ ગામનો પ્રાચીન-અર્વાચીન ઈતિહાસ)

બેણાપ ગામ એ ધર્ષણું જ મહત્વનું ઐતિહાસિક ગામ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંડા જલ્લામાં વાવ તાલુકમાં વાવ થી માત્ર ૨૫ ક્રિ.મી. દૂર પાકા ડામર રોડ ઉપર આવેલું આ બેણાપ ગામ છે. બેણાપ ગામ એ પૂર્વ બેનાતટ નગરી હતી.

દંતકથા મુજબ શ્રી શ્રેષ્ઠિક મહારાજાના પ્રથમ પુત્ર બુદ્ધિના નિધાન શ્રી અભયકુમારનું મોસાળ બેનાતટ નગરમાં હતું.

શ્રી ધનદાત શેઠના પુત્ર ઈલાચી કુમારને નટનું પાત્ર ભજવતાં ભજવતાં મુનિરાજના દર્શન કરતાં આજ બેનાતટ નગરમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તે જ સમયે તેમની સાથે બીજી ત્રણ વ્યક્તિને પણ કેવળજ્ઞાન થયું હતું. એવી કિંવદંતી છે.

અંચલગઢના સ્થાપક આચાર્ય શ્રી આર્થરકિતસૂરીથરજી મહારાજાએ ઘણાં ચાતુર્માસ અહીંયા કર્યા હતાં. તેમજ સંવત ૧૨૭૫માં તેમનો સ્વર્ગવાસ પડા આ પાવન ભૂમિ બેણાપ (બેનાતટ) નગરમાં થયેલો છે. અંચલગઢના પ્રથમ મહત્તરા પૂ. સાધીજી શ્રી સમયશ્રીજી મ.સા. બેણાપ ગામના જ હતાં.

પ. પૂ. આ. ભ. શ્રી ભાવસાગરસૂરીશ્વરજી મહારાજાની આચાર્યપદવી સંવત ૧૨૦૨ માં બેણપ ગામમાં ખુબજ ઉત્સાહપૂર્વક થઈ હતી.

કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યસૂરીશ્વરજી મહારાજા તથા પ.પૂ.આ. શ્રી જ્યસિંહસૂરીશ્વરજી મહારાજા જેઓ બેણપમાં બિરાજમાન હતા ત્યારે તેઓએ શ્રી સંધની શાંતિ માટેના પ્રયત્નો કર્યા હતા. પ. પૂ. આ. શ્રી જ્યસિંહસૂરીશ્વરજી મહારાજ સંવત ૧૨૫૮માં બેણપ (બેનાતટનગર)માં જ કાળધર્મ પામ્યા હતા.

પ. પૂ. આ. શ્રી પુષ્યતિલક સૂરીશ્વરજી મહારાજાએ ડોડીયા જ્ઞાતિના પરમાર વંશીય સોમિલને પ્રતિબોધ આપી આ નગરમાં જ જૈનધર્મ બનાવ્યા હતા.

પ. પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રસિંહસૂરીશ્વરજી મહારાજાએ (પ્રાય: સંવત ૧૨૬૩ થી ૧૩૦૮ વચ્ચે રેલ) અષ્ટોતરી તીર્થમાળાની રચના ચાલુ પ્રતિકમણમાં સ્તવનરૂપે બેનાતટ નગરમાં કરી હતી.

બેણપ મોટું બંદર હતું. મંત્રી શ્રી ધરણના પૂર્વજ જગતદેવ શેઠ બેનાતટ બંદરમાં વસતાં હતા. જગતદેવ શેઠને જકાત માટે રાજા સાથે વાંધો પડતા તે કાળમાં તેમણે ૧૮ લાખ રૂપિયા ખર્ચી બેનાતટ બંદર પાસેનો સાત ગાઉ (૨૧ ક્રિ.મી.) સુધીનો કિનારો પત્થર કચરો વગેરે ભરાવીને પૂરાવ્યો હતો. ઈ.સ. ૧૩૭૮ માં જગતદેવ શેઠના પુત્રો સોમચંદ અને ગુણભદ્રે આબુ-દેલવાડામાં આવેલ લુણિગવસહી દેરાસરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. બેણપ ગામના શેઠ કપર્દીશાહે પાટણમાં બંધાવેલ જિનાલયમાં સુવર્ણમિશ્રિત પંચધાતુના શ્રી ચોવીસમાં તીર્થપતિ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. જે પ્રતિમાના ચક્ષુ લાખ લાખના મૂલ્યવાળા નિલમિણથી બનાવ્યા હતા.

બેનાતટ નગરમાં અતિ ભવ્યાતિભવ્ય એવું બાવન જિનાલય જમીનની અંદર મોજુદ છે જેના અવશેષો આજે પણ મળી આવે છે જેમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી ભગવાન બીરાજમાન છે એવો શિલાલેખ મળેલ છે. આ જિનાલયના અધિષ્ઠાત્રક દેવોએ ઘણીવાર સ્વર્જમાં આવીને બાવન

જિનાલય વિશે વાતો કરેલ છે. આ જિનાલય ટુંક સમયમાં પ્રગટ થશે એવી અમારી સૌની આશા છે.

બેણપ ગામમાં ઉંચાડાવાસ તરીકે ઓળખાતા સ્થાનમાં જિનમંદિર હતું. બે ઓરડામાં ભગવાન બીરાજમાન હતા. પ્રતિમાળ અતિ પ્રાચીન તથા ખૂબ જ પ્રભાવક હતા. બાજુમાં જ ગોરજનું સ્થાનક હતું. દેરાસરજની આજુબાજુ જૈનોની વસ્તી હતી, ભાવિકો ભાવથી પરમાત્માની ભક્તિ કરતા હતા, અને અનેકવિધ ચમત્કારો થતા. કાળકમે જૈનોની વસ્તી હાલ દેરાસર છે તે બાજુ રહેવા આવી અને બેણપ શ્રી સંધે અહીંયા દેરાસરજ બનાવવાનો અલિગ્રહ કર્યો. શુભ દિવસે જમીન ખરીદી તેમાં બે ઓરડા બનાવી પ્રભુજીને પધરાવવાનો વિચાર કર્યો, ત્યારે અધિકારી દેવે સ્વાખમાં આવીને કહ્યું કે શંખેશ્વરજ પાસે પાડલા ગામે શ્રી શાન્તિનાથ ભગવાનનું જિનાલય ખાલી છે અને બેટ આપવાનું છે આ વાત જાણી બેણપ શ્રી સંઘના ભાઈઓ પાડલા સંધ પાસે ગયા અને દેરાસરજ બેટ આપવા વિનંતી કરી. પાડલા સંઘના ભાઈઓને સહર્ષ અનુમતિ આપી અને ત્યાંથી દેરાસરજ ખોલીને બેણપ લાવવામાં આવ્યું, અને આ દેરાસરજના પથ્થરો લાવવાની મજૂરી તે સમયે ૧૦૦૦ (એકહજાર) રૂપિયા થઈ. શ્રી રાજારામ સોમપુરાએ દેવવિમાન જેવું ભવ્ય જિનાલય તૈયાર કર્યું. બેણપ શ્રી સંઘના હૈયામાં હરખ સમાતો ન હતો. પરમ પૂજ્ય પરમ ઉપકારી આ. શ્રી ભદ્રસૂરીશ્વરજ મહારાજા તથા પ.પૂ. પંન્યાસજ શ્રી ચરણવિજ્યજ મહારાજાને બેણપ શ્રી સંધે પ્રતિજ્ઞા કરાવવા પધારવા વિનંતી કરી, અને તેની પૂજ્યશ્રીઓએ અનુમતિ આપી.

સંવત ૧૯૮૮ના મહાવદ સાતમના દિવસે શુભ મુહૂર્ત પ.પૂ.આ. ભ. શ્રી ભદ્રસૂરીશ્વરજ મહારાજા તથા પ.પૂ. પંન્યાસજ શ્રી ચરણવિજ્યજ મહારાજાની નિશ્ચામાં શ્રીમતી સરસ્વતીબેન ગુલાબચંદ જવેરી (સુરત) ના વરદ હસ્તે ધામધૂમથી પ્રતિજ્ઞા થઈ. વડીલોના કહેવા પ્રમાણે પ્રતિજ્ઞાના મહોત્સવમાં સવારે ચા-પાણી નાસ્તામાં સો (૧૦૦) કિ.ગ્રા. ખાંડ વપરાતી એટલો જનસમુદ્દાય આવેલ હતો.

ગ્રાય: સંવત ૨૦૧૨ ની સાલમાં સંઘની વિનંતીથી પ. પૂ. સાધીજી શ્રી ચંદનશ્રીજી મ. સા. તથા પ. પૂ. સાધીજીશ્રી દર્શનશ્રીજી મ. સા. એ બેણપ સંઘમાં ચાતુર્માસ કર્યું હતું. ખુબ જ ઉત્તમ કોટીના સુસંયમી સરળ સ્વભાવી પૂજય સાધીજી મહારાજ હતા. તેમણે બહેનોમાં અપૂર્વ ધર્મજગૃતિ લાવી તથા ભાઈઓને પણ ધર્મનો મહિમા સમજાવ્યો.

જિનાલયમાં મૂળનાયક શ્રી શાન્તિનાથ દાદાની પ્રતિમાજીથી શ્રી નેમિનાથ દાદાની પ્રતિમાજીની દિષ્ટિ ઉંચી હેવાથી સંવત ૨૦૨૭ માં બેણપ શ્રી સંધે પુનઃ પ્રતિષ્ઠા કરાવવાનો નિર્ણય લીધો ત્યારબાદ શ્રીસંધે પ.પૂ. આ. ભ. શ્રી ઊંકાર સૂરીશ્વરજી મહારાજાને પુનઃ પ્રતિષ્ઠા કરાવવા વિનંતી કરી અને તેમણે સંવત ૨૦૨૮ વૈશાખ વદ દશમનું પ્રભુજીની પ્રતિષ્ઠાનું મુહૂર્ત આપ્યું અને બેણપ શ્રીસંધે હર્ષથી નાચી ઉઠ્યો. તે દિવસથી પ્રતિષ્ઠાની ધામધૂમથી તૈયારીઓ થવા લાગી, અને પ. પૂ. આ. શ્રી ઊંકારસૂરીશ્વરજી મહારાજાની પાવન નિશામાં પ્રતિષ્ઠા થઈ. એમની અમીદદિષ્ટ સદાય અમારી ઉપર વરસતી રહે એજ મંગલ ભાવના.

દેવવિમાન સમા જિનાલયમાં તીર્થનાયક તરીકે બીરાજમાન સોળમા તીર્થકર સંકટહર શ્રી શાન્તિનાથ દાદાની ભવ્ય પ્રતિમાજી જોતા આંખો ઠંકક અનુભવે છે. બેઠા પછી ત્યાંથી ઉઠવાનું મન પણ નથી થતું. દિવસમાં ત્રણ રૂપ ધારણ કરતા એ પ્રતિમાજી દર્શનાર્થીઓના દિલમાં ખૂબ આનંદની અનુભૂતિ કરાવે છે. આ પ્રતિમાજી સંપ્રતિમહારાજાના વખતની ભરાવેલ છે. હાલના દેરાસરજીમાં બિરાજમાન સંકટહર શાન્તિનાથ દાદા, યુગાદિદેવ આદેશ્વર દાદા, બાલબ્રહ્મયારી નેમિનાથ દાદા, પુરુષાદાણી પાર્શ્વનાથ દાદા અને વર્તમાન શાસનપતિ ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી દાદા આદિ જિનબિંબો બિરાજમાન છે. આ જિનબિંબો ખુબજ પ્રભાવક તેમજ ચમત્કારિક છે. અગાઉના સમયમાં દેરાસરજીની અંદર રાત્રીના સમયે સુંદર મજાના વાજિંત્રોના અવાજો સંભળાયા છે, તેમજ દેરાસરજીના શિખર ઉપર રાત્રીના સમયે દીવા થતા જોયા છે. અહીં અવારનવાર પ્રતિમાજીઓને અમીઝરણા

પણ થાય છે. છેલ્લા ઘણા સમયથી દેરાસરજીના શિખર ઉપર આખી રાત્રી મોર બેસી રહે છે. ભયંકર વંટોળ હોય કે પુષ્ટ વરસાદ હોય તો પણ મોર શિખર ઉપરથી ડગતો નથી. આ દશ્ય નજરોનજર નિહાળવા જેવું છે.

શ્રી સંકટહર શાન્તિનાથ દાદાનું સ્મરણ કરતા ગમે તેવો સંકટો દૂર થાય છે. અમોને આશા છે કે બેણપ ગામ તીર્થ તરીકે ટુંક સમયમાં જ વિકાસ પામશે. અતે બે ઉપાશ્રય, ભોજનશાળા તથા યાત્રિકોથી પવિત્ર બનેલ એવી ધર્મશાળા તીર્થની ભવ્યતામાં વધારો કરે છે. અહીં શ્રી સંધ સંચાલિત “મૈત્રીધામ ખોડાઢોર પાંજરાપોળ” તેમજ પક્ષીચણ માટે ચબુતરો પણ છે.

આમ, અમારા બેણપ નગરનો ઈતિહાસ તો ભવ્યાતિભવ્ય હતો જ. વર્તમાન પણ ભવ્ય જ છે. કારણ કે દાદાની કૃપાથી બેણપના જૈન પરિવારો જ્યાં જ્યાં સ્થિર થયેલ છે ત્યાં તેઓ રિદ્ધિ સિદ્ધિને પામેલા છે અને અમોને આશા છે કે ભૂતકાળ અને વર્તમાન કાળની જેમ ભવિષ્યકાળ પણ દાદાની કૃપાથી સુવર્ણમય જ હશે.

બેણપ નગરે બિરાજમાન, તારણાહાર.... વિશ્વસેન રાજના પુત્ર, અચિરામાતાના નંદન, શ્રી સંધના ઘારા, કરુણાના મહાસાગર, શ્રી સંધના શિરદ્ધિન્દ્ર, મહામહિમ વિશ્વવંદનીય, તારક દેવાધિદેવ શ્રી શાન્તિનાથ દાદાની અસીમ કૃપાથી.... કરુણાથી નયનોમાંથી વરસતા સતત પ્રેમસાગરથી શ્રી સંધમાં આનંદમંગલ અને લીલા લહેર છે.

“બેનાતટ દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે”

“ધન્ય ધન્ય બેનાતટ નગરી”

શ્રી બેનાતટ નગરની ઐતિહાસિક ઘટનાઓ

શેઠ કપદી અને તેમના ધર્મપત્નિ ગુલાબકુંવર બેનાતટના વતની હતા. તેઓ ધર્મના રાગી હતા. એમની સોમાઈ નામની પુત્રી હતી. તે પુત્રીને ધર્મનું નામ લેતા જ મોંઢુ ચડી જતું. ધર્મના નામે આ બધુ ધતીંગ છે એમ

તે અકળાઈને કહેતી. તે પુત્રીના રહેવાના મહેલમાં ૮૪ દરવાજા હતા. તેનો શોખ હીરા મોતીના કિમતી આભૂષણો પહેરવાનો હતો. તે એક કરોડની કિમતનું ઘરેણું પહેરતી હતી. અને તે મોટા ભાગનો સમય શુંગારમાંજ કાઢતી. કરોડ રૂપિયાના મૂલ્યના હીરાના આભૂષણો ધારણ કરનારી સોમાઈ આચાર્યશ્રીની સંવેગ ભરેલી ધર્મદેશના સાંભળી પ્રભાવિત થઈ અને ત્યાં ને ત્યાં જ તેનું હૃદય પરિવર્તન થયું અને જ્ઞાન-દર્શન-ચારિત્રના શાશ્વત ધન આગળ કિમતી હીરાઓ ઝાંખા લાગ્યા. એ નશ્વર પ્રકાશને તેણે તરત જ દૂર કર્યો અને પોતે સંયમ લેવા નિર્ણય કર્યો. કપર્દી શેઠે ભવ્ય મહોત્સવ કર્યો. સોમાઈએ પોતાની વહાલી-પચ્ચીસ સખીઓ સાથે દીક્ષા બેનાતટમાં લીધી અચલગઢણી તે પ. પૂ. સા. સમયશ્રીજી નામે પ્રથમ મહત્તરા સાધીજી થયાં. તેમણે ૧૩૧૪ સાધીજીઓને દીક્ષા આપી પોતાની શિષ્યા-પ્રશિષ્યા બનાવી, તેમની ૧૦૨ મહત્તરા સાધીઓ અને ૧૧૩૦ સાધીઓ શિષ્યા હતી.

અભયકુમારના પિતા શ્રી શ્રેણિક મહારાજા કુમારાવસ્થામાં રીસાઈને ઘરેથી નિકળી ગયેલા. તે ફરતાં ફરતાં દરિયાઈ માર્ગ જઈ પહોંચ્યા, ત્યાં અચાનક ભયંકર વાવાજોડું આવ્યું ત્યારે તે પોતાનો બચાવ કરવા થડ ઉપર બેસી ગયા અને દરિયાઈ માર્ગ બેનાતટમાં આવી પહોંચ્યાં. શ્રેણિક મહારાજા જે થડ ઉપર બેસીને આવેલા તે થડ ચંદનના વૃક્ષનું હતુ. તે બેનાતટ નગરમાં પહોંચ્યા ત્યારે થડની મધ્યમધતી સુવાસ સમગ્ર નગરમાં ફેલાઈ ગઈ. એ સુવાસથી લોકો ત્યાં ભેગા થઈ ગયા અને બધાને ખબર પડી કે આ સુવાસ ચંદનના થડની છે ત્યારે બેનાતટના વેપારીએ તે થડનું મૂલ્ય પૂછ્યું ત્યારે શ્રેણિક મહારાજાએ તે થડ સોનાના ભારોભાર વેચવાનું કહ્યું અને તે થડ બેનાતટના વેપારીઓએ સહર્ષ સોનાના ભારોભાર ખરીદ્યું.

શ્રીમાલી જ્ઞાતીય રૂપશેઠ સંવત ૧૪૮૫ માં બેનાતટમાં થયા. તેમણે બેણપમાં એક કુવો બંધાવ્યો પણ તેમાંથી પાણી નીકળ્યું નહી. ત્યારે એક

રાત્રીએ પાઈ નામની દેવીએ રૂપાશેઠને સ્વખનમાં કહ્યું કે જો તું તારા પૌત્ર કાનાનું બલિદાન આપે તો આ કુવામાં પાણી આપું. આવી જ રીતે આ જ સ્વખ તે દેવીના સારંગ નામના ભુવાને પણ આવ્યું. ત્યારે તે શેઠ ચિંતાતુર થયા. આમ ચિંતામાંને ચિંતામાં ચાર-પાંચ દિવસ વિત્યા બાદ પોતાના સસરાને ચિંતાતુર જોઈ પુત્રવધુએ તેનું કારણ પૂછતા તેમણે આખી ઘટનાની વાત કહી. ત્યારે પુત્રવધુએ કુવામાં પાણી લાવવા માટે ખુશીથી પોતાનો પુત્ર આયો. પછી શેઠ મહાજનને એકહું કરી પોતાના કાનકુંવરને પારણામાં સુવાડી સંધ્યાકાળે તે ખાલી કુવામાં મુક્યો પછી સર્વ લોકો પોતપોતાના ઘરે ગયા બીજા દિવસની પ્રભાતે તે કુવો પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયો અને પારણું ઉપર તરી આવ્યું, તેમાં કાનકુંવરને લોકોએ રમતો જોયો. ત્યારે લોકોએ રૂપાશેઠની પાસે જઈ વધામણી આપી કે તમારો પૌત્ર જીવતો છે, પછી શેઠ ખુશ થઈને પોતાના કાનકુંવરને ઘેર લાવ્યા. ત્યારથી તેના વંશજો “બાળકુવા” ની અટકથી ઓળખાવા લાગ્યા.

ચંડીસર ગોન્યિ શ્રીમાલી વીરદાસ શેઠ બેનાતટ નગરના લાખણ રાજાના કારભારી હતા, અને લાખણ રાજાની સોનાની કટારી વીરદાસ શેઠ ફેટામાં બાંધતા હતા. એક વખતે નજીકના ભરડવા ગામના સાંખલું નામના ભીલે તેના ઘરમાંથી તે કટારી ચોરીને સુઈગામ પાસેના એક મોટા વૃક્ષના થડ નીચે દાટી. બીજે દિવસે તે ભીલ થરાદમાં ચોરી કરતા, તલવારના ઘાથી માર્યો ગયો પછી વીરદાસ શેઠ તે કટારીની ઘણી શોધ કરી પણ કટારી મળી નહીં. સાંખલું ભીલ મૃત્યુ બાદ વ્યંતર થયો અને તેણે શેઠને સ્વખનમાં તે કટારીની ચોરીની હકીકત ક્રીધી અને જ્યાં કટારી દાટી હતી તે સ્થાન બતાવ્યું. વળી લાખણ રાજાએ પણ આ જ સ્વખ પ્રમાણે દિવાળીના દિવસે પ્રભાતે તેમણે જમીન ખોદી અને ત્યાંથી કટારી નીકળી આમ કટારી ખોવાયા બાદ સાત વર્ષ મળી. ત્યારથી તેના વંશજો ગોત્રજ સાથે તે કટારીને પણ પૂજે છે.

શ્રી બેણપ નગરના પર્વ પર્યુષણાની આરાધનાની ઝલક તથા વિગત

છેલ્લા ઘણા સમયથી પ.પૂ. આચાર્ય ભગવંતોની દરેક સંધોને પ્રેરણા હતી કે ગામડામાંથી ધંધાર્થ શહેરમાં જઈ વસેલા શ્રાવકો પર્યુષણ મહાપર્વ દેશમાં જ એટલેકે જન્મભૂમિમાંજ કરવા આવે. પૂ. ગુરુભગવંતોની આ પ્રેરણાને માન આપી સૌ પ્રથમ શ્રી બેણપ જૈન સંધે પર્યુષણ પર્વની આરાધના ગામમાં જ કરવાનું શરૂ કર્યુ.

બેણપમાં વસતા જૈનો ધંધાર્થ ભાબર, રાધનપુર, પાટણ, અમદાવાદ, સુરત, મુંબઈ વિગેરે સ્થળે જઈ વસ્યા છે. ગામમાં એકાદ-બે ઘર ખુલ્લાં હતા. પરમ પૂજ્ય આચાર્યશ્રી અરવિંદસૂરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવિજ્યસૂરીશ્વરજી મહારાજા એ આજ્ઞા ફરમાવી કે બેણપ સંધના ભાઈઓ બહેનો પર્યુષણ મહાપર્વની આરાધના કરવા બેણપ જાય અને પરમાત્માની ભક્તિ ભાવવિભોર બનીને કરે. આમ તો ગુરુમહારાજની નિશ્રામાં પર્યુષણ પર્વની આરાધના કરવાની હોય પરંતુ અત્યારના સમય સંજોગો ગ્રમાણે પોતાના વતનમાં જઈ વિવિધ પ્રકારે પરમાત્માની ભક્તિ કરો ગુરુ આજ્ઞા તહતી કરીને બેણપ સંધના ભાઈઓ બહેનો છેલ્લા આઠ વર્ષથી પર્યુષણ પર્વની આરાધના કરવા સારી સંખ્યામાં બેણપ આવે છે અને ઘણા ઉમંગથી આરાધના કરે છે. આજુબાજુના ગામોમાથી સહપરિવાર મહાપર્વની આરાધના કરવા ઘણા ભાવિકો પદ્ધારે છે.

પર્વ દરમ્યાન ચોવીસે કલાક નવકાર મહામંત્રનો અખંડ જાપ થાય છે. દેવ ગુરુની કૃપાથી પૌષ્ઠ તથા તપસ્યા ઘણા આનંદ ઉલ્લાસથી થાય છે. નાના-નાના બાળક બાળિકાઓ પર્વ પર્યુષણ દરમ્યાન બધા પ્રભુજીને વિવિધ પ્રકારની આંગીઓ કરે છે તથા દેરાસરજી શાણગારે છે જે, ખુબ જ અનુમોદનીય છે, તથા બીજી પણ અનેક રચનાઓ કરે છે. જતજતની દીવાની રોશની કરે

છે. બાળકો એ કરેલી પ્રભુજીની ભવ્ય અંગરચના (આંગી) નજરે નિહાળવી તે જીવનનો અમુલ્ય લ્હાવો છે. પર્યુષણ મહાપર્વમાં અષ્ટાલીંકા પ્રવચન તથા શ્રાવકો વાંચી શકે તેવું પરમ પૂજ્ય જ્ઞાનવિમલસૂરીશ્વરજી કૃત કલ્પસૂત્ર વંચાય છે. મહાવીર સ્વામી જન્મ વાંચનના દિવસે ચૌદ સુપન ઉતારવામાં આવે છે તથા પ્રભુજીને જુલાવતા હાલરડું ખુબજ ભક્તિ ભાવથી ગાવામાં આવે છે. ચડાવા પણ ઘણા જ આનંદ ઉમંગથી બોલાય છે. હાલરડા સમયે આરતી કર્યા પછી પ્રભુજીને પોંખવામાં આવે છે.

ચાતુર્માસ - અનુમોદના

વિ. સં. ૨૦૬૨નું ચાતુર્માસ બેણાપમાં કરાવવાનો શ્રીસંધના ભાઈ-બહેનોને ભાવ જાગ્યો. પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. અને પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ. સા. આદિનું ચોમાસું વાવ મુકામે નક્કી થતાં સમગ્ર વાવ પથકમાં આનંદની લહેર જાગી. બેણાપમાં પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ. સા. આદિનું ચોમાસું કરાવવા સંઘે જીજીલુવાડા મુકામે શ્રી શાંતિનાથ ભ. ની પ્રતિષ્ઠા પ્રસંગે મહા સુ. ૧૦ ના પૂ. આ. ભગવંતોને આગ્રહભરી વિનંતી કરી. પૂ. આ. ભગવંતોએ આ. મુનિચન્દ્રસૂરિ મ.સા.ના ચાતુર્માસ માટે સ્વીકૃતિ આપતાં આનંદ આનંદ છવાઈ ગયો.

અષાઢ સુદ પ ના ચાતુર્માસ પ્રવેશનું મુહૂર્ત આવતાં પ્રવેશની તડામાર તૈયારીઓ શરૂ થઈ. સોનામાં સુગંધ ભળે તેમ પ્રવેશના દિવસે જ ૮ નૂતન દીક્ષિતોની વડીદીક્ષાનું મુહૂર્ત આવતાં સર્વત્ર પ્રસાન્તતા ફેલાઈ. અભૂતપૂર્વ ઉત્સાહ અને વિશાળ માનવમહેરામણની ઉપસ્થિતિમાં દબદબાત્યો ચાતુર્માસ પ્રવેશ યોજાયો.

પૂ. આ. ભ. અરવિંદસૂરિ મ.સા. પૂ. આ. ભ. શ્રી યશોવિજયસૂરિ મ.સા. પૂ. જિનચન્દ્રવિજય મ.સા. પં. રાજેશ વિજય, પં. ભાગ્યેશ વિજય આદિ વિશાળ સાધુ-સાધ્વીના સમુદ્દરાય સાથે ચાતુર્માસ પ્રવેશ બાદ વડીદીક્ષાની વિધિ અને ગ્રંથ-વિમોચન વગેરે કાર્યો થયા. ચાતુર્માસ માટે પૂ. આ. ભ. મુનિચન્દ્રસૂરિ મ.સા., મુનિ દિવ્યરત્નવિજય મ., મુનિ મૌનરૂપિ વિજય

મ., મુનિ યોગરૂચિ વિજય મ. પૂ.સા. શ્રી સુવર્ણાશ્રીના શિષ્યા પૂ. સા. શ્રી કલ્યલતાશ્રી મ. ના શિષ્યા પૂ. સાધ્વીશ્રી મોક્ષરસાશ્રી, પૂ.સા. શ્રી સુપ્રતાશ્રીના શિષ્યા પૂ.સા. શ્રી તરણાચંદ્રાશ્રીજીના શિષ્યા પૂ. સાધ્વીશ્રી પ્રીતિચન્દ્રાશ્રી આદિ ઠાણા અને પૂ. આ. ભ. શ્રી સાગરાનંદસૂરી મ.સાના સમુદ્દ્રાયના પૂ. સા. શ્રી ચારુશિલાશ્રીજીના શિષ્યા પૂ. સા. શ્રી મલયાશ્રીના શિષ્યા પૂ. સા. શ્રી દિવ્યપૂર્ણાશ્રી પૂ. સા. શ્રી દિવ્યપ્રજ્ઞાશ્રી આદિના ચાતુર્માસ પ્રવેશથી જ તપ-જપ-આરાધના-સાધનાની હેલી વરસાવવા માંડી. ૮-૩૦ કલાકે યોગશાસ્ત્ર અને ૨-૩૦ કલાકે રામાયણ અને મહાભારતના વિષય પર પૂ. આ. ભ. અને મુનિ દિવ્યરત્ન વિ. મ.ના પ્રવચનોમાં ગ્રામજનો પણ સારી સંખ્યામાં લાભ લેતા. ગામના ઘણા ભાગ્યશાળીઓએ ગુરુભગવંતોના પગલાં કરાવ્યા અને વિવિધ નિયમો લીધા. ખાનાભાઈ વજરે જીવનનું આમૂલ પરિવર્તન કર્યુ. બધા વ્યસનો છોડી દીધા. આજીવન બ્રહ્મચર્ય પાલનનો નિયમ લીધો.

તપસ્યા:-

તપસ્યી મુનિશ્રી મૌનરૂચિ વિ.મ. અને સાધ્વીશ્રી આત્મદર્શનાશ્રીના ઉદ્ઘાટન સા. શ્રી શ્રુતયશાશ્રી અને શ્રીમતિ રૂપાબેન જીવતલાલ અદાણીના ઉદ્ઘાટન વીસવિહરમાન સમૂહ તપ, અષ્ટપ્રવચનમાતા સમૂહ તપ, ઉદ્ઘાટન અઙ્ગાઈ.

આ. સુ. ૧૩ થી આ. વ. ૧૩ દરમિયાન પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરી મ.સાએ સૂરિમંત્રની પાંચમી પીઠિકાની આરાધના કરી. આરાધનાના પ્રારંભે કુંભ સ્થાપન, નવગ્રહ, ૧૦ દિંગાલ સ્થાપન વગેરે ના ચડાવા નવકારમંત્રમાં બોલાતાં બે કરોડ ત્રૈસઠલાખ નવકારના રેકર્ડ રૂપ ચડાવા થયેલા.

કા.સુ. ૮ ના ચતુર્વિધ સંધ સાથે દૂધવા ચૈત્યપરિપાટી આદિ વિવિધ પ્રસંગોથી ચાતુર્માસ યાદગાર બની રહ્યું.

વિ. સં. ૨૦૬૨ ના પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરી મ. સા. આદિના ચાતુર્માસ દરમિયાન થયેલી વિવિધ આરાધનાની અનુમોદનાર્થે આ પુસ્તક પ્રકાશનનો લાભ શ્રી બેણાપ જેન શે. મૂ. પૂ. સંધે જ્ઞાનદ્રવ્યમાંથી લીધો છે.

ପଲୁନା ଉତ୍କର୍ଷାକ୍ଷର



॥ प्रभुना हस्ताक्षर ॥

आधारसूत्र

संजोगा विष्पमुक्तस्स, अणगारस्स भिक्खुणो ।
विणयं पाउकरिस्सामि, आणुपुच्चिं सुणेह मे ॥ १/१ ॥
संयोगथी विप्रमुक्त, अणगार ऐवा भिक्षुने हुं विनय शीघ्रवाडीश.
कमसर तुं भने सांभण.

सन्दर्भसूत्र

रसो वै सः ।
रसं होवायं लब्ध्वानन्दी भवति ।
कोहन्यात् कः प्राप्यात्,
यदेष आकाश आनन्दो न स्यात्,
एष होवानन्दयति ॥


-तैतिरिय उपनिषद्

ते ज २८ छे.
ते २८ने भेणवीने साधक आनन्दी बने छे.
जो आ आकाश (प्रभु) आनन्दरूप न होत तो कोणा प्राण टकावी
शक्त ?
ते ज आनन्द आपे छे.

साधनासूत्र

साक्षीभावनां त्रिष्ण चरण :

- संयोगविप्रमुक्ति (पदार्थो अने व्यक्तिओना संगथी उपर उठवुं)
- अणगारत्व (देखाध्यासमुक्ति)
- भिक्षुत्व (सूक्ष्म हुं भावनी पकडथी धूटकारो)



સાક્ષીભાવ : ત્રણ ચરણો

‘સમર્પિતતાના પ્રવાહમાં જબોળાયેલ સાક્ષીભાવ...’ ભાગવતી સાધનાનું આ વર્ણન પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્રના ગ્રારંભે અપાયું છે.

સમર્પિતતા સાક્ષીભાવને આપે છે ભીનાશની પૃષ્ઠભૂ. આને જ તો કહેવાય મણિ-કાંચન યોગ ! સમર્પિતતાની સોને મણી પૃષ્ઠભૂ પર મણિ સમો સોહતો સાક્ષીભાવ.

■ ● ■

પ્રભુના હસ્તાક્ષર ♦ સાક્ષીભાવ : ત્રણ ચરણો

સાક્ષીભાવનાં ત્રણ ચરણો અહીં અપાયાં છે : સંયોગવિપ્રમુક્તિ,
આણગારત્વ અને લિક્ષુત્વ.

પહેલું ચરણ : સંયોગવિપ્રમુક્તિ. સંયોગોથી મુક્તિ નહિ, પ્રમુક્તિ
નહિ, વિપ્રમુક્તિ. શો અર્થ થશે એનો ?

સાક્ષીભાવના આ પ્રથમ ચરણે સાધક પદાર્થો અને વ્યક્તિઓના
સંગથી એટલો તો અળગો હશે કે સંયોગોની નોંધ પણ એની ભીતર
ક્યાંય લેવાયેલી નહિ હોય.

દર્પણની સામે સ્ફટિક હશે તો દર્પણ એનું પ્રતિબિભબ ઉપસાવશે.
અને સામે કોલસો હશે તો તેને એ પ્રતિબિભિત કરશે.

સાધક આવા દર્પણ કરતાં એક ડગલું આગળ છે : સામે વ્યક્તિઓનો
સમૂહ હશે અને છતાં એને લાગશે નહિ કે સામે કોઈક છે.

અણાવક ઋષિ યાદ આવે : 'અહો જનાકીર્ણેઽપિ અરણ્ય સંવૃતં
મમ...' લોકોના સમૂહની વચ્ચેય જંગલનો અનુભવ! કેવી મજા !

લોકોની વચ્ચે રહેવા છતાં એમની સાથે તાદાત્મ્ય નથી, અને એ જ
કારણે આ મજાનો અનુભવ થાય છે.

■ ● ■

સંત શિવપુરી બાબાને એક સાધકે પૂછેલું : કાંટો વાગે ત્યારે આપને
કેવી પીડા થાય ?

બાબા હસ્યા. એમણે કહ્યું : બુધ્ય કરતાં બુદ્ધને પીડાનો ઘ્યાલ તો
વધુ આવે જ, અને સૂક્ષ્મ રીતે, તીવ્રતાથી આવે... પણ એ પીડા સાથે
બુદ્ધ પુરુષનું તાદાત્મ્ય નથી હોતું.

દૂર, દૂર કંઈક થઈ રહ્યું હોય; જેની સાથે પોતાને કોઈ સંબંધ
નથી. તાદાત્મ્ય છૂટી ગયું.

■ ● ■

તાદાત્મ્યના અભાવને ઘણા સંદર્ભમાં જોઈ શકાય. હજારો શ્રોતાઓની સામે બોલનાર વક્તા, જો તાદાત્મ્યને પેલે પાર હોય તો, પોતાની ભીતર એક નાની સી અહંકારની લહેરખી પણ પેદા ન થવા હે.

જેના શબ્દો વડે હજારો શ્રોતાઓ એક લયમાં જૂભ્યા હોય, એ વ્યક્તિની ભીતર કશું જ ન હોય. એ ભક્ત હોય તો એની પ્રતિક્રિયા આ હોય : મારા ભગવાને મારી સાઉંડ સિસ્ટમ વાપરી. ‘પ્રલુ ! તારો હું ઝણી છું કે તું મારા કંઠેથી પ્રગટચો !’

વક્તા નિશ્ચયદષ્ટિથી યુક્ત હશે તો એ કહેશે કે સામી વ્યક્તિઓનું ઉપાદાન જાગૃત હોય તો આ શબ્દોથી કંઈક ફરક પડી શકે. સાંભળનારનું ઉપાદાન જ મહત્વનું છે, મારું બોલવાનું નહિ.

■ ■ ■

આચાર્ય ધર્મધુરનધરસૂરિ મહારાજને સાતા પૂછ્યા ગયેલો. ગળાનું કેન્સર તેમને થયેલ, પીડા ઘણી. પણ ચહેરા પર એ જ ચિર-પરિચિત મુસ્કાન. મેં પૂછ્યું : સાહેબ, સાતામાં ? હસતાં હસતાં તેમણે કહ્યું : હું તો સાતામાં જ છું.

સ્પષ્ટતયા લાગેલું કે શરીરની પીડા સાથેનું તાદાત્મ્ય ત્યાં ન હતું.

■ ■ ■

શૂન્ય પાલનપુરી યાદ આવે :

શૂન્યમાંથી આવ્યા’તા,

શૂન્યમાં ભળી જઈશું,

કોણ રોકનારું છે ?

નાશ ને અમરતાની

શૂખલાઓ કાપીને

લ્યો અમે તો આ ચાલ્યા...!

પ્રભુના હસ્તાક્ષર ♦ સાક્ષીભાવ : ત્રણ ચરણો

શંકરાચાર્યના ‘બ્રહ્મ સત્ત જગન્નિથ્યા’ સૂત્રને શૂન્ય પાલનપુરી કેવી
તો મસ્ત અદાથી વર્ણવે છે :

‘કાંઈ રહેવાનું નથી,
બાકી ફક્ત મારા વિના,
શૂન્યરૂપે હું,
સકળ બ્રહ્માંડનો પડકાર હું.’

■ • ■

સંયોગવિપ્રમુક્તિ : સાક્ષી ભાવનું પ્રથમ ચરણો^૧.

આવશ્યક પદાર્થો - વસ્ત્ર, પાત્ર આદિનો સંયોગ બહારના સ્તરે હોય.
પણ ભીતર તે સંગની કોઈ જ અસર નથી.

‘પરમજ્યોતિઃ પંચવિંશતિકા’ એ સાધકની આ નિર્લેપતાને પરદ્રવ્યમાં
ઉદાસીનભાવરૂપે અને પરભાવમાં સુધુપિત્તિ રીતે વર્ણવેલ છે.^૨ અને એ
કારણો મળે છે સ્વમાં હોવાનો પરમ આનંદઃ સ્વગુણલીનતા.

■ • ■

સંયોગવિપ્રમુક્તિ શબ્દની વ્યાખ્યા ઉત્તરાધ્યયન સૂત્રની સુખબોધિકા
વૃત્તિમાં આ રીતે અપાઈ છે : જ્ઞાન અને ભાવના આદિ અનેક પ્રકારો
વડે આત્યન્તિક રીતે મળેલ સંયોગોની મુક્તિ. જ્ઞાનને ભાવનાના સ્તર
પર લઈ જઈને સાધક બાહ્ય (પદાર્થ, વ્યક્તિ આદિ) અને અભ્યન્તર
(રાગ, દ્રેષ આદિ) સંયોગોથી જ્ઞાતને અળગી કરે છે.

ભાવિત થયેલું જ્ઞાન સ્વ અને પરનાં ખાનાંને છુટ્ટા પાડી દેશે, અને
સાધક પરમાં ન જવાય એની પૂરેપૂરી તકેદારી રાખશે.

■ • ■

(૧) સંજોગ વિપ્પમુક્તસ્, અણગારસ્સ ભિક્ખુણો । - ડત્ત. ૧/૧

(૨) જાગ્રત્યાત્મનિ તે નિત્ય, બહિભવેષુ શેરતે ।

ઉદાસતે પરદ્રવ્યે, લીયન્તે સ્વગુણામૃતે ॥૧૫॥

આણગારત્વ એ બીજું ચરણ છે સાક્ષીભાવનું. અગાર એટલે ઘર. અને એના મમત્વથી ઉપર ઊઠેલ છે સાધક.

પહોંચેલ સાધકો દેહને પણ ઘર કહે છે, અને એની ભીતર આવેલ શુદ્ધ જ્ઞાનાદિ ગુણોને વાસ્તવિક ઘર કહે છે. ઘરમાંય ઘર !

સદ્ગુરુની વ્યાખ્યા આપતાં રવિસાહેબે કહ્યું છે : ‘ઘર મેં ઘર દિખલાઈ હે, વો સદ્ગુરુ હમાર !’

ઇઓડવાની વાત છે એટલે અહીં - આણગારતાના પરિપ્રેક્ષ્યમાં - અગારનો અર્થ પહેલા ઘર (દેહ) સાથે સાંકળી શકાય. રહેવાના સન્દર્ભમાં બીજો અર્થ ઉપયોજાય : જ્ઞાનાદિ ગુણો.

આણગારતા. દેહના સાક્ષી બની જવાનું. પૂ. આનન્દઘનજી મહારાજના શબ્દોમાં કહીએ તો, ‘દેહાદિકનો સાખીઘર કહ્યો.’ અજ્ઞાતાભિજ્ઞાની આ વ્યાખ્યાને આણગારતા જોડે બરોબર સાંકળી શકાય.

■ ● ■

‘અગાર’નો અર્થ ટીકામાં ઘર જ કરાયો હોવા છતાં, નિર્લેપદશાની જે તીવ્રતા આ કક્ષાએ હોય છે તેના સન્દર્ભમાં દેહાધ્યાસથી ઉપર ઊઠેલ સાધક અહીં હોય તેવું માની શકાય.

ઉત્તરાધ્યયન સૂત્રમાં જ, આગળ, આવા સાધક માટે ‘ણત્થિ દેહે મમાયિતં’ (જેને દેહ પર મમત્વ નથી...) જેવી પંક્તિઓ આવે છે.

દેહ : જ્યાં થોડો સમય રહેવાનું છે. ભાડાનું ઘર જ કહો ને ! એના પર રાગ કેવો ? કવિ સરસ અંદાજમાં કહે છે : ‘જુંદગી એક કિરાયે કા ઘર હૈ, એક દિન તો બદલના પડેગા; મૌત જબ તુમકો આવાજ દેગી, તબ ઘર સે નિકલના પડેગા.’

■ ● ■

આણગારતા. દેહધ્યાસના દિવાનખંડમાંથી નીકળીને, ભીતરી ગુણોથી મહેલ નિજના વૈભવી શયનગૃહમાં પ્રવેશવાની આ વાત છે.

વેકેશનના ગાળામાં, ઘરનું દિવાનખાનું પોતા-પરપોતાઓના અવાજથી કોલાહલવાળું બનેલ હોય ત્યારે ગૃહસ્વામી પોતાના એરકન્ડિસન્ડ બેડ રૂમમાં પહોંચી દરવાજો બંધ કરીને સૂઈ જાય છે ત્યારે ન તો ત્યાં ધોંઘાટ છે, ન ગરમી છે.

ગજસુકુમાર મહામુનિના તાજા લોચ કરાયેલા મસ્તક પર મૂકાયેલ ખેરના ધગધગતા અંગારા જ્યારે પોતાની દાહકતાની તીવ્રતા પર પહોંચેલા ત્યારેય એ મહામુનિ આ ઘટનાથી દૂર, ઘણે દૂર, કો આનંદ લોકમાં મહાલતા હતા.

કાશ, આપણનેય આવો ભીતરી એક ખંડ મળો !

■ • ■

સંત શાનદેવ, સંત નામદેવ અને મુક્તાબાઈ કાશીની યાત્રા કરી પાછા ફરતાં ભક્ત ગોરા કુંભારને ત્યાં ઊતર્યાં.

ગોરા ભગતને ત્યાં કાચા ઘડાને ટીપવાનું ટપલું પડ્યું હતું. મુક્તાબાઈએ ભગતને પૂછ્યું : આપણેય માટીના ઘડા છીએ. આ ટપલાથી આપણો કાચા છીએ કે પાક્કા છીએ, એ ખબર પડે ?

ભગત કહે : હા, ખબર પડે. અને લાગલું જ એમણે ટપલું મુક્તાબાઈના માથા પર લગાવ્યું. આ જોઈ નામદેવ ગુસ્સે થયા. ભગત કહે : નામદેવ હજુ કાચો છે.

ગોરા ભગતનું આકલન સ્યાદ હતું : માટી સાથે (દેહરૂપી માટી સાથે) માટીનું (લોઢાના ટપલાનું) જોડાણ થયું એ ઘટનાની નોંધ પણ કેમ લેવાઈ શકે ? અને એ નોંધ લેવાઈ તો એનો મતલબ એ થયો કે મન હજુ માટીમાં - દેહમાં અટવાયેલું છે.

પ્રભુના હસ્તાક્ષર ❖ સાક્ષીભાવ : નૃણ ચરણો

મન અન્યમય ન જોઈએ, તે જોઈએ પ્રભુમય.

નામદેવે પોતાની ભૂલ કબૂલી.

■ ● ■

પ્રશ્ન થશે : દેહાધ્યાસથી આવી દૂરી શી રીતે મળે?

એ માટે જોઈશે અનુભૂતિઃ આત્મતત્ત્વની.

‘શાન્તસુધારસ’ની મજાની પંક્તિ યાદ આવે : ‘ભાવય રે ! વપુરિદમતિમલિનમ્...’ શરીરની અશુચિમય દશાને ભાવિત કરવાની. શરીર ગંદું છે આવું માત્ર સાંભળવાથી કે વાંચવાથી દેહાધ્યાસ જવાનો નથી. સો વાર સાંભળેલું છે અને એકસો એકમી વાર સંભળાય કે શરીર ગંદું છે, ને છતાં દેહરાગ તસુભર પણ ન ખસકે એવું બને.

કચ્છી સંત ડાડા મેકરણ કહેતા : ‘અંદેસડા ન ભાંજિસી, સંદેસડા કહિયા...’ પ્રભુની વાત માત્ર કહેવાથી (કે સાંભળવાથી) સંશય દૂર થતા નથી.

મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજય મહારાજે શ્રીપાળ રાસમાં કહેલી પંક્તિ યાદ આવે : ‘સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને.’

તો શી રીતે સંદેહ ટળે ? મોહનું આ ઘેરું અંધારું શી રીતે ઓછું થાય ? શ્રીપાળ રાસની પંક્તિ યાદ આવે છે :

‘હરાવ્યો અનુભવ જોર હતો જે, મોહમલ્લ જગ બાંઠો;
પરિ પરિ તેહના મર્મ દાખવી, ભારે કીધો ઉપરાંઠો રે...’

અનુભવે દુર્જ્ય મોહમલ્લને હરાવ્યો. મલ્લયુદ્ધમાં હરીફની નિર્બણતાઓથી વ્યક્તિએ પરિચિત થવું જોઈએ અને તેનાં મર્મસ્થળો પર પ્રહાર કરવો જોઈએ.

પ્રભુના હસ્તાક્ષર ❖ સાક્ષીભાવ : ત્રણ ચરણો

અનુભવ આ કામ કરે છે. મોહની નબળાઈઓ જોઈ ત્યાં પ્રહાર કરી તે સાધકને વિજેતા બનાવે છે.

■ ● ■

ડાડા મેકરણો આપેલ સૂત્રનો પૂર્વાર્ધ આગળ જોયેલો : ‘અંદેસડા ન ભાંજિસી, સંદેસડા કહિયા...’ ઉત્તરાર્ધમાં તેનો ઉકેલ આપ્યો છે : તૈ હરિ આયા ભાંજિસી, તૈ હરિ કે પાસ ગયા...’ યા તો પ્રભુ તમારી પાસે આવે ને સંદેહ- દેહમાં આત્મબુદ્ધિ વગેરેની ભ્રમણા ટળે અથવા તો તમે પ્રભુની પાસે જાવ અને સંદેહ ટળે.

પ્રભુ શી રીતે ભક્તોની પાસે આવે છે એની મોહક અભિવ્યક્તિ શ્રીપાળ રાસમાં છે :

‘તૂઠો તૂઠો રે મુજ, સાહિબ જગતનો તૂઠો,
એ શ્રીપાળનો રાસ કરંતાં, અનુભવ અમૃત રસ વૂઠો રે...’

પરમાત્માનો પ્રસાદ એટલે અનુભવ અમૃતની વર્ણા. શ્રીપાળનો રાસ લખતાં, મહામના શ્રીપાળના સમભાવને આસ્વાદતાં મહોપાધ્યાયજીને પણ શમામૃતનો અનુભવ થયો.

શમામૃતનો અનુભવ. પરમ રસનો અનુભવ. શબ્દોને પેલે પારનો અનુભવ.

■ ● ■

કવિવર રવીન્દ્રનાથ ટાગોર ગીતો લખતા ત્યારે કોઈને હાજર રહેવા નહિ દેવાતા. એકવાર મિત્રો બેઠેલા. ટાગોર પોતે ચા બધાને આપી રહ્યા છે અને અચાનક જગ હાથમાંથી છૂટી જાય છે.

પરિચિત મિત્રો સમજ ગયા કે એ તેમની સમાધિની ક્ષણો હતી. પરમપ્રવેશની ક્ષણો.

મિત્રો જતા રહ્યા. બારણું બંધ થયું. ગુરુદયાળ મલ્લિકને ટાગોરની સર્જનની પળો 'જોવી' હતી. મિત્રો ગયા પછી મલ્લિકે ટાગોરના રૂમના બંધ બારણાની તિરાડમાંથી જોયું તો તેઓ સ્તબ્ધ બની ગયા. ઓરડાનું આખું વાતાવરણ બદલાઈ ગયેલું. મલ્લિક પાછળથી નોંધે છે કે એ વખતે એ ઓરડામાં કોઈ અદેશ્ય તત્ત્વની હાજરી વરતાતી હતી.

ટાગોર કહેતા કે પોતે ન હોય ત્યારે જ રચના થતી. 'ગીતાંજલિ' આવી ક્ષણોમાં જ વરસી હશે ને !

પરમની વર્ષાનું ગણિત સીધું સટ છે ! તમે 'પર'ની છત્રીમાંથી બહાર નીકળ્યા કે પરમની વર્ષા ચાલુ !

■ • ■

રુસી અન્તરીક્ષયાત્રી પેકોવે પોતાની ડાયરીમાં નોંધ્યું છે કે આકાશમાં ગુરુત્વાકર્ષણ-વિહોણી ક્ષણોમાં પેટે પછો બંધાયેલ હોય, પણ જપકી આવતાં જ હાથ અદ્ભુત થઈ જાય, ઊચકાઈ જાય. ને એ નિદ્રાની ક્ષણોમાં - અલપઅલપ નિદ્રાની ક્ષણોમાં - દેહાધ્યાસથી પર જવાનો અનુભવ મળે.

તમે તમારા શરીરને, તે બીજાનું હોય એ રીતે જોઈ શકો તો દેહાધ્યાસને ખરતો તમે અનુભવી શકો.

રોગની ક્ષણોમાં પણ જાગ્રત સાધકનો દેહાધ્યાસ ભરી શકે.

અધ્યાસ શબ્દની બહુ જ ઘારી વ્યાખ્યા શંકરાચાર્યે આપી છે : જે ન હોય છતાં 'છે' ના ઘાલથી તમને ભરી દે તે અધ્યાસ.

દેહનો અધ્યાસ ખરે, પર-રસ જાય અને પરમ રસની અનુભૂતિ થાય.

■ • ■

તૈત્તિરિય ઉપનિષદ કહે છે : ‘રસો વૈ સઃ...’ રસ તે જ છે. પરમાત્મા જ. એ રસ મળે તેને આનન્દ જ આનન્દ.

અને એ આનન્દ વિના તો જીવન ટકે કેમ ? પૂ. આનન્દધનજી કહે છે : ‘આનન્દધન બિન પ્રાણ ન રહે છિન, કોટિ જતન કરી લિજે...’ કરોડો બીજા ઉપાય કરીએ તોય એ પ્રાણાધાર વિના, આનન્દધન વિના પ્રાણ ટકી ન શકે. ‘આનન્દધન એક વલ્લભ લાગે, ઔર ન લાખ કરોર...’ ગમે તેને જુઓ, ‘એ’ને જોયા પછી બધું જ લાગે : ફિક્ઝુન્-ફિસ.

■ ■ ■

સંયોગવિપ્રમુક્તિ અને અણગારત્વ પછીનું સાક્ષીભાવનું ત્રીજું ચરણ છે ભિક્ષુત્વ. જે સાધકને વૈભાવિક હું-ભાવની પકડથી મુક્ત બનાવી સ્વાભાવિક હું-ભાવની ધરતી પર મૂકે છે.

ભિક્ષુ શબ્દ બોલતાં પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્રનું ‘સભિક્ષુ’ અધ્યયન યાદ આવે અને યાદ આવે પરમપાવન આચારાંગ સૂત્રનું આ ઘારું ગાથાસૂત્ર :

ણ મે દેતિ ણ કુપ્પેજા,
થોવં લદ્ધું ન ખિંસઙ્ |
પડિસેહિતો પરિણમેજા,
એતં મોણં સમણુવાસિજ્જાસિ ત્તિ બેમિ ||

મુનિ ક્યાંક વહોરવા ગયા છે. ગૃહસ્વામી ભિક્ષા નથી આપતા, તો મુનિ ગુરુસે થતા નથી. ક્યારેક થોડી ભિક્ષા મળી તોય મુખ પર જલાનિ નથી. કોઈએ કદાચ ઘસીને ના પાડી કે અહીં તમારે આવવાનું જ નહિ; એ સાંભળીને પણ મુનિ સહેજે વિષાદ વિના આગળ ધપે છે...

આ શું છે ? સૂક્ષ્મ હુંની પકડથી મુનિ મુક્ત થયા છે એ ભાવને સૂચવતું આ સૂત્ર છે.

‘જ્ઞાનસાર’ ગ્રન્થ સાધકને આકાશની ઉપમા આપે છે તેનું સ્મરણ અહીં થઈ ઊઠે. હુંભાવથી ઊંચે ઊઠેલ સાધક એટલે આકાશ સો નિર્મળ સાધક. એવો સાધક વિભાવોથી મુક્ત જ હોય. ‘આકાશમિવ પઙ્કેન, નાસૌ પાપેન લિપ્યતે...’

પરમનું આકાશ કેટલું તો નીચે ઝણુંબી આવ્યું !

■ • ■

‘બુદ્ધિસ્ટ પેરેબલ્સ’માં એક સરસ પ્રસંગ કથા છે.

સાધક ગુરુ પાસે પોતાને મૂંજવતો કોઈક પ્રશ્ન લઈને આવે છે. ગુરુને એ કહે છે. ગુરુ એ સાંભળીને ખડખડાટ હસી પડે છે. કોઈ જવાબ નહિ માત્ર મુક્ત હાસ્ય.

સાધક જંખવાણો પડે છે. પોતાની કુટિરે તે જાય છે. ત્રણ દિવસ સુધી તે કંઈ ખાઈ કે પી શકતો નથી. ઊંઘ નથી આવતી એને. ફરી તે ગુરુ પાસે આવે છે અને ત્રણ દિવસની વીતક કથા કહે છે.

ગુરુ કહે છે : તું સરકસના વિદૂષક (જોકર) જેવો પણ નથી ? શિષ્યને ઘ્યાલ નહિ આવ્યો કે ગુરુ શું કહેવા માગે છે. ગુરુએ કહ્યું : સરકસનો વિદૂષક પણ બીજાને હસતાં જોઈ રાજી થાય છે. તેં મને હસતો જોયો; તું રાજી થવાને બદલે ભિન્ન કેમ બન્યો ?

ગુરુ એમ કહેવા માગતા હતા કે તું મારા હાસ્યને કેમ સ્વીકારી ન શક્યો ? અહીં વ્યક્તિની અપેક્ષા તેને નડે છે. અપેક્ષા ગુરુના માર્ગદર્શનની હતી, ગુરુના ઘારા-ઘારા શબ્દોની હતી અને મળ્યું હાસ્ય. અપેક્ષાના પાત્રમાં એ સ્મિત જીલાયું નહિ.

અપેક્ષાની પાછળ હતો હું ભાવ. મને ગુરુ આ રીતે સાંભળે... મને તેઓ આ રીતે પ્રત્યુત્તરિત કરે... એ હું ભાવનાં જ છોતરાં ઉડી જાય તો..... ? કેવી મજા !

ભિસ્કુ... પ્રભુનો ખારો સાધુ. હું ભાવની પકડથી મુક્ત સાધક. કોકે કંઈક કહ્યું તો એ એની પાસે. મને શું ? હા, એમાંથી મારે યોગ્ય હોય તે લઈ લઉં. મારી તત્કાલીન સાધના માટે ઉપયોગી હોય તે શબ્દોને ગાંઠે બાંધું. બીજા પર મન ન દઉં. ખજુર ખાઈને ઠળિયાં ફેંકી દેનાર માણસની જેમ.

■ ● ■

સાક્ષીભાવનાં ત્રણ ચરણો આપણે જોયાં. પહેલા ચરણો સાધક પદાર્થો અને વ્યક્તિઓના સંયોગથી ઉપર ઉઠે છે. બીજા ચરણમાં તે દેહભાવથી ઉપર ઉઠે છે. અને ત્રીજા ચરણમાં હું ભાવથી ઉપર જવાય છે.

બધાનો સાક્ષી છે સાધક : પદાર્થોનો, વ્યક્તિત્વોનો, દેહભાવનો અને હું ભાવનો પણ.

■ ● ■

આ સાક્ષીભાવને સમર્પણના રસમાં ઢાળીને સાધક પ્રભુની સાધનાને પામે છે.

સમર્પણમાં છે ભીનાશ જ ભીનાશ. ‘આ બધું તે આપેલું છે, પ્રભુ ! તારી કૃપાથી જ સાધનાને પામી શકાય, પ્રભુ !’

યાદ આવે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીની ‘વીતરાગસ્તોત્ર’માં વહેલી દિવ્ય વાણી : ‘ભવત્પ્રસાદેનૈવાહમિયતીં પ્રાપિતો ભુવમ्’... આનો અનુવાદ જોવા મળે મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીની આ સ્તવના પંક્તિમાં : ‘ઈતની ભૂમિ પ્રભુ ! તુમ હી આણ્યો....’

‘એવ’ અને ‘હિ’ શબ્દો જકારના ભાવને સૂચયે છે. તમારી કૃપાથી જ, પ્રભુ ! હું સાધનાની આ પગથારે આવેલ છું. અહીં સાધકના કર્તૃત્વનો છેદ ઊરી જાય છે. પ્રભુની કૃપા જ હાથ પકડીને સાધકને અહીં સુધી લાવેલ છે તેનો અનુભવ તેને થાય છે.

એક દર્દી. અસાધ્ય કહેવાતું દર્દ. કંટાળી ગયો દવા લઈ લઈને. વર્ષો વીત્યાં. કેટલાય ડૉક્ટર, કેટલાય વૈદ્ય, દવાઓનો પાર નહિ; અને આ બાજુ દર્દ ટસનું મસ ન થાય.

એવામાં એક અનુભવી વૈદ્ય મળ્યા. તેમણે કહેલી દવા એ દર્દીએ લીધી. ચરી તેણે પાળી. અને દર્દ એક મહિનામાં છૂ ! એના મિત્રે અને પૂછ્યું : અરે, દર્દ કઈ રીતે ગયું ?

એ એમ નહિ જ કહે કે મેં દવા લીધી અને ચરી પાળી માટે દર્દ ગયું. કારણ કે એને ઘ્યાલ છે કે દવા લેવામાં કંઈ બાકી નહોતું રાખ્યું અને છતાં દર્દ એમ ને એમ હતું. એ કહેશે કે વૈદ્ય મળ્યા ને દર્દ ગયું. પૂરું કર્તૃત્વ એ વૈદ્ય પર જવા દેશે.

આ જ અનુભૂતિ સાધકની છે, ‘ઈતની ભૂમિ પ્રભુ ! તુમ હી આણ્યો,’ કહેતી વખતની.

■ ■ ■

સમર્પણના પ્રવાહમાં જબોળાયેલ સાક્ષીભાવ એ પ્રભુની સાધના...

પ્રભુ ! અમને આ સાધના આપો !



॥ પ્રભુના હસ્તાક્ષર ॥

આધારસૂત્ર

સંજોગ વિપ્પમુક્તસ્સ, અણગારસ્સ ભિક્ખુણો ।

વિણયં પાઉકરિસ્સામિ, આણુપુણ્ણ સુણેહ મે ॥ ૧/૧ ॥

(સંયોગોથી વિપ્પમુક્તિ, અણગાર એવા ભિક્ખુને વિનય હું શીખવાડીશ,
ક્રમસર તું મને સાંભળ.)

ઇંગિયાગારસંપણો, સે વિણીએ ત્તિ કુચ્છઙ ॥ ૧/૨ ॥

(સદ્ગુરુના ઈંગિત અને આકારને જે જાણો છે, તે વિનીત શિષ્ય
છે.)

પસાયપેહી ણિયાગઢી, ઉવચ્ચિદ્દે ગુરું સયા ॥૧/૨૦ ॥

(ગુરુદેવના પ્રસાદનો ઈચ્છુક, મોક્ષાર્થી શિષ્ય હંમેશા ગુરુની પાસે
રહે છે.)

સાધનાસૂત્ર

સદ્ગુરુની શિષ્ય પર કામ કરવાની ચાર મોહક રીતો :


શબ્દ,

ઈંગિત,

આકાર,

ઉપનિષદ.

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી



સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી

પ્રભુની સાધનાના માર્ગ ચાલવું છે.
પણ શી રીતે ચાલવું ? જ્યારે પૂજ્ય
આનંદધનજી મહારાજ જેવા મર્મી
સાધક પ્રભુની સાધનાને તલવારની ધાર
પર ચાલવા કરતાંય અધરી બતાવે છે
ત્યારે સાધકના પગ કંપી ઉઠે છે. ‘ધાર
તલવારની સોહિલી, દોહિલી ચૌદમા
જિન તણી ચરણસેવા’

ભક્તિયોગિની મીરાંની કેદ્ધિયત પણ
આવી જ છે. તેણી કહે છે :

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભાડી

ઉંચી નીચી રાહ લપટીલી, પાંવ નહિ ઠહેરાય;
સોચ સોચ પગ ધરું જતન સે, બાર બાર ડિગ જાય...
ઉંચા ઉંચા મહલ પિયા કા, માંસું ચઢા ન જાય;
પિયા દૂર પંથ મારો જીણો, સુરત જકોલા ખાય...

દુર્ગમ છે એ માર્ગ. સાવધાનીથી ચાલીએ તોય ડગી જવાય. મંજિલની
આ દૂરી અને સ્મૃતિ (પ્રભુ સ્મરણ)નો દીવો લબ્દુક જબ્દુક થયા કરે.

શું કરવું ?

ના, નિરાશ થયે પાલવે એમ નથી.

મીરાંએ જ કહું છે :

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, સદ્ગુરુ દિયો બતાય,
જુગન જુગન સે બિછડી મીરાં કો, લીની ઘર મેં આય...

પ્રભુએ સદ્ગુરુ બતાવ્યા... સદ્ગુરુની સાથે - તેમની આંગળી પકડીને
- ચાલવાનું. ને લ્યો, આ રહ્યા પ્રભુ ! માની આંગળી પકડીને મોસાળ
જવાના જેવું જ ને આ તો !

■ ■ ■

ભારતીય રહસ્યવાદ કહે છે કે પ્રભુ જ સાધકને સદ્ગુરુ આપે છે.

પ્રાર્થનાસૂત્ર 'જ્ય વીયરાય'માં પણ પ્રભુની પાસે જ સદ્ગુરુયોગની
માગણી કરવામાં આવી છે.

સદ્ગુરુયોગ (સુહગુરુજોગ)ની આ પ્રાર્થના ઉંડા મનોવૈજ્ઞાનિક
આયામની છે. માત્ર સદ્ગુરુ નથી માયા અહીં. સદ્ગુરુયોગ માયો છે.

નાથ ! મને સદ્ગુરુનાં ચરણોમાં સંપૂર્ણતયા સમર્પિત થવાનું બળ
આપો ! સદ્ગુરુનાં ચરણોમાં હું સમર્પિત એ રીતે થાઉં કે પછી સદ્ગુરુ
જ રહે. હું ન રહું.

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી

સંત કબીર યાદ આવે : ‘પહુલે હમ થે, ગુરુ નહિ, અબ ગુરુ હૈ
હમ નાંહિ; પ્રેમગલી અતિ સાંકરી, તામે દો ન સમાંહિ...’

પ્રભુ સદ્ગુરુયોગ આપે અને સદ્ગુરુ પ્રભુયોગમાં મને મૂકી ટે. કેવી
મજાની વાત ! પંચસૂત્રકમાં વાંચ્યું’તું : ‘અઓ ચેવ પરમગુરુસંજોગો’
ત્યારે કેવો નાચી ઊઠેલો ! સદ્ગુરુ દ્વારા જ પરમગુરુનો સંયોગ !

■ ● ■

સદ્ગુરુનો યોગ મળે અને પ્રભુના માર્ગ પર ચાલવાનું એક મજાના
અનુભવમાં ફેરવાઈ જાય.

સાધનાનો માર્ગ મજાનો હતો જ, પણ પગ અહંકારની માટીથી
ખરડાયેલા હતા; ચીકણા બનેલા, શી રીતે ચાલવું?

સદ્ગુરુએ બે રીતે કામ કર્યું : હાથ પકડ્યો સાધકનો અને અહંકારના
કાદવને હટાવવાનું પણ કર્યું.

■ ● ■

સદ્ગુરુ.

કેવી અપાર છે કરુણા એમની ! સાધકને પ્રભુના માર્ગ દોડતો કરવા
તેઓ મથ્યા જ કરે છે. પણ સદ્ગુરુની એ કિયા હોય છે નિર્ભાર.
‘મારા પ્રભુએ કહું છે, ને મારે કરવું છે.’ કાર્યનો બોજ બિલકુલ નહિ.

ગામને પાદરેથી મહારાજ સાહેબો વિહાર કરી આગળ જતા હતા.
મોટા મહારાજ ડોળીમાં હતા. બે જણા ઉંચકીને ચાલતા’તા. તે વખતે,
ગામના પાદરે ઊભેલા બે બાળકોએ મહારાજ સાહેબને વન્દન કર્યા.
ડોળી સડસડાટ આગળ વધી.

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી

ઇ વર્ષના બાબાએ આઠેક વર્ષના લાગતા પોતાના મોટા ભાઈને
પૂછ્યું : ભાઈ ! આ બે જણા મહારાજ સાહેબને ઊંચકીને જતા'તા,
તેમને ભાર ન લાગે ?

આઠ વર્ષના દીકરાએ કહ્યું : વચ્ચે ડોળીમાં હતા તે મહારાજ સાહેબ
હતા. અને એમના હદ્યમાં હોય ભગવાન. અને ભગવાન હદ્યમાં હોય
ત્યારે ભાર હોય જ ક્યાંથી ? ઉમેર્યું તેણે : એ ઊંચકનારા તો ૫૦-૬૦
વર્ષના હતા. પણ આપણે બે જણા એ ડોળી ઊંચકીએ તો આપણનેય
ભાર ન લાગે ને !

■ ● ■

સદ્ગુરુ સાધકને સમર્પિતતાના પાઠ કેવી તો સલૂકાઈથી શીખવે છે
તેની મજાની વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. સદ્ગુરુની, શિષ્ય પર કામ
કરવાની, મોહક ચાર રીતોનો ત્યાં ઉલ્લેખ છે : શબ્દ, ઈંગિત, આકાર
અને ઉપનિષદ.

સદ્ગુરુની મોહકતા એ રીતે કામ કરશે કે અહેંકાર ક્યારે છૂટી
ગયો અને સમર્પણની ધારામાં સાધક ક્યારે વહેવા લાગ્યો એનો એને
ઘ્યાલ પણ નહિ આવે.

મીરાંની સરસ કેફિયત છે : ‘સંતન ઢિંગ (પાસ) બૈઠ બૈઠ, લોકલાજ
ખોઈ.’ સદ્ગુરુની સંગતમાં જ તમને ઘ્યાલ આવે છે કે ન નામનું કંઈ
મૂલ્ય છે, ન બદનામીની કોઈ પીડા છે. બધું તો છે આ પાણી પરની
લકીરો જેવું. પાણી પરના લીસોટા : કેટલી વાર એ રહી શકે ? પૂરો
દોરાયો પણ નથી ને છૂ !

કોઈ તમને નિન્દે કે પ્રશ્નસે, શો મતલબ આ લકીરોનો ? મીરાંએ
જ કહ્યું છે : ‘કોઈ નિન્દે કોઈ બંદે, મૈં અપની ચાલ ચલુંગી...’ સદ્ગુરુ

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભડી

પાસે બેસવાથી તમારી ચાલ સ્પષ્ટ થઈ જાય છે. નિંદા કે પ્રશંસાના શબ્દોથી એ ચાલમાં ફરક પડતો નથી.

■ ● ■

સદ્ગુરુની પહેલી શિક્ષાપદ્ધતિ : શબ્દ. વાત્સલ્યની કેટલી તો મીઠાશ આ સ્તરે ગુરુ ઘોળે છે. કહી શકાય કે શબ્દ તો બહાનું છે. વાત્સલ્ય જ અપાઈ રહ્યું છે. જુના વખતના જમણવારોમાં રોટલી બહાનું બની રહેતી, ધી જ અપાતું રોટલીના માધ્યમે. એવું જ અહીં બન્યું.

સદ્ગુરુના ઘારા ઘારા શબ્દો. ‘વિણયં પાઉકરિસ્સામિ, આણુપુંબિ
સુણેહ મે.’ હું સમર્પિતતાના પાઠો તને શીખવીશ, તું કમસર મને સાંભળ.

આવા મોટા ગુરુ કહે છે : તું મને સાંભળ. કરુણાની ગંગાનું
હિમાલય પરથી થતું આ અવતરણ.

પણ એ ગંગાને જીલે કોણ ? શિવજીની જટા કઈ ? શિષ્યનો
અહોભાવ એ જ છે એ જટા.

અને એટલે શિષ્ય માત્ર કાનથી સદ્ગુરુને નહિ સાંભળો. પૂરા
અસ્તિત્વથી સાંભળશો. કહો કે પીશે. અને સદ્ગુરુને જોવાનું પણ.

કેનોપનિષદ્ધમાં શિષ્ય ગુરુને પૂછે છે : ચક્ષુને જોવાની અને કર્ષણે
સાંભળવાની શક્તિ કોણ આપે છે ?

ગુરુનો ઉત્તર કેવો સરસ છે ! ‘તે શ્રોત્રનું શ્રોત્ર, કર્ષણું કર્ષણ, વાણીની
વાણી, મનનું મન અને જીવનનું જીવન છે.’ સ્પષ્ટતા કરતાં કહે છે :
નેત્રથી જેને નીરખી શકાય તેમ નથી, પરંતુ જેને કારણો નેત્ર નીહાળી
શકે છે, તને તું બ્રહ્મ જાણ.

■ ● ■

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી

પહેલીવાર ઉત્તરાધ્યયન સૂત્ર ગોખતાં ‘સુણેહ મે...’ (તું મને સાંભળ) પદો જોથાં ત્યારે હું સત્ત્વ બની ગયેલો. આંખોમાંથી આંસૂ ઝર્યા કરે. સદ્ગુરુની કેવી મોટી કરુણા ! તેઓ કહે છે : તું મને સાંભળ.

મૌનના શિખર પર બિરાજેલ સદ્ગુરુ. જેમને શબ્દોની સપાટી પર ઉત્તરવું દુષ્કર લાગે, એ સદ્ગુરુ કહે છે : તું મને સાંભળ !

મને ઘ્યાલ છે કે ‘સુણેહ મે...’ આ બે શબ્દોએ જન્માવેલી ભાવવિભોરતાની દુનિયામાં હું ટિવસો સુધી રહેલો. આગળ વાંચવાનું શક્ય ન બનેલું. ‘સુણેહ મે...’ ભીતર ઉત્તરતું ગયું.

■ ● ■

‘તું મને સાંભળ...’ બહુ જ મજાના મનોવૈજ્ઞાનિક આયામમાં ઉત્તરી આવેલી સદ્ગુરુની આ શીખ છે. લગભગ શ્રોતાઓ પોતાની અવધારણાને જ સાંભળતા હોય છે અને ત્યારે, સદ્ગુરુને સાંભળવાની વાત છલના બની જાય છે.

સદ્ગુરુએ કહેલ ઘણી બધી વાતોમાંથી મન એ વાતની નીચે જ લીટી દોરે છે, જે વાત એને પોતાને ગમી છે.

છલના અહીં એ થઈ શકે કે સદ્ગુરુએ કહ્યું છે માટે સારું છે આ વાત અહીં નથી. પોતાને ગમતું સદ્ગુરુએ કહ્યું, માટે એ સારું છે.

■ ● ■

સદ્ગુરુ જ્યારે કહે છે : ‘તું મને સાંભળ...’ ત્યારે ભાર ‘તું’ શબ્દ પર છે. ગુરુદેવ પૂછે છે : તું મને સાંભળે છે ને ? તારા કાન નહિ, તારું મન નહિ, તું પોતે મને સાંભળે છે ને ?

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી

જે અસ્તિત્વને પૂરેપૂરું ભીજવવું છે, તે જો શ્રવણની સીમામાંથી આવે નહિ તો સદ્ગુરુ સંભળાવવા તૈયાર નથી. સદ્ગુરુ, આથી, પ્રારંભે જ અંકે સો કરવા માંગે છે કે તું મને સાંભળીશ ને ? તો હું તને સંભળાવીશ.

સદ્ગુરુની આ પક્કાઈ પર ઓવારી ગયા વિના કેમ રહેવાય ?

‘સુણેહ મે..’ સદ્ગુરુને સાંભળતા જઈએ. ઓગળતા જઈએ.

યાદ આવે ભક્ત કવિ સૂરદાસજી. તેઓ ભક્તની સદ્ગુરુને સાંભળવાની લાલાયિતતા વર્ણવતાં કહે છે : ‘સબ તન શ્રવણ.’ પૂરું શરીર કાન-મય બની ગયું છે.’

■ ■ ■

‘સુણેહ મે...’ની પહેલાં એક શબ્દ આવેલ છે : આણુપુણ્ય.. કમસર. સદ્ગુરુ અહીં કહેવા એ માગે છે કે તને ગમતા શબ્દો પર મનના ઘોડાને ફૂદાવીને અણગમતા શબ્દોને તું ઓળંગી ન જતો !

આપણું તો ભલું પૂછવું. ગુરુને સાંભળવાના ખરા, પણ હજુ પેલાં ખાનાં ભૂસાયાં નથી : આ મનગમતું, આ અણગમતું.

સદ્ગુરુ આ પ્રિયાપ્રિયતાની વાતને દૂર કરી શિષ્યના મનમાં સર્વસ્વીકારનું બીજ રોપે છે. કમસર બધું જ તારે સાંભળવાનું છે. આ સારું છે ને આ બરોબર નથી એવી પસંદગી કરવાનો તને અધિકાર નથી. સદ્ગુરુ કહે તે બધું જ સારું, આ ભાવ શિષ્ય પાસે જોઈએ. ‘મધુરાધિપતેરભિલં મધુરમ્.’

‘સુણેહ મે...’થી શિષ્યના અહમ્ભૂને ગુરુએ કાઢેલું. ‘આણુપુણ્ય’ કહીને તો એમણે અહમ્ભૂના ગોટલાં-છોતરાં કાઢી નાખ્યાં !

કેવી કરુણા સદ્ગુરુની !

■ ■ ■

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભજી

સદ્ગુરુની શિક્ષા પદ્ધતિનું બીજું ચરણ છે ઈંગિત.

ઈંગિત. સૂક્ષ્મ ઈશારો સદ્ગુરુનો. આંખનાં ભવાં સહેજ બદલાવાં. ભવાંનું સહેજ ઉંચકાવું. ઈશારો નાનકડો હશે, પણ શિષ્ય એને પકડી લેશે. કારણ કે શિષ્ય ગુરુદેશિક છે.

ઈશારો પણ સદ્ગુરુનો. એમાં શું હશે એમ કહેવાને બદલે એમાં શું ન હોય એમ કહેવું જોઈએ.

સાધનાને પ્રતિકૂળ કોઈ ઈચ્છા શિષ્યને થઈ હોય અને ગુરુના આંખના ખૂણા ના પાડતા હશે; શિષ્ય એ સંદેશ જીલી લેશે અને સાધનાને માર્ગ એ દોડવા લાગશે.

■ ■ ■

ગુરુદેવની આંખોમાં આંખો પરોવીને શિષ્યનું બેસી રહેવું- તદ્દદાસ્તિકતા- એ પરમપાવન આચારાંગસૂત્રે કહેલી શિષ્ય માટેની વિશિષ્ટ સાધના છે.

એ વખતે સદ્ગુરુની આંખોમાં પ્રતિબિમ્બિત થયેલ પ્રભુનું દર્શન એને થશે.

સદ્ગુરુની આંખોને નીહાળતાં રહીમની ઘારી પંક્તિ યાદ આવે : ‘પ્રીતમ છબી નૈનન બસી, પર છબી કહાં સમાય ? ભરી સરાય રહીમ લખી, પથિક આય ફિર જાય...’

જે આંખોમાં પરમાત્માની છબી જલકી, તેમાં પરની છબી ક્યાંથી જલકે ? ધર્મશાળા પૂરી, પૂરી ભરાયેલી હોય તો મુસાફર પાછો ફરી જાય તેમ પરમથી આંખો ભરાયેલ હોય ત્યારે પરને પાછા ફર્યો જ છૂટકો !

સદ્ગુરુની આંખોમાં આંખો પરોવી શિષ્યનું બેસવું અને પરમનું પામી ઊઠવું.

■ ■ ■

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી

સૂક્ષ્મ વાતો કહેવા માટે શબ્દો અસમર્થ બને છે ત્યારે ઈંગિત તે વાત ભણી ઈશારો કરી દે છે.

મહોપાધ્યાય યશોવિજય મહારાજ કહે છે :

‘જિન હી પાયા, તિન હી છિપાયા, ન કહે કોઉ કે કાન મેં,
તારી લાગી જબ અનુભવ કી, તબ સમજે સહુ સાન મેં...’

જેમણે પણ પરમ તત્ત્વ મેળવ્યું, તેમણે તે છુપાવ્યું. કારણ કે એ તત્ત્વની વાત શબ્દોમાં કહી શકાતી નથી. પણ હા, જ્યારે અનુભવની તન્મયતા (તારી) પ્રગટે છે ત્યારે આનો ઘ્યાલ આવે છે કે પરમ તત્ત્વ શું છે. શબ્દો દ્વારા એ તત્ત્વ અવ્યાખ્યેય છે.

શબ્દ દ્વારા પરમ તત્ત્વ અવ્યાખ્યેય. ઈંગિત દ્વારા તે વ્યાખ્યેય બની શકે.

સદ્ગુરુની આંખોમાં પ્રતિબિભિત થયેલ પ્રભુનું દર્શન ઈંગિતના સ્તરે
મળી શકે.

■ • ■

સદ્ગુરુની શિક્ષાપદ્ધતિનું ત્રીજું ચરણ છે આકાર.

ઈંગિતમાં ભાવજગતની સૂક્ષ્મતા હતી, આકારના ચરણે એ જ
ભાવજગત- સદ્ગુરુની ભીતર રહેલું - વધુ સ્પષ્ટ થઈને મુખરિત બને છે.

સદ્ગુરુની આ કરુણા તો જુઓ ! નાનકડો, અતિસૂક્ષ્મ ઈશારો
સદ્ગુરુની આંખના ખૂણો જબકીને વિલાઈ ગયો. શિષ્ય કદાચ એને વાંચી
શક્યો નથી, તો ગુરુદેવ એનો સ્થૂળ અનુવાદ કરી આપશે.

સહેજ ભવાંને કે મસ્તકને હલાવવું એ ઈશારાની સૃષ્ટિ છે. જ્યારે
આકારના ચરણે શરીરના સ્તર પર કિયાઓ થાય છે. મુખના સ્તર પર પણ.

ગુરુ પ્રસંગ વદને જોશે. સિમત આપશે. શિષ્યની સાધનાને ઊંચકવા
માટે આ શ્રેષ્ઠ પરિબળ બનશે.

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભજી

સદ્ગુરુ બહાર જવા માગે છે અને શિષ્યને એનું સૂચન કરવું છે તો જે દિશા તરફ જવું છે, તે દિશાને જોશે. સદ્ગુરુની આ ચેષ્ટાને શિષ્ય તરત સમજી લેશે.

■ ● ■

સદ્ગુરુ શિષ્યને પ્રભુનું દર્શન કર્દી રીતે કરાવે છે તેની, આકારના સ્તર પરની, મજાની વાત પૂ. આનન્દધનજી મહારાજે પરમતારક શ્રી ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કહી :

પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે,
દેખે પરમ નિધાન;
હદ્ય નયાશ નીહાળે જગધાણી,
મહિમા મેરુ સમાન....

સદ્ગુરુ શિષ્યની આંખોમાં પ્રવચન-અંજન આંજે છે અને શિષ્ય હદ્યની આંખોથી પરમાત્માને જુએ છે.

આ શક્તિપાતની વાત છે. સદ્ગુરુ આંખોમાં આંખ પરોવીને પણ શક્તિપાત કરે છે. મસ્તક પર - બ્રહ્મરન્ધ્ર પર - હાથ મૂકીને પણ શક્તિપાત કરે છે. બે આંખની વચ્ચે આવેલ આજાચકને અંગૂઠાથી દબાવીને પણ શક્તિપાત કરે છે.

આ છેલ્લા શક્તિપાતની વાત મહોપાધ્યાય યશોવિજય મહારાજે સ્તવનામાં કરી છે : ‘જસ કહે સાહિબ મુગતિનું, કર્યું તિલક નિજ હાથે.’ ઈશારો આજાચકને દબાવવાની કિયા પરત્વે છે, અને આજાચક ખૂલતાં, ખીલતાં મુક્તિ જરૂરથી મળે છે માટે તેને મુક્તિનું તિલક કર્યું. અને સદ્ગુરુ પરમના પ્રતિનિધિ તરીકે આ કિયા કરે છે માટે પ્રભુએ મુક્તિનું તિલક કર્યું એવો શબ્દ-પ્રયોગ થયો છે.

■ ● ■

ક્યારેક પ્રભુની વાત કરતાં સદ્ગુરુ કહેતા હોય છે : આ રહ્યા પ્રભુ! તેમનો હાથ એ સમયે આકાશ ભણી તકાયેલો હોય છે, પણ શિષ્યે એ વખતે સદ્ગુરુની આંખમાં ઝાંકવાનું હોય છે અને ત્યારે શિષ્યને પ્રભુનું દર્શન ત્યાં મળે છે.

■ ■ ■

પૂનમની રાત.

ઉપાશ્રયમાં ચંદ્રનો રમ્ય પ્રકાશ બારીઓ વાટે રેલાયેલો. ગુરુએ આ દશ્ય જોયું. આ એક અનુભવ હતો. જે ભીતર લઈ જઈ શકે.

અનુભવને હસ્તાન્તરિત કરવા માટે તેમણે શિષ્યને જગાડ્યો. ચંદ્ર તરફ આંગળી ચીંધી કહ્યું : જો !

શિષ્ય ગુરુની, ચાંદનીમાં પ્રકાશિત થયેલી આંગળીઓને જોઈ રહ્યો. ગુરુ કહે : આંગળીઓ સામે નહિ, એ તકાયેલી છે એ દિશા તરફ જો !

શિષ્યે ચંદ્ર જોયો અને ભીતર ઉજાશ-ઉજાશ તેણે અનુભવ્યો.

ઈશારાને આ રીતે ખોલવો જોઈશે. ગુરુ હાથ લંબાવીને કહેશે : પ્રભુ આ રહ્યા ! ને શિષ્ય એ વખતે તેમની આંખોમાં પ્રભુને જોશે.

■ ■ ■

શબ્દ, ઈંગિત અને આકાર પદ્ધીનું શિક્ષાપદ્ધતિનું ચરણ છે ઉપનિષદ્.

ગુરુદેવના ઉપનિષદ્માં / આભામંડળમાં શિષ્ય દૂબી શકે તો સાધનાનો સૂક્ષ્મતમ આયામ એને સાંપડે, અને શાશ્વતીના લયમાં સાંપડે. શબ્દ, ઈંગિત અને આકાર તો ક્યારેક, ક્યારેક મળે. ગુરુદેવનું ઉપનિષદ્ લાંબો સમય માટે મળી શકે. .

ઘારું સૂત્ર આવ્યું : 'પસાયપેહી ણિયાગઢી ઉવચિઢે ગુરું સયા.' પ્રસાદનો ઈચ્છુક મોક્ષાર્થી સાધક હંમેશા ગુરુદેવની નજીદીક રહે.

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી

બૌદ્ધ પરંપરાની એક ઘટના છે કે પહૃશિષ્ય આનંદ એક પૂરી રાત
મહાત્મા બુદ્ધની પાસે જાગતા બેઠા હતા.

શું હતું આ ?

ગુરુદેવના ઉપનિષદ્માં દુભવાનો શિષ્યનો આ પ્રયોગ હતો.

■ • ■

સદ્ગુરુના ઉપનિષદ્દને માણવા માટેની શિષ્યની સજજતા કઈ ?

પરંપરામાં આવેલી અરણિક મુનિની કથા આ પ્રશ્નનો સરસ ઉત્તર
આપે છે. વૈશાખ-જેઠની બળબળતી બપોરે વહોરવા ગયેલ અરણિક મુનિ
વેશ્યાના સૌન્દર્યમાં લુભ્ય થયા. સાધ્વી માતાના ઉપદેશથી ગુરુદેવ પાસે
તેઓ આવ્યા. ગુરુદેવનાં ચરણોમાં તેઓ આવ્યા. ગુરુદેવનાં ચરણોમાં
તેમણે મસ્તક ઝૂકાવ્યું. ગુરુનો વરદ હાથ તેમના મસ્તક પર ફર્યો.
શક્તિપાત થઈ ગયો.

ગુરુના આ ઉપનિષદ્દને માણ્યા પછી, શક્તિપાતની આ ઘટના પછી,
અરણિક મુનિની ભીતર જે સાધનાજગતમાં આગળ જવાનું સામર્થ્ય
ઊભરાયું એ શબ્દાતીત છે, પણ આપણે એ રીતે આ વાત જોઈ શકીએ
કે વૈશાખ-જેઠની ગરમીથી અકળાતા અરણિક મુનિ ધગધગતી શિલા પર
સંથારો કરી બેસી ગયા !

સવાલ અહીં એ થાય કે સદ્ગુરુનું ભાવોપનિષદ્ (શક્તિપાતરૂપે)
અરણિક મુનિને પહેલાં કેમ ન મળ્યું ?

જવાબ એ છે કે ગુરુદેવના એ ઉપનિષદ્દને માણવા માટે અહોભાવની
જે પ્રબળતા જોઈએ તે પહેલાં ન હતી. વેશ્યાને ત્યાંથી આવ્યા પછી
સાધના પરનો આત્મવિદ્યાસ ડગી ગયો, કહો કે સૂક્ષ્મ અહ્મ ધૂજ ગયું,
અહોભાવનું પૂર સદ્ગુરુ ભણી વહેવા લાગ્યું અને સદ્ગુરુનું ઉપનિષદ્

પ્રભુના હસ્તાક્ષર ♦ સદ્ગુરુ દ્વારા સમર્પિતતા ભણી

મળી ગયું. થયું એમને કે જો આ શ્રીચરણો ન હોય, તો ભવરણમાં હું
ક્યાંય ખોવાઈ જાઉં, પતો ન લાગે.

આત્મવિશ્વાસનું ડગવું,
અહમુનું ધૂજવું,
અહોભાવનું છલકાવું
અને
સદ્ગુરુનું ભાવોપનિષદ્ધ મળી જવું.

■ ● ■

સદ્ગુરુ ચાર રીતે શિષ્યને સમર્પિતતાના પાઠો શીખવાડે છે. ‘વિણં
પાઉકરિસ્સામિ...’

■ ● ■

સમર્પિતતાની આ પૃષ્ઠભૂ પર સાક્ષીભાવનું ખીલી ઊઠવું એ છે
ભાગવતી સાધના.

પ્રભુ ! અમને આ સાધના આપો !



॥ प्रभुना हस्ताक्षर ॥

આધારસૂત્ર

સોચ્ચાણં ફરુસા ભાસા, દારુણા ગામકંટગા ।

તુસિણઓ ઉવેહેજા, ન તાઓ મણસીકરે ॥૨/૨૫॥

(કઠોર ભાધા કે અપશબ્દોને સાંભળીને મુનિ મૌન રહી તેની ઉપેક્ષા કરે. તેને મનમાં ન લાવે.)

હાઓ ન સંજલે ભિકખુમણં પિ ન પાઓસાએ ।

તિતિક્ખં પરમં ણચ્ચા, ભિકખુધમ્મં વિચિત્રએ ॥ ૨/૨૬॥

([લાકડીઓ આદિથી] મારવામાં આવે ત્યારેય મુનિ સહેજે ગુસ્સો ન કરે, મનને સહેજ પણ બગાડે નહિ. તિતિક્ષા-સહનશીલતાને શ્રેષ્ઠ માનીને લિક્ષુધર્મનું ચિન્તન કરે.)

સમણં સંજયં દંતં, હણેજ્જા કેઝ કાત્થઝ ।

ણતિથ જીવસ્સ ણાસો ત્તિ, એવં પેહેજસંજએ ॥ ૨/૨૭॥

(સંયત અને ઈન્દ્રિયોને દમનાર મુનિને કોઈ હણો તો તે વખતે મુનિ જુએ કે આત્માનો નાશ તો થવાનો નથી. પછી ચિન્તા શેની ?)


સાધનાસૂત્ર

ઉપેક્ષા

તિતિક્ષા

પ્રેક્ષા

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા



ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા

ભાગવતી સાધનાને એક જ શબ્દમાં
વ્યાખ્યાયિત કરવી હોય તો એ શબ્દ
ક્યો હોય ?

એ શબ્દ છે સર્વસ્વીકાર. મનગમતી
ઘટનાઓ કે વ્યક્તિત્વોનો સ્વીકાર અને
તેથી વિરુદ્ધનો અસ્વીકાર આ સાંમાન્ય
મનુષ્યના પ્રતિભાવમાં આવતી બાબત
છે; સાધક પાસે છે સર્વસ્વીકાર.

રૂપરૂપના અંબાર સમાં મયણા-
સુન્દરી તે વખતે રક્તપિતા જેમના અંગ-

અંગથી ફૂટી નીકળેલો તેવા શ્રીપાળ મહારાજા જોડે લગ્નની ચોરીમાં બેઠેલાં છે ત્યારે પ્રભુશાસનને સમર્પિત એ સાધિકા - મયણા સુન્દરીનો એ ઘટના પરનો પ્રતિભાવ કેવો હતો ? શ્રીપાળ રાસ મયણા સુન્દરીનાં તે વખતના ભાવોનું સુરેખ શબ્દચિત્ર આપે છે : ‘મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણો બેદ; જ્ઞાનીએ દીકું હું રે...’ ન તો તેમના મુખ પર સહેજે વિધાદ અંકાયો છે, કે ન તેમના હદ્ય પર વિધાદની રેખા દોરાઈ છે. ત્યાં હતો માત્ર સ્વીકાર.

અને એની પાછળનું દિલ્હીબિન્ડુ પણ કેવું મજાનું હતું ! જે ઘટના અત્યારે ઘટી રહી છે, તે અનંત કેવળજ્ઞાની મહાપુરુષોએ પોતાના જ્ઞાનમાં જોયેલ છે. તો એ મહાપુરુષોએ જોયેલ હોય એ જ રીતે ઘટના ઘટવાની. એમાં ફરિયાદ કેવી ? ત્યાં તો ઘટે માત્ર સ્વીકાર.

આને જ આપણો ત્યાં કુમબદ્વારા પર્યાય કહેવામાં આવેલ છે. પર્યાયો કુમમાં બંધાયેલા છે અને એ રીતે જ્ઞાનીપુરુષોએ જોયેલા છે. એ પર્યાયો એ રીતે, તે તે સમયે ખૂલે ત્યારે તેમને માત્ર જોવાના હોય છે.

આ રીતે જોવાની ઘટનાને સાક્ષીભાવ કહેવાય છે. ઉત્તરાધ્યયન સૂત્રનો શબ્દ વાપરીએ તો પ્રેક્ષા.

પરમપાવન આચારાંગ સૂત્રમાં એક સરસ સંવાદ આવે છે. જેમાં શિષ્ય સદ્ગુરુને પૂછે છે કે શું દ્રષ્ટાને કોઈ ઉપાધિ હોય છે ? જવાબ મળે છે : ના, દ્રષ્ટાને કોઈ ચિન્તા નથી હોતી.

વાત તો મજાની થઈ. સાક્ષિતવ આવી જાય, કર્તૃત્વ છૂટી જાય; આનંદ જ આનંદ.

(૧) કિમતિથ ઉવાહી પાસગસ્સ ? ણતિથ તિ બેમિ ॥ - આચારો સૂત્ર,

પણ ત્યાં સુધી પહોંચવું શી રીતે ? પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્રનું બીજું અધ્યયન ઉપેક્ષા અને તિતિક્ષા દ્વારા પ્રેક્ષા સુધી પહોંચવાની વાત કરે છે. ત્રણે ચરણોને કુમસર જોઈએ.

■ ■ ■

પહેલું ચરણ : ઉપેક્ષા.

બહુ સરસ સન્દર્ભ છે. કોઈએ સાધકને કઠોર શાષ્ટોમાં કંઈક કહ્યું. સાધકનો પ્રતિભાવ તે વખતે કેવો હશે ?

સાધક તે વખતે મૌન રહીને ઉપેક્ષા તે ઘટનાની કરશે. ઘટનાને પોતાના મનમાં તે પ્રવેશવા નહિ દે.

મનમાં તો હશે માત્ર પ્રભુનો પ્રવેશ. ત્યાં અન્યનો પ્રવેશ થાય જ કેમ ?

મન-ધરમાં પ્રભુનો વાસ... હદ્યંગમ કલ્યના મહોપાધ્યાય શ્રી માનવિજયજી મહારાજે કરી છે : પ્રભુને મેં આમન્ત્રણ આપ્યું કે તમે મારા મન-ધરમાં ન પથારો ? પ્રભુએ એ આમંત્રણ સ્વીકાર્યું. પ્રભુ મન-ધરમાં પથાર્યા.

માનવિજય મહારાજ ઉમેરે છે : મન-ધર મારું, પ્રભુ એમાં આવ્યા. એટલે અર્થ તો એ જ થયો કે મકાનમાલિક હું, ભાડુઆત પ્રભુ. અને પ્રભુ જેવા સક્ષમ ભાડુઆત હોય તો ભાડું ઓછું કેમ લેવાય ?

પુષ્ટિ અને શુદ્ધિરૂપી ભાડું મેં પ્રભુ પાસેથી વસુલ્યું. ગુણો મળવા રૂપે પુષ્ટિ. દોષો જવા રૂપે શુદ્ધિ. ‘પુષ્ટિ શુદ્ધિ ભાટક ગૃહીજી, હું સુભિયો થયો દાસ.’

■ ■ ■

(૨) સોચ્ચાણં ફરુસા ભાસા, દારુણા ગામકંટગા ।

તુસિણિઓ ઉવેહેજા, ન તાઓ મણસીકરે ॥

પ્રભુના હસ્તકાશર ♦ ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા

ઉપેક્ષા...

શબ્દ કો'કનો આવ્યો. સાધક એ શબ્દોનું વિભાજન એ રીતે કરશે કે જે શબ્દ દ્વારા પ્રભુ તરફ જઈ શકતું હોય એ શબ્દને એ મૂલ્યવાન લેખશે. જે શબ્દ વિભાવમાં ભટકાવી શકે તેમ હોય એને એ બાજુમાં મૂકી દેશે.

સંત કબીરે આ જ વાત કરી છે : ‘શબ્દ શબ્દ બિચ અંતરા, સાર શબ્દ ગ્રહી લેય; જો શબ્દ સાહિબ ભિલે...’ જે શબ્દ દ્વારા પ્રભુ તરફ જઈ શકાય તે જ સાર શબ્દ.

સાર શબ્દ લઈ લીધો. અસાર શબ્દ પ્રતિ ઉપેક્ષા.

■ • ■

પણ ઉપેક્ષા ય કેવી ?

તિરસ્કાર ન ભળેલો હોય તેવી ! મગાની વાત થઈને ?

પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ પરમતારક શ્રી સુવિધિનાથ પ્રભુના સત્વનમાં કહે છે : ‘પર પરિણાતિ અદ્વેષપણે ઉવેખતા હો લાલ...’ પરમાં ભળવા તરફ સાધકની ઉપેક્ષા ચોક્કસ રહેવાની, પણ એમાં અદ્વેષ ભળેલો હોય છે.

અહીં સામી વ્યક્તિ કે અમુક શબ્દ ખરાબ છે એ ભાવ નથી, પણ જ્યારે મારે માત્ર સ્વમાં જવું છે ત્યારે પર તરફ લઈ જતા માર્ગો મારે માટે નકામા છે આ ભાવ ઉપસેલો છે.

પાંચ કે સાત રસ્તા જ્યાંથી નીકળતા હોય એ બિન્હુ પર ઊભેલ પ્રવાસી દરેક માર્ગ કઈ બાજુ જાય છે એ જાણવા આતુર નથી હોતો; એની પાસે એવો સમય પણ નથી હોતો. એ તો માત્ર પોતાને જ્યાં જવું છે તેનો માર્ગ કયો એ જાણી એ બાજુ ચાલી નીકળે છે.

■ • ■

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા

પ્રશ્નમરતિ પ્રકરણે, આ વાતને સરસ રીતે, ઉપસાવી છે. ‘પરવૃત્તા-નાન્ધમૂકબધિર’ એણે સાધકને કહ્યો છે. પર તરફ જતી વાતોને જોવામાં એ અન્ધ, સાંભળવામાં એ બહેરો અને એવું બોલવામાં તે મૂંગો હોય છે.

આથી પણ એક ડગલું આગળ વધીને પ્રશ્નમરતિ કહે છે કે સાધક પરગુણને વિષે પણ ઊંડો ઉત્તરનાર ન હોય.

બહુ મજાનો લય અહીં પકડાયો છે.

પરગુણપ્રેક્ષા એ મજાનો માર્ગ છે, સરસ સાધના છે, પણ એ સાપેક્ષ સાધના છે.

સાપેક્ષ સાધના એ સન્દર્ભમાં કે પરદોષદર્શનની કુટેવ પડેલી હોય તો એ કુટેવને છોડાવવા માટે પરગુણદર્શન જરૂરી છે, પણ સાધક જો સ્વમાં જ દૂબેલ હોય તો પરગુણદર્શન જરૂરી નથી... ત્યાં તો છે ગુણપ્રેક્ષા, ગુણનિમજજન. સ્વ અને પર શબ્દોનું ત્યાં મહત્વ છે જ નહિ. ગુણ ગુણ જ છે... શાન, દર્શન, ચારિત્ર... અને જ્યાં એ ગુણોમાં તમે દૂબવાની શરૂઆત કરી; વ્યક્તિઓ ભણી જવાની જરૂર જ ક્યાં છે ?

■ ■ ■

ઉપેક્ષા...

‘તુસિણિઓ ઉવેહેજ્ઞા.’ કો’કે કંઈક કહ્યું, પણ એ તત્કાલીન સાધના માટે જરૂરી નથી, તો સાધક તેની ઉપેક્ષા કરશે.

એ જ પૂછવાનું, એ જ જાણવાનું, જેથી સ્વ તરફ જતા માર્ગની ભાળ મળે.

સમાધિશતક કહે છે : ‘સો કહિએ સો પૂછિએ, તામે ધરિયે રંગ; યા તે મિટે અબોધતા, બોધ રૂપ હુઈ ચંગ (૫૦). તે જ કહો અને તે

જ પૂછો, તેમાં જ આનંદ ધારણ કરો; જેથી સ્વનું અજ્ઞાન નાશ પામે
અને આત્મબોધ પ્રગટે.

■ ● ■

એક આચાર્ય ભગવન્ત સંઘ સાથે યાત્રા માટે જતા હતા. એક ગામમાં
ખ્યાલ આવ્યો કે આગળના મુકામે પાકા રસ્તે જવાથી પાંચેક કિલોમીટર
વધે છે. ટૂંકો માર્ગ છે એ રસ્તે પાંચ કિ.મી. ઓછું થઈ જાય.

રસ્તો કાચો હતો. માર્ગદર્શકો રાખ્યા હતા. આગળ આચાર્ય મહારાજ
હતા. કાચા રસ્તે માઈલસ્ટોન કયાંથી હોય ? ધાર્યું હતું એટલું ચાલવા
છતાં ગામનો કોઈ અણસાર ન મળે. આચાર્ય મહારાજને સંઘમાં ચાલતા
બાળ અને વૃદ્ધ યાત્રિકોની ચિન્તા હોય જ. એમણે પોતાની જોડે ચાલતા
માર્ગદર્શકને પૂછ્યું : હવે કેટલું દૂર છે ગામ ? પેલો કહે : હવે નજીક
છે. અધો કલાક એ પછી ચાલ્યા. ગામનો પત્તો નહિ. પૂછ્યું : હવે
કેટલું ? હવે થોડું જ છે.

બે-ત્રણ જણા થાકેલા. એ વારંવાર પૂછ્યા કરે : કેટલું દૂર છે ?
કેટલું દૂર છે ? માર્ગદર્શકે તત્વજ્ઞાનીની અદાથી કહ્યું : ગાંંવ પૂછને સે
નહિ આતા, ચલને સે આતા હૈ ! ચાલો ! ગામ આવશે.

ભોગ્યિયો જોડે છે. રસ્તાની સચ્ચાઈ વિશે શંકા નથી. હવે શું કરવાનું?
ચાલવાનું જ તો !

આત્મબોધના પથ પર ચાલવું છે. બીજા માર્ગો પ્રત્યે છે ઉપેક્ષા.

■ ● ■

મંજિલ સાધકે નિશ્ચિત કરી છે. મંજિલને અનુરૂપ માર્ગ પકડ્યો છે.
હવે એ માર્ગ બરોબર ચાલવાનું છે. ધણા રસ્તા વચ્ચે ફૂટશે, પણ એનું

તેને કોઈ પ્રયોજન નથી. ઉપેક્ષાનો સીધો અર્થ થશે મંજિલ ભણી લઈ જતા માર્ગ ચાલવું. એ સિવાયના માર્ગાની કથા કરવી નથી.

મધ્યપ્રદેશમાં વિહારયાત્રા અમારી ચાલુ હતી. સાંજે પથર્દર્શક ભાઈએ સવારના માર્ગનું વિવરણ આપેલું. હું સવારે સૌથી પાછળ હતો. જોયું તો થોડા સાધ્યીજીઓને માર્ગ-વિવરણનો ખ્યાલ ન હોઈ વહેલી સવારના એ સમયે તેઓ રસ્તો શોધતા'તા. કોઈ માણસ ન મળે. ત્યાં મને જોયો. પૂછ્યું : આપણો કયા રસ્તે જવાનું છે? મેં વિનોદ કર્યો : આ ડામરનો રોડ સરસ છે ને ! સાધ્યીજીઓ કહે : પણ આ જ આપણો માર્ગ છે ? મેં કહ્યું : આ માર્ગ થોડું ચાલી ડાબા હાથે કંકરાવાળો રોડ છે, તે આપણા પડાવ તરફ લઈ જશે.

કંકરાવાળોય માર્ગ ચાલે. એ મંજિલ તરફ લઈ જાય છે ને! આખરે, માર્ગની જ વ્યાખ્યા શું ? જે આપણને મંજિલ ભણી દોરી જાય તે જ માર્ગ ને!

■ ● ■

બીજું ચરણ છે તિતિક્ષા.

કઠોર શબ્દો સાંભળ્યા. ઉપેક્ષા કરી. પણ ધારો કે કોઈ લાકડીઓથી મારે તો....? એ વખતની સાધકની પ્રતિક્રિયા કઈ હોય ?

એ વખતે મજાથી એ લાકડીઓના મારને સહન કરે. નિર્જરા જેના દ્વારા થાય એ બધું જ એને મજાનું મજાનું લાંગો.

કોઈ ગરીબ માણસને કહેવામાં આવે કે લાકડીના મારને તું સહન કરે તો તેને એક હજાર રૂપિયા મળે. તો પેલા માણસને લાકડીનો પ્રહાર ખણિંગ ખણિંગ રૂપિયાના અવાજ જેવો લાગે.

(૩) હાઓ ન સંજલે ભિક્ખુ, મણ પિ ન પઓસએ ।

તિતિક્ષબં પરમ ણચા, ભિક્ખુધમ્મ વિચિંતએ ॥

આવું જ સાધકને થાય. લાકડીઓનો વરસાદ વરસે અને એ નિર્જરાની વર્ષા એમાં જુએ.

■ ■ ■

સમી સાંજનો સમય.

ગલીમાં અંધારું ઘેરાવા લાગેલું.

એક સંત એ ગલીમાંથી ચાલી મંહિરે જતા હોય છે.

અચાનક એક ગુંડાની લાકડી એમના માથા પર આવી. પેલાની કંઈક ગેરસમજ થયેલી. મારવાનો હતો બીજાને. અંધારામાં સંત પર પ્રહાર થઈ ગયો. ઘ્યાલ આવતાં જ ગુંડો તો રફુચક્કર થઈ ગયો.

સંત પ્રહારને કારણો નીચે ઢળી પડ્યા. બાજુમાં આવેલી દુકાનમાં બેઠેલ વેપારીએ આ દશ્ય જોયું. એ સંતને ઊંચકીને પોતાની દુકાને લાવ્યો. પાટાપિંડી કરી. સંતને વેપારીએ પૂછ્યું : કોણ હશે એ દુષ્ટ માણસ, જેણે આપના જેવા પર પ્રહાર કર્યો ?

સંતે કહ્યું : એ કોઈ ન હતું. મારું કોઈ દુષ્કર્મ હતું, પણ મને સેવા પણ કેવી સરસ મળી ગઈ !

સંતના મનમાં તો ચિન્તન કંઈક જુદું જ હતું, પણ સામી વ્યક્તિના પલ્લે તે ઊતરે તેમ ન હતું, એથી તેમણે કહ્યું નહિ. સંતના મનમાં ચાલતી અનુપ્રેક્ષા તો એ હતી કે લાકડીના સ્પર્શ ટાણે મેં પ્રભુનો સ્પર્શ માણેલો. જે સમયે કોધ આવવાની સંભાવના ગણી શકાય એ વખતે ક્ષમાભાવ આવી ગયો, એ પ્રભુનો સ્પર્શ નહિ તો બીજું શું ?

સંતની આંખો સજળ બની. પ્રભુ તરફ મસ્તક જૂકાવી એમણે કહ્યું : પ્રભુ ! હું તો તારા દર્શન માટે આવતો'તો, તેં સામે ચાલીને મને સ્પર્શ આપ્યો. પ્રભુ ! કેવી તારી કૃપા !

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા

લાકડીના પ્રહારમાં પ્રભુની કૃપા દેખાય. એ ટાણો સમાધિ રહી અને
નિર્જરા થઈ એ પ્રભુનો જ ઉપકાર ને !

■ ■ ■

તિતિક્ષા.

સહનશીલતા.

આમ જુઓ તો, ભૂતકાળમાં ના છૂટકે કેટલું બધું સહન કર્યું છે ?
પીડિતોને જુઓ, કેટલું બધું તેઓ સહન કરે છે ? ત્યાં અકામનિર્જરા છે.
પણ મનની બળતરા બહુ જ હોય તો કર્મબંધ પણ કેટલો બધો !

અને, ઈચ્છાપૂર્વક, કહો કે પ્રભુની આજ્ઞાપૂર્વક થોડું સહન કરીએ
ત્યારે કેવી અપૂર્વ નિર્જરા થાય ?

અદ્ભુત છે આ તિતિક્ષા.

■ ■ ■

ભગવદ્ગીતાનો શ્લોક યાદ આવે :

દુ:ખેષ્વનુદ્વિગ્રમના: સુખેષુ વિગતસ્પૃહ: ।

વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મંનિરુચ્યતે ॥

હુખોમાં જેનું મન સહેજ પણ ઉદ્વિગ્ર થતું નથી. સુખોમાં જેની કોઈ ઈચ્છા
નથી; રાગ, ભય અને કોધને પેલે પાર ગયેલ તે સાધક સ્થિતપ્રણ છે.

બહુ ઘારો શબ્દ છે સ્થિતપ્રણ. જેની પ્રણા સ્વમાં સ્થિર થઈ તે
સ્થિતપ્રણ. બહાર બુદ્ધિને ખૂબ ખૂબ મોકલી; પર પદાર્થોમાં, પર
વ્યક્તિઓમાં, શું મળ્યું અને શું મળી શકે ? સિવાય કે પીડા.

પરમાં જવાથી જે પીડા અનુભવી છે, તેનો સમ્યક્ અનુભવ પણ
સાધકને સ્વમાં સ્થિર બનાવી દે.

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા

ઉપેક્ષા અને તિતિક્ષાથી સ્વ ભણીની શરૂ થયેલી યાત્રાનો છેલ્લો
પડાવ છે પ્રેક્ષા.

■ ■ ■

પ્રેક્ષા.

જોવાનું.

માત્ર જોવાનું.

કોઈ પ્રતિક્રિયા એમાં ભેળવવાની નહિ.

‘જ્ઞાનસાર’ પ્રકરણ મુનિની વ્યાખ્યા આપતાં કહે છે : મન્યતે યો
જગત્તત્ત્વ, સ મુનિઃ પરિકીર્તિતઃ । જે જગતના તત્ત્વને માત્ર જાણો; એમાં
તરે નહિ, સરે નહિ, દૂબે નહિ, વહે નહિ તે મુનિ.

પ્રવાહમાં વહેવામાં કર્તૃત્વ છે. જોવામાં સાક્ષીભાવ છે.

અહીં આવશે સર્વસ્વીકાર. ઘટના આમ ઘટી તો પણ જોવાની છે,
તેમ ઘટી તો પણ જોવાની છે.

■ ■ ■

ઘટનાઓ પ્રત્યે બે બાબતો શક્ય છે. ઘટનાને તમે ચૂર-ચૂર પણ
કરી શકો, બદલી શકો; અથવા તો તમે બાજુમાંથી પસાર થઈ જાવ.

રાત્રે આવેલ વાવાડોડામાં જો મોટા ઝડનું થડ આખા રોડને આવરીને
ઢળેલું પડ્યું હશે તો બુલડોઝરવાળો યાત્રિક એને પોતાના બુલડોઝરથી
દૂર કરીને ચાલ્યો જશે. પણ નાનકડી ગાડી લઈને નીકળેલો યાત્રિક
નીચે ગાડી ઉતારી, ડાયવર્જન લઈ, આગળ નીકળી જશે.

આપણા જેવાઓ માટે બીજો માર્ગ બરોબર છે : ઘટનાને નજરઅંદાજ
કરીને ચાલી નીકળવું. ઘટનાથી પ્રભાવિત ન બનવું. પ્રભુથી પ્રભાવિત
બનવું. આ જ તો છે ઘટનાનો સ્વીકાર.

ઘટનાઓ પ્રત્યે પહેલો માર્ગ મહાપુરુષોનો હોય છે.

મારા દાદા ગુરુદેવ ભદ્રસૂરિ મહારાજાના જીવનની એક ઘટના મને યાદ આવે છે. એ વખતે પૂજ્યશ્રીનું વય સો વર્ષનું. સ્વમાં જ સ્થિત મહાપુરુષ - ગીતાભાષ્યા સ્થિતપ્રશ્ન સા તેઓ હતા. આરાધનામાં લીન.

વિહારયાત્રા, તે વખતે અમારી અમદાવાદથી રાધનપુર તરફની હતી. વણોદ મુકામે આવ્યા. ઘ્યાલ આવ્યો કે સાંજે પાનવા જઈ શકાય તો સવારે શંખેશ્વરજી પહોંચી જવાય. શંખેશ્વરજી દાદાનાં ચરણોમાં એક દિવસ વધુ રોકાવા મળે. અમે લોકોએ નિર્ણય લીધો સાંજના વિહારનો. પાનવામાં રાત્રિરોકાણ માટે સ્કૂલ આદિની વ્યવસ્થા થઈ ગઈ. સાંજે સાડા ચારે પૂજ્યપાદશ્રીજીને કહ્યું કે, સાહેબજી ! સાંજે વિહાર છે.

અચાનક જ તેઓશ્રીના મુખમાંથી નીકળ્યું : આજે સાંજે વિહાર ? નહિ, સાંજે વિહાર નહિ. વિનંતી કરી કે, સાહેબજી ! કાલે સવારે અહીંથી નીકળીએ તો પંચાસર સુધી જવાશે. શંખેશ્વરજી બીજા દિવસે પહોંચાશે. જ્યારે સાંજે વિહાર કરીએ તો કાલે સવારે શંખેશ્વરજી પહોંચી શકાય. પણ પૂજ્યશ્રી કહે : સવારે વધારે વિહાર કરવો હોય તો ના નથી, પણ આજે સાંજે નહિ.

વિહાર બંધ રાખ્યો. તે સાંજે વહોરીને આવ્યા ને એવી તો આંધી ઊપડી કે બારી-બારણાં ઊપાશ્રયનાં બંધ કરવા છતાં નળિયામાંથી એવી ધૂળ ખરતી કે ગોચરી કેમ કરવી એની વિમાસણ થઈ. એ વખતે થયું કે જો પૂજ્યપાદશ્રીને ડોળીમાં લઈ સાંજે વિહાર કર્યો હોત તો વઢિયારના એ વૃક્ષોવિહોણા પ્રદેશમાં પૂજ્યશ્રીને કઈ રીતે અમે સામે ગામ પહોંચાડત?

એ પછી તો રોજ સાંજે - ચૈત્ર વદના એ દિવસોમાં આંધી ઊપડતી. અને અમે લોકોએ નક્કી કર્યું કે સવારે થોડું વધારે ચાલવું, પણ સાંજે વિહાર ન કરવો.

શંખેશ્વરજીથી સમી થઈને બાસ્પા ગામે આવ્યા. અચાનક પૂજ્યપાદ-શ્રીજીએ પૂછ્યું : રાધનપુર ક્યારે પહોંચીશું? કહ્યું, કાલે ગોચનાદ. પરમ દિવસે રાધનપુર. ક્યારેય પૂજ્યશ્રીજી વિહારની બાબતમાં હસ્તક્ષેપ ન કરે. આજે તેમણે કહ્યું, સાંજે ગોચનાદ ચાલો. કાલે સવારે રાધનપુર પહોંચવું છે.

અમે તો વિચારમાં પડી ગયા. રોજ સાંજે આંધી ઊપડતી. આવામાં પૂજ્ય ગુરુભગવંતને લઈને વિહાર કેમ કરવો? પરંતુ, તેઓશ્રીના વચન પર અનન્ય આસ્થા પણ ખરી. તેથી વિહાર કર્યો. તે સાંજે ન આંધી, ન ધૂળ... અમે બરોબર સમયસર ગોચનાદ પહોંચી ગયા.

મહાકવિ ભવભૂતિએ કહ્યું છે : 'ત્રણીણાં પુનરાદ્યાનાં ચમર્થોઽનુધાવતિ...' જ્ઞાણિઓની વાણીની પાછળ અર્થ દોડે છે. તેઓ માત્ર શબ્દો ઉચ્ચારી દે છે. પ્રકૃતિનાં પરિબળો તેને સાર્થક કરવા યતે છે.

■ • ■

પ્રેક્ષા.....

ઘટનાઓથી અપ્રભાવિત દશા. સ્વમાં જ સ્થિર થવાની મજાની વાત.

મહાભારતનો પ્રિય શ્લોક છે; જે કહે છે કે ઊભો રહેતો, બેસતો, ચાલતો, સૂતો કે ખાવા આદિની કિયા કરતો સાધક આત્મા સિવાય બીજું કાંઈ જાણતો નથી કે અનુભવતો નથી. એ કિયાઓ બહારથી ચાલ્યા કરે છે અને સાધક પોતાની ભીતર સ્વ-રસને આસ્વાદ્યા કરે છે.՝

(૪) તિષ્ઠન્તમાસીનમુત બ્રજન્તં, શયાનમુક્ષન્તમુદન્તમત્તમ् ।

સ્વભાવમન્યત્ કિમપીહમાનં, આત્માનમાત્મસ્થમતિર્ વેદ ॥ -મહાભારત

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા

વિભાવની ચાલતી કિયાઓ વચ્ચે પણ સાધકનું પોતાની ભીતર ઠરવું.
કેવી મજાની વાત !

■ ● ■

પ્રેક્ષા.....

શરીરને પણ જોવાનું.

શરીરમાં થતી કિયાઓનેય જોવાની.

અને એનો નાશ - શરીરનો - થતો હોય તો એય જોવાનો.

સંત દદામીને એક સમ્રાટે કહું : ચાલો, મારી સાથે મારે દેશ.

સંતે ના પાડી. સમ્રાટનું જોર શેમાં ? તલવારમાં ! એણો તો તલવારને
મ્યાન બહાર કાઢી. સંતના ગળા પાસે અડાડીને કહું : મારું કહું માનો,
નહિતર આ તલવારથી માથું ઊરી જશે.

સંતની પ્રતિકિયા આટલી જ હતી : માથું ઊરુશે ત્યારે એ કિયાને
જોઈશું. એમાં પણ ભળવું ક્યાં છે ? એનેય જોઈશું.

■ ● ■

પ્રેક્ષા....

મુનિને તલવાર લઈને કોઈ હણવા આવેલ છે, ત્યારે મુનિ વિચારે છે
કે આ શું કરશે ? શરીરને હણશે. કહો કે આત્મા અને શરીરના સંયોગને
દૂર કરશે. બાકી અહીં ખરેખર તો કંઈ મરવાનું નથી જ. ‘ણતિથ જીવસ્સ
નાસો ત્તિ.’ આત્મા તો અમર છે. એનો ક્યાં નાશ થવાનો છે ? ૫

‘અખ હમ અમર ભયે, ન મરેંગે !’ ગાવાની કેવી મજાની આ ક્ષણો !

(૫) સમણ સંજયં દંતં, હણેજ્જા કેઇ કત્થઇ ।

ણતિથ જીવસ્સ નાસો ત્તિ, એવં પેહેજ સંજએ । -ઉત્તરાધ્યયન સૂત્ર

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉપેક્ષા, તિતિક્ષા, પ્રેક્ષા

ગીતામાં અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું છે : અધ્યાત્મ કોને કહેવાય ?

શ્રીકૃષ્ણ કહે છે : સ્વભાવ તે જ અધ્યાત્મ છે.:

સ્વભાવિક લયમાં અસ્તિત્વ પ્રગટે તે જ અધ્યાત્મ. વૈભાવિક લયનું ‘હું’ દૂર થાય અને સ્વભાવિક લયનું હું પ્રગટે તે જ અધ્યાત્મ.... તે જ સાધનાપ્રેક્ષા આ ભૂમિકા સુધી સાધકને પહોંચાડે છે.

મિર્રો ગાલિબની એક પંક્તિ યાદ આવે : ‘ન થા કુછ તો ખુદા થા,
ન હોતા કુછ તો ખુદા હોતા; દૂબોયા મુજકો હોને ને, ન હોતા મૈં તો
ક્યા હોતા ?’

■ • ■

રમણ મહર્ષિને માંદગીની ક્ષાળોમાં લાગ્યું કે મૃત્યુ નજીક આવી રહ્યું છે.
થયું કે જોઈ લાઉં મૃત્યુને. અનુભવ થયો કે શરીર ઠંડું પડી રહ્યું છે ને ‘હું’ તો
અકબંધ છે. ‘અહું બ્રહ્માસ્મિ’ (હું બ્રહ્મ છું)નો આ પહેલો તેમનો અનુભવ.

દેહમાં રહેતા, વેદનાને કે મૃત્યુને જોતાં જોતાં શુદ્ધ હું ભાવને પામવાની
આ કેવી મજાની રીત !

■ • ■

ઉપેક્ષા, તિતિક્ષા અને પ્રેક્ષા... સાધનાને પ્રતિકૂળ જે કંઈ હોય, શબ્દો
કે ઘટનાઓ, તેને ફૂદાવી જવાની આ મજાની વિધિઓ.

પ્રેક્ષાની ભૂમિકાએ જે સર્વસ્વીકાર છે, તેને જીલવા માટેની સજ્જતા
ઉપેક્ષા અને તિતિક્ષાની ભૂમિકાઓએ પણ કરી છે. ત્રણે સાધના પદ્ધતિઓ
દ્વારા સાધક પામે છે સર્વસ્વીકારને. પ્રભુની સાધનાને સાધક આ રીતે
આત્મસાત્ કરે છે.

(૬) સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે ॥ -ગીતા



આધારસૂત્ર

-સોહી ઉજ્જુયભૂયસ્સ, ધમ્મો સુદ્વસ્સ ચિદૃઙ ।

નિવાણ પરમં જાઇ, ઘયસિત્તુ વ્ય પાવએ ॥ - ૩/૧૨ ॥

ऋજુ સાધકને શુદ્ધિ ગ્રામ થાય છે. અને શુદ્ધ હદ્યમાં ધર્મ રહે છે. ધર્મી સાધક ધીથી સિંચાયેલા અગ્રિની પેઠે પરમ નિર્વાણને (સમાધિને) પામે છે.

- અજવયાએ ણં ભંતે કિં જણયિ ?

અજવયાએ ણં કાઉજ્જુયયં ભાવુજ્જુયયં ભાસુજ્જુયયં અવિસંવાયણં જણયિ । અવિસંવાયણસંપન્નયાએ ણં જીવે ધમ્મસ્સ આરાહએ ભવિં । - ૨૧/૪૯

ऋજુતાથી, હે ભગવન् ! શું મળે?

ऋજુતાથી કાયાની ઋજુતા, ભાવોની ઋજુતા, ભાષાની ઋજુતા, અને અવિસંવાદન (જેવું કહેવું તેવું કરવું) ને જીવ મેળવે છે.

અવિસંવાદને પામેલો જીવ ધર્મનો આરાધક બને છે.

પુછ્છેજા પંજલિઉડો, કિં કાયવ્ય મએ ઇહ ।

ઇચ્છં નિઓડિં મંતે, વેયાવચ્ચે ય સજ્જાએ ॥

વેયાવચ્ચે નિત્તેણ, કાયવ્ય અગિલાયઓ ।

સજ્જાએ વા નિત્તેણં, સવ્વદુક્ખવિમોક્ખણે ॥ ૨૬ / ૩-૧૦

(સૂર્યનો ઉદ્ય થતાં દિવસના પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થ ભાગમાં પાત્રાદિનું પ્રતિલેખન કરીને) શિષ્ય હાથ જોડીને પૂછે છે: હવે મારે શું કરવું જોઈએ ? હું ઈચ્છાં છું કે વેયાવચ્ચે કે સ્વાધ્યાયમાંથી એક કાર્યમાં આપ મને જોડો !

॥ પ્રભુના હસ્તાક્ષર ॥


વૈયાવૃત્યમાં જોડવામાં આવે તો તે પ્રસત્તા પૂર્વક કરે અથવા સર્વ
દુઃખોમાંથી મુક્ત કરનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરવામાં આવે તો
પ્રસત્તાભાવથી તે કરે.

સાધનાસૂત્ર

ત્રણજુતાથી

હદ્યની નિર્મળતા અને

હદ્યની નિર્મળતા તે જ ધર્મ.



નિર્મણ હદ્ય

કેનેડિયન કવિ લેનર્ડ કોહેનની એક
કવિતાનો સુરેશ દલાલે કરેલો અનુવાદ:

એ એટલું સરસ ગાય છે કે
(લાગે કે)
એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.
એ એકલી ગાય છે.
આપણાને બધાને કહેવા માટે કે
હજુ આપણો આપણાને મળ્યા નથી.

■ ● ■

સાધના એટલે આપણું આપણાને મળવું. આ છે સહજને કિનારે ચાલવાની મજાની લટાર.

સિદ્ધ સરહપાદનું સૂત્ર યાદ આવે : ‘ના તોહિ વાચહિ ગુરુ કહૈ,
ના તોહિ બૂજ હી શિષ્ય; સહજ સ્વભાવ હી અમીય રસ, કાસુ કહીજે
કિસ ? જેતાઈ પઈસે જલ હી જલ, તેતાઈ સમરસ હોઈ; દોષ ગુણાકર
ચિત્તતા, મૂઢ ! પ્રતિપક્ષ ન હોઈ.....

જેને ગુરુ વાણીથી ન કહી શકે, જેને શિષ્ય મનથી સમજ ન
શકે, તે સહજ સ્વભાવરૂપ અમૃતરસને શી રીતે કહી શકાય ?

જેમ જળમાં જળ સમાઈ જાય છે, તેમ (પૂરું ચિત) સમરસ
બની જાય છે. અરે મૂઢ ! તેવા ચિતમાં ગુણા, દોષ કે તેમનો પ્રતિવાદ
કંઈ જ પ્રવેશતું નથી.

અનુભૂતિગમ્ય ભીતરી દુનિયા ભણીનો આ ઈશારો છે. જ્યાં આનંદ
જ આનંદ છે. સહજતા એટલે આપણું મૂળ સ્વરૂપ, અને તે આનંદથી
ભરપૂર છે.

■ ● ■

‘યોગશાસ્ત્ર’માં કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજી અનુભૂતિગમ્ય આ
વિશ્વનું શબ્દચિત્ર આ રીતે આપે છે :

સતત ઉદાસીન ભાવમાં દૂબેલ, પ્રયત્નોથી પર ઉઠેલ, પરમાનંદમાં
મહાલનાર આત્મા ક્યાંય મનને જોડતો નથી.

આત્મા વડે ઉપેક્ષિત મન ઈન્દ્રિયોનો આશ્રય લેતું નથી, અને આવી
દશામાં, આશ્રય વિના, ઈન્દ્રિયો પણ પોતપોતાના વિષયોમાં પ્રવેશતી નથી.

જ્યારે આત્મા મનને પ્રેરતું નથી, અને મન ઈન્દ્રિયોને પ્રેરતું નથી;

ત્યારે બંને બાજુથી વિખૂટું પડેલું (આત્મા અને ઈન્દ્રિયોથી) મન પોતાની મેળે નાશ પામે છે.

મન, આ રીતે, નષ્ટ થયે છતે, બહિર્ભાવ સંપૂર્ણતા વિલીન થાય છે અને ત્યારે નિષ્કલંક એવું આત્મતત્ત્વ ઉદ્દિત થાય છે. હવા વગરના સ્થાનમાં રહેનાર દીવાની પેઠે.¹

સાધકને યોગશાખે ત્રણ વિશેષણો આપ્યા : ઉદાસીન ભાવમાં દૂબેલ, પ્રયત્નોથી પર ઉઠેલ અને પરમાનન્દમાં મહાલનાર.

ઉદાસીનતા... બહુ ઘારો શબ્દ છે આ. બે શબ્દોના જોડાણથી આ શબ્દ બન્યો છે : ઉદ્ + આસીનતા. ઉંચે રહેવાપણું. પ્રવાહમાં વહેવાનું નહિ, કંઠે બેસીને જોયા કરવાનું.

કર્તૃત્વનો છેદ ઉડ્યો અહીં. અને એટલે જ બીજું વિશેષણ આવ્યું : પ્રયત્નોથી પર ઉઠેલ.

કોઈ જ વૈભાવિક ઈચ્છા જ નથી જ્યારે - પ્રશંસા આદિની - કર્તૃત્વની પીડા ક્યાં રહી ?

(૧) ઔદાસીન્યનિમગ્રઃ, પ્રયત્નપરિવર્જિતઃ સતતમાત્મા ।

ભાવિતપરમાનન્દઃ, ક્રचિદપિ મનો ન નિયોજયતિ ॥

કરણાનિ નાધિતિષ્ઠત્યુપેક્ષિતં ચિત્તમાત્મના જાતુ ।

ગ્રાહે તતો નિજનિજે કરણાન્યપિ ન પ્રવર્તન્તે ॥

નાત્મા પ્રેરયતિ મનો, ન મનઃ પ્રેરયતિ બહિ:કરણાનિ ।

ઉભયભ્રષ્ટં તર્હિ સ્વયમેવ વિનાશમાપ્રોતિ ॥

નષે મનસિ સમન્તાત्, સકલં વિલયં સર્વતો યાતે

નિષ્કલમુદેતિ તત્ત્વં, નિર્વાતસ્થાયદીપવત् ॥ -યોગશાખ, ૪૦ ૧૨

ભગવદ્ગીતાનો શ્લોક હોઠે ચડી આવે :

યस્ત્વાત્મરતિરેવ સ્યાદ्, આત્મતૃસશ્ર માનવः ।

આત્મન્યેવ ચ સન્તૃપ્ત-સ્તસ્ય કાર્ય ન વિદ્યતે ॥

આત્મરતિ, આત્મતૃપ્ત અને આત્મસન્તૃપ્ત સાધકને કોઈ કાર્ય બાકી રહેતું નથી.

સરસ ત્રણ ચરણો આવ્યાં : આત્મભાવમાં રતિ, તૃપ્તિ, સન્તૃપ્તિ. આત્મભાવમાં છબદ્ધબિયાં, તરવાનું અને ઉંડી દૂબકી.

ઉદાહરણ આ રીતે અપાય : જ્ઞાતાભાવના ત્રણ સ્તર કલ્પીએ. સામાન્ય જ્ઞાતાભાવ, વિશેષ જ્ઞાતાભાવ અને વિશિષ્ટતર જ્ઞાતાભાવ. શી રીતે આ સ્તરો સર્જશે ? જ્ઞાતાભાવમાં જેમ જેમ નિર્લેપતા ભળતી જશે તેમ તીક્ષ્ણતા આવતી જશે. તો નિર્લેપતા તીવ્ર માત્રામાં ભળી, તો જ્ઞાતાભાવ તીક્ષ્ણ બન્યો.

આ જ સંદર્ભમાં જ્ઞાતાભાવની તીક્ષ્ણતાને ચારિત્ર (નિર્લેપદશા/ ઉદાસીનભાવ) અધ્યાત્મગીતા કહે છે : ‘જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ.’

જ્ઞાતાભાવના પ્રથમ સ્તરે સાધક હોય આત્મરતિ. બીજા સ્તરે આત્મતૃપ્ત. અને ત્રીજા સ્તરે આત્મસન્તૃપ્ત સાધક બને છે.

■ • ■

કર્તૃત્વનો છેદ ઉંડ્યો અને સાધક પરમ આનન્દને માણનાર બન્યો.

આવો સાધક - ઉદાસીન, કર્તૃત્વને પેલે પાર ગયેલ અને પરમાનન્દમાં દૂબેલ - મનને ક્યાંય જોડતો નથી.

મનોલય વિભાવલયમાં પરિણમશે, અને એ વિભાવોના વાદળાઓ વિખેરાતાં જ, આત્મારૂપી ચન્દ્રનો ઉદ્ય દેખાશે. ‘નિષ્કલમુદેતિ તત્ત્વं,

નિર્વાતિસ્થાયિદીપવત् ॥' ઉદાહરણ સરસ આપ્યું : હવા વગરના સ્થાને
રહેનાર દીવાની પેઠે આત્મતત્ત્વરૂપી દીપ પ્રકાશે છે.

ફાનસ પ્રગટાવેલું હોય, પણ હવાના જોરદાર જપાટા આવે તો એ
બૂજાઈ જ જાય. એમ આત્મતત્ત્વનું થોડુંક અનુધ્યાન લાગતું હોય અને
વિકલ્પોનો પવન 'સાંય-સાંય' કરતો વહ્યો તો...? પેલું અનુધ્યાન ક્યાં રહેશે?

પહોંચેલ સાધક તો, આ રીતે, મનોવિજેતા હશે જ. પણ પ્રારંભિક
સાધક પાસે અપેક્ષા એટલી જ છે કે સાધનાના સામા છેડાના વિકલ્પો
તેના મનમાં ન પ્રવેશે તેની એ તકેદારી રાખે. સાધનાને અનુકૂળ વિચારોનો
ત્યાં વાંધો નથી.

■ ■ ■

'યોગશાસ્ત્ર'ની ઉપર કહેલી વાત સાધનાનું પરિણામ દેખાડે છે.
સાધકના હદ્યમાં કેવો તો આનંદ છલક છલક છલકાતો હોય છે એની
વાત ત્યાં કરાઈ.

પણ પ્રારંભિક સાધક પૂછશે કે આ તો સાધનાની બહુ જ ઊંચી
દશા છે. પ્રારંભ બિન્દુ કયું ?

ઉત્તરાધ્યયનસૂત્ર પ્રારંભબિંદુ તરીકે ઋજુતાને સ્વીકારે છે. ઋજુતાથી
હદ્યની નિર્મળતા અને એ નિર્મળતા તે જ સાધના.²

'યોગસાર' ગ્રન્થમાં શિષ્યના પ્રશ્નને કલ્પીને ગુરુદેવ જે પ્રત્યુત્તાર
આપે છે, ત્યાં પણ આ જ વાત કહેવાઈ છે.

શિષ્યનો પ્રશ્ન હદ્યથી નીકળેલ છે : ગુરુદેવ ! પ્રભુનો આજ્ઞાધર્મ
પીસ્તાળીશ આગમગ્રન્થો અને એ પછીના સેંકડો ગ્રન્થોમાં સમજાવાયેલ
છે. આપ મને સંક્ષેપમાં એ આજ્ઞાધર્મ સમજાવો ને !

(2) સોહી ઉજ્જુઅભૂઅસ્સ । ધર્મો સુદ્ધસ્સ ચિદૃઙ ।

ગુરુની કરુણા શબ્દોમાં આ રીતે વહી આવે છે : ‘આજ્ઞા તુ નિર્મલં ચિત્તં, કર્તવ્યં સ્ફટિકોપમમ્’ ચિત્તને, હદ્યને સ્ફટિક જેવું નિર્મળ બનાવવું તે છે પ્રભુનો આજ્ઞાધર્મ.

■ ● ■

ઝજુતા.

અને તેથી આવેલી હદ્યની નિર્મળતા.

તો, ઝજુતા અને નિર્મળતા વચ્ચે કાર્ય-કારણ ભાવ થયો.

ઝજુતાનો પર્યાય આપણે લચીલાપણું કરી શકીએ.

શિષ્યના બે પ્રકાર બતાવેલા છે : બરફ જેવો, પાણી જેવો. બરફનો મોટો ટૂકડો હશે. જગમાં કે વોટરબેગમાં નાખવો હશે તો એને તોડવો પડશે. પણ, પાણી...? એને તો કોઈ આકાર જ નથી, અને માટે એ ગમે તે પાત્રમાં ઢળી શકશે, ગોઠવાઈ જશે.

શિષ્યનું લચીલાપણું આ હદનું હશે. ગુરુદેવની કોઈપણ આજ્ઞાને તે પ્રેમથી સ્વીકારી શકશે. કારણ કે એની પોતાની કોઈ ઈચ્છા નથી.

આવા નિરીહ સાધકના મુખેથી જ આ વચન નીકળો : ગુરુદેવ ! આજે મારે શું કરવાનું છે ?³

અહીં શિષ્ય છે કોરી સ્લેટ જેવો. ગુરુ લખે તે જ અક્ષર ! બરોબર છે ને ! ચિત્તની સ્લેટ પર ગુરુદેવ લખશે, કોરશે તે જ તો અક્ષર-શાશ્વત બનશે ને ! બાકી બધું તો છે ક્ષર.

(૩) કિં કાયવ્ય મએ ઇહ ?

-ઉત્તો સૂત્ર

રમેશ પારેખનું ગીત યાદ આવે :

કે કાગળ હરિ લખે તો બને,

અવર લખે તે એકે અક્ષર

નથી ઉક્લાતો મને....

મોરપીંછનો જેના ઉપર

પડછાયો ના પડિયો;

શું વાંચું એ કાગળમાં,

જે હોય શાહીનો ખડિયો;

એ પરબીડિયું શું ખોલું, જેની વાટ ન

હો આંખને.....

મીરાં કે પ્રભુ શાસ અમારો,

કેવળ એક ટપાલી;

નિશાદિન આવે જાય લઈને,

થેલો ખાલી ખાલી;

ચિંઠી લખતાં વેંત પહોંચશે,

સીધી મીરાં કને....

■ ■ ■

શિષ્યનું ચિત્ત કોરી સ્લેટ જેવું હોવું જોઈએ. સવારે અને સાંજે પ્રતિકમણમાં ‘સવ્વસ્સ વિ...’ સૂત્ર દ્વારા શિષ્ય ગુરુદેવને પોતાની ચિત્તની સ્લેટ પર ડસ્ટર (લૂંછણિયું) લગાવવાની વિનંતિ કરે છે.

ગુરુદેવ ! મારી ચિત્તની સ્લેટ દુર્વિચારોથી ખરડાઈ ગઈ છે, મારો વાગ્યોગ દુર્ભાષણાથી અને કાયયોગ દુષ્કાર્યોથી અશુભ બન્યો છે.... અને ગુરુદેવ ‘પડિકુમેહ’ શાષ્ટ્રનું ડસ્ટર મારી ચિત્તની સ્લેટને-ત્રણો યોગોને

-શુભ બનાવે છે. ગુરુદેવ આજી આપે છે : તારે દુર્વિચાર કરવાના ન હતા, પણ થઈ ગયા છે તો હવે પાછો ફરી જા !

શિષ્ય ગુરુદેવની આજી માને છે. અને લ્યો, આ ચિત્તની સ્લેટ કેવી તો ચોક્ક્ખી ચણાક થઈ ગઈ !

■ ● ■

ઋજુતા એટલે નિર્દ્દર્શનતા.

દર્ભા હોય ત્યાં જ હોય મહિનતા. નિર્દ્રભતા છે ત્યાં નિર્મળતા જ હોય.

ऋજુ સાધકે ગુરુદેવથી કંઈ જ છુપાવવાનું નથી. એની ચિત્તની ડાયરી બિલકુલ ખુલ્લી છે, અને સાધકની એ સાવધાની છે કે જીવનની ડાયરીનો એક નાનકડો ખૂણો પણ ગુરુથી વંચાયા વિનાનો ન રહે.

સહેજ પણ સ્ખલન થયું, મનમાં પણ કોઈ ખરાબ વિચાર આવી ગયો; એ ગુરુદેવને જણાવી દેશે.

નિર્દ્રભતાનો પર્યાય છે અવિસંવાદન. કહેવામાં અને કરવામાં અન્તર ન હોય તે અવિસંવાદન. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઓગણત્રીસમાં અધ્યયનમાં જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રભુ ! ઋજુતાથી શું મળે ? ત્યારે ત્યાં કહેવામાં આવ્યું કે ઋજુતાથી અવિસંવાદન મળે છે. અને અવિસંવાદક - નિર્દ્રભ સાધક સાધનાનો સાધક બને છે.૪

ઋજુતાથી જેમ અવિસંવાદન મળે છે, તેમ કાયાની ઋજુતા, ભાવોની ઋજુતા અને ભાષાની ઋજુતા મળે છે તેમ પણ ઉત્તરાધ્યયન સૂત્ર (૨૮/૪૮)માં કહેવાયું છે.

(૪) અજવયાએ એં કાઉજુયં ભાવુજુયં ભાસુજુયં અવિસંવાયણ જણયાએ। અવિસંવાયણસંપત્ત્રયાએ એં જીવે ધર્મસ્સ આરાહાએ ભવાએ ॥ -ઉત્ત૦ ૨૯/૪૯

■ ● ■

જીજુ સાધકના હદ્યના ભાવો જીજુ હોય, બરોબર; તેની ભાષામાં
પણ સરળતા હોય, બરોબર; પરંતુ તેની કાયામાં જીજુતા હોય છે એવું
કહેવાની પાછળ શું તાત્પર્ય ?

બહુ મજાની વાત થઈ કે કાયા પણ દર્પણ જેવી છે. ભીતરી સરળતા
ચહેરા પર ડોકાયા વિના કેમ રહી શકે ?

સદ્ગુરુ, આથી જ, ચહેરાને વાંચીને સાધકના હદ્યના ભાવોને જાણી
લે છે.

■ ■ ■

જીજુતાની પાછળ છે સમર્પિતતાનો ભાવ. આથી વિરુદ્ધ આગહની
પાછળ અહેંકાર ધૂપાયેલ છે, અને એટલે, જીજુ સાધક નિરાગહી હોય છે.

‘હું આમ જ કરીશ’ આવો શબ્દ પ્રયોગ કે વિચાર નિરાગહી સાધકને
ન હોય. એનું ચિન્તનનું ધૂવપદ તો આટલું જ હોય : ગુરુદેવ જે પ્રમાણે
આશા કરે તેમ કરવું છે.

■ ■ ■

સંત કબીરે સાધક કેવો હોવો જોઈએ તેની માર્મિક પ્રસ્તુતિ કરી છે :

રોડા હોઈ રહો વાટ કા, તજિ આપા અભિમાન;
લોભ મોહ તૃષ્ણા તજે, તાહિ મિલે ભગવાન....

સાધક રસ્તાના પથ્થર જેવો હોય. પથ્થર... કોઈ એને હડસેલે,
ધૂતકારે, તિરસ્કારે એની કોઈ પ્રતિક્રિયા નથી.

સાધક હોય ઘટનાઓથી અપ્રભાવિત.

■ ■ ■

જો કે, પથ્થર બીજાઓથી પ્રાપ્ત થતી અસુવિધાઓમાં સ્વસ્થ રહે.
પણ પોતાના તરફથી બીજાને તકલીફ પડે એનું શું ?

પથ્થર કોઈને વાગી જાય તો... ?

એટલે આગળની સાખી આવી :

રોડા ભયા તો કયા ભયા, પંથી કો દુખ દેહ;
સાધુ ઐસા ચાહિયે, જ્યોં પૈરે કી બેહ.

પથ્થર મુસાફરને તકલીફ આપે છે. તો સાધક જોઈએ રસ્તાની ધૂળ
(પૈરે કી બેહ) જેવો.

મતલબ કે સાધક હોય કોમળ-કોમળ હદ્યવાળો.

■ ○ ■

પણ, રસ્તાની ધૂળથી તો પ્રવાસીના અંગો રજોટાઈ જાય, આ તો
કેમ ચાલે ?

બેહ ભયા તો કયા ભયા, ઊરિ ઊરિ લાગે અંગ;
સાધુ ઐસા ચાહિયે, જૈસે નીર નિપંગ.

નિર્મણ જળ જેવો સાધક જોઈએ.

બીજાને પણ નિર્મણતા આપનારો હોય સાધક. એના અસ્તિત્વમાંથી
એવી તો નિર્મણ આભા નીકળતી હોય કે એ આભાથી નજીક આવનારાઓ
- એના ઔરા સર્કલમાં પ્રવેશનારાઓ - નિર્મણ બની જાય.

હજુ કબીરજીને સંતોષ નથી. એટલે કહે છે :

નીર ભયા તો કયા ભયા. તાતા સીરા હોય;
સાધુ ઐસા ચાહિયે, જો હરિ હી જૈસા હોય....

પાણી ઠંડુ-ગરમ થાય છે. નીચે આગ ચૂલાની હોય તો પાણી ગરમ
થઈ જશે. સાધક તો કોધવાળો ચાલી જ ન શકે. એટલે કહું : સાધક
પ્રભુ જેવો હોય. આમ પણ, પ્રભુને ભજતાં પ્રભુ જેવાં જ બનવાનું છે
ને! ‘અરિહન્તના ધ્યાને અરિહન્ત બની જશું....’

સિદ્ધપ્રભુની પાસે જે ગુણો છે, તે બધા જ સાધક પાસે છે જ. એ ઢંકાયેલા છે. જ્યાં ઘ્યાલ આવે છે કે ક્ષમા વગેરે મારા ગુણો છે. ત્યારે કોઈનું પ્રાગટ્ય કર્યાં થશે ?

નિર્મણતા છે, પણ નિર્મણતાના ભાર વિનાની. નિર્મણતાનોય અહંકાર આવી જાય તો નિર્મણતા કર્યાં રહી ?

નિર્મલ ભયા તો કયા ભયા, નિર્મલ માંગે ઠૌર;
મલ-નિરમલ સે રહિત હૈ, તો સાધુ કોઈ ઔર...

નિર્મલતાનું અભિમાન ન જોઈએ. હું નિર્મણ છું, બીજા સમલ છે આવો જો ભાવ ભીતર હોય તો દુન્યવી નજરે મળિન (હકીકતમાં તો સિદ્ધ સમાન તે પણ છે) વ્યક્તિત્વોને પ્રેમ કેમ આપી શકાશે?

સમલ દશા કે નિર્મલ દશાની ફેરફારમાં બદ્ધ સાધુ ન જ હોય. એની દણિમાં કોઈ વ્યક્તિ પતિત છે જ નહિ.

ઉલદું, એને તો એમ લાગે કે દુનિયામાં જો હીનમાં હીન કોઈ હોય તો તે હું છું. ભક્ત કવિ સુરદાસજી પ્રાર્થનામાં કહે છે : ‘મોં સમ કૌન કુટિલ ખલ કામી, જિન તનુ દિયો સો હી બિસરાયો, એસો નિમકહરામી...’ ભગવાન ! મારા જેવો વાંકો, દુષ્ટ અને કામી કોણ હશે? જેણે આ શરીરને આપ્યું એ પ્રભુને ભૂલી જનાર હું કેવો તો નિમકહરામી છું !

■ ■ ■

પરમ પાવન ઉત્તરાધ્યયન સૂત્રનું આ ઘારું સૂત્ર હદ્યની ગુફામાં ગુંજું ઉઠદું જોઈએ : ‘સોહી ઉજ્જુયભૂયસ્સ...’ ઝજુતા સાધકનો અનિવાર્ય ગુણ છે. ઝજુતા દ્વારા નિર્મણ હદ્ય અને એ પછી સાધનામાર્ગે પ્રયાણ.

પ્રભુ ! અમને નિર્મણ હદ્ય આપો.



આધારસૂત્ર

સુત્તેસુ યાવી પડિબુદ્ધજીવી, ન વીસસે પંડિએ આસુપણો ।

ઘોરા મુહુત્તા અબલં સરીરં, ભારંડ પક્ખી વ ચરપ્પમત્તે ॥૪-૬॥

આશુપ્રશ્ન પંડિત સૂતેલ વ્યક્તિઓની વચ્ચે અપ્રમત્ત રહે. પ્રમાદમાં વિશ્વાસ ન કરે. કાળ કુર છે. શરીર નિર્બણ છે, એથી ભારંડ પક્ખીની પેઠે અપ્રમત્ત રીતે સાધક વિચારે.

ચરે પયાઙ્ગ પરિસંકમાણો, જં કિંચિ પાસં ઇહ મત્ત્રમાણો ।

લાભંતરે જીવિય વૂહિત્તા, પઢ્છા પરિન્નાય મલાવધંસી ॥૪/૭॥

ડગલે ડગલે દોષોથી ભયભીત સાધક થોડા દોષને પણ પાશ-ફાંસલો માનીને ચાલે. નવા નવા ગુણોની પ્રાપ્તિ થાય તે માટે જીવનને સાચવે. અને નવા ગુણોની પ્રાપ્તિની શક્યતા ન હોય ત્યારે વિચાર પૂર્વક શરીરનો ત્યાગ કરે.

છંદં નિરોહેણ ઉવેઝ મોકખં, આસે જહા સિક્ખિયવમ્ધારી ।


પુષ્વાઙ્ગ વાસાઙ્ગ ચરપ્પમત્તો, તમ્હા મુણી રિખ્પમુવેઝ મોકખં ॥૪-૮॥

શિક્ષિત, બખ્તરવાળા અશ્ચ જેમ યુદ્ધમાં પાર પામે તે રીતે સ્વચ્છન્દતાનો નિરોધ કરી મુનિ મોક્ષને પામે છે. પૂર્વો/વર્ષો સુધી અપ્રમત્તભાવે વિહરીને મુનિ જલ્દી મુક્તિને પામે છે.

સાધનાસૂત્ર

અપ્રમાદ

ઈચ્છાનિરોધ



અપ્રમાદ - યાત્રા

કવિ રોબર્ટ ફ્રોસ્ટની પ્રસિદ્ધ કાવ્ય
પંક્તિઓ યાદ આવે :

Woods are lovely, dark and deep,
but I have a word to keep;
And miles to go before I sleep
And miles to go before I sleep.

(જંગલો સુન્દર, ધેરાં, ગહન, કિન્નુ
મેં તો દીધાં છે કેંક વચન,

પોઢચા પહેલાં જાવું કેંક જોજન,
પોઢચા પહેલાં જાવું કેંક જોજન.)

મંજિલ દૂર છે અને એટલે વચ્ચે ક્યાંય રોકાવાય તેવું નથી. ચાલ્યા જ કરો.

અને, આ માર્ગ ચાલતાં થાક નહિ લાગે. ‘મોહિ મગ ચલત ન હોહિહી હારિ, જિન જિન ચરન સરોજ નીહારી.’ પ્રભુનાં ચરણ-કમળોને જો સતત નીરખ્યા કરવાના હોય તો થાક ક્યાંથી લાગે ?

જેઈએ માત્ર પ્રાણવાન સંકલ્ય. યાત્રા શરૂ !

મહાત્મા બુદ્ધનું વચન યાદ આવે :

ઇહાસને શુદ્ધ્યતુ મે શરીરં,
ત્વગસ્થિમાંસં પ્રલયં ચ યાતુ ।
અપ્રાપ્ય બોધિં બહુકલ્પદુર્લ્લભા,
નैવાસનાત् કાયમનશ્રલિષ્યતિ ॥

(આ આસન પર શરીર સૂક્ષ્માઈ જાય કે ચામડી, હાડકા, માંસ બધું જ સાફ થઈ જાય, ઘણા જન્મોએ પણ ન મળે તેવી બોધિને પામ્યા વિના આ આસનથી મારી કાયા કે મન ડગશે નહિ.)

પરમપાવન દશવૈકાલિક સૂત્રમાં સાધકના સંકલ્યને આ રીતે બિરદાવવામાં આવેલ છે :

આત્મા થયો નિશ્ચિત જેહનો કે,
ત્યજશ હું દેહ ન ધર્મશાસન;
તેને ચળાવી નવિ ઈન્દ્રિયો શકે,
ઝંજાનિલો મેરુ મહાદ્રિને યથા.’

(૧) જસ્સેવમપ્પા ઉ હવિજ નિચ્છિઓ, ચિંજ દેહં ન તુ ધર્મસાસણ ।

તં તારિસં નો પફલંતિ ઇંદિઆ, ઉવિંતવાયા વ સુદંસણ ગિરિ ॥ -દસ. ચૂ. ૧/૧૭

ભક્ત હદ્ય આ સંકલ્પને આ રીતે સંવેદે છે : હદ્યમાં રહેલ તમારા વડે જે રીતે પ્રેરણા અપાય છે, પ્રભુ ! તે જ રીતે હું કરું છું.^૩

■ ● ■

સાધક ભીની, ભીની ભીતરની ભોમકા પર સંકલ્પનાં બીજોને છીડકે છે જેથી તે જલ્દી ફળાયી નીવડે.

આ ભીનાશ પ્રભુના અનુગ્રહને સ્વીકારવાથી પ્રગટી છે. આ ભીનાશ સદ્ગુરુદેવની કૃપાધારાને જીલવાથી થઈ છે.

પરમનો અનુગ્રહ કર્તૃત્વના પડોની કઠિનતાને દૂર કરી હદ્યની ભૂમિકાને કોમળ બનાવે છે.

અને એ ભૂમિકા પર સંકલ્પના બીજો જલ્દી અંકુરિત, પુણ્યિત અને ફલિત થાય છે.

■ ● ■

સંકલ્પ: યાત્રાને વણથંભી ચાલુ રાખવાનો. અપ્રમાદ-સૂત્રોમાં આ વિષે બહુ જ માર્મિક માર્ગદર્શન અપાયું છે.

પ્રજ્ઞાવાન સાધક અપ્રમત્તા રહે એમ ચતુર્થ અધ્યયન કહે છે.^૪

સાધનાનો બીજો પર્યાય, આમ પણ, અપ્રમાદ જ છે ને !

ભક્તિ એટલે ગાઢ સ્મરણ.

સાધના એટલે તીક્ષ્ણ અપ્રમાદ.

■ ● ■

(૨) ત્વયા હષીકેશ ! હદ્દિ સ્થિતેન, યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ ॥

(૩) સુત્તેસુ યાવી પડિબુદ્ધજીવી, ન વીસસે પંડિએ આસુપણે ।

ઘોરા મુહુત્તા અબલં સરીરં, ભારંડ પક્ખી વ ચરપ્પમત્તે ॥૪-૬ ॥

ચંદનબાળાએ પ્રભુ મહાતીર દેવને કહેલું : આપ મારે ઘરેથી પાછા કેમ જઈ શકો, નાથ ! ‘એક શાસમાં હિ સો વાર, સમરું તમને રે..’ સાંસ-સાંસ પર એક વાર નહિ, સો-સો વાર તમારું સુભિરન કરનારી હું, તમે મારે દારેથી પાછા કેમ જઈ શકો ?

પૂ. વીરવિજય મહારાજ બાર વ્રતની પૂજામાં કહે છે : ‘એમ ચંદનબાળાને બોલડે, પ્રભુજી પધાર્યા રે...’

ભક્ત પાસે છે ગાઢ સુભિરન. ક્ષણ-ક્ષણાનું સુભિરન...

સાધક પાસે છે ક્ષણ-ક્ષણનો અગ્રમાદ. એક ક્ષણ પણ પ્રમાદ રહી ગયો તો...? આત્મ-ધન છૂ !

■ ■ ■

સાંજના સમયે એક સંત ગામ બહાર એક વૃક્ષ નીચે આવ્યા. સાધના કરવા લાગ્યા. રાતે નવેક વાગ્યે બાજુમાં રહેલ બંગલાનો ચોક્કિયાત આંટો મારવા નીકળ્યો. ત્યાં એણે જોયું : સંત છે. પાસે આવ્યો, પગે લાગ્યો.

સંતે પૂછ્યું : તમે કોણ છો ? શું કરો છો ?

ચોક્કિયાતે કહ્યું : હું સામે રહેલ બંગલાના માલિકનો નોકર છું. શેરી મને પગાર આપે છે. આખી રાત, મટકુંય માર્યા વિના મારે જાગવાનું હોય છે કે જેથી કોઈ ચોર વગેરે આવી ન જાય.

સંતે મનમાં કહ્યું : તું તારા માલિકને વફાદાર છે. એટલો હું મારા માલિકને વફાદાર હોત...તો ! તો એક ક્ષણ પણ પ્રમાદમાં હું ન હોઉં ને ! આવી પ્રભુની કૃપા મારા પર ઉતરો !

■ ■ ■

આશુપ્રજા સાધક અગ્રમત્તા રહે...

અગ્રમત્તતા તે જ સાધકની ચતુરાઈ...

પૂ. દેવચન્દ્રજી મહારાજે પરમતારક શ્રી ઋષભદેવ પ્રભુની સ્તવનામાં સરસ સવાલ ઉઠાવ્યો છે : ‘ऋષભ જિષાંદ સું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર...’ હે પ્રજ્ઞાવાન ભક્ત ! મને કહો કે પ્રભુ સાથે પ્રીતિ કેવી રીતે થાય ?

બહુ મજાની આ વાત થઈ. પ્રભુની સાથે પ્રીતિથી ગુંથાયેલું મન જેનું હોય તે ચતુર ભક્ત... અને એને જ પૂછાય કે પ્રભુ-પ્રીતિનો માર્ગ ક્યો ?

સાધકની ચતુરાઈ એની ક્ષણ-ક્ષણની અપ્રમત્તાની છે.

■ ■ ■

સુત્તેસુ યાવી પઢિબુદ્ધજીવી । સૂતેલાઓની વચ્ચે - પ્રમાદીઓની વચ્ચે રહેવા છતાં સાધક હોય છે જાગૃત, અપ્રમત.

પ્રમાદીને જોવાય, એના પ્રમાદના ફળને જોવાય, સાધક અપ્રમત બની જ જાય.

ત્રણ અવસ્થાઓ અત્યારે આપણી પાસે છે જ : જાગરણ, સ્વખ, નિદ્રા...

જાગરણ અને સ્વખ બેઉ સમાન છે. સામાન્ય વ્યક્તિના જાગરણમાં વિકલ્પોનું ઘોડાપૂર ચાલતું હોય છે. સ્વખમાં પણ એ ચાલતું હોય છે. નિદ્રામાં આત્મબોધ / હોશ નથી હોતો.

ઉજાગર એને કહે છે, જેમાં નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર આત્મબોધ હોય છે.

આમ ઉજાગર અવસ્થા તેરમા ગુણસ્થાનકે છે. પણ એની નાનકડી આવૃત્તિ આપણી કક્ષાએ હોઈ શકે છે. જ્ઞાનસાર ગ્રન્થ એટલે જ અનુભવને ઉજાગર અવસ્થા કહે છે.૪

(૪) ન સુષુપ્તિરમોહત્વા-ન્નાપિ ચ સ્વાપજાગરૌ ।

કલ્પનાશિલ્પવિશ્રાન્તેસ્રુત્યેવાનુભવો દશા ॥ -જ્ઞાનસાર, ૨૬/૭

ઉજાગર યોગીઓની લાડકી અવસ્થા છે, અને તેથી યોગીઓ તેને નામથી સંબોધણા નથી. તેને તુરીયા, તુર્યા, ચતુર્થી, ખ ફોર્થ એ રીતે તેઓ સંબોધે છે.

શિવસૂત્રનું એક સૂત્ર છે : 'ત્રિષુ ચતુર્થ તૈલવદાસેચ્યમ्।' ત્રણ અવસ્થા-જાગૃતિ, નિદ્રા, સ્વપ્ન-માં ઉજાગરને ભેળવવું.

આનો પ્રાયોગિક રસ્તો આ છે કે દર કલાકે પાંચથી દશ મિનીટ ઉજાગરને ભેળવીએ. ઉજાગરની એ ક્ષણોમાં વિકલ્પો ન હોય અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સ્વગુણોમાં સાધકનું રહેવાનું હોય.

■ ■ ■

અનુભવ તે જ ઉજાગર દશા, અથવા એમ કહીએ કે સંપૂર્ણ સ્વાનુભૂતિ તે ઉજાગર.... સાધકની કક્ષાની અનુભૂતિ તે ઉજાગરની નાનકડી આવૃત્તિ:

અનુભવ જોઈએ નિર્દ્વન્દ્વ. નિર્દ્વન્દ્વ આત્મસ્વરૂપને જેનાથી અનુભવી શકાય તે અનુભવ દ્વારાને પેલે પારનો હોવો જોઈએ.^૫

દ્વન્દ્વ શી રીતે મચે છે ? અનુભવ એટલે માત્ર અને માત્ર સ્વનો અનુભવ. હવે જો વિકલ્પોની પૃષ્ઠભૂ પર અનુભવ થશે તો અહીં સ્વાનુભૂતિ અને પરાનુભૂતિનું મિશ્રણ થયું. ખારું પાણી અને મીઠું પાણી ભેગું થયેલ હોય તેમ.

અનુભવ જોઈશે નિર્દ્વન્દ્વ, વિકલ્પાતીત.

'જ્ઞાનસાર'માં ઉપાધ્યાયજી શ્રીયશોવિજય મહારાજ ભાવુકને પૂછે છે: નિર્દ્વન્દ્વાનુભવ વિના નિર્દ્વન્દ્વ આત્મસ્વરૂપને તમે કેમ જોશો ? / અનુભવશો? અને, નિર્દ્વન્દ્વાનુભવ શબ્દો વડે કેમ મળશે ?

(૫) પશ્યતુ બ્રહ્મ નિર્દ્વન્દ્વ, નિર્દ્વન્દ્વાનુભવં વિના ।

કથં લિપિમયી દ્રષ્ટિ-વાડીમયી વા મનોમયી ॥ -જ્ઞાનસાર, ૨૬/૬

ન તો ત્યાં લખેલ વાણી - ગ્રન્થાત્મિકા - કામ લાગશે, ન બોલાયેલ
શબ્દો ત્યાં કામના થશે કે ન તો વિચારપ્રવાહ.

તો શું કરવાનું ?

માર્ગ જ્ઞાનસારના અનુભવાષ્ટકમાં જ છે. શાસ્ત્રદિષ્ટ વડે સંપૂર્ણ
શબ્દબ્રહ્મને પામીને સાધક સ્વસંવેદ્ય આત્મસ્વરૂપને અનુભવ વડે પામે છે. ९

આગળ શબ્દો પર ચોકડી મૂકી કે શબ્દો અનુભવની દિશામાં જવા
માટે સાવ નકામા છે. અહીં કહે છે શબ્દબ્રહ્મને શાસ્ત્રદિષ્ટ વડે પામીને
સ્વાનુભૂતિ કરાય છે.

બે શબ્દો પર આપણું અનુધ્યાન જશે કે તરત ફરક સમજાઈ જશે.
પહેલાં જે કહ્યું કે શબ્દો અંકિયિત્કર છે, તે વ્યક્તિના પોતાના અભિમત
શબ્દોની વાત હતી. વિકલ્પોને અનુસાર ઢળેલ અભિમત... શો અર્થ
એનો?

અહીં શાસ્ત્રદિષ્ટની વાત કરી. સદ્ગુરુ દ્વારા મળતું જ્ઞાન. ગુરુ દ્વારા
જે જ્ઞાન મળશે તે વિકલ્પો પરની આસ્થાને ચૂરી નાખશે.

અને, સદ્ગુરુ દ્વારા જ્ઞાન મળશે ત્યારે જ એ શબ્દબ્રહ્મ બનશે. બે
કિયાઓ થઈ : ગુરુએ જ્ઞાન આપ્યું ને વિકલ્પો ખર્યા અને શબ્દબ્રહ્મ - જે
પરબ્રહ્મને પામવાનું સશક્ત સાધન છે - મળ્યું.

■ • ■

આ શબ્દબ્રહ્મને જ પર રસ કહેલ છે. પૂજ્યપાદ આનંદધનજીના શબ્દો
યાદ આવે : 'સગરા હોય સો ભર ભર પીવે, નગરા જાયે ઘાસા...'
સદ્ગુરુનાં ચરણોમાં રહેલ વ્યક્તિત્વો આ રસને પેટ ભરીને, મન ભરીને
પી શકે છે. નગરા-ગુરુ વગરનાં વ્યક્તિત્વો રહે છે તરસ્યા, તરસ્યા.

(૬) અધિગત્યાખિલં શબ્દ-બ્રહ્મ શાસ્ત્રદૃશા મુનિઃ ।

સ્વસંવેદ્યં પરંબ્રહ્માનુભવેનાધિગચ્છતિ ॥ -જ્ઞાનસાર ૨૬/૮

સંત રવિદાસજી સદ્ગુરુ દ્વારા અપાતા પર રસની વાત આ રીતે
કરે છે :

સદ્ગુરુએ શ્રવણે રસ રેડ્યો,
ચાંધો રુદ્ધિયા માંહિ,
સાંધેસાંધે રસ સંચર્યો,
ઉન્મુન રહ્યો ઠેરાઈ.

અસ્તિત્વના સાંધે સાંધે એ રસ ઊતરે છે, ફેલાય છે અને મનને
પેલે પારના પ્રદેશમાં - આત્મતત્ત્વની રમણતામાં - તે રસ જર્યા કરે છે.

આ ભૂમિકાએ છે નિરન્તર ખેલ. કર્તૃત્વની ભૂમિકા ધૂટી ગઈ છે.
છે સાક્ષીભાવની ભૂમિકા.

પૂ. આનંદઘનજી મહારાજે કર્તૃત્વને પેલે પારની આ યાત્રાનું હદ્યંગમ
વર્ણન એક પદમાં કર્યું છે :

ના હમ મનસા, ના હમ શબ્દા,
ના હમ તન કી ધરણી;
ના હમ ભેખ ભેખધર નાહિ,
ના હમ કરતા કરણી....
ના હમ દરસન, ના હમ પરસન,
રસ ન ગંધ કઢુ નાહિ;
આનંદઘન ચેતનમય મૂરત...

સદ્ગુરુ દ્વારા અપાયેલ શબ્દભ્રણ-પર રસ શું કરે છે એનું વર્ણન
ઉપર આવ્યું છે.

પહેલે જ છલાંગે નિર્વિકલ્પતા. ‘ના હમ મનસા, ના હમ શબ્દા.’
વિચાર અને શબ્દ તો પૌદ્ગલિક ઘટના છે. હું છું ચિન્મય. વિચાર મારું
સ્વરૂપ નહિ. શબ્દ મારું સ્વરૂપ નહિ.

‘ના હમ તન કી ધરણી.’ દેહ પરની મૂર્ચ્છા-અધ્યાસ ગયો. દેહના માત્ર સાક્ષી. શરીર ખાઈ રહ્યું છે, તમે જુઓ છો. તમે છો માત્ર દષ્ટા.

‘ના હમ ભેખ, ભેખધર નાહિ’ બોલતાં સાધક નિશ્ચયના આકાશમાં વિહરે છે. નરસિંહ મહેતા યાદ આવે : ‘નિશ્ચયના મહેલમાં વસે મારો આતમા...’

પૂજ્યપાદ પદ્મવિજય મહારાજ વ્યવહાર અને નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા આપતાં કહે છે :

‘પરિષહ સહનાદિક પરકારા, એ સબ હૈ વ્યવહારા,
નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા...’

પરિષહોને સહન કરવા એ વ્યવહાર ચારિત અને નિજગુણ સ્થિરતા તે નિશ્ચય ચારિત.

પ્રભુનો વેષ, નિઃશંક, અદ્ભુત વસ્તુ છે. પણ અહીં નિશ્ચયની મુખ્યતા હોઈ સીધા જ આત્મગુણોના સ્પર્શની વાત છે.

અને હવે ઉતે છે કર્તૃત્વનો છેદ : ‘ના હમ કરતા, ના હમ કરની.’ નથી તો વિભાવોનું કર્તૃત્વ મારી પાસે કે નથી વિભાવોની કિયા...

‘ના હમ કરની’ સૂત્ર એક સરસ પ્રાયોગિક સાધના પરત્યે આંગળી ચીધે છે : વિભાવોની, દેખીતી-ખાવા, પીવા આદિની કિયા ચાલતી હોય ત્યારે સાધક એ કિયાઓ સાથે પોતાની જાતને એકાકાર ન બનાવે.

બહારના સ્તર પર ભોજન આદિની કિયાઓ ચાલતી હોય અને ભીતરના સ્તરે સાધક પોતાના જ્ઞાનાદ ગુણોના ઉપયોગમાં મહાલતો હોય.

‘ના હમ દરસના, ના હમ પરસન.’ જોવાની કે સ્પર્શવાની કિયા જોડે આત્માને સંબંધ નથી. આત્મતત્ત્વ દર્શન અને સ્પર્શનને પેલે પાર રહેલું છે એવો ભાવ અહીં ધ્વનિત થાય છે.

તમે, આત્માને માત્ર અનુભવી શકો... ‘રસ ન ગંધ કછુ નાહિ...’

યાદ આવે ‘પરમાત્મપંચવિશતિકા’નો શલોક :

ન સ્પર્શો યસ્ય નો વર્ણો,
ન ગંધો ન રસઃ શ્રુતિઃ ।
શુદ્ધચિન્માત્રગુણવાન्,
પરમાત્મા સ ગીયતે ॥૫॥

સ્પર્શ, રૂપ, ગંધ, રસ અને શબ્દને પેદે પાર રહેલું શુદ્ધ ચિન્માત્રમાં
સ્થિત છે આત્મતત્ત્વ. ‘આનંદધન ચેતનમય ભૂરત...’

■ ■ ■

આ લયમાં આદ્ય શંકરાચાર્યકૃત આ સ્તોત્ર રટવું ગમશે:

મનો બુદ્ધયહઙ્કારચિત્તાનિ નાહં,
ન ચ શ્રોત્રજિહ્વે ન ચ ઘાણનેત્રે,
ન ચ વ્યોમભૂમિર્ન તેજો ન વાયુઃ,
ચિદાનન્દરૂપ: શિવોऽહમ् શિવોऽહમ् ॥૧॥

ન ચ પ્રાણસંજ્ઞો ન પञ્ચાનિલા મે,
ન વા સમધાતુર્ન વા પञ્ચકોશઃ,
ન વાક્પાણિપાદૌ ન ચોપસ્થપાયુઃ,
ચિદાનન્દરૂપ: શિવોऽહમ् શિવોऽહમ् ॥૨॥

ન મે દ્વેષરાગો ન મે લોભમોહૌ,
ભયો નૈવ મે નૈવ માત્સર્યભાવઃ,
ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોક્ષઃ,
ચિદાનન્દરૂપ: શિવોऽહમ् શિવોऽહમ् ॥૩॥

ન પુન્યં ન પાપં ન સૌખ્યં ન દુઃખં,
ન મન્ત્રો ન તીર્થ ન વેદા ન યજાઃ,

અહં ભોજનં નैવ ભોજ્યં ન ભોક્તા,
ચિદાનન્દરૂપઃ શિવોऽહમ् શિવોऽહમ् ॥૪॥

ન મે મૃત્યુશઙ્કા ન મે જાતિભેદઃ,
પિતા નैવ મે નैવ માતા ન જન્મ,
ન બંધુર્ન મિત્ર ગુરુનૈવ શિષ્યઃ,
ચિદાનન્દરૂપઃ શિવોऽહમ् શિવોऽહમ् ॥૫॥

અહં નિર્વિકલ્પો નિરાકારરૂપો,
વિભુવ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાળિ,
સદા મે સમત્વં ન મુક્તિર્ન બન્ધઃ,
ચિદાનન્દરૂપઃ શિવોऽહમ् શિવોऽહમ् ॥૬॥

(૧) મન, બુદ્ધિ, અહંકાર કે ચિત્તરૂપ હું નથી. કાન, જીભ, નાક કે આંખ પણ હું નથી. આકાશ, પૃથ્વી, તેજ કે વાયુરૂપ પણ હું નથી. હું છું ચિદાનન્દરૂપ, શિવ.

(૨) પ્રાણ કે પંચવાયુ સ્વરૂપ હું નથી. સાત ધાતુ કે પાંચ કોશરૂપ પણ હું નથી. વાણી, હાથ, પગ કે અન્ય અવયવરૂપ હું નથી. હું છું ચિદાનન્દરૂપ, શિવ.

(૩) દ્વેષ કે રાગ મને નથી. લોભ કે મોહ પણ મને નથી. અહંકાર કે ઈર્ષા મને નથી. ધર્મ, અર્થ, કામ કે મોક્ષરૂપ હું નથી. હું છું ચિદાનન્દરૂપ, શિવ.

(૪) હું પુષ્પ કે પાપસ્વરૂપ નથી. હું સુખ કે દુખરૂપ પણ નથી. મંત્ર, તીર્થ, વેદ કે યજ્ઞરૂપ હું નથી. હું ભોજન નથી, ભોજ્ય (ખાવાનો) પદાર્થ નથી, કે ભોક્તા નથી. હું છું ચિદાનન્દરૂપ, શિવ.

(૫) મૃત્યુની શંકા મને નથી, કે જન્મ મારો નથી. (અને એથી જ) પિતા, માતા, જન્મ, બન્ધુ, મિત્ર, ગુરુ, શિષ્ય આદિ કોઈ ભાવ મને સ્પર્શતો નથી. હું છું ચિદાનન્દરૂપ, શિવ.

(૬) હું નિર્વિકલ્ય, નિરાકાર છું. હું વ્યાપક છું. સર્વ ઈન્દ્રિયો આદિને વ્યાપીને હું રહેલ છું. મારે હંમેશા સમત્વ છે. નથી મુક્તિ કે નથી બન્ધ... હું છું ચિદાનંદરૂપ, શિવ.

■ ■ ■

શાષ્ટ ખ્રિસ્ત તે પરમ રસ. એને કહેવાય છે અગમ પિયાલો. બુદ્ધિ આદિથી અગમ્ય એવો રસનો ઘાલો. પૂ. આનંદધનજી કહે છે ‘અગમપિયાલા પીઓ !’.

સદ્ગુરુ આ રસ કઈ રીતે આપે છે એની વિધિઓની માર્મિક રજુઆત આપણે ત્યાં થઈ છે.

મહોપાધ્યાયશ્રીયશોવિજ્યમહારાજ શ્રી મુનિસુપ્રતસ્વામી ભગવાનની સ્તવનામાં કહે છે:

‘જસ કહે સાહિબે મુગતિનું, કરિયું તિલક નિજ હાથે.’

અહીં, દેખીતી રીતે, આજાચકને ગુરુ સ્પર્શો છે એનો નિર્દેશ છે. અહીં પ્રભુ અને ગુરુને એક કરી દીધા છે. સદ્ગુરુમાં જ્યારે અહમું આદિનું ખાલીપણું વિકસે છે ત્યારે પરમ ચેતનાનું તેમનામાં પ્રાગટ્ય થાય છે.

તો, આજાચકને અંગૂઠા વડે દખાવો અને એ પરમ રસ મળે આ એક વિધિ.

બીજી વિધિની વાત પૂજ્યપાદ આનંદધનજી મહારાજે કરી : ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન, હદ્ય નયાણ નીહાળે જગધણી, મહિમા મેરુ સમાન...’

સદ્ગુરુ ભક્તતના અસ્તિત્વના સ્તર પર પ્રવચન અંજન આંજે છે. અહોભાવનું પ્રગાઢ રીતે અવતરણ સદ્ગુરુ કરે અને ભક્ત હદ્ય અંદરનાં નેત્રોથી પ્રભુને જુએ.

ત્રીજ વિધિ ખેચરી મુદ્રાની પણ છે.

આખરે તો, વિધિઓ સદ્ગુરુના હાથમાં છે. પરમ રસ પીવાની તીવ્ર તડપન સાધકના પક્ષે છે.

■ ● ■

‘સુત્તેસુ યાવી પડિબુદ્ધજીવી, ન કીસસે પંડિએ આસુપણો....’

આશુપ્રશ પંડિત પ્રમાદમાં વિશ્વાસ ન કરે. પ્રમાદીઓને જોઈને, તેમને પડતી તકલીફો જોઈને તે અપ્રમત્ત બને.

પર ભાવમાં જેની બુદ્ધિ ગઈ તે પ્રમત્ત. અને પરમાં જ જ્યારે રહેવાનું હોય, સુખ ક્યાંથી ?

પરનો સંયોગ દુઃખોની પરંપરા ઊભી કરશે. સાધક નિશ્ચિંત હોય છે. સુખી હોય છે. કારણ કે તેની પાસે છે પરમસંયોગ. પર-સંયોગ નહિ.

ઝષીકેશમાં આવેલ એક ભક્ત સંતોને પ્રસાદ વહેંચવા નીકળ્યા. કોઈ સંત આ કુટિરમાં, કોઈ સંત પેલી કુટિરમાં છે. ભક્ત બધે ફરે છે. પહેલા જ જે સંત મળ્યા, એમણે કહ્યું : આજ કા ભોજન હો ગયા. ભક્તે વિનંતિ કરી : મિઠાઈ છે. કાલે પણ કામ આવશે. સંતે કહ્યું : કલ કી બાત કલ ! એમણે ધરાર ના પાડી. ‘કલ મિલેગા તો ખાયેંગે. વર્ના ઉપવાસ કરેંગે... જૈસી માલિક કી ઈચ્છા...’

ચહેરા પર એવી તો મસ્તી ઝલકતી હતી કે સંપત્તિથી સમૃદ્ધ તે ભક્તને એ મસ્તીની ઈર્ધા આવી...

■ ● ■

ઘોરા મુહુર્તા, અબલં સરીરં, ભારણપક્ખીવ ચરણપ્પમત્તે... કાળ ભયંકર છે, શરીર નિર્બણ છે એટલે સાધક ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત રીતે વિહરે.

ભારંડ પક્ષીનું વર્ણન પવિત્ર કલ્પસૂત્રની કિરણાવલી ટીકામાં આ રીતે અપાયું છે : બે જીભ અને બે મુખવાળા, એક પેટવાળા પણ લિન્ન ફળોને ખાવાની ઈચ્છાવાળા ભારંડ પક્ષી છે. °

પંચતન્ત્રમાં સરસ કથા ભારંડ પક્ષીની આવે છે. અમૃત ફળ મળ્યું. એક મુખે તેને ખાધું. બીજા મુખને ખાવાની ઈચ્છા થઈ. એણે કહ્યું : આમ ફરી જઈએ તો હું પણ - મારા મુખને - જીવાને પણ એનો આસ્વાદ મળે. પહેલા મુખે ના પાડી.

એક વાર ક્યાંક વિષ ફળ દેખાયું. ગિન્ધાયેલા બીજા મુખે વિષફળ ખાધું. પહેલાએ ના પાડી. પણ આ તો ગુસ્સામાં હતું.. ‘તનેય બતાવી દઉ !’ વિષફળ પેટમાં ગયું. પેટ એક હતું. બંને મૃત્યુને શરણ થયા.

ભારંડ પક્ષી સતત જાગૃત રહે તો જ જીવન તેનું લંબાઈ શકે. ઊંઘવા, ખાવા વગેરેની કોઈ પણ કિયા બેઉની સહમતિથી થાય તો ભલે. નહિતર, ખેલ ખતમ !

■ • ■

સાધક કેવો હોય ?

પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્રે સાધકને મજાનું વિશેષજ્ઞ આપ્યું છે: સંશોદક. એક એક ડગલું ભરતાં એના હદ્યમાં શંકા હોય કે અહીંથી તો મને રાગ કે દ્રેષ નહિ થઈ જાય ને !^(૭)

સસલું વગડામાંથી ગામમાં આવી ગયું હોય અને એને રસ્તાની એક બાજુની વાડથી બીજી બાજુની વાડે જવું હોય તો એ કેવું તો ભયભીત

(૭) દ્વિજિહ્બા દ્વિમુખાશ્વૈકોદરા ભિન્નફલौષિણ: । -કલ્પસૂત્ર, કિરણાવલી

(૮) ચરે પયાંં પરિસંકમાણો, જં કિંચિ પાસં ઇહ મત્રમાણો । ૪/૬

હોય ! રસ્તો ઓળંગતી વખતે કોઈ ફૂતરું કે બીજું પ્રાણી પોતાને મારી તો નહિ નાખે ને !

સાધક આવો સશંક, ભયભીત હોય. કોઈ પણ દોષ પોતાને લાગી ન જાય એ માટે એની તીવ્ર સાવધાની છે.

■ • ■

દોષમુક્ત કોણ બનાવે ?

દોષોથી મુક્તિ પ્રભુ અપાવે. સદ્ગુરુ અપાવે.

આચારાંગ સૂત્ર કે ઉત્તરાધ્યયન સૂત્રનો હદ્યસ્પર્શી કોઈ શબ્દખંડ અન્તસ્તરને હલબલાવી નાખે, વલોવી નાખે ત્યારે એ પાવન શબ્દોમાંથી એવું બળ પ્રગટે છે કે સાધકના દોષો ધૂ થઈ જાય ! એથ અગુતે અણાણાએ... જેવું નાનકદું સૂત્ર હદ્યને વલોવી નાખે ત્યારે....? અરે, ગુપ્તિઓ મારામાં નહિ હોય તો હું પ્રભુની આશાની બહાર જતો રહીશ ! નહિ, એ મને પાલવી ન શકે. મારે તો પ્રભુની આશામાં જ રહેવું છે. સૂત્રનો આ જાતનો સ્પર્શ ગુપ્તિપાલનમાં પરિણામે જ ને !

પણ અહીં સાધકની પોતાની સજાગતા જરૂરી છે. એવી સજાગતા ન હોય તો શબ્દો ઉપરથી વહી જાય.

આવા સાધક માટે સદ્ગુરુ કાર્યસાધક બની શકે. સદ્ગુરુ વારંવાર પ્રેરણા આપી તેને તૈયાર કરશે.

પ્રોફેસરને પ્રતિષ્ઠાનું એક ભાષણ આપવા વહેલી ટ્રેઇનમાં જવાનું હતું. એમણે પોતાના નોકરને કહું કે તે તેમને ત્રણ વાગ્યે પરોઢિયે જગાડે. કાર બોલાવી રાખે. તૈયાર થઈ સાડા ત્રણે પ્રોફેસર સ્ટેશને પહોંચે. અને ગાડી પકડી લે.

નોકર કહે : સાહેબ, મારે તમને શી રીતે જગાડવા ? ક્યારેક મોર્નિંગ કોલેજ હોય ત્યારે સવારે છ-સાડા છ વાગ્યે પણ તમે જાગતા નથી... હું નણ વાગ્યે તમને શી રીતે જગાડું ? (એલાર્મ ક્લોકની ઘંટી પણ કામ નહોતી લાગતી.)

પ્રોફેસરે કહ્યું : કાલે કોઈ પણ રીતે તારે મને ઉઠાડવો છે. તું ઢંડા પાણીની બાલદી નાખીશ મારા પર તોય વાંધો નથી. કદાચ ગુસ્સે થઈ હું તને તમાચ લગાવી દઉં તો એને તું સહન કરજે. પણ તું મને જગાડજે અવશ્ય.

નોકરે એ રીતે જગાડ્યા પ્રોફેસરને. પ્રોફેસર ભાષણ આપી શક્યા.

આપણે સદ્ગુરુવરને આવો કોરો ચેક-પ્રોફેસર જેવો-આપી શકીએ?

ગુરુમા, ગમે તે રીતે, પણ મને દોષમુક્ત તમે કરો. મને લડજો, ફટકારજો, બધું જ તમે કરી શકો છો, પણ મને દોષમુક્ત બનાવો જ. આટલી પ્રાર્થના જો સાધકની હોય તો દોષમુક્ત થવામાં વાર કેટલી ?

■ • ■

ચા પીનારની રકેખીમાંથી ચાનો છાંટો કપડાં પર પડી જાય તો એ ભાઈ શું કરશે ?

તરત જ પાણીમાં એ વસ્ત્ર જબોળી નાખશે. જેથી ડાઘ તરત અદ્રશ્ય થઈ જાય.

દોષોને આટલી ઝડપથી કાઢી શકાશે ?

સૂત્રાત્મકરૂપે વાતને આ રીતે મૂકી શકાય : દોષ લાગ્યો, એ કંઘ્યો અને ગય્યો....

■ • ■

પ્રમાદને / દોષોને દૂર કરવા શું કરીશું ? બહુ જ મજાનો ઉપાય બતાવ્યો છે : છંદ નિરોહેણ ઉવેદ મોકખં. પોતાની ઈચ્છાને બાજુમાં મૂકી

દેવાની, પ્રભુની અને સદ્ગુરુની આજા પ્રમાણે ચાલવાનું. દોષ ક્યાંથી રહેશે ? પ્રમાદ શી રીતે રહેશે ?

મુક્તિનો મજાનો આ શોર્ટકટ : ઈચ્છાઓને દૂર કરો, મુક્તિને પામો!

તમને ગમે તે નથી કરવું. પ્રભુને ગમે તે કરવું છે. કવિ ઉશનસ્ની મજાની પ્રાર્થના છે :

‘પ્રભુ ! તમને અણગમતું ના કરીએ, એ જ અમારી પ્રીતિ.’

વેણીશંકર પુરોહિત તો પ્રભુમયતાને જ જીવનરૂપ માને છે. ‘તમારા વિનાના અમે અમારા વિનાના.’ પ્રભુ વિહોણા હોવાનો મતલબ છે પોતાના વિનાના હોવું.

પ્રભુ સાથે હોવું એટલે પ્રભુની આજાની સાથે હોવું. અને આપણી ઈચ્છા કેન્દ્રમાં આવી તો...? તો પ્રભુ અદ્રશ્ય ! બેઉ તો સાથે કેમ રહેશે?

સમી સાંજનો સમય. મીરાં સદ્ગુરુના આશ્રમે ગઈ છે. દરવાજા બંધ છે. મીરાંએ દરવાજે ટકોરા માર્યા. અંદરથી ગુરુનો અવાજ આવ્યો: કોણ ?

મીરાંએ કહું : હું મીરાં. પ્રભુનાં ચરણોની દાસી.

દરવાજા ખૂલ્યા. મીરાં અંદર ગઈ. ગુરુનાં ચરણોમાં પ્રણિપાત કર્યો. અને ત્યારે ગુરુએ પૂછ્યું : મીરાં, તું મીરાં પણ હોય અને પ્રભુનાં ચરણોની દાસી પણ હોય, એવું બેઉ શી રીતે સાથે બની શકે ?

ગુરુ સમજાવે છે : પ્રભુના ચરણોની દાસી બનવાનો અર્થ છે પ્રભુના સમંદરનું બિન્હુ બની જવું. બિન્હુની-સમુદ્રમાં ભણ્યા પછી - કોઈ અલગ ઓળખ - આઈન્ટિટી-હોઈ શકે ? બિન્હુને નામ શું ? સરનામું શું ? તો પછી ‘મીરાં’ નામ ક્યાંથી ?

મીરાંને આ વાત એટલી તો અસર કરી ગઈ કે એણીએ નક્કી કર્યું
કે મીરાં કેન્દ્રમાંથી હઠી રહી છે.

અને, કેવો ચમત્કાર સર્જીય છે ? જે ક્ષણો તમે કેન્દ્રને છોડી દો
છો, પ્રભુ તમારી અંદર અવતરે છે. તમારું હટવું. પ્રભુનું અવતરવું.

ઉપરની ઘટના બન્યા પહેલાં જે ભજનો રચાયા તેમાં છેતે લખાતું:
'મીરાં કે પ્રભુ...' ઉપરોક્ત ઘટના બન્યા પછીનાં ભજનોમાં છેલ્લે આવે
છે : 'મૈં તો રાવ રી દાસી...' મીરાં ગઈ છે અને પ્રભુ પ્રગટ્યા છે.

તમારી ઈચ્છાઓનું, તમારા અહુમાનું હોવું એટલે જ તમારું (સ્વાભાવિક
રૂપે) ન હોવું.

તમારી ઈચ્છાઓનું ન હોવું - છંદ નિરોહિણા.' - એટલે જ તમારું
હોવું. એ જ તો મુક્તિ.

Being- હોવું એ જ મોક્ષ. Doing- કર્તૃત્વ એ જ સંસાર.

■ ● ■

અપ્રમાદ....

ક્ષણ-ક્ષણ અપ્રમાદમાં હોય સાધક.

પરમપાવન આચારાંગ સૂત્રનો એક નાનકડો સૂત્રખંડ યાદ આવે :
'ખણ જાણાહિ પંડિએ.' હું એનો મુક્ત અનુવાદ આ રીતે કરું છું. પ્રભુ
પૂછે છે કે, બેટા ! તારી એક ક્ષણ તું મને આપીશ ?

આપણો તો ઓવારી જઈએ પ્રભુના આ શબ્દો પર. પ્રભુ મારી પાસે
માગે છે ! હું પ્રભુની પાસે સતત યાચતો રહ્યો છું, પ્રાર્થતો રહ્યો છું...
આજ પ્રભુ મને કહી રહ્યા છે. આપણો કહીશું : પ્રભુ ! એક ક્ષણ શું,
આપ કહો તેટલી ક્ષણો આપું.

પ્રભુ કહે છે : ના, એક જ કાણ. પરંતુ એ જોઈશે. શુદ્ધ-શુદ્ધ કાણ. વિકલ્ખોથી ઘેરાયેલી એ કાણ ન જોઈએ.

પ્રાયોગિક ધોરણે આજથી આની શરૂઆત કરીએ : દિવસમાં એક કાણ શુદ્ધ મળો. એક મિનીટ. પછી દર કલાકે (જાગવાના સમયગાળામાં) એક મિનીટ મળો.

એ મિનીટમાં શુદ્ધ વર્તમાન હોય. ઉદાસીન ભાવે રહેવાનું. ન રતિ, ન અરતિ... ઉદાસીન ભાવ....

‘અપૂર્વ અવસર’ યાદ આવે : ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કલ્યે નહિ, દેહે પણ કિંચિત મૂર્ચ્છા નવિ જોય જો...’(૨)

■ ■ ■

પ્રમાદ અને અપ્રમાદને પેલે પાર છીએ આપણે. ‘સમયસાર’ ગ્રન્થ યાદ આવે :

ણવિ હોવિ અપ્પમત્તો, ણ પમત્તો જાણઓ દુ જો ભાવો ।

એવં ભવતિ સુદ્ધં, ણાઓ જો સોડ સો ચેવ ॥ ૬ ॥

શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મામાં શુભ કે અશુભ ભાવોનું પરિણમન નથી અને એટલે આત્મા પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી. જ્ઞાયકરૂપે આત્મા છે.

શ્રીપાળરાસમાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ઉપરોક્ત ગાથાનો જ ભાવ લઈ આવ્યા છે : ‘પ્રમત્ત અપ્રમત્ત ન કહીએ દ્વિવિધે વારુણ, જાણંગ ગુણાણંગ તે વર્યો...’



॥ પ્રભુના હસ્તાક્ષર ॥

આધારસૂત્ર

પદ્મખી પત્તાં સમાદાય, નિરવેકખો પરિવ્વએ । ૬/૧૫

પક્ષી જેમ પાંખને ફરજાવીને આકાશમાં ઊડે છે તેમ નિરપેક્ષ
મુનિ પાત્ર વગેરેને લઈને વિહરે છે.

એસણાસમિઓ લજ્જા, ગામે અળિયાઓ ચરે ।

અપ્પમત્તો પમત્તોહિં, પિણ્ડવાયં ગવેસએ ॥ ૬/૧૬

એષણાસમિતિથી યુક્ત, લજ્જાવાન, મુનિ ગામમાં અનિયત રીતે
વિહરે. અપ્રમત્ત એવા મુનિ પ્રમત્તો (શ્રાવકો આદિ) પાસેથી લિક્ષા લે.

સાધના સૂત્ર

નિરપેક્ષતા

ઉત્સુકતાનો અભાવ

સ્વસ્થતા

પ્રભુના હસ્તાક્ષર ♦ નિરભુ નભ સું ચિત



શ્રી હરીન્દ્ર દવેની સરસ પ્રાર્થના
યાદ આવે :

આજે નિરભુ નભ સું શૂન્ય ચિત
ત્યાં તારી મંગળ છબી પ્રગટાવ, માતાત્
કોઈ વિચાર-વિહંગોની ન આવ જાવ,
ત્યાં ધ્યાન તારું સરજે કશી દિવ્ય સાત.

પ્રભુ ! મારી મા ! આજે મારું
મન વાદળા વિહોણા આકાશ જેવું સાફ
બન્યું છે. ત્યાં તું તારી દિવ્ય છબી
ઉપસાવ !



નિરભુ નભ સું ચિત

શ્રી હરીન્દ્ર દવેની સરસ પ્રાર્થના
યાદ આવે :

આજે નિરભુ નભ સું મુજ શૂન્ય ચિત,
ત્યાં તારી મંગળ છબી પ્રગટાવ, માત,
કોઈ વિચાર-વિહંગોની ન આવ જાવ,
ત્યાં ધ્યાન તારું સરજે કશી દિવ્ય સાત.

પ્રભુ ! મારી મા ! આજે મારું મન
વાદળા વિહોણા આકાશ જેવું સાફ બન્યું
છે. ત્યાં તું તારી દિવ્ય છબી
ઉપસાવ !

પ્રભુના હસ્તાક્ષર ♦ નિરભ્ર નભ સું ચિત્ત

કેવું મન બન્યું છે સાધકનું ? વિકલ્પરૂપી પક્ષીઓની આવ-જાવ ત્યાં
બિલકુલ નથી... છે પ્રભુનું ધ્યાન.

■ ○ ■

સદ્ગુરુ માટે કે પહોંચેલ સાધક માટે આ સરસ વિશેષાણ : નિરભ્ર
આકાશ જેવી શૂન્યતા.

એક વિરાટ ખાલીપો : વિભાવનો. જેમાં પરમચેતના ઉત્તરે છે.
પરમચેતના આપણી ભીતર ઉત્તરવા તૈયાર જ છે. આપણી પાસે જોઈએ
રીતાપન. ખાલીપણું.

ભિક્ષુ બોધિધર્મને ચીનના સમ્રાટ વૂએ પૂછેલું : આપનું નામ....
પરિચય... ? બોધિધર્મ કહેલું : No knowing...

I Don't know (હું જાણતો નથી) એમ બોધિધર્મ કહેતા નથી.
I/હું ખરી પડ્યું છે ને !

વિકલ્પોની આધારશિલા હું છે. એ હું ખરી જવું જોઈએ.

ગંગા સતી પાનબાઈને કહે છે :

'એમ તમે તમારું શિશ ઉતારો પાનબાઈ, તો તો રમાં બાવનની
બહાર.'

બાવન અક્ષર...શબ્દ... એને પેલે પાર, અશબ્દ અનુભૂતિમાં જવાય
શિશ ઉતારવાથી. અહમને બાજુમાં મૂકવાથી.

બીજા એક પદમાં ગંગા સતી કહે છે :

'ભાઈ રે ! હું અને મારું ઈ તો મનનું છે કારણ, પાનબાઈ !

ઈ મન જ્યારે મરી જો ને જાય...'

મન જાય... અને ભીતર ઝળાંહળાં થઈ જાય.

પ્રભુના હસ્તક્ષર ♦ નિરભ્ર નલ સું ચિત્ત

પદ આગળ વધે છે :

ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યારે હતું એમ દરસાય રે...’
વાસ્તવ દર્શન મનને પેલે પાર થશે.

એ વાસ્તવદર્શન માટે મનના આંશિક વિલય પછી નિરતિ અને સુરતિની ભૂમિકા આવે છે.

શ્રી ભાણદેવ ‘ગંગાસતીનું અધ્યાત્મ દર્શનમાં’ નિરતિ અને સુરતિને સરસ રીતે વ્યાખ્યાયિત કરે છે. નિરતિ (નુરત) અને સુરતિ (સુરત)ના પાંચ અર્થો ત્યાં બતાવ્યા છે :

(૧) નિરતિ = શાસ, સુરતિ = ઉચ્છ્વાસ.

(૨) નિરતિ = જગતમાંથી ધ્યાન હટાવી લેવું.

સુરતિ = પ્રભુનાં વચ્ચેનોમાં સુરતા - તન્મયતા લગાવવી, અને એમ કરીને આત્મતાત્વમાં તન્મય બનવું.

(૩) નિરતિ = તેજ, સુરતિ = ધ્યાન. બેઉનો સંયુક્ત અર્થ થશે : તેજોમય એવા સ્વરૂપનું ધ્યાન.

(૪) સુરતિ = સાલંબન ધ્યાન

નિરતિ = નિરાલંબન ધ્યાન

(૫) સુરતિ = સાધકલ્ય સમાધિ

નિરતિ = નિર્વિકલ્ય સમાધિ

પાંચે વ્યાખ્યાઓનો સાર એ થશે કે સાધક બહિર્ભાવને છોડીને અન્તર્ભાવમાં જાય.

■ • ■

ગંગા સતીનું એક પદ છે : 'સુરતા લગાડી ત્રિકુટી મા'ય રે...'

ભાષાદેવ લખે છે : ત્રિકુટી એટલે ભૂમધ્યમાં રહેલું આજાચક. સાધનાના પથમાં આ ત્રિકુટી છેલ્યું કર્માડ છે, તેનું ભેદન થાય એટલે સાધકની ચેતના ભ્રઘરંધ્રસ્થ સહસ્રારમાં પહોંચે છે અને સાધકનો સમાધિમાં પ્રવેશ થાય છે. ત્રિકુટી ભેદ થતાં ધ્યાતા, ધ્યાન અને ધ્યેયનો ભેદ વિલીન થાય છે.

આજાચકની નીચે ભેદસૂષિ છે. આજાચકની ઉપર અભેદ તત્ત્વ છે. પરાત્પર ચૈતન્ય ત્યાં વિલસે છે.

■ ■ ■

સંત ગોરખનાથનું પદ યાદ આવે : મરો હે જોગી મરો... મરણ હે મીઠો... જિસ મરણિ ગોરખ મરે...

આ મનના મૃત્યુની વાત છે. નિરભ્ર આકાશ સું મન થઈ રહે છે.

વિચારોના પંખીઓની ત્યાં આવન-જાવન નથી.

'ધ જીરો એકસપીરિયન્સ'માં આવેલી ઝેનકથા છે :

સોહેઈએ ગુરુ સુબીને પૂછ્યું : બોધિધર્મ પશ્ચિમથી પાછા ભારત કેમ આવ્યા ?

ગુરુ સુબી કહે છે : કોઈ નહિ હોય ત્યારે તને કહીશ.

જંગલમાં પદયાત્રા માટે જવાનું થયું, જ્યારે કોઈ ન હતું. સોહેઈએ પૂછ્યું : બોધિધર્મ પશ્ચિમથી પાછા કેમ આવ્યા ? ત્યાં ધર્મપ્રચારની વધુ તકો હતી.

ગુરુ કહે છે : આ વાંસના વૃક્ષોને તું જો ! (ગુરુ એ કહેવા માગતા હતા કે વાંસની પેઠે તું ય મૌનમાં જતો રહે. એક સાધક તરીકે બિનજરૂરી પ્રશ્નોનો શો અર્થ ? અને સાધક માટે જરૂરી - બિનજરૂરીની વ્યાખ્યા

સ્વષ્ટ છે : જે દ્વારા સાધનામાર્ગમાં આગળ વધાય તે જરૂરી. બાકીનું બધું જ બિનજરૂરી.)

■ ● ■

મનમાંથી અપેક્ષાઓ હટી જાય તો મન નિરભ્ર આકાશ જેવું બની જાય.

‘યોગસાર’નો ઘારો શ્લોક યાદ આવે. જેમાં નિરપેક્ષ દશાથી અનુત્સુકતા અને તેનાથી સ્વસ્થતાના પડાવે પહોંચવાની વાત કરાઈ છે. અને એ સ્વસ્થતા તે જ પરમ આનંદ છે.¹

નિરપેક્ષદશા-ઉત્સુકતાનો અભાવ-સ્વસ્થતા આ કમ થયો, તેથી વિરુદ્ધનો કમ આ છે, જે આપણા અનુભવનો છે : અપેક્ષા-ઉત્સુકતા-અસ્વસ્થતા.

અપેક્ષા જાગી કે લોકો મને સારો માને. લોકો મારા પ્રવચનથી પ્રભાવિત બને. એક નાનકડો એખણાનો આ પરપોટો, પણ સાધકની સ્વસ્થતાને એ સાફ કરી નાખે!

પ્રભુએ આચારાંગ સૂત્રમાં સાધકને, આથી જ, કહ્યું છે : ણો લોગસ્સેસણં વાએ. મારા લાલ ! તું લોકેખણાના પથ પર ન જતો !

એખણા.... લોકો મને સારો કહે.... એક ફિલોસોફરે સરસ વાત કહી છે : આજનો માણસ સારો કહેવડાવવા માટે જેટલી મહેનત કરે છે એટલી જો ખરેખર સારો બનવા માટે કરે તો એ સારો થઈ જ જાય !

સારપનું વિતરણ....

બીજામાં રહેલ ગુણને જોવાની વૃત્તિ...

‘શ્યામ, એક વાર આવો ને આંગણો’માં દિનકર જોધી કૃષ્ણજીવનના એક સરસ પ્રસંગનું આદેખન કરે છે :

(૧) નૈરપેક્ષયાદનૌત્સુક્ય - મનૌત્સુક્યાચ્ચ સુસ્થતા ।

સુસ્થતા ચ પરાનન્દ-સ્તદપેક્ષાં ક્ષયેન્મુનિઃ ॥ -યોગસાર

પ્રભુના હસ્તક્ષર ♦ નિરભ્ર નભ સું ચિત્ત

‘કૃષ્ણ ગોકુળ છોડી મથુરા આવવા નીકળ્યા ત્યારે એમણે મા યશોદાને વચન આપેલું : મા, ફરી ગોકુળમાં તારી પાસે આવીશ. અને ન આવું ત્યાં સુધી માખણ-મિસરીને હાથ નહિ લગાડું.’

દ્વારકા આવ્યા પછી મા દેવકીએ માખણ-મિસરી (માખણ-ખાંડ) પીરસ્યા. કૃષ્ણની આંખમાં આંસૂ : મા ! મેં મા યશોદાને આ રીતે વચન આપ્યું છી... ને અહીં તેં એ જ પીરસ્યું છે. હું શું કરું, મા ?

મા દેવકીએ કહ્યું : તું ન ખા, બેટા ! મારો આ પ્રેમ સ્વાર્થમાંથી પ્રગટ્યો છી... (તું મારું સંતાન છે એ ભાવ ત્યાં મુખ્ય છે.) મા યશોદાને તેં આપેલ વચન એ ત્યાગમાંથી નીપજેલ પ્રેમ છે, તારે એને સન્માનવો જોઈએ...’

મા દેવકીની આ કેવી મહાનતા હતી ! આ જ છે સારપનું વિતરણ.

■ ■ ■

અપેક્ષાનો નાનકડો તિખારો સુખ નામના રૂની ગંજુમાં ચંપાય અને ભડભડ ભડકો !

અપેક્ષાની ઉત્સુકતા. પેલા અગ્રણી મારે માટે શું માને છે... એમાં એમ લાગે કે એમનો ભાવ પોતાના માટે સારો છે, તો રતિભાવ જન્મશે. પોતાના માટે ભાવ બરોબર નથી એવું લાગશે તો અરતિભાવ જન્મશે.

રતિ અને અરતિના જૂલે આમ જૂલવાનું થશે, અને આમાં સ્વસ્થતાનું શું થશે ? સ્વસ્થતા નંદવાશે.

બહુ ઘારો શબ્દ છે આ સ્વસ્થતા. લોકો ઘણીવાર એકબીજાને પૂછતા હોય છે. તમે સ્વસ્થ છો ને ?

સ્વસ્થ શબ્દનો અર્થ ન તો પૂછનાર જાણો કે ન જવાબ આપનાર જાણો.

પ્રભુના હસ્તાક્ષર ♦ નિરબ્ર નભ સું ચિત્ત

સ્વ-સ્થ હોવું એટલે પોતાનામાં હોવું. આપણે આપણા ગુણો-જ્ઞાનાદિમાં હોઈએ તો આપણે સ્વસ્થ.

અને સ્વસ્થતા તે જ આનન્દ.

વિકલ્પોમાં હોઈએ તો પીડા જ પીડા. મજાની વાત એ છે કે ઘટનાનો આપણી ભીતરી પ્રવેશ કર્ય રીતે થાય છે ? વિકલ્પો દ્વારા એ થાય છે.

ઘટનાથી પ્રભાવિત તમે કયારે બનો છો ? જ્યારે વિકલ્પો એ ઘટના તરફ કેન્દ્રિત થાય છે.

એટલે જ, પ્રતિકૂળ, મોટી ઘટના પણ યોગીપુરુષને અસ્વસ્થ નથી કરી શકતી. વિકલ્પો નથી ને !

વિકલ્પો બહુ ઓછા હોય તો ઘટના એક બાજુ પડી રહે છે. તમે બીજી બાજુ હો છો. તમને ઘટનાની અસર નથી થતી.

આયરિસ કવિ મૂર એક જગ્યાએ કવિતા પાઠ કરી રહ્યા હતા. સંભાન્ત લોકોથી ભરેલું સભાગૃહ હતું. એક વિરોધી માણસ ઊભો થયો. એણે કહ્યું : તમારા પિતાજી તો મરચા-મીઠાની ફેરી કરતા'તા. તમે આ ધ્ખારે કયાંથી ચડ્યા ?

કવિ મૂર પેલા ભાઈને ઓળખતા હતા. એ સહેજે વિક્ષિમ ન થયા. અને એમણે કહ્યું : અચ્છા, તમારા પિતાજી તો સજજન માણસ હતા. તમારી પાસે પણ આવી જ અપેક્ષા હતી....

■ • ■

બહુ મજાનું સૂત્ર : 'સ્વસ્થતા પરમાનન્દ'. સ્વસ્થતા એ જ પરમ આનન્દ.

સદ્ગુરુની સ્વસ્થ જીવનશૈલી કેવી હોય છે તે શ્રીયોગાનન્દજીના જીવનની એક ઘટના પરથી જોવા મળે છે.

શ્રીયોગાનન્દજીને ગુરુ યુક્તેશ્વરજી પાસે આવ્યા પછી ઝટપટ આધ્યાત્મિકતા શિખરો સર કરવાની તાલાવેલી લાગેલી. ગુરુ તો તેમની - યોગાનન્દની કક્ષા પ્રમાણે સાધના આપતા હતા. પણ યોગાનન્દજીને લાગ્યું કે આ સાધનાની ઝડપ તો બહુ ધીમી છે.

એક વાર ગુરુને કહ્યા વગર તેઓ ત્યાંથી જતા રહ્યા. ઘણા યોગીઓ પાસે ગયા. રહ્યા. પણ અનુભવે ખ્યાલ આવ્યો કે સદ્ગુરુનાં શ્રી ચરણો વિના મારો ઉદ્ધાર નથી. ફરી ગુરુજીના આશ્રમે આવી ગયા.....

એક દિવસ... બે દિવસ... ગુરુએ યોગાનન્દનો અભ્યાસક્રમ શરૂ કરી દીધો. સાધના શરૂ કરાવી. દિવસો વીત્યા. સદ્ગુરુ પૂછતા નથી કે તું ક્યાં ગયો હતો ?

સદ્ગુરુની આ વર્તણુક - સ્વસ્થ જીવનશૈલીથી પ્રભાવિત બનેલા યોગાનન્દજી એક વાર ગુરુને પૂછે છે : તમે કેમ મને લડતા નથી ? હું ક્યાં ગયો હતો, કેમ ગયો હતો... આવું કશું કેમ પૂછતા નથી.

યુક્તેશ્વરજીએ કહ્યું : મારું વાત્સલ્ય શરતો કે બન્ધનો વિનાનું છે. એ વહ્યા જ કરશે....

અહીં સાચી નિરપેક્ષતા ખૂલ્લી. શિષ્યે શું કરવું તે એ જાણો. પોતે શિષ્ય પર વાત્સલ્ય વરસાવ્યા કરશે. આ નિરપેક્ષતાએ આપી હતી સ્વસ્થ જીવન શૈલી.

■ ● ■

નિરપેક્ષ દશાની ભજાની ભૂમિકા ચર્ચાતું આ સૂત્ર : પક્ખી પત્તાં સમાદાય, નિરવેક્ખો પરિવ્વાએ. પક્ખી જેમ પાંખોને ફફડાવીને અસીમ અવકાશમાં ઊડે છે તેમ નિરપેક્ષ મુનિ પણ પાત્ર આદિ ઉપધિને ઉંચકીને નિર્બધ રીતે વિહારે છે.

નિરપેક્ષતા નિર્બધ વિહારમાં પલટાઈ.

■ ● ■

પ્રભુના હસ્તાક્ષર ♦ નિરબ્ર નભ સું ચિત્ત

નિર્બન્ધવિહાર... અનિયતવિહાર. ગામે અણિયાઓ ચરે.⁽²⁾

નિર્બન્ધવિહારની મજા માણી છે. કોઈ બન્ધન નહિ. સંબંધોની માયાજીળ નહિ. પ્રભુની આજાને સામે રાખીને ફરવાનું. એટલે જ સાધકને વિશેધાણ આપ્યું : 'લજૂ'. લજાવાન. સંયમને વિષે અનન્ય ઉપયોગવાળો.

નિરવેકખો પરિવ્વાએ.... નિરપેક્ષ એવો સાધક વિહારે. પરિવ્વાએ. પરિગ્રજ્યા. સંપૂર્ણતયા ચલન. એક એક આત્મપ્રદેશ, સાડા ત્રણ કરોડ રૂંવાડાં એ ચાલવામાં સહભાગી હોય.



(૨) એસણાસમિઓ લજૂ ગામે અણિયાઓ ચરે ।
અપ્પમત્તો પમત્તેહિં, પિણ્ડવાયં ગવેસએ ॥ ૬/૧૬

આધારસૂત્ર

અધુવે અસાસયંમિ, સંસારમિ દુક્ખપડરાએ ।

કિં નામ હોજ તં કમ્મયં, જેણાહં દુગઙ્ઠં ન ગઢેજા ॥ ૮/૧ ॥

અધૃવ, અશાશ્વત અને દુઃખપ્રચુર આ સંસારમાં તે કયું અનુષ્ઠાન છે, જે વડે હું દુર્ગતિને ન પામું.

વિજહિતુ પુષ્વસંજોગં, ન સિણોહં કહિંચિ કુવ્વિજા ।

અસિણોહ સિણોહકરેહિં, દોસપઓસેહિં મુચ્ચાએ ભિક્ખુ ॥ ૮/૨ ॥



પૂર્વ સમ્બંધોનો ત્યાગ કરીને સાધક કોઈની સાથે સ્નેહ ન કરે. સ્નેહ કરવાવાળાઓથી અસ્નેહ કરનાર ભિક્ષુ દોષો (માનસિક સંતાપો) અને પ્રદોષો (નરક ગતિ આદિ)થી મુક્ત થાય છે.

સાધનાસૂત્ર

- ક્યાંય સ્નેહ ન કરવો.

- સ્નેહકર તત્ત્વો સાથે પણ અસ્નેહ.

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રીત કિયે દુઃખ હોય...



પ્રીત કિયે દુઃખ હોય...

ભક્તિયોગની મીરાંની કેદ્દિયત છે:

'જો મૈં એસા જાનતી, પ્રીત કિયે દુઃખ
 હોય; જગત ઢંઢેરા ફેરતી, પ્રીત ન કરજો
 કોય...''

પ્રીતથી દુઃખ મળે છે આવો ઘ્યાલ
 હોત તો બધાને કહી દેત કે કોઈ પ્રીતિ
 ન કરશો. આ કેદ્દિયત દુન્યવી પ્રીતિ
 માટે છે. જેને સાપેક્ષ પ્રીતિ કહેવાય છે.
 આનન્દધનજીના શબ્દોમાં એ છે
 સોપાધિક પ્રીતિ. આશંસાવાળી પ્રીતિ.

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રીત કિયે દુઃખ હોય....

ઘારું વચન છે એમનું :

‘પ્રીત સગાઈ રે જગતમાં સહૂ કરે રે, પ્રીત સગાઈ ન કોય;

પ્રીત સગાઈ રે, નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોય.’

જ્યાં કશું જ મેળવવાની ઈચ્છા નથી તે જ સાચ્યો પ્રેમ. નિરૂપાધિક પ્રીતિ. ‘હું તને આ આપું, ને તું મને આ આપ!’ અને પ્રેમ કેમ કહેવાય? એ તો છે સોદાબાળ.

■ ■ ■

સોપાધિક પ્રીતિ.....

એક ભાઈ માતાજીના ભક્ત હતા. વારે તહેવારે માતાજીને નાણિયેર માને. વધેરે. અને શેષ પ્રસાદીરૂપે ખાય. વર્ષો પછી એક ભાઈ એમને ત્યાં ગયેલા. બે-ચાર દિવસ રહ્યા પણ માતાજીનું નાણિયેર ક્યારેય વધેરાયું નહિ. પૂછ્યું: કેમ, માતાજીની માનતા હવે..... પેલા ભાઈ કહે: હવે એકું દાંત નથી રહ્યો !

તો પેલી માતાજીની ભક્ત હતી કે પોતાની !

■ ■ ■

નિરૂપાધિક પ્રીતિ માટે સુરદાસજી કહે છે : ‘પ્રેમ પ્રેમ સહૂ કોઈ કહે, પ્રેમ ન ચીન્દે કોઈ, આઠ પહેર ભીના રહે, પ્રેમ કહાવે સોઈ....

ચોવીસે કલાક હુદય અને આંખો જેની ભીની રહે તે પ્રભુના પ્રેમમાં છે તેમ કહેવાય.

મરાઠી કવિ બોરકર કહે છે : ‘પારિજીત રોજ જરે છે ફૂલ, પણ ગણે નહિ.’ પ્રેમને ગણિત સાથે નહિ, અગણિત સાથે સંબંધ છે.

ગણિતમાં જ છે સાપેક્ષતા, સોદાબાળ. સુરેશ દલાલ કહે છે : ‘મનના મેવાડમાં એક રાણો વસે છે, એ રાણાને અહીંથી ઉથાપો કોઈ, મને મીરાંનું પાગલપન આપો કોઈ...’

■ ■ ■

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રીત કિયે દુઃખ હોય...

નિરૂપાધિક પ્રીતિની દુન્યામાં થોડા ડગ ભરાયા કે આનંદ જ
આનંદ. પછી દુન્યવી પ્રીતિ લોભામણી ન બની શકે.

પણ, સાચુકલી પ્રીતિનો અનુભવ ન થયો તો -

■ ● ■

પરમ પાવન ઉત્તરાધ્યયન સૂત્રના આઠમા અધ્યયનનો પ્રારંભ આ
બિન્હુથી થાય છે; જ્યારે દુન્યવી પ્રીતિની ગડમથલમાં મનનાં તાણાં ને
વાળાં ફસાયેલાં છે અને સુખ નામની સંઘટના અદૃશ્ય બનેલ છે.

કેવળજ્ઞાની મહર્ષિ કપિલ મુનિની વિહારયાત્રામાં આવે છે એક દુર્ગમ
વન. જેમાં રહેતા'તા પાંચસો ચોરો. ચોરોના જાસૂસે મુનિને જોયા. પોતાના
નાયક પાસે તે એમને લઈ ગયો. ચોરોના આગેવાને કહ્યું : અરે, આ તો
શ્રમણ છે. મહારાજ કંઈક ગાઓ ! મજા આવશે. ત્યારે કેવળજ્ઞાની
મહર્ષિ એમના પ્રતિબોધ માટે ગાય છે :

અધુવે અસાસયંમિ, સંસારમ્મિ દુક્ખપતરાએ ।

કિં નામ હોજ તં કમ્મયં, જેણાહં દોગગં ન ગચ્છેજ્ઞા ॥

આ ગાથાસૂત્રમાં મૂકેલ પ્રશ્નનો ઉત્તર આપતાં આગળના ગાથાસૂત્રોમાં
દુન્યવી પ્રીતિની પીડાકરતાની વાત એમણે કરી છે અને બધા ચોરોને એમણે
મુનિ બનાવ્યા છે : ચોરો પ્રભુપ્રેમમાં પાગલ વ્યક્તિત્વો બની ગયા.

ઉપરના ગાથાસૂત્રમાં મૂકેલ પ્રશ્ન પણ ચિન્તકને એ ચિન્તન બિન્હુ
પર મૂકી શકે કે આર્થદેશના ચોરોની પણ પૃષ્ઠભૂ કેવી સુન્દર હતી ! એ
પણ પરલોકને માનનાર હતા, અને પરલોકમાં અમારી દુર્ગતિ ન થાય
એવો એમનો વિચાર હતો.

ગાથાસૂત્રનો અર્થ આવો છે : અધ્યુવ, અશાશ્વત અને દુઃખપ્રચુર આ
સંસારમાં એવું કયું અનુષ્ઠાન છે કે જેનાથી હું દુર્ગતિમાં ન જાઉં.

■ ● ■

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રીત કિયે દુઃખ હોય...

સંસાર : અધૂવ, અશાશ્વત, દુઃખપ્રચુર.

સ્થળના સન્દર્ભે અધૂવતા. આજે અહીં તો કાલે ક્યાંય, તેરા ફેરવ્યા જ કરવાના : વણગારાની પેઠે. આજે આ ગતિ (મનુષ્યાદિની), પછી વળી બીજી ગતિ..... ફર્યા જ કરવાનું.

અશાશ્વતતા સમયના સન્દર્ભમાં. કેટલો સમય રહેવાનું : કોણે ખબર? ક્ષણ પછી પણ હદ્ય ધબકતું બંધ પડી શકે.

અને દુઃખપ્રચુરતા તો દેખાય જ છે. અનુભવાય જ છે.

જીવનની અશાશ્વતીને શબ્દોમાં વણતા બરકતઅલી (બેઝામ) એક જગ્યાએ કહે છે : ‘‘બેઝામ’ તોય કેટલું થાકી જવું પડ્યું, નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.’

■ ■ ■

મૂળ વાત જોઈનો તન્તુ હવે સંધાય છે : સાપેક્ષ પ્રીતિની પીડા-કરતાનો.

અદ્ભુત સૂત્રો છે : ણ સિણેહં કહિચિ કુવ્યિજા । અસિણેહ સિણેહકરેહિ । સાધક ક્યાંય સ્નેહ ન કરે. સ્નેહકર તત્વોની સાથે અસ્નેહ.

પહેલું સૂત્ર : ક્યાંય સ્નેહ નહિ કરવાનો. એવું નથી કે મહેલ સાથે જ સ્નેહ બંધાઈ શકાય. ગ્રૂપડી સાથે પણ પ્રીતિ બંધાઈ શકાય છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ પદાર્થ હોય કે પોતાનું શરીર હોય; સાધક ક્યાંય સ્નેહ ન કરે.

■ ■ ■

જનક રાજા વિદેહી કહેવાતા. એક સાધકને એના ગુરુએ આગળનું જ્ઞાન લેવા જનક રાજા પાસે મોકલ્યો. સાધકે જ્યારે સિંહાસન પર બેઠેલ

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રીત કિયે દુઃખ હોય...

અને વસ્તો, આભૂષણોથી શાશગારાયેલ દેહવાળા રાજાને જોયા ત્યારે તે ચમક્યો : આ ભોગી મને શું શાન આપશે ?

જનક રાજા તેના મનની શંકા જાણી ગયા. તેમણે કહ્યું : તમે અતિથિગૃહમાં આરામ કરો. કાલે તમને મળવાનો સમય આપીશ.

બીજી સવારે મહેલની પાછળ રહેલ નદીમાં રાજા જનક સ્નાન કરતા'તા. પેલો સાધક પણ ત્યાં નહાવા આવ્યો છે. અચાનક એણે જોયું : રાજમહેલમાંથી આગાની લપેટો નીકળી રહી છે.

જનક રાજા એ જોવા છતાં સ્નાનની કિયા પહેલાંની જેમ કરવા લાગ્યા. પેલા સાધકે એ જોયું અને ત્યારે એને સમજાયું કે જનક વિદેહી કેમ કહેવાય છે. અને પોતાને ગુરુએ એમની પાસે શાન લેવા કેમ મોકલેલ છે.

એ વખતે સાધકને પોતાનાં વસ્તોની યાદ આવે છે. એક કે બે જોડી વસ્તો છે. અને એ એને બચાવવા દોડે છે.

■ ■ ■

રાગ મનમાં હોય છે ત્યારે કૌપીન પણ મહત્વનું બની ઉઠે છે. અંદર વિરાગ છે ત્યારે મહેલ બળે અને કંઈ ન થાય.

ઘટના તો સામાન્ય જ હોય છે; વ્યક્તિની મૂર્ચ્છા એને અસામાન્ય બનાવી હે છે.

ઘટનાનો પ્રવેશ પણ મનમાં શી રીતે થાય છે ?

માધ્યમોના આ યુગમાં અસંખ્ય ઘટનાઓ વ્યક્તિની આંખો પર છવાતી હોય છે અને છતાં એમાંથી કેટલીક જ - જેની જોડે એણે પોતે સંબંધ બનાવ્યો છે - મનમાં પ્રવેશે છે.

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રીત તિયે દુઃખ હોય...

પતંજલિ ઋષિનું યોગસૂત્રનું આ ખારું સૂત્ર : તદર્થમેવ દૃષ્ટયાત્રા। દશ્યનું અસ્તિત્વ માત્ર દ્રષ્ટા માટે હોય છે. એટલે કે જ્યારે દ્રષ્ટા ખોવાઈ જાય છે, બહિર્ભાવરૂપે એ વિલીન થાય છે ત્યારે દશ્ય પણ ખોવાઈ જાય છે.

આ એક ઉંડો કન્સેપ્ટ છે. આ દુઃખ, આ વિષમતા આ બધું શા માટે ? તમે જાગી શકો તે માટે.

પતિ મિત્રને ભોજન સમયે લઈ આવ્યો. પતી ઝુঁગલાઈ. નોકરાણી છે નહિ, સવારનાં વાસણ એમ ને એમ પડ્યાં છે. રસોઈનું ઠેકાણું નથી ને તમે કો'કને જમવા લઈ આવ્યા.

પતિ કહે : શાન્તિ રાખ. એને લગ્નની બહુ ઉતાવળ હતી. એટલે ગૃહસ્થાશ્રમ કેવો દુષ્કર છે એ એને બતાવવા જ અત્યારે લાવ્યો છું.

ઝેન ગુરુ ટોકાઈ બપોરના ભોજન પછી આરામ કરતા હતા. રસોડામાં એ વખતે આગ લાગી. બધા જ સાધકો બહાર નીકળી ગયા. એક સાધક ગુરુ ટોકાઈના રૂમની બહાર આવ્યો. એમણે બારણે ટકોરા માર્યા.

ગુરુએ બારણું ખોલ્યું. પૂછ્યું : કેમ ? સાધક કહે : રસોડામાં આગ લાગી છે. ગુરુ કહે : જો, મારા ખંડના બારણા પાસે આગ આવે ત્યારે મને કહેજે હો ! કહી બારણું બંધ કરી સૂઈ ગયા.

મહત્વ ઘટનાનું નથી. ઘટના તો સાદું તત્ત્વ છે. તમારો રાગ, દ્રોગ કુ અહંકાર જ ઘટનાને મહત્વ આપે છે.

■ • ■

અદ્ભુત સૂત્ર આપણી સામે છે : 'ન સિણોહે કહિન્ચિ કુલ્લિજા.' સાધક ક્યાંય સ્નેહ ન કરે. સાધક કશાણી પ્રતિભાજ ન હોય.

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રીત કિયે દુઃખ હોય...

આવું સ્થાન કે આવો સમય હોય તો મારી સાધના સારી ચાલે
આવી પ્રતિબદ્ધતાને ક્ષેત્ર પ્રતિબદ્ધતા અને કાળ પ્રતિબદ્ધતા કહેવાઈ છે.

સાધક હોય સંપૂર્ણતયા અપ્રતિબદ્ધ. કશાથી બંધાયેલો નહિ.

નદીના પ્રવાહને જુઓ. ક્યાંય જો ખૂણો બન્યો અને ત્યાંનું પાણી
સ્થિર થઈ ગયું તો લીલ-કૂલ જામી જ જવાની. પ્રવાહ ચાલુ હશે ત્યાં
હશે નિર્મણતા. માટે જ કહ્યું : ‘સાધુ તો ચલતા ભલા.’ ક્યાંક બેઠા,
ગમ્યું સ્થાન કે ત્યાંનો પરિવેષ; બંધાયા.

શાસ્ત્રોએ મુનિજીવનની આંકેલી મર્યાદાઓ પર, આથી જ, અહોભાવ
જન્મે. ચોમાસામાં ચાર મહિના એક જગ્યાએ રહ્યા. કાર્તિકી પૂનમ આવી.
હવે ચાલો !

■ ■ ■

બીજું સૂત્ર : ‘અસિણેહ સિણેહકરેહિં.’ સ્નેહ કરનારા કોઈ પણ તત્વો
જોડે સ્નેહ નહિ.

સ્નેહ ક્યાંય નહિ કરવો... એ સામાન્ય સૂત્ર ગણીએ તો આ વિશેષ
સૂત્ર થશે. નીચે લાલ લીટી ઢોરેલું. ‘સ્નેહકર તત્વો સાથે અસ્નેહ.
સતત જોયા કરવું પડે કે આ પદાર્થ કે આ વ્યક્તિ પર મને સહેજ પણ
કૂણી લાગણી થઈ તો નથી ગઈ ને ?

નોટ અને પેન લખવા માટે જરૂરી છે. પણ એના પર પણ રાગ
થઈ ગયો તો...? તો તરત સાવધાન બની જવાનું. નવાં વલ્લો-જૂનાં ફાટી
ગયાં હોય ત્યારે - પણ રાગ ન થઈ જાય માટે આપણી પરંપરામાં
સરસ વ્યવસ્થા છે. સાધક ઉપરનું અને અધોવલ્લ બેઉ નવાં સાથે ન
કાઢે. એક જૂનું હોય, બીજું નવું. નવાને પણ જૂનું કરવા માટે ઈંટ આદિ
પર ઘસવાની પ્રથા હતી.

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રીત કિયે દુઃખ હોય...

‘અસિણેહ સિણેહકરેહિ.’ જાગૃત સાધક સતત આત્મનિરીક્ષણ કર્યા કરે : મને સહેજ પણ રાગ ક્યાંય થયો નથી ને ? અને જો સહેજ પણ પ્રીતિકર એ પદાર્થ આદિ બની ગયા તો... : અસ્નેહ.

■ ○ ■

પદાર્થ આદિની પ્રીતિની ધારાથી બહુ જ ઉપર ઊંચકાયેલો સાધક નિરપેક્ષ પ્રીતિની ધારામાં જશે.

નિરપેક્ષ પ્રીતિ. પ્રીતિ છે, પણ એનું દૂધપણ નથી. પ્રીતિમાં અપેક્ષા, આશંસા ભણે છે ત્યારે એ સવિષ-ઝેરવાળી પ્રીતિ બની જાય છે.

પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ પરમતારક શ્રી, ઋષભદેવ પ્રભુની સ્તવનામાં કહે છે :

પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હો કરવા મુજ ભાવ;
કરવી નિર્વિષ પ્રીતિડી, કિણ ભાંતે હો કહો બને બનાવ....

સંસારી જીવોને પ્રીતિનો અભ્યાસ અનાદિકાળથી છે, પણ તે પ્રીતિ અપ્રશસ્ત છે. પુદ્ગલની આશંસાથી ભરેલ હોવાથી વિષભરેલી છે. તે રીતે પ્રભુ ! તમારી સાથે પણ એવી જ વિષમય પ્રીતિ કરવાનો મને ભાવ થાય છે, પણ પ્રભુ સાથે તો નિર્વિષ પ્રીતિ કરવાની હોય છે. તો તે કઈ રીતે કરવી ? મને બતાવો !

સ્તવનાની આગળની કરી નિર્વિષ પ્રીતિનો માર્ગ બતાવે છે :

પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ;
પરમ પુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણગોહ...

પુદ્ગલો આદિ પર સાથેની પ્રીતિ જે સાધક તોડી શકે છે, તે નિર્વિષ પ્રીતિ પ્રભુ સાથે બાંધી શકે છે.

પ્રભુના હસ્તાક્ષર ❖ પ્રીત કિયે દુઃખ હોય....

પરમાત્મા સાથેનો રાગ એમના ગુણોમાં તન્મયતા પ્રગટવાને કારણે
ગુણરૂપ છે.

■ ■ ■

આશંસા - અપેક્ષા સાથેની પ્રીતિ તોડવી છે. નિરાશંસ - નિરૂપાધિક
પ્રીતિના માર્ગ જવું છે.

નિરાશંસ ભક્ત માટે હિન્દુપરંપરા એક શબ્દ આપે છે : આકાશવૃત્તિ. એ
ભક્ત હોય છે આકાશ જેવો નિર્લેંપ. કોઈ ઈચ્છા એની પોતાની
નથી. 'પ્રભુ જે કરશે તેનો સ્વીકાર...' આ એનો ધૂવ મન્ત્ર છે.

સાધકના સ્તર પર બૌદ્ધપરંપરાનો તથાતા શબ્દ સ્મરી આવે.
તથાતા..... જેમ બની રહ્યું છે તેનો સ્વીકાર...

જૈનપરંપરા પ્રમાણે કુમબદ્વારા પર્યાયતા. જે ક્ષણે જે, જેવો પર્યાય ખૂલે
તેને સ્વીકારવો. એ સિદ્ધાન્તને સર્વસ્વીકારની વિભાવના તરીકે પણ
ઓળખવામાં આવે છે.



આધારસૂખ્ર

સુહં વસામો જીવામો, જેસિં મો ણાથિ કિંચણ ।

મિહિલાએ ડજ્જમાણીએ, ન મે ડજ્જઙ કિંચણ ॥ ૧/૧૪ ॥

અમે સુખપૂર્વક રહીએ છીએ અને તે જ રીતે જીવીએ છીએ :
જેમને પોતાનું કશું જ નથી.

મિથિલા નગરી બળતાં મારું કંઈ જ બળતું નથી.

ચત્તપુત્તકલત્તસ્સ, નિવ્વાવારસ્સ ભિક્ખુણો ।

પિયં ન વિજાએ કિંચિ, અપ્પિયં પિ ન વિજાએ ॥ ૧/૧૫ ॥

પુત્ર, લી આદિ જેણે ત્યજી દીધેલા છે તેવા અને વ્યાપાર રહિત
એવા ભિક્ખુને કંઈ જ પ્રિય નથી કે કંઈ અપ્રિય નથી.

બહું ખુ મુણણો ભદ્દં, અણગારસ્સ ભિક્ખુણો ।

સવ્વઓ વિષ્પમુક્તસ્સ, એગન્તમણુપસ્સઓ ॥ ૧/૧૬ ॥


બાધ્ય અને અભ્યન્તર પરિશ્રહથી મુક્ત, ઘર વગરના અને હું
એકલો છું, મારું કોઈ નથી એવા એકત્વને જોનારા મુનિને ખૂબ જ
સુખ હોય છે.

સાધનાસૂખ્ર

અક્ષિચનતા

પ્રિયાપ્રિયતાથી રહિતતા

એકાન્ત-દર્શિતા



વિકલ્પોને પેલે પાર : આત્માનુભૂતિ

સંત રાબિયાને એક ભક્તે પૂછેલું:
આપને પ્રભુ શી રીતે મણ્યા ?

ઉત્તરમાં સંતે કહેલ તેમની
આપવીતી આ પ્રમાણે હતી : તેઓ
ગુલામ તરીકે એક શેઠને ત્યાં કામ
કરતાં. પેટપૂર ખાવાનું પણ, મળે ન
મળે. સાંજે મહેમાન આવી ગયા ને
રસોઈ પૂરી થઈ ગઈ, તો ભૂઘ્યાં સૂઈ
જવાનું.

અધૂરામાં પૂરું, શેઠ બહુ જ
ગુસ્સાવાળા. નાનકડી વાતમાં ચાબૂકોથી
ફટકારવા માંડે.

એકવાર કીમતી ફૂલદાની - જે શેઠને બહુ જ ગમતી'તી - ટેબલને સાફ કરતાં નીચે પડી ગઈ, ફૂટી ગઈ. રાબિયા ગભરાઈ ગયાં. હવે શું થશે ? નાની-નાની બાબતોમાં ચાબૂક ફટકારનાર શેઠ આજે તો જાનથી મારી નાખશે એવો ડર લાગ્યો.

પ્રાણ બચાવવા પાછળના રસ્તેથી તેઓ જંગલમાં ભાગી છૂટે છે. પણ જંગલમાંય કેડી પર જવામાં - દોડવામાં ભય હતો. પાછળથી શેઠના બીજા ગુલામો આવીને પોતાને પકડી જાય તો ?

અડાબીડ રસ્તે રાબિયા ચાલે છે. એવું સધન જંગલ. જ્યાં ધોળે દિવસે અંધારું હતું. અંધારામાં દેખાયું નહિ અને એક ખાડામાં પડી જવાયું. તમ્મર આવી ગયા. લાગ્યું કે હાથ-પગ ભાંગી ગયા હશે. એ વખતે રાબિયા પ્રભુને કહે છે : પ્રભુ ! હવે મને નોકરીએ પણ કોણ રાખશે ? હાથ-પગ પણ મારા ન રહ્યા. કોઈ મારું ન રહ્યું.....

અને એ ખાડામાં એમને પરમ ચેતનાનો સાક્ષાત્કાર થાય છે.

રાબિયા આ આપવીતી ટાંકીને ભક્તોને કહેતાં : જેની પાસે કશું નથી, જેની પાસે કોઈ નથી; જે અક્રિયન છે, તેને પ્રભુ મળે છે.

ગીતા કહે છે : અનન્યાશ્રિન્તયન્તો મામ्, યે જના : પર્યુપાસતે; તેણા નિત્યાભિયુક્તાનાં, યોગક્ષેમં વહામ્યહમ् ॥ પ્રભુની અનન્ય ચિત્તે ઉપાસના કરવાથી પ્રભુ તરફથી ગુણોની પ્રાપ્તિરૂપ યોગ અને ગુણોના સંરક્ષણા, સંવર્ધનરૂપ ક્ષેમ મળે છે.

ભક્તિસૂત્રમાં નારદ ઋષિ કહે છે : 'તસ્મિન् અનન્યતા, તદ્વિરોધિ-ઘૂદાસીનતા ચ...' તેને વિધે - પરમાત્માને વિધે અનન્યચિત્તતા અને પરમાત્મા સિવાયના બીજા પદાર્થો અને વ્યક્તિઓ પ્રત્યે ઉદાસીનભાવ હોવો જોઈએ.

ગ્રભુના હસ્તાક્ષર ♦ વિકલ્પોને પેલે પાર : આત્માનુભૂતિ

અકિંચનતા. અનન્યતા. બીજા બધાને છોડ્યા, એકને-ગ્રભુને મેળવ્યા.

એથી વિરુદ્ધ કરનારને ઉદેશીને સંત કહે છે : કોઈ કો તો બહુત સમ્હાલા, લાલ રતન ક્યું છોડ દિયા ? નામ-જપન ક્યું છોડ દિયા ?

■ ■ ■

અકિંચનતાથી એકત્વતાની મજાની યાત્રાનું વર્ણન પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં છે.

અધ્યયનની પૃષ્ઠભૂત પણ ઘારી, ઘારી છે. નમિ રાજાને દાહ-જવર થયો. પૂરા શરીરમાં બળતરા. કોઈ રીતે શાન્તિ ન થાય. રાજવૈદ્યોએ ઘણી દવા કરી; પણ બધી જ નિષ્ઠળ. છેવટે ચન્દન શરીરે ઘસવાનું નક્કી કરાયું. રાણીઓ ચન્દન ઘસે છે. પણ ઘસતી વખતે કંકણો અથડાવાથી અવાજ થાય છે. રાજાથી એ સહન થતો નથી અવાજ. મન્ત્રીઓ રાણીઓને એક એક કંકણ રાખવાનું સૂચવે છે. હવે અવાજ બંધ. રાજાએ પૂછ્યું : ચન્દન ઘસવાનું બંધ થયું ? મન્ત્રી કહે છે : ઘસવાની કિયા ચાલુ છે, પણ કંકણ ઘણા હોવાથી અથડાતા હતા, એક હોવાથી હવે અથડામણ નથી થતી.

રાજાના ચિત્તમાં આ એકત્વની વાત ઊતરી ગઈ. દીક્ષા લેવાનું નક્કી કર્યું.

દીક્ષિત થયેલ નમિ રાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા કરવા ઈન્દ્ર આવે છે અને કહે છે કે અગ્રિ અને વાયુ આપના મહેલને બાણી રહ્યા છે, આપ કેમ તે તરફ જોતા નથી ?

નમિ રાજર્ષિએ કહ્યું : જે અકિંચન છે, તે સુખપૂર્વક રહે છે અને જીવે છે. મિથિલા નગરી બળે તેમાં મારું કંઈ બળતું નથી.'

(૧) સુહં વસામો જીવામો, જેસિમો ણતિથ કિંચણ ।

મિહિલાએ ડજ્ઞમાણીએ, ન મે ડજ્ઞાઇ કિંચણ ॥

પ્રભુના હસ્તાક્ષર ♦ વિકલ્પોને પેલે પાર : આત્માનુભૂતિ

અંકિયનતા જ્યાં, ત્યાં સુખ. એવું મળાનું સૂત્ર અહીં મળ્યું.

અવધૂત ગીતાનો ઘારો શ્લોક યાદ આવે :

રથ્યાકર્પટવિરચિતકન્થः, પુણ્યાપુણ્યવિવર્જિતપન્થः ।

શૂન્યાગારે તિષ્ઠતિ નગ્રઃ, શુદ્ધ-નિરઝન-સમરસમગ્રઃ ॥

લક્ષ્યાલક્ષ્યવિવર્જિતલક્ષ્યઃ, યુક્તાયુક્તવિવર્જિતદક્ષઃ ।

કેવલતત્ત્વનિરઝનપૂત્રઃ, વાદવિવાદે કથમવધૂતઃ ॥

શેરીના ચીંથરાથી બનેલ કંથાવાળો, પુણ્ય- પાપને પેલે પાર પહોંચેલ,
મહાશૂન્યમાં હું-તું-તેના બધા આવરણોને ઉતારી નાખનાર તે મુક્ત પુરુષ
શુદ્ધ, નિષ્ઠલંક સમરસ સ્વરૂપમાં દૂબેલ હોય છે.

એને કંઈ લક્ષ્ય નથી કે અલક્ષ્ય નથી; છતાં એના લક્ષ્ય બહાર કશું
નથી. યુક્ત-અયુક્ત (યોગ્ય-અયોગ્ય)ને સામે પાર હોવા છતાં એના
જેવો નિપુણ અન્ય કોઈ મળે નહિ. એકમાત્ર નિરંજન તત્ત્વમાં ભળીને જે
પવિત્ર બન્યો છે તે અવધૂતને વાદ શું ને વિવાદ શું ?

અવધૂત... જેણો કર્મ-રજને ખાંખેરી નાખી છે. અવધૂત... અંકિયનતાથી
એકત્વતાની યાત્રા કરનાર વિરલ વ્યક્તિત્વ.

અહીં સુખ જ સુખ છે.

■ • ■

આવા વ્યક્તિત્વ માટે જ આ પંક્તિઓ લખાઈ છે :

અમીરી કી તો ઐસી કી,

કુ અપના ઘર લુટા બૈઠે;

ફીરી કી તો ઐસી કી,

કુ ખુદા કે ઘર મેં જા બૈઠે.

■ • ■

પ્રભુના હસ્તાક્ષર ♦ વિકલ્પોને પેલે પાર : આત્માનુભૂતિ

આ ભૂમિકાએ છે સમ-રસની વર્ષા. એકત્વાનુભૂતિની પાછળ છે આ સમત્વ. ક્યાંય અનેકતા લાગતી જ નથી. બધું એક જ રસથી રસાયેલું લાગે.

અનેકતા, વિભિન્નતા-પદાર્�ોમાં કે વ્યક્તિઓમાં - લાગે છે, તે ભ્રમણાને કારણે છે. વાસ્તવ-દર્શન થાય ત્યારે બધું એકરૂપ લાગે છે.

સામાન્ય વ્યક્તિ પદાર્થોને અને વ્યક્તિઓને બે ખાનાંમાં વહેંચે છે : સારા, નરસા. આ ગણિતની મોટી ચૂક એ છે કે અહીં કેન્દ્રબિન્દુ જ ખોટું છે.

મને અનુકૂળ છે માટે અમુક વ્યક્તિઓ સારી; મને પ્રતિકૂળ છે માટે અમુક વ્યક્તિઓ ખરાબ... એ જ રીતે, મને ગમે છે માટે અમુક પદાર્થો સારા; મને નથી ગમતા માટે અમુક પદાર્થો ખરાબ.

અહીં કેન્દ્રમાં હું આવ્યું. પણ આ બિન્દુ સમ્યક્ છે ખરું ?

આજે અમુક વ્યક્તિ ખૂબ પ્રિય લાગે છે; કાલે એ અપ્રિય બની જાય છે. અહીં ખરેખર શું બદલાયું ? વ્યક્તિ કે હું ?

હું બહુરૂપી જેવું છે. જે પોતે જ વ્યાવર્તનશીલ - અનિશ્ચિત છે, તેના આધારે કરેલી ગણતરી ખોટી જ પડવાની ને ?

રાતના એક માણસ અજાણ્યા ગામમાં અફીણ લેવા નીકળ્યો. અફીણ લીધું. દુકાનદાર પાસે ધૂઢ્હા ન હતા. એક રૂપિયો બાકી રાખેલો. સવારે આવીને લઈ જવાનું વિચાર્યુ.

મહેમાન બનીને પોતે આ ગામમાં આજે જ આવેલ છે. અને ગામડા ગામની દુકાનો. કોઈ સાઈન બોર્ડ છે નહિ. નિશાની તરીકે કંઈક તો રાખવું જોઈએ ન ! એક આખલો દુકાનની સામે બેઠેલો. એની નિશાની નક્કી કરી ગયો.

પ્રભુના હસ્તાક્ષર ♦ વિકલ્યોને પેલે પાર : આત્માનુભૂતિ

સવારે ઊઠ્યો. તૈયાર થઈ બજારમાં આવ્યો. આખલો તો ઊઈને એક દરળની દુકાન સામે બેઠેલો. આ તો નવાઈમાં પડી ગયો. રાતોરાત આણો તો ધંધોય બદલી નાખ્યો ! મારા રૂપિયા માટે !!

કેન્દ્રબિન્દુ પરિવર્તનશીલ ન ચાલે. કેન્દ્રબિન્દુ જ આવું હોય તો એના આધારે કરેલ ગણતરીઓ ખોટી જ પડવાની ને !

■ ■ ■

મને અનુકૂળ પેલી વ્યક્તિ છે માટે તે સારી છે; પેલી વ્યક્તિ મને પ્રતિકૂળ છે માટે ખરાબ છે આ ગણિત ખોટું એટલા માટે છે કે અહીં કેન્દ્ર જ ખોટું છે.

તો શું થવું જોઈએ ?

ઘારું સૂત્ર આવ્યું :

'ચત્તપુત્તકલત્તસ્સ, નિવ્વાવારસ્સ ભિકખુણો ।

પિયં ન વિજાએ કિંચિ, અપ્યિયં પિ ન વિજાએ ॥

લિક્ષુને નથી કંઈ પ્રિય નથી કંઈ અપ્રિય.

પ્રિય કે અપ્રિયનું લેબલ સાધક કોઈના પર લગાડતો નથી. પદાર્થ પદાર્થ છે, વ્યક્તિ વ્યક્તિ છે; પ્રિય-અપ્રિય એ મનના કમ્યૂટરની ચાલી આવેલી ભૂલ છે, જેને સાધક સુધારી લે છે.

કમ્યૂટરમાં પ્રોગ્રામ ખોટો ફીડ કર્યો હોય તો રીજલ્ટ ખોટું જ આવવાનું છે ને !

મનના કમ્યૂટરમાં પ્રિય અને અપ્રિયનો પ્રોગ્રામ ખોટી રીતે ફીડ કરાયો છે; સાધક એ ભૂલને સુધારી લે છે.

■ ■ ■

ભૂલ-સુધાર માટે ગાથાસૂત્રમાં આવેલ 'નિવ્વાવારસ્સ' પદ મહત્વનું છે. પર તરફ ખૂલતી કિયાઓ પર સાધકની નજર નથી. પ્રશભરતિ

પ્રભુના હસ્તાક્ષર ♦ વિકલ્પોને પેલે પાર : આત્માનુભૂતિ

પ્રકરણમાં મુક્યેલ ‘લોકવ્યાપારરહિતસ્ય’ પદ યાદ આવે. મુનિ લોકવ્યાપારથી દૂર હોય.

લોકો શું કરે છે કે નથી કરતા એની જોડે મુનિને કશી જ નિસ્બત નથી.

■ • ■

મુનિને કંઈ જ પ્રિય નથી. કંઈ જ અપ્રિય નથી.

અહીં જ આનન્દની તીવ્ર અનુભૂતિ થાય છે.

■ • ■

ત્રણ સૂત્રો આપણી સામે છે. પહેલું સૂત્ર અકિયનતા-પરક છે. બીજું સૂત્ર પ્રિયતા અને અપ્રિયતામાંથી - એટલે કે અનેકવિધતામાંથી સાધકને બહાર કાઢે છે. ત્રીજું સૂત્ર એકત્વાનુભૂતિ-પરક છે.

પ્રિયતા અને અપ્રિયતાની વિભાવનાના મૂળમાં ‘હું અને મારું’ આ બે વિભાવનાઓ પડેલી છે. અકિયનતા એનો છેદ ઉડાડે છે, અને પછી એકત્વાનુભૂતિ આવશે.

■ • ■

ખારું સૂત્ર એકત્વાનુભૂતિનું :

બહું ખુ મુણણો ભદ્રં, અણગારસ્સ ભિકખુણો ।

સવ્વઓ વિપ્પમુક્તસ્સ, એગન્તમણુપસ્સઓ ॥

સર્વથી વિપ્રમુક્ત સાધક એકત્વનો દર્શી હોય છે.

જગતમાં પણ એકતાનું દર્શન થાય; પોતાની ભીતર પણ એકતાનું દર્શન.

ઉપનિષદ્દના ઋષિ જગતને જોવા માટેની દ્રષ્ટિ આપતાં કહે છે : મિત્રસ્ય ચક્ષુષા પણ્ય’. મિત્રની આંખથી દુનિયાને જો ! બધા જ મિત્ર

પ્રભુના હસ્તાક્ષર ♦ વિકલ્પોને પેલે પાર : આત્માનુભૂતિ

છે અહીં. પરમપાવન આચારાંગ સૂત્રનું ઘારું સૂત્ર છે. ‘એ આયા.’ આત્મા એક છે. વ્યવહાર જગતમાં આ સૂત્રનો અનુવાદ કરીએ ત્યારે બધા જ આત્માને એક સરખા - સત્ત, ચિત્ત, આનન્દથી પૂર્ણ - માનવાના.

નિશ્ચય જગતમાં આત્માની એકતાને અનુભવવા માટેનું સૂત્ર સવાસો ગાથાના સ્તવનમાં ઉપાધ્યાયજી શ્રી યશોવિજય મહારાજે આપ્યું છે :

એકતા જ્ઞાન નિશ્ચય દ્યા,
સુગુરુ તેહને ભાખે;
જેહ અવિકલ્પ ઉપયોગમાં,
નિજ પ્રાણને રાખે.

એકત્વાનુભૂતિની કેવી સરળ વિધિ ! ‘જેહ અવિકલ્પ ઉપયોગમાં નિજ પ્રાણને રાખે.’ નિર્વિકલ્પ ઉપયોગમાં રહેવાથી એકત્વનો અનુભવ થાય.

અત્યારે, વિકલ્પોમાં રહેવાને કારણે આપણી ચેતનાની ખંડિત દશાનો આપણાને અનુભવ થાય છે. ક્યારેક રતિ, ક્યારેક અરતિ...ચિત્તના સમંદરમાં ભરતી ને ઓટ ચાલ્યા જ કરે.

એની સામે, નિર્વિકલ્પ ઉપયોગ હોય તો એક જ દશા ભીતરની ચાલ્યા કરે.

■ ■ ■

વાત તો મજાની થઈ. પણ વિકલ્પોને પેલે પાર જવું કેમ ?

‘કર્યો કોયડો કોડીનો’ની જેમ એકવાર વિકલ્પોને સ્વિચ-ઓફ કરતાં આવડી ગયા તો એકદમ સરળ એ લાગે તેવું છે.

વિકલ્પો પ્રત્યેની ભાવકની આસ્થા એ સ્વિચ-ઓન થવાની પ્રક્રિયા છે, અને એની સામે, એ આસ્થાનું દૂર થવું તે સ્વિચ-ઓફ થવાની પ્રક્રિયા છે.

પ્રભુના હસ્તાક્ષર ♦ વિકલ્પોને પેલે પાર : આત્માનુભૂતિ

અમૃતવેલની સજ્જાય યાદ આવે : ‘દેહ મન વચન પુદ્ગલ થકી,
કર્મથી બિન તુજ રૂપ રે...’ જ્યારે મન, વિચારવાની પ્રક્રિયા એ મારું
સ્વરૂપ જ નથી, ત્યારે મને એમાં આસ્થા કેમ હોય ?

વિકલ્પોને કારણે જે પીડાઓ સહન કરી છે એ જોતાં વિકલ્પોને પેલે
પાર મારું સ્વરૂપ છે એ ઘ્યાલ આવતાં કેટલો તો આનંદ આવે !

■ ● ■

અંકિયનતા... પહેલું ચરણ.

પ્રિયાપ્રિયતાના ઘ્યાલોને પેલે પાર જવું તે બીજું ચરણ.

એકત્વનો અનુભવ (આત્માનો અનુભવ) તે ત્રીજું ચરણ...

■ ● ■

આત્માનુભૂતિ જ તો સાધનાનો સાર છે ને !

સુઈગાન વિદ્વાન હતો. વિદેશયાત્રા પછી તે ગુરુ જિભ્યો પાસે ગયો.
ગુરુ તેને પૂછે છે : સાધનાનો સાર શું ?

સુઈગાન કહે છે : આકાશમાં વાદળો ન હોય ત્યારે ચન્દ્રપ્રકાશ
તળાવનાં મોજાંને પ્રકાશિત કરે છે, તેમ વિકલ્પો વિનાના ચિત્તમાં આનન્દ
રેલાયા કરે છે...

ગુરુએ તે વખતે શિષ્યની આંખોમાં જોયું. લાગ્યું કે માત્ર કાવ્યાત્મક
પ્રસ્તુતિ હતી. ત્યાં અનુભવ નહોતો.

ગુરુએ કહ્યું : શું આ રીતે તું સાધનાનો સાર પામીશ ? તું જન્મ-
મૃત્યુની પાર આ રીતે જઈ શકીશ ?

સુઈગાન જૂક્યો. તેની આંખમાં આંસૂ હતા. તેણે વિનંતિ કરી :
આપ જ મને સાધનાનો સાર કહી બતાવો !

ગ્રભુના હસ્તાક્ષર ♦ વિકલ્પોને પેલે પાર : આત્માનુભૂતિ

ગુરુએ કહ્યું : આકાશમાં વાદળો ન હોય ત્યારે ચન્દ્રપ્રકાશ તળાવનાં મોજાંને પ્રકાશિત કરે છે તેમ વિકલ્પો વિનાના ચિત્તમાં આનંદ રેલાયા કરે છે.

સુઈગાનને ઘ્યાલ આવી ગયો કે પ્રસ્તુતિ પોતાની બરોબર હતી. પરંતુ અનુભૂતિ પોતાની પાસે ન હતી. તે ગુરુનાં ચરણોમાં અનુભૂતિ મેળવવા બેસી ગયા.



આધારસૂત્ર

પણા સમિક્ખાએ ધર્મં, તત્ત્વ તત્ત્વવિણિચ્છયં । ૨૩/૨૫

પ્રજ્ઞા ધર્મ તત્ત્વને અને તત્ત્વના વિનિશ્ચયને સમ્યક્ રીતે જુઓ છે.

એગે જિએ જિઆ પંચ, પંચ જિએ જિઆ દસ ।

દસહા ઉ જિણિત્તાણં, સવ્વસત્તુ જિણામહં ॥ ૨૩/૨૬

એક (આત્મા) જિતાયે છતે પાંચ (ચાર કૃથાયો સાથે) જિતાય છે, અને પાંચ જિતાયે છતે દશ જિતાય છે. (પાંચ ઈન્દ્રિયોના વિજય સાથે) અને આ દશ જિતાયા એટલે સાધક સર્વશત્રુ વિજેતા બની ગયો.

રાગદ્વોસાદઓ તિવ્વા, નેહપાસા ભયંકરા ।

તે છિંદિત્તુ જહાનાયં, વિહરામિ જહુક્રમં ॥ ૨૩/૪૩

રાગ-દ્વેષ વગેરે તીવ્ર સ્નેહપાશ ભયંકર છે. તેને યથાશાત ઉપાયો વડે છેદીને મુનિના આચાર પ્રમાણો હું વિચરું છું.

સાધનાસૂત્ર

- પ્રજ્ઞા વડે તત્ત્વનિશ્ચય
- આત્મજ્ઞાન વડે કૃથાયજ્ય અને ઈન્દ્રિયવિજ્ય
- રાગ, દ્વેષાદિનો છેદ ઉપાયો વડે શક્ય છે.



સંત દરિયાએ એક સરસ રૂપકક્ષથા
આલેખી છે : એક હતી બિલાડી. ભારતની
જ રહી હશે. વિચાર કર્યો કે
ગુરુ તો માથે જોઈએ જ. એ ગુરુ કરવા
માટે નીકળી. પણ બુદ્ધિ બિલાડીની જ.

ગઈ તળાવને કંઠે. ત્યાં એણીએ
બગલાને જોયો. બરોબર ધ્યાનમાં...
ક્યારે માછલું આવે ને ક્યારે પકું ?
બિલાડીની બુદ્ધિએ કહ્યું : વાહ ! ગુરુ
હોય તો આવા જ !



પ્રજ્ઞા વડે તત્ત્વનિશ્ચય

સંત દરિયાએ એક સરસ રૂપકક્ષથા
આલેખી છે : એક હતી બિલાડી.
ભારતની જ રહી હશે. વિચાર કર્યો કે
ગુરુ તો માથે જોઈએ જ. એ ગુરુ કરવા
માટે નીકળી. પણ બુદ્ધિ બિલાડીની જ.

ગઈ તળાવને કંઠે. ત્યાં એણીએ
બગલાને જોયો. બરોબર ધ્યાનમાં...
ક્યારે માછલું આવે ને ક્યારે પકું ?
બિલાડીની બુદ્ધિએ કહ્યું : વાહ ! ગુરુ
હોય તો આવા જ !

બુદ્ધિથી શું થઈ શકે ?

ઝેન આશ્રમોમાં તકતી મારેલી હોય છે : No mind, please.
તમારી બુદ્ધિને લઈને અહીં ન આવો !

બુદ્ધિ તો છે વર્તુળ. તમને ગતિ લાગે, પણ ત્યાં ગતિ જેવું કંઈ હોતું નથી. એના એ જ ચકરાવામાં તમે ઘૂમ્યા કરતા હો છો.

બુદ્ધિના કમ્પ્યુટરમાં કેવા ખોટા ગણિત ફીડ કરવામાં આવે છે તેની વાત જે. કૃષ્ણમૂર્તિ આ રીતે કહેતા : એક બાળકને આપણે કહીશું કે તારે વર્ગમાં પહેલા નંબરે આવવાનું છે. બાળકને ખ્યાલ છે કે પહેલો કુમાંક એક જ હોય. બીજાને ત્યાં ન આવવા દઉં, તો જ હું ત્યાં આવી શકું. આવી રીતે પ્રથમ કુમાંકે આવેલ બાળક મોટો થઈને વેપારી બનશે તોય એની બુદ્ધિમાં હવે આ જ ગણિત બેસી ગયું : નંબર વનવાળું ! બીજા બધાને નવડાવો, જહનમમાં મોકલો; પણ આપણે નંબર વન પર આવો!

બુદ્ધિમાં સ્વાર્થ ભળી ગયો...

હવે થયું વર્તુળ... એ એમાં ફર્યા કરશે અને પોતે ‘પ્રગતિશીલ’ છે એમ માન્યા કરશે!

■ • ■

સદ્ગુરુની નજીક આપણે શી રીતે જઈશું ?

સદ્ગુરુની નજીક જવાની ચાર વિધિઓ છે : આભા, સુગન્ધ, આંખ,
અભિવ્યક્તિ.

કમશઃ ચારેને જોઈએ.

■ • ■

સદ્ગુરુની પાસે છે આભા. ઓરા. ચારિત્ર દ્વારા પવિત્ર થયેલ આન્દોલનો. સાધક એ આભામંડલમાં - ઓરાસર્કલમાં પ્રવેશે કે તરત એ ભરાઈ જાય.

શરત એટલી જ છે કે સાધકે ખાલી થઈને - વિભાવોથી પર બનીને-ગુરુ પાસે જવું જોઈએ.

આમ જુઓ તો, થોડીક ક્ષણો માટે વિભાવોથી ખાલી થઈ જવું અઘરું નથી. ગુરુદેવ પાસે અહોભાવભર્યા હદ્યે જવાનું હોય છે ને !

એક તત્ત્વજ્ઞ સરસ વાત કહી છે : પ્રભુ મેધ જેવા છે. સાધકનું હદ્ય ધરતી જેવું છે. સદ્ગુરુદેવ એ ધરતીમાંથી માટી (અહંકારની) કાઢીને ખાડો બનાવશે, જે તળાવમાં ફેરવાઈ જશે.

સવારનો પહોર. એક શિષ્ય ગુરુદેવ પાસે આવ્યો. અને વન્દના કરીને પોતાને ધોગ્ય સેવા આપવા વિનંતિ કરી.

ગુરુએ કહ્યું : સામે જગ્યા પેલી દેખાય છે, ત્યાં એક કુટિર બનાવવી છે. ગુરુની આજા. શિષ્ય તો લાગી ગયો કામમાં. સાંજ સુધીમાં માથોડા જેટલી ભીતં ચણાઈ ગઈ. અને સાધક સાંજે ગુરુદેવ પાસે આવે છે : ગુરુદેવ ! આટલું કામ થયું છે.

ગુરુએ સ્મિત આપ્યું. થોડી વાર પછી બીજો એક શિષ્ય આવ્યો. ગુરુએ એને કહ્યું : પેલી ભીતો આજે ચણાઈ છે, એ તોડી નાખ ! એ શિષ્ય ભીત તોડવા માટે ચાલ્યો.

પેલો ચણનાર શિષ્ય ત્યાં જ હતો. એ સાંભળી રહ્યો છે. પરંતુ ગુરુદેવ પર એવી શ્રદ્ધા છે કે એ સમજે છે કે ગુરુદેવ જે કંઈ કરતા હશે તે ઠીક જ કરતા હશે.

બાય ધ વે : આપણી સદ્ગુરુ પ્રત્યેની શ્રદ્ધા કેવી ? ઉદાહરણમાં આવેલ શિષ્ય પ્રાર્થિક સાધક છે, આપણા શર્ષોમાં કહીએ તો માર્ગાનુસારી

સાધક છે, અને એનામાં આવી દિવ્ય શ્રદ્ધા હોય તો આપણી પાસે કેવી હોવી જોઈએ ?

બીજી સવારે એ સદ્ગુરુએ પહેલા શિષ્યને ફરીથી કુટિર બનાવવા કહ્યું : અને એ શિષ્ય ગઈ કાલ જેવા જ ઉત્સાહ, થનગનાટ સાથે કામમાં લાગી ગયો : ‘ગુરુદેવે કહ્યું છે !’

સાંજે ફરી તે ગુરુદેવ પાસે આવ્યો. કામનું નિવેદન કર્યું. ગુરુએ ફરી બીજા શિષ્ય પાસે તે ચંદોલી ભીંતો તોડાવી નાખી.

રાતે આ શિષ્યને ઘ્યાલ આવ્યો કે સદ્ગુરુ ભીંતને નહોતા તોડાવતા, એ કર્તૃત્વના શિષ્યના અહૂંકારને તોડી રહ્યા હતા.

એ શિષ્યની ધરતી ખાડામાં ફેરવાઈ અને મજાનું તળાવ ત્યાં થઈ ગયું!

■ • ■

સદ્ગુરું ખાલી પણ કરે.

સદ્ગુરુ અહોભાવથી ભરી પણ દે.

સદ્ગુરુની આભા....

પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે સામાચારીના કોઈ નિયમના ભંગ માટે એક સાધુને શિક્ષા કરી : એક મહિના સુધી પોતાના (ગુરુનાં) વલોનું પ્રતિલેખન તે ન કરી શકે. શિષ્ય ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો : ગુરુદેવ ! બીજી કોઈ શિક્ષા કરો ને ! આ સજા તો બહુ જ અધરી છે.

શિષ્યનું ગણિત સાફ હતું : રોજ બંને સમય ગુરુદેવનાં વલનો સ્પર્શ એટલે પરમ પાવન આભાનો સ્પર્શ. ગુરુદેવે કલાકો સુધી જે વલ પહેરી રાખેલ હોય તેમાં ગુરુદેવના પવિત્ર આનંદોલનો / વિક્રિરણો આવેલ હોય. તેનો સ્પર્શ થતાં પોતાના અપવિત્ર આનંદોલનો છૂ થઈ જાય !

■ • ■

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રજ્ઞા વડે તત્ત્વનિશ્ચય

તો, વિભાવોથી સહેજ પર ઊઠીને, સદ્ગુરુદેવના આભામંડલમાં જઈએ અને સદ્ગુરુ આપણને પવિત્રતા વડે ભરી દે.

બીજી વિધિ-સદ્ગુરુની નજીક જવાની છે સદ્ગુરુની સુગંધ. આભામંડળ સૂક્ષ્મ હોવાથી બધા જ સાધકો તેને ન પિછાણી શકે તો સુગંધ તો ઘ્યાલમાં આવી જ જાય.

મારા દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી ભક્તસૂરીશ્વરજી મહારાજ પહોંચેલા સાધકશ્રેષ્ઠ હતા. એઓશ્રીનું ઉપનિષદ્ મને ખૂબ માણવા મળેલું. પૂજ્યપાદશ્રીજીની જોડે વર્ષો સુધી બેસવાનું થયું અને એ ઉપનિષદ્ જ, એ આભામંડળે જ મને ભક્તિ અને સાધનાના ગુહ્યતમ સિદ્ધાન્તો શીખવાડ્યા.

જુનાડીસાના ઉપાશ્રયના જે ખંડમાં પૂજ્યપાદ શ્રી શિયાળામાં રહેતા. તે ખંડ રાત્રે લગભગ બંધ હોય. સવારે તે ખોલીને પૂજ્યશ્રીજીને વન્દનાર્થ જે લોકો આવે તેને એક દિવ્ય સુગંધનો અનુભવ થતો.

શુભ લેશ્યાની સુગંધ આપણે ત્યાં વર્ણવાયેલી છે. જ્યારે વિચારો, ભાવો અત્યાર્ત પવિત્ર બની જાય છે ત્યારે આ સુગંધ સહજ રીતે આવ્યા કરે છે.

■ • ■

સદ્ગુરુની આંખો.

રહીમની ઘારી પંક્તિ યાદ આવે :

‘પ્રીતમ છબિ નેનન બસી, પર છબિ કહાં સમાય ?

ભરી સરાય રહીમ લખી, પથિક આય ફિર જાય....’

સદ્ગુરુની આંખોમાં હોય પ્રિયતમની, પરમાત્માની ઝલક. અને તેથી જ પરની છબિ એ આંખોમાં ઝલકતી નથી. ધર્મશાળા (સરાય) ભરાયેલી હોય તો મુસાફર પાછા જાય ત્યાંથી. એમ સદ્ગુરુની આંખોમાં પરમાત્માની ઝલક એવી તો હોય કે પર માટે ત્યાં જગ્યા જ ન હોય.

એક ભક્ત ગુરુદેવ પાસે ગયો. ચરણોમાં પડ્યો. વિનંતિ કરી :
ગુરુદેવ ! પ્રભુનું દર્શન કરાવો !

અને ત્યારે સદ્ગુરુ કહે છે : ‘ઉપર જો !’ માત્ર બે જ શબ્દો.
ભક્તે ઉપર પલકોને ઉઠાવી, સદ્ગુરુની આંખોમાં જોયું અને તેને પ્રભુનું
દર્શન થઈ ગયું.

સીધું પ્રભુનું દર્શન એ તો અદ્ભુત છે જ. પણ ગુરુદેવની આંખોમાં
પ્રતિબિમ્બિત થયેલ પ્રભુરૂપનાં દર્શનની વાત કયા શબ્દોમાં કરીશું ?
સદ્ગુરુની ભીની, ભીની આંખોમાં તરલિત થયેલા પરમાત્માને નીહાળવા
તે ખરેખર જીવનનો લહાવો છે.

■ ● ■

આભા, સુગંધ, આંખ અને હવે ચોથું પરિમાણ - સદ્ગુરુની નજીક
સરવાનું- છે અભિવ્યક્તિ.

સદ્ગુરુની અભિવ્યક્તિમાં ‘હું’ શબ્દ કદાચ શોધ્યોય નહિ મળે.
ત્યાં પ્રભુ જ પ્રભુ હશે. મારા પ્રભુની કૃપા કે આવો સાધનાપથ એણે
આપ્યો.

વિનિયોગની - શિષ્યને સાધના આપવાની - ભૂમિકાએ પ્રતિષ્ઠિત
થયેલા ગુરુદેવ ક્યારેય નહિ માને કે પોતે બીજાઓને કંઈક આપી રહ્યા
છે. એમની મનોભૂમિકા એ હશે કે મારા પ્રભુએ જે આપેલું છે તેની
વાતો હું બીજાને કરી રહ્યો છું. કારણ કે એ કથા તે પ્રભુભક્તિ છે.
એમાં, સામી વ્યક્તિનું ઉપાદાન સક્ષમ હોય તો તેને મળી જાય.

ગંગા નદી ક્યારેય હિસાબ રાખે ખરી કે સેંકડો કિલોમીટરના
પોતાના પ્રવાહમાં તેણે કેટલા લોકોને પાણી આપ્યું...! નહિ, નદી વહ્યા
કરે છે. કંઈ આવેલ લોકો પોતાની તરસ છિપાવે તો તે તેમના તરફ
ખૂલતી વાત છે.

એમ સદ્ગુરુ ક્યારેય વિચારતા નથી કે પોતે કેટલાને ધર્મબોધ આપ્યો. જરૂર, વિનિયોગ એમની ફરજ છે, અને એ ફરજમાં તેઓ સહેજે ઉણા ઉત્તરતા નથી.

બૌદ્ધ ગુરુ ધર્મબોધિ ચીનમાં ગયેલા. તેઓ લગભગ ભીતની સામે મોહું કરીને બેસતા. લોકો પ્રવચન માટે બહુ જ વિનંતિ કરતા કે દર્શન માટે સન્મુખ બેસવાની વિનંતિ કરતા; ત્યારે ધર્મબોધિ તરત મોહું લોકો તરફ ફેરવતા અને કહેતા : લો, મને ફરતાં કેટલી વાર લાગી ? હું તો તમારી સન્મુખ થઈ ગયો; તમે મારી સન્મુખ થવામાં કેટલો સમય લેશો? દેખીતી રીતે, ગુરુ શ્રોતા કે દર્શકોના ચિત્તને પોતાની સન્મુખ ફેરવવાની વાત કરી રહ્યા હતા.

કેટલી સરસ વાત !

■ ■ ■

સદ્ગુરુની આભા, સુગંધ, આંખ અને અભિવ્યક્તિ દ્વારા સદ્ગુરુની નજીક અને એ રીતે પ્રભુની નજીક જવાય છે.

ચર્ચાનો સાર એ થથો કે અતીન્દ્રિય તત્ત્વો - પરમાત્મા, સદ્ગુરુ, ધર્મ આદિ-ને પામવા બુદ્ધિ કોઈ કામની નથી. પ્રજ્ઞા વડે જ તે તત્ત્વોને પામી શકાય.

બુદ્ધિની સાથે અહંકારની જુગલબંધી છે. પ્રજ્ઞાની સાથે શ્રદ્ધાની જુગલબંધી છે.

બુદ્ધિ અને અહંકારના વર્તુળમાં ગતિ ભલે લાગે, એ ગતિ હોતી જ નથી.

તો સાધનામાર્ગ ગતિ શેનાથી મળે ? પ્રજ્ઞા વડે. અને પ્રજ્ઞામાં શ્રદ્ધા બરોબર ભરાયેલી છે, એટલે શ્રદ્ધાથી સાધના માર્ગ ગતિ મળે.

આ જ સંદર્ભમાં સ્તવનાની કરી વહી છે : ‘તું ગતિ, તું મતિ, આસરો,
તું આલંબન મુજ ઘારો રે; વાચક જસ કહે માહરે, તું જીવજીવન આધારોરે...’

સાધનામાર્ગ ગતિ પ્રભુથી કહેવાનો સંદર્ભ પ્રભુશ્રદ્ધામાં પર્યવસિત છે.

‘ચરણો આપણા, ગતિ પ્રભુની.

તો મતિ કોને આધીન ?

પ્રભુને જ તો !

ઉપનિષદો કહે છે : ‘યસ્ય ભાસા વિભાતિ ઇદં સર્વમ्।’ જેના તેજથી
બધું પ્રકાશે છે.

પરમતારક સુવિધિનાથ પ્રભુના સ્તવનમાં પૂજ્ય મહોપાધ્યાયજી શ્રી
યશોવિજ્ય મહારાજ આ વાતને સરસ રીતે કહે છે : ‘લઘુ પણ હું તુમ
મન નવિ માવું રે, જગ ગુરુ તુમને દિલમાં લાવું રે, કેહને દીજે એહ
શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિઝાંદ વિમાસી રે...’

પ્રભુ ! હું તો છું નાનકડો, અને છતાં તમારા હદ્યમાં મારું સ્થાન,
કદાચ નથી. તમે આવા મોટા, અને છતાં હું તમને મારા નાનકડા
મનમાં ધ્યાઈ શકું. પ્રભુ ! બોલો તો, આમાં શાબાશી કોને મળશે ?

જવાબ બહુ મજાનો અપાયો છે : ‘જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને
દીજે એહ શાબાશી રે...’ મને આ વિચાર કોના પ્રભાવથી - તેજથી
આવ્યો? આપની કૃપાથી જ... એટલે આ યશ બધો આપનો જ છે.

પ્રભુને આધીન મતિ તે જ પ્રજ્ઞા.

■ ■ ■

પરમપાવન ઉત્તરાધ્યયન સૂત્રના કેશી-ગૌતમીય અધ્યયનના પ્રારંભમાં
જ આ પ્રજ્ઞાની વાત થઈ છે.

ભગવાન ગૌતમગણધર ગણધર કેશી સ્વામીજીને કહે છે : યણા સમિક્ખાએ ધર્મં, તત્ત્વાની રહસ્ય અને તત્ત્વોનો વિશેષ નિશ્ચય પ્રજ્ઞા દ્વારા થાય છે.

અધ્યયનની પૃષ્ઠભૂ પણ મળાની છે.

શ્રાવસ્તી નગરીના તિન્દુક નામના ઉદ્યાનમાં ભગવાન કેશીગણધર (પાર્શ્વનાથ પ્રભુના) શિષ્યવૃન્દ સાથે આવેલા. ભગવાન ગૌતમગણધર પણ એ સમયે શ્રાવસ્તીના કોષ્ટક ઉદ્યાનમાં આવ્યા. વહોરવા જતી વખતે બન્ને ગણધરોના શિષ્યો મળે અને ત્યારે જૈન શ્રમણો હોવા છતાં વેષ આદિમાં જ ફરક હતો, તેથી શિષ્યોને જિજાસા થતી : આવું કેમ? (પાર્શ્વનાથ પ્રભુના શિષ્યો રંગીન અને બહુમૂલ્ય વસ્ત્રો પણ પહેરી શકે, જ્યારે પ્રભુ મહાવીરના શિષ્યો સરેદ અલ્પમૂલ્યનાં વસ્ત્રો પહેરતા...)

શિષ્યવૃન્દની શંકા દૂર કરવા બન્ને ગણધરોએ ભેગા થવાનું વિચાર્યુ અને કેશી ગણધર મોટા હોવાથી ગૌતમ સ્વામી તેમના સ્થાને જાય છે. કેશી ગણધર તેમનો સત્કાર કરે છે.

કેવા એ નિરભિમાની મહાત્માઓ ! કેશીગણધર પૂછે છે ગૌતમ સ્વામીને : એક જ મોક્ષ માટે ઉદ્યમ કરનાર આપણામાં પરસ્પર આ વસ્તુ અને મહાપ્રતો (એકમાં ચાર, એકમાં પાંચ) વગેરેમાં વિભેદ કેમ છે ?

ગૌતમગણધર બહુ જ માર્ભિક વાત અહીં કરે છે : પ્રજ્ઞાથી જ ધર્મતત્ત્વને જોવાવું - સમજાવું જોઈએ. કોઈ પણ તત્ત્વનો નિશ્ચય પણ પ્રજ્ઞા વડે જ થઈ શકે.

પ્રજ્ઞા અભેદની ભૂમિકા છે.

બુદ્ધિ વિભેદની ભૂમિકા છે.

એટલે, આપણી દસ્તિએ આપણાને ભેટ દેખાય, તેનો મતલબ ત્યાં ભેટ છે એવો નહિ કરતાં મારી બુદ્ધિ ભેટ દેખાડે છે આ વાત વિચારવાની.

પ્રભુના અનેકાન્તવાદને આના વિના કેમ સમજી શકાય ?

પાર્શ્વપત્ય સાધુઓની વિરાગાવસ્થા તીવ્ર હોવાથી તેમને જે પણ વસ્તો નિર્દોષ મળે તે લેવાનું સૂચવવામાં આવ્યું. પ્રભુવીરના શ્રમણોને બહુમૂલ્ય વસ્તોમાં રાગની શક્યતા જોઈ તે નિવારવા માટે સર્કાર, અલ્યમૂલ્ય વસ્તોની વાત કરી.

■ • ■

આવા શ્રેષ્ઠ જ્ઞાનીઓ મળે ત્યારે અન્તરંગ સાધનાની જ વાતો થવાની. કેશીગણધર ગૌતમ સ્વામીજીને પૂછે છે : હજારો શત્રુઓની વચ્ચે તમે રહો છો અને તે શત્રુઓ તમને પરાજિત કરવા મથી પણ રહ્યા છે, તો તમે તે શત્રુઓને કઈ રીતે જીતો છો ?

ગૌતમસ્વામી કહે છે : એક શત્રુને જીતવાથી પાંચ શત્રુઓ જિતાય છે અને પાંચ પર વિજય મેળવવાથી દશ શત્રુઓ પર વિજય મળે છે. અને દશ દુશ્મનો જીતાતાં બધા જ દુશ્મનો જિતાઈ ગયા.

જ્ઞાનીઓની વાત જ્ઞાનીઓ તો ઈશારામાં સમજી જાય. પણ ત્યાં તો શ્રમણવર્ગની સાથે બીજા દાર્શનિકો, લોકો, દેવો, યક્ષો વગેરેની મોટી સભા હતી. એટલે બીજાઓ ગૌતમ સ્વામીના પ્રત્યુત્તરમાં કંઈ સમજે નહિ તે શક્ય હતું. આથી કેશી ગણધરે ગૌતમ સ્વામીને તેમનો જવાબ સ્પષ્ટ કરવા કહ્યું.

ગૌતમ સ્વામી કહે છે :

એગણ્ણા અજિએ સત્ત્વ, કસાયા ઇંદિયાણિ ચ ।

તે જિણિતુ જહાનાયં, વિહરામિ અહં મુણી ॥ ૨૩/૩૮ ॥

આત્મ-અજ્ઞાન એ પહેલો અવરોધ, એ પછી કખાયોથી પરાજિત હોવું અને વિષયોને અધીન હોવું આ જાતને શત્રુઓને હવાલે છોડવા જેવું છે. એની સામે, આત્મજ્ઞાન, કખાયજ્ય અને ઈન્દ્રિયજ્ય એ દાવને વિજયી બનાવવા માટેની વિધિ છે.

બહુ જ મજાનો આ સાધનાકમ છે. સહૃથી પ્રથમ જોઈએ આત્મજ્ઞાન. પણ એ જ્ઞાન એટલે માહિતીજ્ઞાન નહિ; અનુભૂતિ ભણી જનારું એ જ્ઞાન જોઈએ.

એક ગુરુએ પોતાના એક શિષ્યને પૂછ્યું : આત્મા વિષે તું શું જાણો છે ? કહી બતાવ તો !

‘વિદ્વાન’ શિષ્યે દોઢ કલાક સુધી લંબાજાથી આત્મતત્ત્વ વિષે ચર્ચા રજૂ કરી. ઘણા બધા જ્ઞાનિપુરુષોના એ અંગેનાં ઉદ્ઘરણો પણ આપ્યા.

ગુરુએ બધું સાંભળ્યું. પણ તેમને લાગ્યું કે આ માણસ કોરો છે. તેને કશું સ્પર્શ્યું નથી. ગુરુની ટિપ્પણી ધારદાર હતી : ભાખરીના ચિત્રથી કોઈનું પેટ ભરી શકતું નથી....

આત્માનુભૂતિ તે વાસ્તવિક ભાખરી.

આત્મા અંગેનું માહિતી જ્ઞાન એ ભાખરીનું ચિત્ર.

■ • ■

આત્માનુભૂતિ.

જ્ઞાનગુણ દ્વારા કે દર્શન ગુણ કે ચારિત્રગુણ દ્વારા આત્મતત્ત્વનો અનુભવ તે આત્માનુભૂતિ. અને આત્મદ્રવ્યનો અનુભવ તે પણ આત્માનુભૂતિ.

પૂજ્યપાદ આનન્દધનજી મહારાજ પરમતારક શ્રી અરનાથ પ્રભુના સ્તવનમાં આ બેઉ અનુભૂતિઓને અલગ-અલગ રૂપે દર્શાવે છે :

‘દર્શનજ્ઞાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે;
નિર્વિકલ્પ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે.’

દર્શનગુણાની પૃષ્ઠભૂ પરનું આત્મસ્વરૂપ ભિન્ન અને જ્ઞાન કે ચારિત્ર ગુણાની પૃષ્ઠભૂ પરનું આત્મસ્વરૂપ (અલખ-અલક્ષ્ય-આત્માનું રૂપ) પણ ભિન્ન હશે.

ભિન્નતા બે કારણોથી નિપળ છે. એક : ગુણાત્મક ચાદરો ભિન્ન-ભિન્ન હોવાને કારણો. બીજું : વિકલ્પોની ભૂમિકા ચાલુ હોવાને કારણો.

દ્રષ્ટાભાવ - સાક્ષીની ભૂમિકાએ એક સાધક છે. માત્ર જોવાનું બની રહ્યું છે, કર્તૃત્વની ભૂમિકા દૂર છૂટી ગઈ છે. આ ભૂમિકા પર આત્મગુણાનો આસ્વાદ... પણ હવે જો ઉદાસીનભાવની તીવ્રતાની પૃષ્ઠભૂ હશે તો ? તો આસ્વાદ બદલાશે.

કર્તૃત્વમાં સજા હતી. સાક્ષીભાવમાં મજા છે.

લિમતા-આસક્તિમાં સજા હતી. ઉદાસીન ભાવમાં - અનાસક્ત દશામાં મજા છે.

પણ, મોહનો વિલય નથી થતો ત્યાં સુધી સૂક્ષ્મ પણ વિકલ્પો ચાલ્યા કરતા હોય છે. એટલે સાધકની અત્યારની કક્ષાએ જ્ઞાતાભાવ, દ્રષ્ટાભાવ કે ઉદાસીનભાવ હોવા છતાં વિકલ્પોનું પૂર ચાલતું હોય છે અને એથી જ્ઞાતાભાવ આદિનો પૂરો આનંદ મળતો નથી.

મોહનો વિલય થયા પછી, નિર્વિકલ્પભાવની પૃષ્ઠભૂ પર આત્મદ્રવ્યની અનુભૂતિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિની અભિન્નતામૂલક અનુભૂતિ. જેને અભેદ રત્નરૂપી કહેવામાં આવે છે. યથાજ્યાતચારિત્રની ભૂમિકાએ આ અનુભૂતિ મળે છે.

પરન્તુ આપણા સ્તરે નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પરની અનુભૂતિ થઈ શકે ? યોગવિશિકા ટીકામાં અનાલંબન દશાની જે સંયોગોમાં હા પાડી છે, તે દશામાં આ અનુભૂતિની નાનકડી ઝલક મેળવી શકાય. વિકલ્પો મોટા મોટા ખરી પડ્યા હોય, સાધક સ્વને અનુભવવા માટે ઉપયોગવાળો બનેલ હોય અને નેશાયિક આત્મસ્વરૂપનું વિભાવન ચાલી રહ્યું હોય તો આ અનુભૂતિની નાનકડી ઝલક મળી શકે.

■ ● ■

આત્મજ્ઞાનની આ ભૂમિકા પછી ક્ષાયવિજય સરળ થઈ પડે છે. સ્વમાં ઊંડો આનંદ આવવા માંડ્યો; હવે પરમાં જવાશે જ કેમ ?

ક્ષમાનો આનંદ નથી મેળવ્યો એ જ મનુષ્ય કોધની ક્ષણોમાં વહી શકે. નવાઈની વાત એ છે કે આપણે ક્ષમા ગુણને તો તીવ્રતાથી આત્મસાતું નથી કર્યો; પણ કોધને પણ ક્યાં બારીકાર્યથી જોયો છે ?

સમયસારનું ગાથાસૂત્ર યાદ આવે : જેમાં લઘ્યું છે કે કોધ કોધમાં, મારે શું ? હું તો સ્વમાં જ હોઉં. પરમાં હું શી રીતે હોઉં ?

આત્મવિજય (આત્મજ્ઞાન) અને ક્ષાયવિજય થયો, તો વિષયવિજય બહુ સરળ છે. અને આ દશ પર વિજય થયો તો સાધક બન્યો સર્વવિજેતા.

૨. સમયસાર : જહ જીવસ્સ અણણુવઓગો, કોહો વિ તહ જદિ અણણો। જીવસ્સા જીવસ્સ ય, એવમણણત્તમાવણં ॥૨-૧૧૩

જેવી રીતે જીવનો ઉપયોગ અનન્ય હોય છે, તન્મંયતાને કારણે આત્મોપયોગ જ સતત હોય છે. તે રીતે કોધ પણ અનન્ય છે.

મતલબ કે આત્મા સદાય આત્મોપયોગમાં રહેશે કોધાદિ જડભાવમાં એ ક્યારેય જઈ શકે નહિ

■ ● ■

વિષયવિજેતા (ઈન્દ્રિયવિજેતા) બનવા માટે ભક્તિયોગના સહારાની વાત પૂ. ઉપાધ્યાય માનવિજ્ય મહારાજે પરમતારક શીતલનાથ પ્રભુની સત્તવનામાં કરી છે :

‘તુજ મુખ સન્મુખ નીરખંતાં, મુજ લોચન અમીય ઠરંતા..’ પ્રભુના મુખની સામે જોવાય અને આંખોમાંથી વહેતા વિરહાશ્રૂ જામી જાય. પ્રભુ ન મળ્યાનો અપાર રંજ... અને ત્યાં જ પ્રભુનું દર્શન... આંખમાં આવેલ અશ્રૂબિન્દુ ઝીજ થઈ જાય.

‘તુજ નામ સુણ્યું જબ કાને, હૈયું હુઉ તબ સાને; મૂરછાણો માણસ વાટે, સજજ હુએ અમૃત છાંટે...’ ભગવાનનું નામ સંભળાયું, ને હદ્ય સ્વસ્થ બન્યું. મજાની ઉપમા આપી. બળબળતી બપોરે કોઈ માણસ રક્તામાં બેભાન થઈને પડેલ હોય અને તેને ઠંડું પાણી કે અમૃત છાંટવામાં આવે તો કેવો તરત એ ભાનમાં આવી જાય ? એ જ રીતે પ્રભુનું નામ સાંભળતાં ભક્તહદ્યને ઓચ્છવ-ઓચ્છવ થઈ રહે.

આંખ અને કાનને તો મજા આવી ગઈ. હવે નાસિકા કેમ બાકી રહે? ‘શુભ ગંધને તરતમ યોગે, આકુલતા હુઈ ભોગે; તુજ અદ્ભુત દેહસુવાસે, તેહ મિટી રહત ઉદાસે’..., બહારની સારી ગંધ- અતાર આદિની- ભોગોમાં મનને વ્યાકુળ બનાવશે... જ્યારે પ્રભુના અદ્ભુત દેહની સુગંધ વ્યાકુળતાને મિટાવી, ઉદાસીન દશાને આપશે.

‘તુજ ગુણ સંસ્તવને રસના, છાંડે અન્ય લયની ત્રસના...’ જિહ્વાને પ્રભુ ગુણ ગાવાનો જ્યાં આનંદ આવ્યો, બીજું બધું છૂટી ગયું ! એ સિવાય બીજું કાંઈ ગમે જ નહિ તો....!

‘પૂજાએ તુજ તનુ ફરસે, ફરસન ઉલ્લસિત થઈ હરસે...’ પૂજા કરતી વખતે પ્રભુના અંગોનો સ્પર્શ આંગળીઓને થાય, અને કેવો તો આનંદ પૂરા અસ્તિત્વમાં વ્યાપી રહે !

■ • ■

એક ભક્તે મને પૂછેલું : પ્રભુની પૂજા વખતે પ્રભુનો સ્પર્શ થવા છતાં ભીતર ખલબલાટી કેમ મચતી નથી ?

મેં કહેલું : ઈલેક્ટ્રોિક ટેકનીશીયન વાયર જોડે રોજ કામ પાડતો હોવા છતાં લાકડાનું કે બીજું કંઈક ઉપકરણ હાથમાં પહેરી રાખે તો લીક થયેલ વાયરને અડવા છતાં એને કંઈ નહિ થાય. એ જ રીતે પ્રભુની અને ભક્તની વચ્ચે કશોક અવરોધ આવી જાય તો ભક્તની પાસે ખલબલાટી નહિ હોય. અને એ અવરોધ છે વિચાર. મન જો અન્યાન્ય વિચારોમાં રોકાયેલું હોય તો અહોભાવ ન હોય, અને તો સ્પર્શનો આનન્દ કોણ લઈ શકે ?

ગભારામાં પ્રવેશતાં પહેલાં ભક્તે પોતાની જાતને એ રીતે તૈયાર કરવી જોઈએ કે સાક્ષાત્ પ્રભુનો સ્પર્શ મને મળવાનો છે. ઓહ ! આવી પ્રચંડ ઘટના... અને એના સાક્ષી બનવાનું સૌભાગ્ય મને !

અહોભાવની આ પૃષ્ઠભૂ પ્રભુના સ્પર્શની ખલબલાટી આપશે.

■ ■ ■

પ્રભુપૂજાના સન્દર્ભમાં એક યુરોપીયન પ્રોફેસરે પાલીતાણામાં પૂજ્યપાદ ગુરુદેવને પૂછેલું કે તમારી પૂજાપદ્ધતિમાં ચરણથી શરૂઆત શા માટે હોય છે ? આર્યપદ્ધતિમાં મસ્તિષ્કનો પણ મહિમા ન્યારો છે. તો પૂજાનો પ્રારંભ મસ્તકથી કેમ નહિ ?

આપણને પણ આ સવાલ આ રીતે થઈ શકે : તીર્થસ્થળોમાં જ્યારે પરમાત્માને નવ અંગની પૂજા - ભક્તો વધુ હોય ત્યારે - બંધ કરવામાં આવે અને એક અંગે પૂજા કરવા દેવામાં આવે, ત્યારે એ એક અંગ ચરણ જ (જમણા ચરણનો અંગૂઠો) કેમ ?

ગુરુદેવે જવાબ આપેલો : પ્રભુની મૂર્તિ પ્રાણપત્રિષ્ઠિત હોય છે એમાંથી ઉર્જા નીકળતી હોય છે. પરંતુ ચરણમાંથી એ ઉર્જા વિશેષ પ્રમાણમાં નીકળે છે.

યુરોપિયન પ્રોફેસર સંતુષ્ટ થયા.

■ ■ ■

આવું જ સદ્ગુરુના ચરણ-સ્પર્શની બાબતે છે. સ્ખલન - અપરાધ સેવીને આવેલ શિષ્ય પોતાનું શિર ગુરુના ચરણે ટેકવે છે, અને ગુરુના ચરણમાંથી નીકળતી ઉર્જા એને પવિત્ર બનાવે છે.

■ ■ ■

ઈન્દ્રિય-વિજયના સન્દર્ભમાં ભક્તિયોગને આપણે જોયો.

મન્દિરોનું પૂરું તત્ત્વ પણ ઈન્દ્રિયોના અપર રસમાંથી મુક્ત કરાવી સાધકને ઈન્દ્રિયાતીત પર રસની દુનિયામાં ધકેલે છે.

દહેરાસરોમાં ઘંટનો જ અવાજ જોઈએ. આવું કહેનાર આપણા પૂર્વજીને અનાહત ધ્વનિનો ધ્યાલ હશે જ એવું માનવા મન લલચાય.

ઘંટની દિવાલ પર તેનું પેન્ડુલમ ભટકાય ત્યારે અવાજ થાય છે તે નહિ, પણ પેન્ડુલમના ધક્કા પછી જે રમ્ રમ્ રમ્ જેવો રણકાર થાય છે, તે અનાહત નાદની સમાન છે.

નાદ બે છે. એક આહત. (કોઈ પણ ચીજને બીજી ચીજ સાથે ટકરાવીને થતો ધ્વનિ.) બીજો છે અનાહત નાદ. જે કુદરતી રીતે ભીતર ચાલ્યા કરે છે.

તો ઘંટનાદ એ ભોંયરાનું પ્રવેશદ્વાર થયું; જેમાંથી અનાહતના ભૂગર્ભમાં ઊતરી શકાય.

■ ■ ■

મન્દિર એટલે જ પૂરું તત્ત્વ. અમદાવાદ, વાધણપોળના એક દહેરાસરના ભોંયરામાં - મને ધ્યાલ છે ત્યાં સુધી - ચાલીસ પગથિયા નીચે હું ઊતરેલો અને ત્યાં પ્રભુની સામે જે અનુભવ થયો. અદ્ભુત.

ત્યાં વેન્ટિલેસન - વાજાળિયાં મૂકાયેલાં, પણ એ સીધા નહિ, એક વાજાળિયું હોય, તેનો પ્રકાશ નીચો ઊતરે, હવા પણ... એને સમાન્તર નહિ, પણ ૪-૫ ફૂટ દૂર બીજું વાજાળિયું નીચે હવા-પ્રકાશ વહી જતું હોય.

બહુ જ વૈજ્ઞાનિક આ દિઝિકોષ હતો : પ્રભુની મૂર્તિમાંથી જે ચૈતન્ય કણો, દિવ્ય આન્દોલનો બહાર નીકળતા'તા, તે નીચેના એ ભોંયરાના મંડપમાં ધૂમરાયા જ કરે. અને એ રીતે ભાવક એ આન્દોલનોનો, લિફ્ટની જેમ ઉપયોગ કરી, આધ્યાત્મિકતાના શિખરે પહોંચે.

■ • ■

પ્રાચીન દહેરાસરોને પોતાની આસપાસ બગીચાઓ હતા. એ બગીચામાં ઊગતા ફૂલોની સુગંધ અને ધૂપની મહેકથી દહેરાસર મહેકી ઊઠતું. સુગંધમાં પણ ધ્વનિની જેવો જ સિદ્ધાન્ત પકડાયેલો છે. એવી સુગંધ, જેના આધારે ભીતરી સુગંધમાં સરવાનું શક્ય બને.

દહેરાસરોમાં એવી રીતે ધૂપને ઉખેવવાની વાત આવે છે કે નિજમંડપમાં પણ ધૂમ્રસેરો આમથી તેમ ઢોડતી હોય.

■ • ■

ગર્ભગૃહમાં અંધારું રહે. ભોંયરાના નિજમંડપમાં પણ બહુ જ આછી રોશની હોય. અને એ વખતે ગર્ભગૃહમાં ટીમટીમતો ગાયના ધીનો દીવો પ્રભુના રૂપને લિખ લિખ આયામોથી દર્શાવ્યા કરે.

ત્રાટકાચાર્યો કહે છે કે ગાયના ધીના દીવા પર ત્રાટક (અપલક નજરે જોવાનું) કર્યું હોય તો આંખો રોશની-સભર બને છે.

નિજમંડપનું આછું અંધારું, અને ગર્ભગૃહમાં પ્રકાશતો દીપક. ભક્તનું અન્ધકારમાંથી પ્રકાશ ભણીનું જે ગમન છે, તેનું એ પ્રતીક બની જાય.

■ • ■

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રક્ષા વડે તત્ત્વનિશ્ચય

પ્રાચીનકાળથી દહેરાસરોમાં ફરસમાં સંગેમરમર બેસાડાતો. એનું કારણ હતી સંગેમરમરની ઠંડક. એ ઠંડા સ્પર્શના સહારે ભીતર ઉત્તરાતું.

અને, ભક્ત જે સત્તવનાઓ ઉચ્ચારતો તેનો ધ્વનિ ગુંબજ (ઘુમ્મટ)માંથી પડધાઈ પાછો ફરતો ત્યારે પ્રભુ પોતાના સાદનો પ્રતિસાદ આપી રહ્યા હોય તેવી અનુભૂતિ થતી.

■ • ■

ઘુમ્મટ અવાજને પડધાવા માટે હતો. બીજો ઉદેશ ઘુમ્મટનો વિશાળતાની અનુભૂતિ માટેનો હતો. નીચી છતવાળા કમરામાં રહીએ ત્યારે થતી અનુભૂતિ કરતાં ઊંચે-બહુ ઊંચે આવેલી છત હોય ત્યારે થતી અનુભૂતિમાં ફરક પડે છે એ આપણા અનુભવની વાત છે. ઘુમ્મટની નીચે આ વિશાળતાનો અનુભવ થાય છે. હદ્યને ઉદાર બનાવવાનું છે ને ! ‘ચદ્રૈ ભૂમા તત્ત્વ સુખમ्, અલ્યે સુખં નાસ્તિ, એ ઉપનિષદ્-સૂત્રનો જીવંત અર્થ અહીં ઘ્યાલમાં આવે. (જે વિશાળ છે તે જ સુખાનુભૂતિ કરાવી શકે. અલ્યમાં સુખાનુભૂતિ ક્યાંથી ?)

■ • ■

ગુંબજ વિશાળતા-ઉદારતા (ભૂમા)ના અનુભવ માટે. શિખર બિનજરૂરી વિકિરણોને અટકાવવા માટે. ઊંચું-ઊંચું શિખર, ઉપરથી ખરતા બિનજરૂરી વિકિરણોને - આન્દોલનોને અટકાવે છે. જેથી ગર્ભગૃહમાં બિરાજેલ પ્રભુના દેહમાંથી ધૂટતા વિકિરણો પૂરા મન્દિરમાં ઘુમરાયા કરે.

■ • ■

કેશી-ગૌતમીય સંવાદની કાણોમાં આપણે સરી રહ્યા છીએ. કેશી ગણધર ગૌતમસ્વામીને પૂછે છે : લોકો બન્ધનગ્રસ્ત રીતે રહે છે. અને તમે મુક્ત હો તે રીતે વિચરો છો એનું શું કારણ ?

પ્રશ્નનું ઊંડાળ ગજખનું છે. એક સાધકના ચહેરા પર, એના પૂરા અસ્તિત્વ પર મુક્તિની આભા પથરાયેલી હોય છે. પરંપરા આ મુક્તિ માટે જીવનમુક્તિ શબ્દ વાપરે છે.

જીવનમુક્તિનું વર્ણન વર્તમાન ક્ષણો અનાસક્ત ભાવે રહેવારુપે થયેલ છે. એવા સાધકને નથી તો ભૂતકાળની કોઈ ચિન્તા. નથી આવતી ક્ષણો માટે કોઈ વિચાર. જે ક્ષણ એની સામે છે એ ક્ષણને ઉદાસીનતાથી - અનાસક્તથી ભરી દેવી એટલું જ એનું કર્તવ્ય હોય છે.^૩

પરંપરામાં આ ભાવ માટેનો શબ્દ છે વર્તમાનયોગ. એક સાધુ ગોચરી વહોરીને આવ્યા પછી ગોચરી વહેંચી રહ્યા હોય, અને બહારથી કોઈ ભક્ત વિનંતિ કરે : સાહેબજી, મારે ત્યાં લાભ નથી મળ્યો... પધારો! એ વખતે મુનિને એમ પણ લાગતું હોય કે કદાચ ગોચરી ખૂટશે. તો પણ તેઓ એમ નથી કહેતા કે એક મિનિટ ઊભા રહો! જોઉં... નહિ, તેમના મુખમાંથી આ જ પ્રત્યુત્તર નીકળશે : વર્તમાનયોગ. મને આ ક્ષણ જોડે સંબંધ છે. આ ક્ષણો ખપ નથી. આવતી ક્ષણનું કોઈ કમિટમેન્ટ - આશ્વાસન, વચન તેઓ નહિ આપે.

જીવન કેવું મળાનું હોય આ ! .

■ ■ ■

કેશીસ્વામીએ ગૌતમગણધરના ચહેરા પર રહેલી મુક્તિની આભા તેમણે જોઈ છે. અને લોકોને જાણવા મળે એ માટે આ પ્રશ્ન તેઓ પૂછી રહ્યા છે કે બન્ધનગ્રસ્ત લોકમાં તમે મુક્ત હો તે રીતે શી રીતે વિચરો છો?^૪

(૩) અતીતાનનુસન્ધાનં, ભવિષ્યદવિચારણમ् ।

ঔદાસીન્યમપિ પ્રાસે, જીવમુક્તસ્ય લક્ષણમ् ॥

(૪) દીસંતિ બહવે લોએ, પાસબદ્ધા, સરીરિણો ।

મુક્તપાસો લહુબ્ધૂઓ, કહં તં વિહરસિ મુણી ॥ ૨૩/૪૦

સાધકના ચહેરા પર રમી રહેલી આ મુક્તિની મજાની કાન્તિની પાછળનું રહસ્ય ગૌતમસ્વામીએ આ રીતે સમજાવ્યું : રાગ, દ્રેષ, અહૂંકાર આદિ પાશોને - સ્નેહાદિના બન્ધનોને યથાજ્ઞાત ઉપાયો વડે છેદીને મુક્ત રીતે હું વિચરું છું.

સાધક શબ્દોની દુનિયામાં ગમે એટલો ઉત્તરે, અશબ્દનો વિશાળ પ્રદેશ છૂટી જ જવાનો છે. શબ્દમાં સાધનાને મૂકી પણ કેમ શકાય ? જરૂર, આંગળી ચીંધી શકાય છે.

ગૌતમગણાધરના પ્રત્યુત્તરમાં અશબ્દનો વિશાળ પ્રદેશ છે. રાગ, દ્રેષ, અહૂંકાર, આદિનો છેદ મેં જ્ઞાનોલા ઉપાયો વડે કરું છું.

ક્યા ઉપાયો ?

સહૃથી મોટી વાત તો છે પ્રભુનો અનુગ્રહ. ભગવાન ગૌતમ તો પ્રભુ મહાવીર દેવના ઉપનિષદ્માં જ રહે છે અને એથી પ્રભુના અનુગ્રહ દ્વારા જ સાધના મળી શકે છે તે તેમના અનુભવમાં છે.

પંદરસો અને ત્રણ તાપસોને દીક્ષા આપીને ગૌતમસ્વામીજી પ્રભુના સમવસરણા તરફ આવી રહ્યા છે. ગૌતમ સ્વામીને ખ્યાલ નથી અને આ બધા જ નવદીક્ષિત શિષ્યો કેવળજ્ઞાની બની ગયા છે. ગૌતમરાસકાર મહર્ષિ આ સન્દર્ભમાં કહે છે : ‘આપ કને આણહુંત, ગોયમ દીજે દાન ઈમ.’ બિસ્સામાં હોય ત્યારે તો દાન આપી શકાય. પણ ગૌતમસ્વામીજી પોતે અકેવળી હોવા છતાં પોતાના શિષ્યોને કેવળજ્ઞાનની ભેટ ધરતા હતા.

સમવસરણામાં આવ્યા પછી આ નવદીક્ષિત શ્રમણો - કેવળજ્ઞાનીઓ-કેવળજ્ઞાનીઓની સભામાં બેસવા માટે જઈ રહ્યા છે ત્યારે ગૌતમસ્વામી તેમને રોકે છે : અરે, એ તો કેવળજ્ઞાનીઓની પર્ષદા છે. ત્યાં તમારાથી ન જવાય. પ્રભુ એ વખતે કહે છે : ગૌતમ ! કેવળીઓની આશાતના ન કર ! એ બધા કેવળજ્ઞાની છે !

ગૌતમ સ્વામી એક ક્ષણ વિચારમાં પડી ગયા : હમણાં દીક્ષિત
થયેલ મારા શિષ્યો કેવળી અને હું અકેવળી !

પ્રભુ કહે છે : ગૌતમ ! તને પણ કેવળજ્ઞાન હમણાં જ મળી જાય.
તું મારા પરના રાગને છોડી હો. અને એ વખતે ગૌતમ સ્વામીજીએ
કહેલુંઃ પ્રભુ ! મને આપના વિના નહિ ચાલે.

પ્રભુ પરના રાગ દ્વારા - પ્રશસ્ત રાગ દ્વારા એમણે વૈભાવિક રાગને
હટાવી દીધેલો.

મજાનો આયામ રાગ, દ્વેષ અને અહમ્મને દૂર કરવાનો આ છે :
પ્રભુ પર રાગ... તો દ્વેષ / ગુસ્સો ક્યાં કરીશું? ત્યાં જ તો !

ગણિત સાફ છે : નાનો બાબો પહેલી વાર રીસેપ્શનમાં ગયેલ.
એને ઘ્યાલ નહિ કે એકદમ સારાં કપડાં પહેરીને ત્યાં જવું જોઈએ.
મમ્મીએ પહેરાવ્યાં તેવાં સાદાં વલ્લો પહેરી એ સમારોહમાં ગયો. ત્યાં
એનાં સાદાં કપડાંને કારણે બધામાં એ હાંસીપાત્ર બન્યો. ઘરે આવીને એ
મમ્મીને કહેશે : તને ખબર ન પડે કે રીસેપ્શનમાં કેવાં કપડાં પહેરીને
જવું જોઈએ ? મને એવાં વલ્લો તેં કેમ ન પહેરાવ્યાં ?

આ જ લયમાં ભક્ત પ્રભુને કહેશે : મારામાં આવા દોષ તું કેમ
ચલાવી લે છે, પ્રભુ ! હું તારું બાળક. હું ગંદું હોઈશ તો પ્રતિષ્ઠા તારી
જ ઓછી થશે ને !

રાગ પરમાત્મા સાથે. ગુસ્સો પણ ત્યાં. અહંકાર ક્યાં કરીશું ? એ
પણ ત્યાં જ. આવા પરમાત્મા મને મળ્યા છે એનો અહંકાર...

કેવો આ ટૂંકો માર્ગ ! રાગ, દ્વેષ, અહં થઈ જાય છૂ !

મૂળનું ગાથાસૂત્ર છે : ‘તે પાસે સવ્વસો છિત્તા, નિહંતૂણ ઉપાયઓ।’ (૨૩/૪૧) રાગ, દ્વેષ આદિ સ્નેહપાશોને ઉપાયથી દૂર કરે છે સાધક. શ્રી નેમિયન્દ્રાચાર્ય બૃહદ્વૃત્તિમાં કહે છે : ‘ઉપાયતः સદ્ગૂતભાવનાભ્યાસરૂપાત्।’ ભાવનાઓના અભ્યાસ વડે રાગાદિનો વિજય થઈ શકે.

જડ પદાર્થો પરના રાગને હટાવવા માટે અનિત્યાદિ ભાવનાનો અભ્યાસ. જરૂરી છે. કે પોતે જ રહેનાર નથી એ સંપત્તિ આદિ માટે પ્રયત્ન શો કરવાનો ?

■ ■ ■

રાગાદિના શિથિલીકરણ માટે ‘યોગશતક’ ગ્રન્થમાં આત્મનિરીક્ષણાની સરસ વિધિ બતાવી છે.

આત્મનિરીક્ષણા પ્રથમ તબક્કે સાધક વિચારે છે : કો મં પીડેડ્ઝ ? મને શું નરે છે ? રાગ, દ્વેષ અને અહૂકારમાંથી મારી સાધના માટે અવરોધક તત્ત્વ કર્યું ?

બીજા તબક્કે એ વિચારે છે કે મારી પાસે રહેલગુણસ્થાનકના સન્દર્ભમાં મારી પાસે ગુણો છે કે નથી, લોકો શું માને છે ? દા.ત. છઢા ગુણસ્થાનકે રહેલ એક સાધુ વિચારશે કે લોકો મારા આ સ્થાન માટે શું માને છે ?

છઢા ગુણસ્થાનકે કોધાદિ જળરેખા જેવા હોય. પાણીમાં કરાતી રેખા. આગળ લીટી દોરાય અને ત્યારે પાછળની લીટી હોય જ નહિ. પોતાનો ગુસ્સો શું આવો છે ?

અંધારામાં પ્રતિકમણ પછી શ્રાવકો કે સાધકો ઉપાશ્રયમાં બેઠેલ હોય ત્યારે એમની પોતાના સન્દર્ભની કોઈ વાતો હોય તો સાધક સાંભળે. જેથી પોતામાં રહેલ ક્ષતિઓનો અને ઘ્યાલ આવે.

પ્રભુના હસ્તાક્ષર ❖ પ્રજા વડે તત્ત્વનિશ્ચય

આત્મનિરીક્ષણ માટે રોજ કેટલો સમય ફાળવીશું ? આજનો માણસ ઘણા બધાને રોજ મુલાકાત (એપોઇન્ટમેન્ટ) આપતો હોય છે. પોતાની જાતની મુલાકાત ક્યારે ?

આ બહુ જ જરૂરી છે. બીજાની સાથેની મુલાકાત વખતે તમારા ચહેરા પર મુખવટો હશે. પણ તમે તમને મળશો ત્યારે....?

બીજાની સાથે નમૃતાથી વાતનો દેખાવ કર્યો હશે, અને અંદર પારાવાર અહૂંકાર ઉછળી રહ્યો હોય એવું બને. પણ જ્યારે પોતે પોતાની મુલાકાત લે ત્યારે ...? ત્યારે પૂછી શકાય, પેલા ભાઈની સાથે વાત કરતી વખતે અહૂંકાર કેટલો ઉછળેલો ?

આ છે ઉપાયો. જેના વડે રાગાદિનાં બન્ધનોથી સાધક મુક્ત થઈ શકે છે.



આધારસૂત્ર

આલંબણેણ કાલેણ, મગેણ જયણાઙ્ ય ।
 ચઉકારણપરિસુદ્ધં, સંજએ ઇરિયં રિએ ॥

તત્થ આલંબણં નાણં, દંસણં ચરણં તહા ।
 કાલે ય દિવસે વુત્તે, મગે ઉપ્પહવજિએ ॥

દવ્વાઓ ખેત્તાઓ ચેવ, કાલાઓ ભાવાઓ તહા ।
 જયણા ચઉભ્વિહા વુત્તા, તં મે કિત્તયાઓ સુણ ॥

દવ્વાઓ ચકખુસા પેહે, જુગમિત્તં ચ ખેત્તાઓ ।
 કાલાઓ જાવ રિએજા, ઉવડત્તો ય ભાવાઓ ॥ ૨૮/૪-૭

ઇન્દ્રિયત્થે વિવજિતા, સંજ્ઞાયં ચેવ પંચહા ।
 તમ્મુત્તી તપ્પુરક્ષારે, ઉવડત્તે ઇરિયં રિએ ॥ ૨૮-૮

આલભ્બન, કાલ, માર્ગ અને યતના; આ ચાર કારણોથી પરિશુદ્ધ
 એવી ઈર્યાપૂર્વક સાધક ચાલે.

આલભ્બન છે જ્ઞાન, દર્શન, અને ચારિત્ર... કાળ એટલે દિવસ.
 માર્ગ, જે વ્યવસ્થિત હોય: ઉત્પથ-કુમાર્ગ ન હોય.

જ્યાણા ચાર પ્રકારે છે : દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી.

દ્રવ્યથી ચક્ષુ વડે જોઈને ચાલે. ક્ષેત્રથી યુગમાત્ર ભૂમિને જોઈને ચાલે.
 કાળથી જ્યાં સુધી ચાલવાનું હોય ત્યાં સુધી. ભાવથી ઉપયુક્ત રીતે ચાલવાનું.


ઇન્દ્રિયના વિષયોને અને પાંચે પ્રકારના સ્વાધ્યાયને છોડીને તન્મૂર્તિ
 (ઈર્યામૂર્તિ) અને તત્પુરસ્કૃત (ઈર્યાપુરસ્કૃત) મુનિ ઉપયુક્ત રીતે ચાલે.

સાધનાસૂત્ર

અષ્ટપ્રવચન માતા :

શુભથી શુદ્ધ ભણી જતી

યાત્રાના પથનું દર્શન



અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

એક મુનિરાજની સતવના કરી
ભક્તે : આપ પાંચ સમિતિથી સમિત
અને ત્રણ ગુપ્તઓથી ગુપ્ત છો.

મુનિરાજે પોતાની કાયગુપ્તિની
ખંડિતતાની વાત કરી પોતે ત્રિગુપ્તિએ
ગુપ્ત નથી તેમ કહ્યું. એવું બનેલું કે
મુનિરાજ ગુરુ આણાથી એકાકી વિહાર
કરતા હતા. વિહારમાં સૂર્યાસ્ત થયો અને
ગામ દેખાતું નથી ત્યારે તેઓ એક વૃક્ષ
નીચે બેઠા. પ્રતિકમણાદિ કરી, સ્વાધ્યાય
કરી, સંથારા પોરિસી ભણાવી તેઓ સૂતા.

પ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યપવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

થોડી વાર પછી વટેમાર્ગુંઓ આવ્યા. જેમણે તાપણું સળગાવ્યું. અને પછી ઓલવ્યા વગર ચાલતા થયા. તાપણાની એ આગ મુનિના હાથની આંગળીઓ સુધી આવી. તરત જ મુનિનો હાથ સંકોરાઈ ગયો. પણ સહસા મુનિ ચોંકી ઉઠ્યા. અપ્રતિલેખિત જગ્યા પર હાથ મૂકાયો'તો! કાયગુપ્તિ બંદિત થઈ ગઈ.

■ ● ■

સમિતિ અને ગુપ્તિનો અર્થ છે હોશ. જાગૃતિ.

આ જાગૃતિને ચોવીસ કલાકના લય પર ફેલાવવા માટે પહેલાં તથાકથિત જાગરણનો સમય પકડવો જોઈએ. વહેલી સવારથી મોડી રાત સુધીના સમયને બારીકાઈથી લેવો જોઈએ.

ચાલ્યા તો સાવધાની. બોલવું છે તો સાવધાની. કોઈ વસ્તુ લેવી કે મૂકવી છે તોય પૂરી સાવધાની.

આ ગાળો એકવાર પકડાય તો પછી ઊંઘના ગાળાને પણ આવરી લેવાશે. શરીર થાકેલું છે તો સૂઈ જાય. જાગૃત મન - કોન્સ્યસ માઈન્ડ થાકેલું હોય તો તેય સૂઈ જાય. અજાગૃત મન - તમે શા માટે ઊંઘો ? એ જ સમયખંડને સંથારાપોરિસીસૂત્રમાં આવરી લેવાયો છે : 'અતરંત પમજાએ ભૂમિં.' રાતે ઊંઘમાં પડખું બદલવાનું હોય તો મુનિ તે પડખાની જગ્યાને રજોહરણથી પૂંજે:

■ ● ■

ઈર્યાસમિતિ.

યુગમાત્ર દસ્તિ હોય છે સાધકની ચાલતી વખતે. ગાડાના ધૂંસરા જેવી શરૂઆતમાં સાંકડી અને આગળ જતાં વિસ્તૃત એવી દ્રષ્ટિ તે યુગમાત્ર દસ્તિ. અથવા ચાર હાથ જેટલી વિસ્તરેલી દ્રષ્ટિ તે યુગમાત્ર દસ્તિ.^(૧)

(૧) જુગમિતં ચ ખેત્તાં । ૨૮૭

પ્રભુના હસ્તાક્ષરઅધ્યવચન માતા : શુભ્યી શુદ્ધ ભણીની યાત્રા

બૌદ્ધ ગ્રન્થ વિશુદ્ધિમાર્ગમાં પણ આ રીતે કહેવાયું છે : લોલુપ્ત
સ્વભાવનો ત્યાગ કરી, આંખો નીચી કરી યુગમાત્રદર્શી સાધક ચાલે.^૨

આયુર્વેદના ગ્રન્થોમાં પણ યુગમાત્ર ભૂમિને જોઈને ચાલવાની વાત
આવે છે.

■ ● ■

ઈર્યાસમિતિ એક બાજુ દસ્તિસંયમને સુગ્રથિત કરે છે. બીજુ બાજુ
તે નિર્વિકલ્પતાને પુષ્ટ કરે છે.

ચાલવાની વિધિને સમ્યગ્ રીતે જોઈએ, અનુભવીએ તો થાય કે
મહાપુરુષોએ આપણી સાધનાને કેવી તો મજાથી ઊચકી છે !

નિર્વિકલ્પ બનવું એ બહુ અધરું લાગે, પણ ઈર્યાસમિતિમાં ઉપયુક્ત
સાધક માટે નિર્વિકલ્પ બનવું બહુ જ સરળ બની જાય. મજાની વાત
આવી: પાંચે પ્રકારના સજ્જાયને - સ્વાધ્યાયને મૂકીને ચાલવાનું છે.
એટલે કે અનુપ્રેક્ષાની પણ ના પાડી. શુભ ચિન્તન પણ નહિ કરવાનું.
ચાલતી વખતે માત્ર ચાલવાનું. ઉપયોગ પૂર્ણતયા એમાં કેન્દ્રિત થયેલ
હોય.^૩

પ્રભુની આજ્ઞાના પાલનમાં ઉપયોગ. અને પૃષ્ઠભૂ નિર્વિકલ્પતાની.
ધ્યાનદશા જ થઈ ગઈ ને !

■ ● ■

ઈર્યાસમિત સાધક દસ્તિસંયમી હોય. દસ્તિને નીચે જ સ્થિર કરી
રાખવાનું એને ફાવી ગયું છે. ચાલતી વખતે નીચી દસ્તિ. સ્વાધ્યાય

(૨) લોલુપ્યારં ચ પહાય તસ્મા, ઓકિખત-ચક્ખુ યુગમત્તપસ્સી ।

-વિશુદ્ધિ માર્ગ, ૧,૨,

(૩) સજ્જાયં ચેવ પંચહા । ૨૮/૮

પ્રભુના હસ્તાક્ષર ♦ અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભડીની યાત્રા

વખતે નીચી દણ્ઠિ. અનુપ્રેક્ષા આદિ વખતે નીમિલિત ચક્ષુ - બંધ નેત્ર. કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ સામે જોવાની ટેવ જ ન હોય.

આપણા યુગમાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત તેલાસસાગરસૂરિ મહારાજને જોયેલા. નીચાં ઢળેલ નેત્ર... આંખો તેમની ઊંચે થયેલી ક્યારેય જોવા ન મળે.

■ • ■

ઈર્યાસમિત સાધકને ઈર્યામૂર્તિ, ઈર્યાપુરસ્કૃત કહેવામાં આવેલ છે.^૪

બૃહદ્વૃત્તિમાં મૂર્તિનો અર્થ શરીર કરેલ છે. એટલે ઈર્યામાં જેનું શરીર વ્યાપ્તિયમાણ છે અને મનનો ઉપયોગ પણ ઈર્યામાં જ છે, તે ઈર્યામૂર્તિ. વચન-વ્યાપાર તો ચાલતી વખતે નિષિદ્ધ છે જ.

આ રીતે ઈર્યામાં ત્રણે યોગો સમાહિત હોય છે.

ઈર્યાપુરસ્કૃત છે સાધક. ઈર્યાને જ પ્રમુખ માનીને ચાલનાર.

■ • ■

અષ્ટપ્રવચન માતાની સજ્જાયમાં પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ સરસ પ્રશ્ન ઉઠાવે છે ઈર્યાના સન્દર્ભમાં : જ્ઞાન અને ધ્યાનના અનુભવરસના સુખ-સાગ્રાજ્યમાં મહાલતા મુનિવર બહાર ક્યાંય જાય જ શા માટે ? એવો તો આનંદ જ્ઞાન-ધ્યાનનો આવી રહ્યો હોય કે તે છોડીને ક્યાંય બહાર જવાનું મન જ તેમને ન થાય.^૫

(૪) તમુતી તપ્પુરકારે ॥ ૨૮/૮

(૫) જ્ઞાન ધ્યાન સજ્જાયમે જી, સ્થિર બેઠા મુનિરાય;
જાને ચપળપણું કરે જી, અનુભવ રસ સુખરાજ... ૧/૩

પ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

ઈનર-સ્પેસ (આન્તર જગત)નો આનંદ જેણે માણ્યો, તેને આઉટર-સ્પેસ (બાહ્ય જગત)માં જવાની ઈચ્છા જ કેમ થાય ?

અને, પ્રભુના દર્શન, વિહાર, આહાર આદિ કારણોસર બહાર જવાનું થાય તો ઈર્યાસમિતિ હાજર હશે. મજા જ મજા ને !

■ ● ■

રાજા અજાતશત્રુનો મંત્રી બૌદ્ધધર્માનુયાયી હતો. એકવાર મહાત્મા બુદ્ધ અજાતશત્રુની રાજધાનીની બહારના ઉપવનમાં આવ્યા.

મંત્રીએ રાજાને કહ્યું : આપણે ભગવાન બુદ્ધનાં દર્શન કરીએ. તેમનો ઉપદેશ સાંભળીએ. રાજાએ હા પાડી. રથમાં રાજા અને મંત્રી ઉપડ્યા. જે ઉપવનની અંદર બુદ્ધ હતા. તેની બહાર મંત્રીએ રથ રોકાવ્યો. રાજાને કહ્યું : ચાલો ! રાજા કહેલે : દશ હજાર બિક્ષુઓની સાથે ભગવાન બુદ્ધ આવ્યા છે તેમ તમે કહેતા હતા. હજુ તો દૂર હશે. મન્ત્રી કહે : નહિ, મહારાજ ! આ વૃક્ષોના ઝુરમુટની પાછળ જ તેઓ છે.

રાજા નવાઈમાં દૂદ્યો. દશ હજાર બિક્ષુઓ અહીં જ હોય. અને અવાજ જરા પણ નહિ. મંત્રીએ કહ્યું : મહારાજ ! એ દશ હજાર બિક્ષુઓ છે ને ! માણસો સો-દોઢસો હોત તોય કોલાહલ હોત...

રાજા અંદર ગયો. બુદ્ધની સાથે શાન્ત રીતે બેઠેલ, ધ્યાનાદિને કરતા હજારો બિક્ષુઓને તેણે જોયા.

■ ● ■

ભાષાસમિતિ

બિક્ષુ. મુનિ.

જે મૌનમાં દૂબેલ હોય તે મુનિ.

‘જ્ઞાનસાર’નો મૌનનો માપદંડ તો મજાનો છે : બહિર્ભાવમાં અપ્રવૃત્તિ તે જ મૌન.«

(૬) પુદ્ગલેષ્વપ્રવૃત્તિસ્તુ યોગાનાં મૌનમુત્તમમ् ॥ -જ્ઞાનસાર. ૧૩/૭

ગ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભજીની યાત્રા

અધ્યપ્રવચન માતાની સજ્જાય યાદ આવે :

‘સાધુ નિજ વીર્યથી પર તણો, નવિ કરે ગ્રહણને ત્યાગ રે;
તે ભજી વચન ગુમે રહે, એહ ઉત્સર્ગ મુનિ માર્ગ રે....’

બહુ જ માર્મિક વાત આવી : સાધક પોતાની શક્તિ-આત્મવીર્ય-ને
પરને પકડવામાં કે પરને છોડવામાં શા માટે વાપરે ? એ માટે
સામાન્યતયા મુનિ મૌનમાં જ દૂબેલ રહે.

ભાષાવર્ગણાના પુદ્ગલોને પકડવા, આત્મસાત્ કરવા અને તેમને
છોડવા; શા માટે મુનિ પરમાં આ હેઠે જાય?

હા, સદ્ગુરુની પદવી પર પ્રતિષ્ઠિત થયેલ વ્યક્તિત્વ હોય તો તે
શિષ્યોને પ્રબોધવા માટે ભાષાનો ઉપયોગ કરશે, પણ એ ય ભાષાસમિત
રીતે.

■ ■ ■

સદ્ગુરુના શબ્દોમાં એ તાકાત હોય છે કે એ સાધકને ચોક્કસ
મુકામે પહોંચાડી હે.

સદ્ગુરુ સાધકમાં રહેલ સંભાવનાઓને પરખે છે અને એમને અનુકૂળ
વાતાવરણ આપી સંભાવનાઓને મૂર્તિમન્ત કરે છે. ક્યારેક સંભાવનાઓને
નવી પણ પેદા સદ્ગુરુ કરી શકે છે. આને જ આપણે સદ્ગુરુનો શક્તિપાત
કહી શકીએ.

કોધના આવેશમાં અસત્ય-ભાષણ સુધી પહોંચી શકનાર એક સાધકને
સદ્ગુરુ ક્યાં સુધી પહોંચાડે છે તેનું માર્મિક ઉદાહરણ પહેલા અધ્યયનમાં
છે. ગુરુ પહેલાં એવા શિષ્યને કહે છે : કોધના આવેશમાં તું જેમ તેમ બોલી
ન નાખતો. પછી બીજા ચરણમાં એને કહે છે : તું બહુ બોલતો નહિ. એ

પ્રભુના હસ્તાક્ષર ♦ અષ્ટપ્રવચન માતા : શુદ્ધ ભણીની યાત્રા
 ચરણ પકડાતાં કહેશે : તું બરોબર અધ્યયન કર ! અને ચોથા ચરણો સાધકને
 એકાંતમાં જઈ ધ્યાનમાં ડૂબવાની પ્રેરણા સદ્ગુરુ આપે છે !

■ • ■

ભાષા સમિતિની સજ્જાયની છેલ્લી કરી કેવી તો હૃદયંગમ છે ! :
 ‘મોહ ઉદ્યે અમોહી એહવા, શુદ્ધ નિજ સાધ્ય લયલીન રે;
 દેવચન્દ્ર તે મુનિ વન્દીએ, જ્ઞાન અમૃતરસ પીન રે...’

જ્ઞાન-ધ્યાનના અમૃતરસમાં ઉત્તરેલ મુનિ પોતાના સાધ્ય-મોક્ષ અને
 જિનાજ્ઞાપ્રતિબદ્ધતા - ભણી એવા તો અગ્રેસર હોય છે કે એમની યાત્રા
 સાધ્ય તરફ ચાલ્યા જ કરે છે : અટક્યા વગર.

સવાલ થાય કે કોધ, મોહ આદિ સત્તામાં તો પડેલ છે, એ ઉદ્યમાં
 તો આવી શકે જ. તો એ વખતે યાત્રા રોકાશે નહિ ? સરસ ઉત્તર
 અપાયો છે : ‘મોહ ઉદ્યે અમોહી એહવા...’ મોહનો ઉદ્ય ચાલુ હોય
 અને છતાં મુનિ નિર્માહાવસ્થામાં મહાલતા હોય.

જેવી રીતે, અસાતાનો ઉદ્ય શરીરના સ્તર પર ચાલતો હોય, છતાં
 મનના સ્તર પર સહેજે અસાતા નથી હોતી. એ જ રીતે મોહનો ઉદ્ય
 મનના સ્તર પર હોય, તોય અન્તઃકરણનું સ્તર તો એનાથી સહેજે લિમ
 હોતું નથી. એ વખતે સાધક મોહનો દ્રષ્ટા હોય છે. મોહમાં ભળનાર એ
 નથી હોતો.

સમિતિઓ કેવી તો મજાની છે !

■ • ■

(૭) મા ય ચંડાલિયં કાસી, બહુયં મા ય આલવે ।
 કાલેણ ય અહિજિતા, તઓ જ્ઞાએજ એગાઓ ॥ ૧/૧૦

પ્રભુના હસ્તાક્ષર ♦ અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભજીની યાત્રા
એષણાસમિતિ.

વિના કારણે તો સાધક આહારાદિ પરને ગ્રહણ ન કરે. સંયમના સાધક
દ્વય તરીકે આહારાદિ લેવાના હોય ત્યારે શાસ્ત્રે ભાખેલી રીત વડે લે.

બહુ મજાની કરીઓ અષ્ટપ્રવચન માતાની સજ્જાયમાં આવી છે :

ચેતનતા ચેતન તણી જી, નવિ પર સંગી તેહ;
તિણે પર સન્મુખ નવિ કરે જી, આત્મરતિ પ્રતી તેહ. ॥૨॥

કાયયોગ પુદ્ગલ ગ્રહે જી, એહ ન આત્મધર્મ;
જીણંગ કરતા ભોગતા જી, હું માહરો એ મર્મ. ॥૩॥

અનભિસન્ધિ ચલ વીર્યનો જી, રોધક શક્તિ અભાવ;
પણ અભિસન્ધિજ વીર્યથી જી, કિમ ગ્રહે પરભાવ. ॥૪॥

ચેતના પરની સંગિની કેમ હોય ? આત્મભાવમાં જ જેને આનંદ
આવે છે તેવો સાધક પર ભણી વહેતો નથી.

કાયયોગ પુદ્ગલોને - આહારાદિના- ગ્રહણ કરે છે, પણ એ આત્મધર્મ
તો નથી જ. આત્મધર્મ તો સ્વના શાતા, સ્વના કર્ત્તા અને સ્વના ભોક્તા
હોવામાં જ છે.

વીર્યના બે પ્રકાર છે : અનભિસન્ધિજ અને અભિસન્ધિજ. ઈચ્છાપૂર્વકનું
શરીર આદિનું હલન ચલન તે અભિસન્ધિ કિયા છે. અને શરીરમાં,
નસોમાં લોહી વહેવા આદિની કિયા તે અનભિસન્ધિજ કિયા છે.

તો, અનભિસન્ધિજ ચલ વીર્યને રોકવાની આપણી શક્તિ નથી; પણ
અભિસન્ધિજ વીર્ય વડે આત્મા પરભાવ કેમ ગ્રહે ? (આંખ આદિ ઈન્દ્રિયો
દ્વારા તે પરભાવમાં કેમ જાય ?)

આવું હોવા છતાં, મુનિ આહાર આદિને તો ગ્રહણ કરે છે. કારણ
કે શરીરાનુયાયી જે આત્મશક્તિ છે, તે આહારને કારણે વર્તે છે. જે

પ્રભુના હસ્તાક્ષર ♦ અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભડીની યાત્રા

રીતે વૃદ્ધને લાકડી જોઈએ છે તે રીતે શરીરાનુયાયી વીર્યને આહારાદિક જોઈએ છે.

માટે, એષણાસમિતે સમિત મુનિ નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે.

■ ■ ■

નિક્ષેપણાસમિતિ.

જે પણ વસ્તુને લેવી કે મૂકવી હોય તેને પહેલાં આંખ વડે જોવાની અને પછી રજોહરણ આદિથી પ્રમાર્જવાની. આ છે નિક્ષેપણાસમિતિ.^८

નિક્ષેપણાસમિતિની સજ્ગાયની કરી યાદ આવે :

પુદ્ગલ ખંધ ગ્રહણ નિખેવણા, દ્રવ્યે જ્યણા રે તાસ;
ભાવે આત્મ પરિણાતિ નવનવી, ગ્રહતાં સમિતિ પ્રકાશ..

બાધક ભાવ અદ્વેષપણે ત્યજે, સાધક લે ગતરાગ;
પૂરવ ગુણ રક્ષક પોષણપણે, નીપજતે શિવ માર્ગ....

નિક્ષેપણાને કેટલી ભીતર લીધી છે પૂજ્ય દેવચન્દ્રજી મહારાજે :
દ્રવ્ય નિક્ષેપણા વસ્તુને લેતી કે મૂકતી વખતની જ્યણામાં થશે. ભાવ
નિક્ષેપણા પણ ત્યાં એમણે ખોલી : પરપરિણાતિનો ત્યાગ અને
આત્મપરિણાતિનો સ્વીકાર.

આ ત્યાગ અને સ્વીકારમાં સાવધાની કર્દ રાખવાની ? મજાની વાત
કહી છે : પરપરિણાતિને અદ્વેષભાવે છોડવાની અને આત્મપરિણાતિને રાગ
વગર સ્વીકારવાની.

સાધના માટે બાધક કોઈ તત્ત્વ છે, એને છોડવું પણ છે; પરંતુ
છોડવાનું ય સલુકાઈથી. દ્વેષભાવ ત્યાં આવી ન જાય એ રીતે.

૮. ચક્કબુસા પડિલેહિતા, પમજોજ જયં જઇં ।

આઇએ નિક્ષિખવેજા વા, દુહઓવિ સમિએ સયા ॥ ૨૮/૧૪

પ્રભુના હસ્તાક્ષર ♦ અણપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

ધારો કે નવરાત્રીના લાઉડ-સ્પીકર જોરથી ગર્જ રહ્યા હોય અને પહેલી રાત્રે જ લાગે કે સ્વાધ્યાય, ધ્યાન આદિ માટે આ અવાજ બાધક છે. ત્યારે સાધુ શું કરશે ? એ શ્રાવકોને પૂછશે : પેલા બીજા ઉપાશ્રયમાં, જ્યાં થોડો વખત શરૂઆતમાં રહેલા, એની આજુભાજુ જો શાન્તિ હોય તો કાલથી સાંજે, સાંજે ત્યાં જઈએ. જેથી અમારા સ્વાધ્યાયાદિમાં અમને વાંધો ન આવે. પણ એ જોરદાર અવાજ ચાલતો હોય ત્યારે સાધનામાં બાધક એ પરિસ્થિતિ પર દ્રેષ નહિ આવે.

એ જ રીતે, કોઈ ઉપાશ્રય સાધના માટે અનુકૂળ છે. તો તેનો સ્વીકાર સાધક કરશે; પણ ત્યાં એ સ્થાન પ્રત્યે રાગ-ભાવ નહિ હોય.

કેવી મજાની આ સાધના !

■ ■ ■

પારિષાપનિકાસમિતિ.

શરીરમાં ઉત્પન્ન થતા કચરાને, મલ આદિને, જીવ-જન્તુની વિરાધના ન થાય તે રીતે પરઠવવો તે પારિષાપનિકાસમિતિ.

પારિષાપનિકા કઈ જગ્યાએ કરે?

સાધક લોકોની દૃષ્ટિથી દૂરના સ્થાનમાં, લોકોની અવર-જવર જ્યાં ન હોય ત્યાં પરઠવે. જે જમીન પર પરઠવે તે નીચે ચાર આંગળ સુધી અચિત-સૂર્યપ્રકાશ આદિથી - બનેલી હોવી જોઈએ. પોલાણ (તિરાડ કે દર વગેરે) વગરની જગ્યા તે જોઈએ.⁹

9. અણાવાયમસંલોએ, પરસ્સણુવધાઇએ । સમે અજ્ઞુસિરે યાવિ, અચિરકાલકયંમિ ય ॥

વિનિષ્ઠણે દૂરમોગાઢે, નાસુંત્રે બિલવજીએ ।

તસપાણબીયરહિએ, ઉચ્ચારાઈણ વોસિરે ॥ ૨૮-૧૭/૧૮

પ્રભુના હસ્તાક્ષર ❖ અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

અષ્ટપ્રવચન માતાની સજ્જાયની હૃદયંગમ કિડીઓ યાંદ આવે :

વળી એહ દ્રવ્યથી ભાવે પરઠવે રે, બાધક જે પરિણામ;

દ્વેષ નિવારી માદકતા વિના રે, સર્વ વિભાવ વિરામ... ॥૮॥

આત્મ પરિણાતિ તત્ત્વમયી કરે રે, પરિહરતા પરભાવ;

દ્રવ્ય સમિતિ પણ ભાવ ભણી ધરે રે, મુનિનો એહ સ્વભાવ... ॥૧૦॥

દ્રવ્ય પારિષાપનિકા મળ આદિની; ભાવપારિષાપનિકા સાધનામાં જે જે બાધક - અવરોધક પરિણામો છે તેની. તે પરિણામોને છોડતી વખતે ન તો દેખભાવ કોઈના પ્રત્યે હોય, ન અહંકાર હોય. (મેં છોડ્યું એવો અહંકાર ન આવી જાય. માટે જ સાધકના શબ્દકોષમાં છૂટી જવાનો લય છે... પ્રભુનું સમ્મોહન અન્તઃસ્તરને ધેરી વળ્યું ને સંસાર છૂટી ગયો. સાધના તીવ્રરૂપે ગમી; અને તેના અવરોધકો છૂટી ગયા. ‘મેં છોડ્યું’ એ લયમાં છોડનાર બચી જાય છે...)

પરભાવ જતાં જ આત્મપરિણાતિ તત્ત્વમયી બને છે. એટલે ભાવપારિષાપનિકા આ : પરને છોડવું. સ્વને સ્વીકારવું.

■ ■ ■

ભિક્ષુ નાગાર્જુન એક ગામે ગયેલા. ધર્મશાળામાં ઉત્તરેલા. સવારે ઉઠ્યા ત્યારે જોયું કે પોતાનાં પાત્ર ગૂમ છે. વિચાર્યું કે મધ્યાલે ભિક્ષા માટે જવું છે. તે વખતે જોઈશું. અત્યારે એની શી કથા ?

બપોરે બાર વાગ્યે પણ પાત્ર તો છે નહિ. વગર પાત્રે ભિક્ષા માટે નીકળ્યા. જે શ્રેષ્ઠીને ત્યાં ગયા, એમણે સરસ મજાનું પાત્ર - સોનાનું, રતે જરૂરું - આપ્યું. નાગાર્જુને એમાં ભિક્ષા લીધી. ધર્મશાળા તરફ તેઓ આવી રહ્યા છે, ત્યારે એક ચોરની નજર આ કીમતી ભિક્ષાપાત્ર પર પડી : અરે, ભિક્ષુને આવા ભિક્ષાપાત્રની શી જરૂરિયાત ? ચાલો, એ સૂઈ જશે ત્યારે હું લઈ લઈશ.

પ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યગ્રવચન માતા : શુભથી શુદ્ધ ભડીની યાત્રા

ચોર બિક્ષુની પાછળ ધર્મશાળામે ગયો. નાગાર્જુનને ઘ્યાલ આવી ગયો. તેમણે ભોજન કરી પાત્ર ધોઈ લૂછી ચોર હતો એ બાજુ- બારી બહાર ફેંક્યું. ચોરે એ પાત્ર લઈ લીધું.

પણ એને આ બિક્ષુ ગજબનો લાગ્યો. આવા પાત્ર પર પણ સહેજે રાગ નહિ ! ચોર બિક્ષુ પાસે આવ્યો. કહ્યું : મહારાજ ! કંઈક ઉપદેશ આપો... પણ હું ચોર છું. એટલે ચોરી ન કરવાનો ઉપદેશ કે નિયમ ન આપતા.

નાગાર્જુને કહ્યું : જે કંઈ કરે તે હોશપૂર્વક કરજે.... ચોર ગયો. અઠવાડિયે પાછો આવ્યો બિક્ષુ પાસે. કહે : તમે તો ગજબની વાત કરી. હવે ચોરી કરી શકાતી નથી. હોશપૂર્વક ચોરી કરવી શી રીતે ? હવે તો મારે મજૂરી કરીને પરસેવાનો રોટલો ખાવો છે.

■ • ■

હોશ. કાણા-કાણાની જાગૃતિ. સમિતિ અને ગુપ્તિ સાધકને કાણા-કાણાની જાગૃતિની દુનિયામાં મૂકે છે.

■ • ■

મનોગુપ્તિ.

ગુપ્તિ અને સમિતિમાં ભેટ આ રીતે માન્યો છે : સમિતિની વ્યાખ્યા છે : સમ્યક્ પ્રભુની આશા પ્રમાણે, ઈતિ- આત્મવ્યાપાર, તે સમિતિ.^{૧૦} ગુપ્તિનો અર્થ અશુભ મનોયોગ આદિથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ આવો કરાયેલ છે.^{૧૧}

(૧૦) સમ્યક् - સર્વવિત્રવચનાનુસારિતયા ઇતયઃ આત્મનશ્રેષ્ટાઃ સમિતયઃ ।

-બૃહત્ ટીકા ૨૮/૧

(૧૧) એયાઓ પંચ સમર્ઝિઓ, ચરણસ્સ ય પવત્તણે । ગુત્તી નિયત્તણે કુત્તા, અસુભત્યેસુ ય સવ્વસો ॥ ૨૮/૨૬

(અપિશબ્દાત્ ચરણપ્રવર્તને પીતિ સૂત્રાર્થઃ । -બૃહત્ ટીકા)

પ્રભુના હસ્તાક્ષર ❖ અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભડીની યાત્રા

મનોગુપ્તિ, મનઃસમાધારણા અને એકાગ્રમનઃસ્થાપના આવાં ત્રણ શબ્દોનો ઉપયોગ રદ્દમાં અધ્યયનમાં છે.

પ્રશ્ન કરાયો કે મનોગુપ્તિ દ્વારા શું મળે ? ઉત્તર અપાયો કે મનોગુપ્તિ દ્વારા એકાગ્રતા મળે છે.¹²

મનઃસમાધારણાથી (મનને આગમકથિત ભાવોમાં સારી રીતે લગાવવાથી) શું મળે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે મનઃસમાધારણા વડે એકાગ્રતા મળે છે. એકાગ્રતા દ્વારા જ્ઞાનના વિવિધ આયામો (પર્યાયો)ની પ્રાપ્તિ થાય છે અને તે દ્વારા સમ્યગ્દૂર્ધનની વિશુદ્ધિ મળે છે.¹³

એકાગ્રમનઃ સ્થાપના વડે સાધકને શું મળે તેવા પ્રશ્નના ઉત્તરમાં કહેવાયું કે તેના વડે ચિત્તનિરોધ મળે છે.¹⁴

પ્રાતિનો કુમ આવો રહેશે : મનઃ સમાધારણા, મનોગુપ્તિ, એકાગ્રમનઃ સ્થાપના.

જ્ઞાનયોગમાં લીન સાધક, અપૂર્વ શ્રુતના આયામોમાં દૂબી રહેલ હોય ત્યારે મનઃસમાધારણા. દેશવિરતિ શ્રાવક સામાયિક કે પौષ્ઠ આદિમાં અને સર્વવિરતિ સાધક ગુપ્તિની આરાધના કરશે, અને એ વખતે અશુભથી દૂર થઈને અને શુભમાં દૂબીને એકાગ્રતા પ્રાપ્ત કરશે.

(૧૨) મણગુત્તયાએ ણ ભંતે ! જીવે કિં જણયઇ ?

મણગુત્તયાએ ણ જીવે એગાં જણયઇ ! એગાંચિતે ણ જીવે મણગુતે સંજમારાહએ ભવઇ ॥ ૨૯/૫૪

(૧૩) મણસમાહારણયાએ ણ ભંતે ! જીવે કિં જણયઇ ?

મણસમાહારણયાએ ણ એગાં જણયઇ, જણઇત્તા
નાણપજ્જવે જણયઇ, જણઇત્તા સમ્મતં વિસોહેઇ, મિચ્છત્તં વ નિજરઇ ॥ ૨૯/૫૭

(૧૪) એગાગમણસંનિવેસણયાએ ણ ભંતે ! જીવે કિં જણયઇ ?

એગાગમણસંનિવેસણયાએ ણ ચિત્તનિરોહં કરેઇ ॥ ૨૯/૨૬

પ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યપ્રવચન માતા : શુદ્ધ ભણીની યાત્રા

એકાગ્રમનઃસ્થાપનામાં શુદ્ધની ભૂમિકા રહેશે. જ્યારે ચિત્ત-મન બાજુમાં સર્યું હશે અને નિર્વિકલ્પતાની પૃષ્ઠભૂ પર સ્વગુણ સ્થિતિ (જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિમાં રહેવાની ભૂમિકા) મળેલી હશે.

■ • ■

શુભમાં પ્રવર્તનું તેને તો ગુપ્તિ કહેવાઈ જ છે, પણ શુદ્ધની ભૂમિકાને સ્પર્શવી તેય ગુપ્તિ છે એવી પરંપરા આપણે ત્યાં છે.

પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ અધ્યપ્રવચન માતાની સજ્જાયમાં મનોગુપ્તિની સજ્જાયમાં આ બિન્હુને બહુ જ સ્પષ્ટ રીતે ચર્ચે છે :

યોગ તે પુદ્ગલ જોગ છે રે, બાંધે અભિનવ કર્મ;
યોગ વર્તના કંપના રે, નવિ એ આત્મધર્મ....

શુદ્ધની ભૂમિકામાં પ્રવેશવા માટેનું મળાનું ઉપરનું સૂત્ર એ રીતે શરૂ થયું કે મનોયોગ, વાગ્યોગ કે કાય્યોગનો અર્થ પુદ્ગલો સાથે જોડાવું તે છે, અને બહિર્ભાવમાં જવું તે આત્મધર્મ નથી.

મનોયોગ : વિચારોના પુદ્ગલોને પકડવા, આત્મસાત્ત કરવા અને છોડવા... પુદ્ગલોને પકડીને છોડવાની વાત હોય ત્યાં આત્મધર્મ કેવો?

બહુ અદ્ભુત આ સૂત્ર : ‘યોગ વર્તના કંપના, નવિ એ આત્મ ધર્મ...’ યોગમાં રહેયું એટલે જ કર્મન... મન આદિની ચંચળ દશા. આત્મધર્મ તો છે સ્થિરતા.

અને એ સ્થિરતા મળે સ્વગુણમાં.

આ જ લયને પુષ્ટ કરતી આગળની કડી:

વીર્ય ચપલ પરસંગમી રે, એહ ન સાધક પક્ષ;

જ્ઞાન ચરણ સહકારતા રે, વરતાવે મુનિ દક્ષ.... ॥૫॥

પ્રભુના હસ્તાક્ષર ♦ અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

આત્મવીર્ય ચપળ - ચંચળ હોય અને પરના - પુદ્ગલના સંગમાં (વિચારો, શબ્દો, કૃત્યો આદિની ધારામાં) વહેતું હોય તો એ સાધકના પક્ષે ખૂલતી વાત ન થઈ. મુનિ તો પોતાની આત્મશક્તિને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભણી જ વહાવે.

ત્યાં પછી, જ્ઞાન પર પદાર્થનું કે પર વ્યક્તિનું નથી હોતું. સ્વનું જ હોય છે. સાધકના સન્દર્ભમાં આને જ આપણે જ્ઞાતાભાવ કહીએ છીએ. પૂ. દેવચન્દ્રજી મહારાજના શબ્દને વાપરીએ તો, જાણંગ ભાવ.

પરને સંયમ આદિમાં જરૂરી હોય તેટલું જાણવાનું હોય છે; પણ પર તરફની લિમતા ત્યાં હોતી નથી.

પૂજ્યપાદ આનંદધનજી મહારાજે સાધકના આ જ્ઞાતાભાવને આ શબ્દોમાં બિરદાવ્યો છે :

સબ મેં હૈ ઔર સબ મેં નાહિં,
તૂ નટ રૂપ અકેલો,
આપ સ્વભાવ વિભાવે રમતો,
તૂ ગુરુ ઔર તૂ ચેલો...

સાધક ઉપયોગરૂપે આજુબાજુના પદાર્થોમાં હોઈ શકે. નાની પણ વસ્તુ લેવી કે મૂકવી છે તો પૂંજવા, પ્રમાર્જવાનો ઉપયોગ એનો રહેશે. ચાલતી વખતેય યુગમાત્ર ભૂમિને જોવામાં તેનો ઉપયોગ રહેશે. પણ, સાધક મૂર્ચ્છા / આકર્ષણના સતર પર એક પણ પદાર્થમાં નહિ હોય.

પછી મજાની વાત કરી : વિભાવમાં રમે તે શિષ્ય. સ્વભાવમાં રમે તે ગુરુ.

શિષ્ય, જો કે, સ્વભાવની દિશા ભણી ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ અનાદિની ખોટી ચાલને કારણે મન વારંવાર વિભાવમાં સરી પડે છે તેનું.

પ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

ગુરુ તો છે માત્ર સાક્ષીની ભૂમિકામાં. શિષ્ય કર્તૃત્વની ભૂમિકાએ આવી જાય છે.

ઔપનિષાદિક સુનદર પંક્તિઓના પૂજ્યપાદ આનન્દઘનજીએ કરેલ આ અનુવાદમાં ગુરુ અને શિષ્યની ભૂમિકાઓ સ્પષ્ટરૂપે આલેખાઈ છે:

તરુવર એક પંખી દોઉ બેઠે,
એક ગુરુ એક ચેલા;
ચેલે ને જુગ ચુન ચુન ખાયા,
ગુરુ નિરાતર ખેલા...

નિરાતર, સતત ખેલની - સાક્ષીની ભૂમિકામાં હોય તે ગુરુ. શિષ્ય કર્તૃત્વમાં ફસાઈ જાય છે.

શિષ્યનો જ્ઞાતાભાવ જેમ વિકસિત થતો જશે, તેમ તેનો સાક્ષીભાવ પ્રબળ બન્યા કરશે.

■ ■ ■

સવિકલ્પ ગુણ સાધના રે, ધ્યાની ને ન સુહાય;
નિર્વિકલ્પ અનુભવ રસી રે, આત્માનંદી થાય...॥૫॥

ધ્યાનની કક્ષાએ સમ્યગ્રૂદ્ધનાદિ ગુણોની સાધના હોય... પણ વિકલ્પોની પૃથ્બી પરની ગુણ-સાધના ધ્યાની માટે બરોબર નથી.

ધ્યાનની વ્યાખ્યા જ થશે : એકાગ્રતા... એકમાં / આત્મતત્ત્વ કે તેના ગુણોમાં દૂબી જવાનું. વિકલ્પો એટલે તો અનેકાગ્રતા. વિકલ્પોનાં તાણાં ને વાણાં ક્યાંના ક્યાં ગુંથાતા હશે. આમાં ધ્યાન કેવું ?

ઉપાધ્યાય પદની પૂજામાં પૂ. પદ્મવિજય મહારાજે ધ્યાનમાં પ્રવેશવા માટે ચાર ચરણોની વાત કરી છે. બહુ મજાની, આસ્વાધ કરીઓ છે ત્યાંની :

પ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

નમો ઉવજગાયાણં જપો હો ભિતા,

જેહના ગુણ પચવીસ રે એકાગ્રચિતા;

એ પદ ધ્યાવો રે !

એ પદ ધ્યાવો ધ્યાનમાં હો ભિતા,

મૂકી રાગ ને રીસ રે...

જાપ, એકાગ્રચિતતા, ધ્યાન અને રાગ-દ્વેષનું શિથિલીકરણ. આ ચાર ચરણો ઉપરની કડીઓમાં બતાવ્યા.

પહેલાં જાપ... એક પદ લીધું. એનું આવર્તન. રીપીટેશન. આવર્તન પણ એ રીતે કે પૂરો ઉપયોગ એ પદ પર જ હોય. સાધકની ચેતના પદમયી બની જાય.

આ જાપમાં હવે એકાગ્રતાને ઉમેરો. જે પરમેષ્ઠીનું ધ્યાન કરતા હોઈએ, તેમના ગુણોમાં ચેતના ઓતપ્રોત થઈ જાય.

અહીં એક જ સાવધાની રાખવી ઘટે કે એકાગ્રતા તૂટી ન જાય. મનને વિકલ્પોનો એવો અભ્યાસ પડી ગયો છે કે એ વારંવાર વિકલ્પોમાં ગયા કરે છે.

વિકલ્પોનું મૂળ છે રાગ, દ્વેષ, અહંકાર. આ ત્રણ વૃત્તિઓ દ્વારા વિકલ્પો પાંગર્યા કરે છે. આપણી પરંપરા નિર્વિચારતા પર નહિ, પણ નિર્વિકલ્પતા પર ભાર મૂકે છે તેનું કારણ અહીં સમજશે.

રાગ, દ્વેષ આદિની વૃત્તિઓ ન હોય અને છુફ્ટાછવાયા વિચારો આવી જતા હોય તો તે સાધનાને તોડી નાખતા નથી; પણ રાગ-દ્વેષ આદિ સહિતના વિકલ્પો સાધકની ધારાને તોડી નાખે છે. ઉપાધ્યાયજી મહારાજનાં સરસ સૂત્રો આથી જ, આ રીતે આવ્યાં : ‘નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...’ ‘એકતા જ્ઞાન નિશ્ચય દ્યા, સુગુરુ તેહને ભાખે; જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે...’

પ્રભુના હસ્તાક્ષર ♦ અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ લાણીની યાત્રા

એટલે : જાપ, એકાગ્રતા પછી ધ્યાનનું ચરણ મૂક્યું. પણ એ ધ્યાન ટકી રહે એ માટે ચોથું ચરણ રાગ-દેખની શિથિલતાનું આપ્યું. કેવાં સરસ મજાનાં ચરણો !

‘સવિકલ્પ ગુણ સાધના, ધ્યાનીને ન સુહાય...’ તો શું, કરે સાધક? જવાબ ઉત્તરાર્થમાં આવ્યો : ‘નિર્વિકલ્પ અનુભવ રસી રે, આત્માનની થાય.’ અનુભવમાં હોય છે નિર્વિકલ્પતા. આત્મગુણોની ધારામાં જ જ્યારે સાધક વહે છે ત્યારે વિકલ્પો કેવા ?

નિર્વિકલ્પા અનુભૂતિ આત્માનન્દ આપે છે.

■ • ■

ગુજરાતી ભાષામાં જવલ્યે જ આવી અનુભૂતિની વાતો મળશે; જે પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે અષ્ટપ્રવચન માતાની સજ્જાયમાં કરી છે : (આ સજ્જાય પર અનુપ્રેક્ષા ‘અનુભૂતિનું આકાશ’ શીર્ષક પુસ્તકમાં કરી છે.)

શુકલધ્યાન શ્રુતાલંબના રે, એ પણ સાધન દાવ;
વસ્તુધર્મ ઉત્સર્ગ મેં રે, ગુણ ગુણી એક સ્વભાવ. ॥૮॥

શુકલધ્યાનના પહેલા પાયામાં શ્રુતનું આલંબન હોય છે. બહુ જ માર્મિક ઘ્યાલ અહીં અપાયો છે કે મારે જ્યારે મારા સ્વરૂપમાં ઓતપ્રોત થવું હોય ત્યારે મારે પરની - શબ્દોની જરૂર પડે ખરી ?

મારા ધરમાં જ મારે જવું હોય તો ત્યાં મને થોડો ભોમિયો-ગાઈડ જોડો જોઈશે ?

જરૂર, પ્રારંભિક સ્તર પર પ્રભુના શબ્દો બહુ જ ઉપયોગી છે. બીજા શબ્દો કે વિચારો જોડેનો સંબંધ તોડાવી પ્રભુના શબ્દો આપણી જાત સાથેનો સંવાદ રચી આપશો.

પ્રભુના હસ્તાક્ષર ♦ અષ્ટપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભડૂની યાત્રા

પણ જ્યારે વારંવાર સ્વમાં જવાનું બને છે ત્યારે, તમે બેસો છો અને અંદર ઊતરી જાવ છો. ત્યાં કોઈ સહાયકની જરૂર પડતી નથી.

‘ગુણ-ગુણી એક સ્વભાવ...’ જ્ઞાન ગુણ દ્વારા (કોઈ ખારા શબ્દો પરની અનુપ્રેક્ષા વડે) હું મારી ભીતર જાઉં એ ખ્યાલની જગ્યાએ (જે પ્રારંભિક દશામાં હોય છે) અહીં જ્ઞાન અને જ્ઞાનીને એકરૂપ માન્યા. એટલે જ્ઞાન દ્વારા જ્ઞાનીને મળવાની વાત હવે ન રહી.

આ જ લયને પાછળની કડી ઘૂંટે છે :

પર સહાય ગુણ વર્તનારે, વસ્તુ ધર્મ ન કહાય;

સાધ્યરસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાય...

પ્રભુ મહાવીર દેવને ઈન્દ્રે પ્રાર્થના કરેલી : પ્રભુ ! આપને સાધના કાળમાં ઘણા જ ઉપસર્ગો આવનાર છે, માટે મને આપની સાથે રહેવા દો ! પ્રભુએ કહેલું : ઈન્દ્ર ! બીજાની સહાયથી આત્મઋદ્ધિ પ્રાપ્ત કરી શકાતી નથી.

આ જ લયમાં અહીં કડી ચાલે છે – ‘પરસહાય ગુણવર્તના રે, વસ્તુ-ધર્મ ન કહાય...’ પરની મદદથી - વિચારો કરીને, મનની સહાય લઈને નિજ ગુણમાં જવું તે કોઈ બરોબર વાત નથી. અને એટલે સાધુ ચિત્તની સહાય કેમ લે? અદ્ભુત આ સૂત્ર મૌક્કિતક : ‘સાધ્યરસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાય...’

■ • ■

વચનગુણિ.

બહુ ખારી કડી અષ્ટપ્રવચન માતાની સજ્જાયમાં વચનગુણિની સજ્જાયમાં છે :

અનુભવ રસ આસ્વાદતાં રે, કરતાં આત્મધ્યાન,
વચન તે બાધક ભાવ છે રે, ન વદે મુનિ અનિદાન...

ગ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભડીની યાત્રા

મુનિ શેમાં ખોવાયેલા હોય ? મુનિ અનુભવ-રસનો આસ્વાદ કરતા હોય છે. સ્વગુણોના કે સ્વદ્રવ્ય (આત્મદ્રવ્ય)ના ધ્યાનમાં મુનિરાજ ઓતપ્રોત હોય છે.

આ ઓતપ્રોતતામાં શબ્દ તો ક્યાં રહેશે ? શબ્દાતીતતામાં પહોંચેલ સાધક શબ્દોની દુનિયામાં શી રીતે ઉત્તરી શકે ?

‘વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ...’ આથી મુનિ બોલતા નથી. કેવા મુનિ ? ‘અનિદાન. નિરાશાંસ મુનિ.’ જેમને કોઈ સ્પૃહા, ખેવના નથી; જેમને કંઈ જ કોઈની પાસેથી જોઈતું નથી.. શા માટે બોલે ?

આત્મદાષ્ટિ સાધક શબ્દોની સીમામાં ક્યારેય બદ્ધ નથી થઈ શકતો. કબીરજીનું આ અનૂદું વચન :

કાગદ લિખે સો કાગદી, કિ વ્યવહારી જીવ;
આત્મદાષ્ટિ કહાં લિખે, જિત દેખૈ તિત પીવ...

લખનાર તો હોય લહિયો, અથવા વ્યવહારની દાખિમાં રહેલ જીવ;
આત્મદાષ્ટિ સાધક શું લખે ? શા માટે લખે? દેખ્યું અને માણ્યું. દેખ્યું
અને પીધું... શબ્દોની વાત જ ક્યાં આવે ?

વૈજ્ઞાનિક આઈન્સ્ટાઇનને પૂછવામાં આવ્યું કે સ્કુલિંગ - જબકાર જેવા વિચારો આવી જાય ત્યારે તેમને તમે તરત લખી લેતા હશો ?

આઈન્સ્ટાઇનની આ નામોક્રિત હતી : જબકાર જેવા વિચારો ભીતરની સ્લેટમાં એ રીતે ઉડે ઉત્તરી જાય છે કે એને લખવાની જરૂર નથી હોતી.

કબીરજીની સરસ અભિવ્યક્તિ યાદ આવે :

હદ મેં બૈઠે કહત હૈ, બેહદ કી ગમ નાહિં;
બેહદ કી ગમ હોય તથ, કહને કો કુછ નાહિં.

પ્રભુના હસ્તાક્ષર ♦ અધ્યપ્રવચન માતા : શુભથી શુદ્ધ ભણીની યાત્રા

સીમાતીતતાનો - બેહદ દશાનો જેને, ખ્યાલ નથી તેવો સાધક હદમાં/
એક ઘેરાવમાં રહીને બધું કહે... પણ જેને શબ્દાતીતતાને અનુભવેલ છે
તેને માટે કહેવાનું કંઈ બચતું નથી.

પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ બોલવાની ચેષ્ટાને નિરર્થક કસરત
જેવી ગણાવી કહે છે :

ભાષા પુદ્ગલ વર્ગણા રે, ગ્રહણા નિસર્ગ ઉપાધિ;

કરવા આત્મવીર્યને રે, શાને પ્રેરે સાધ... ?

ભાષાવર્ગણાના પુદ્ગલોને પકડવા અને છોડવા એ તો ઉપાધિ, વિભાવ
છે. એ માટે સાધક પોતાના આત્મવીર્યને શા માટે પ્રયોજે ?

■ ■ ■

કાયગુપ્તિ.

કાયાને સ્થિર, અડોલ રાખવાની. કહે છે સંત કબીર : ‘આસન સું
મત ડોલ રે !’ અડોલપણું. અક્ષણી.

શરીરમાં પ્રક્રમનોની એક જાળ ફેલાયા કરતી હોય છે. આંખ કશુંક
સારું ખાવાનું જોશે, તો રસનેન્દ્રિય - જીભ સળવળી ઊઠશે. ઈન્દ્રિયો
અને મનની જુગલબંધીમાં સતત પ્રક્રમનોની લહેરો ઢોક્યા કરે છે.

કાયગુપ્તિ એટલે અપ્રક્રમતા. નાની શી ઘટના, અને મન-ઈન્દ્રિયો
પ્રતિભાવ આપી દે એ પ્રક્રમનોનું જગત છે. ઘટનાથી અપ્રભાવિતતા એ
છે એ અપ્રક્રમિતતા.

ધ્યાન વતા કાયગુપ્તિ એટલે કાયોત્સર્ગ. અથવા તો ત્રિગુપ્તિસાધના
તે કાયોત્સર્ગ.

ઈર્યાસમિતિના ઉપયોગપૂર્વક સાધક ચાલે છે ત્યારે એકાગ્રતારૂપ ધ્યાન
તેની પાસે છે. પણ કાયોત્સર્ગમાં ત્રણે ગુપ્તિઓ વ્યવસ્થિત જોઈશે.

પ્રભુના હસ્તાક્ષર ♦ અષ્ટપ્રવચન માતા : શુદ્ધ ભડીની યાત્રા
 પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજના સક્ષમ શર્જદો યાદ આવે !
 યાવત કંપન તાવત બંધ છે,
 ભાઘ્યું ભગવઈ અંગો જી;
 તે માટે ધૂવ તત્ત્વ રસે રમે,
 માહણ ધ્યાન પ્રસંગે જ...
 જ્યાં કુમ્પન, અસ્થિરતા ત્યાં બન્ધ છે. તેથી સાધક નિશ્ચલ
 આત્મતત્ત્વના ધ્યાનમાં જ રહે છે.

■ • ■

પાંચ સમિતિઓ અને ત્રણ ગુરુિઓને અષ્ટપ્રવચન માતારૂપે લેખાયેલ
 છે. બાળકનો વિકાસ માને આધીન જ હોય છે. એમ સાધક પણ આ
 પ્રવચનમાતાને ક્યારેય ન છોડે.

શુભને ધૂંટીને શુદ્ધમાં પ્રસ્થાપિત થવાની ઘટનાનું બીજું નામ છે
 અષ્ટપ્રવચન માતા.

અષ્ટપ્રવચન માતાના આશ્રયે રહીએ.



આધારસૂત્ર

ખમાવણયાએ ણં ભંતે ! જીવે કિં જણયઇ ?
 ખમાવણયાએ ણં પલ્હાયણભાવં જણયઇ,
 પલ્હાયણભાવમુવગાએ ય સવ્વપાણભૂયજીવસત્તેસુ મિત્તીભાવમુપ્પાએઝ ।
 મિત્તીભાવમુવગાએ યાવિ જીવે ભાવવિસોહિં કાઊણ નિબ્ધાએ ભવઇ ॥

- ૨૯/૧૮

હે ભગવન् ! ક્ષમાપના દ્વારા જીવને શું મળે ?

ક્ષમાપના દ્વારા પ્રસંગતા મળે છે. પ્રસંગતા વડે સર્વ પ્રાણો, ભૂતો,
 જીવો અને સત્ત્વો પર મૈત્રીભાવ ઉપજે છે. મૈત્રીભાવ દ્વારા ભાવવિશુદ્ધિને
 પામીને સાધક નિર્ભય બને છે.

॥ પ્રભુના હસ્તાક્ષર ॥

સાધનાસૂત્ર

ક્ષમાપના

પ્રસરતા

મૈત્રીભાવ

ભાવવિશુદ્ધિ

નિર્ભયતા



કવિવર રવીન્દ્રનાથ ટાગોર પ્રાર્થનામાં
લખે છે : 'હું જ્યારે સંસારની બારી આગળ
અન્યમનસ્ક ભાવે બેઠો હોઈશ તારે કરતો
જતો માણસ પણ આરા મુખના ભાવમાં તારા
સમાચાર જોઈ નહો.'
કોઈ પણ સાધકની કેદીન
આપી નહું શું હોઈ રહે ? : 'આરા મુખ
પર 'એ'ની છાપ !' હું હું ન હોઉં, તે-મય
બની જાઉં.

ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

કવિવર રવીન્દ્રનાથ ટાગોર
પ્રાર્થનામાં લખે છે : 'હું જ્યારે સંસારની
બારી આગળ અન્યમનસ્ક ભાવે બેઠો
હોઈશ ત્યારે રસ્તે જતો માણસ પણ
મારા મુખના ભાવમાં તારા સમાચાર
જોઈ જશે.'

કોઈ પણ સાધકની કેદીન આથી
વધુ શું હોઈ શકે ? : 'મારા મુખ પર
'એ'ની છાપ !' હું હું ન હોઉં, તે-મય
બની જાઉં.

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણઃ ચિત્તનો સમભાવમાં લય

અહંમયતાને તન્મયતામાં ફેરવવા માટે તો છે આ સાધના. નારદ
શિષ્યએ ભક્તોનું વર્ણન કરતાં ભક્તિસૂત્રમાં ઘારું સૂત્ર આપ્યું :
'તન્મયાઃ'.

ભક્ત કેવો હોય ?

તન્મય. 'તે' મય.

■ ■ ■

તન્મયતાની સરસ કથા જેન પરંપરામાં છે : શિષ્ય ગુરુની પાસે
આવે છે અને પૂછે છે : ભગવાન બુદ્ધના ચહેરા પર કેવા ભાવો જલકતા
રહેતા હોય છે ?

ગુરુના આસન પાસે એક બારણું હતું, જે ૭-૮ કૂટ નીચે શેરી
તરફ પડતું હતું. ગુરુએ શિષ્યને પકડીને તે બારણેથી હડસેલ્યો. શિષ્ય
નીચે પટકાણો. સદ્ગ્રામયે નીચે રેતી હતી. વધારે વાગ્યું તો નહોતું જ.
એ વખતે ગુરુ બારણામાં ડોકિયું કરી નીચે જુએ છે અને પૂછે છે :
ભગવાનના ચહેરા પર કેવા ભાવો હોય એ ઘ્યાલ આવ્યો ?

શિષ્યે હકારમાં માથું હલાવ્યું.

શિષ્યે પ્રશ્ન મનના સ્તર પર કરેલો. ગુરુ એ સ્તર પર એને પ્રત્યુત્તર
આપવા નહોતા માગતા. માટે એમણે ધક્કો માર્યો. આવી કોઈ ઘટના
આકસ્મિકરૂપે ઘટે ત્યારે મન બે કાણ ધૂ થઈ જતું હોય છે. શિષ્યના
મનનું સ્તર બાજુમાં હટયું કે તરત ગુરુએ પૂછ્યું : બુદ્ધ ભગવાનના
ચહેરા પર કેવા ભાવો હોય એનો ઘ્યાલ આવ્યો ?

શિષ્યે એ વખતે ગુરુના ચહેરા સામે ધારીને જોયું અને ત્યારે તેને
એ ચહેરા પર બુદ્ધના ચહેરા પરના ભાવોની જલક દેખાણી.

■ ■ ■

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

મનનું બાજુ પર હટવું. એ ઉન્મનીકરણ છે.

‘યોગસાર’નો પ્રિય શ્લોક છે :

સહજાનન્દતા સેયં, સૈવાત્મારામતા મતા ।

ઉન્મનીકરણ તદ્ય યદ્ય, મુનેઃ શમરસે લયઃ ॥ ૩/૧૫

ઉન્મનીકરણને સહજાનન્દ દશા, અને આત્મારામ દશા શબ્દોથી વર્ણવવામાં આવી. એટલા માટે કે મન હટતાં જ સાધકનો સમરસમાં પ્રવેશ, કહો કે દૂબકી લગાવવાનું થાય છે.

મન હટવું અને સહજ આનન્દ દશા પ્રગટી. મન હટવું અને આત્મરમણતા પ્રગટી.

■ ● ■

શા માટે મનને બાજુમાં ખસેવવાની વાત થાય છે ?

મનની પાસે જરી પુરાણી વિચાર-વ્યવસ્થા છે, જે સાધકને આનન્દ નથી આપી શકતી.

મનની પાસે ‘જેવા સાથે તેવા’ની વિચારશૈલી છે. એ સતત સંઘર્ષ કર્યા કરે છે. અહીં આનન્દની સંભાવના પણ ક્યાંથી ?

■ ● ■

ચિત્તનું સાધનામાર્ગ જોડાણ, તે પ્રણિધાન. પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે પ્રણિધાનની વ્યાખ્યા જે કરી છે, તેમાં તેમણે બે વાતોનો વિશેષજ્ઞપ્રે નિર્દેશ આમ કર્યો છે : પોતાનાથી નીચેની ગુણસંપદાએ રહેલ વ્યક્તિત્વ પરનો અદ્વેષ અને પરોપકારની વાસના ચિત્તમાં ભળેલી હોય ત્યારે તે પ્રણિધાન માટે સક્ષમ બને છે.¹

(૧) હીનગુણદ્વેષભાવ-પરોપકારવાસના વિશિષ્ટ :

અધિકૃતધર્મસ્થાનસ્ય કર્તવ્યતોપયોગ: પ્રણિધાનમ् ॥

-યોગવિશિકા ટીકા, ગાથા : ૧, (મહો. યશોવિજયજી)

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

કુશલ મનોવૈજ્ઞાનિકની અદાથી તેમણે ચિત્તનાં ડામાડોળપણાને દૂર કરવા માટે આ બે વાતો બતાવી છે.

ચિત્ત અસ્થિર થાય છે કેમ ? બીજાઓ પ્રત્યેનો તિરસ્કાર અને સ્વાર્થીય ધારા ચિત્તને અસ્થિર કરે છે.

સાધના માર્ગ જવા મનને તૈયાર કરેલું હોય અને ત્યાં કોઈ પ્રત્યે તિરસ્કાર આવી ગયો. આ દેખની ધારા સાધનાના નીતર્થી પાણીને ડહોળી જ નાખશે ને !

એ જ રીતે સ્વાર્થ મનમાં વસી ગયો, એના કારણો રાગ યા દેખ મનમાં છલકાયા; સાધના અસ્થિર બની જ જવાની છે.

■ ● ■

મનને બાજુમાં હડસેલવાનો અર્થ થયો મનની નબળાઈઓ બાજુમાં હડસેલવી.

અને એ હડસેલાતાં જ સાધકનો સમ-રસમાં પ્રવેશ થશે.

અને સમ-રસમાં લીન સાધકના ચહેરા પર પ્રભુના ભાવોની અમીટ છાપ કોરાયેલી હશે જ.

■ ● ■

પવિત્ર કલ્પસૂત્રના સામાચારી વિભાગમાં સાધકનો એક સરસ પ્રશ્ન આવેલો છે : પ્રભુ મારી સાધનાને પ્રમાણિત કરે એવું કયારે બને ?

સાધકની આ એક તીવ્રતમ જંખના છે કે પ્રભુના સાધના માર્ગ પોતે ચાલે તો છે, પણ એ ચાલવાનું પ્રભુ દ્વારા સમ્મત છે ?

સદ્ગુરુએ ત્યાં મગાનો પ્રત્યુત્તર આપ્યો છે : જો ઉવસમફ તસ્સ અસ્થિ આરાહણા, જો ન ઉવસમફ તસ્સ ણાત્થિ આરાહણા । ખમિયવ્બં, ખમાવિયવ્બં ।

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

જે બીજા પ્રત્યે ઉપશમ-ક્ષમા ધારે છે તે આરાધક છે. જે ક્ષમા માંગી કે આપી શકતો નથી તે આરાધક નથી.

■ ■ ■

ક્ષમાશીલ હદ્ય. કોમળ-કોમળ હદ્ય.

આપણો ત્યાં, પૂર્વમાં હદ્યનો પર્યાય જ છે લાગણીશીલતા.

મકાનમાલિક કઠોર હૈયાનો. મહિનો થયો નથી કે એની પઠાણી ઉઘરાણી ભાડા માટે આવી નથી. એ મકાનમાલિકનું અવસાન થયું. એક ભાડુઆત બીજા ભાડુઆતને પૂછે છે : શી રીતે તેઓ મરી ગયા ? બીજો કહે : તેમનું હદ્ય ધબકતું બંધ થઈ ગયું.

પહેલાએ નુક્તેચીની કરી : અચ્છા, તો તેમને હદ્ય હતું ખરું ?

બહુ મજાની આ આપણી પૂર્વની વિભાવના છે જ્યાં હદ્યને માત્ર લોહીના પમ્પિંગ મશીન તરીકે જ નહિ, પણ લાગણીઓના આદાન-પ્રદાનના એકમ તરીકે ઓળખવામાં આવે છે.

પશ્ચિમમાં આઈ.ક્યું. મપાય છે. બૌદ્ધિકતાની ફૂટપઢી ત્યાં છે. પૂર્વમાં છે હદ્યનું ગણિત.

■ ■ ■

ગામડાનો માણસ શહેરમાં ગયો. ઘર ભાડે લીધું. ધંધો શરૂ કર્યો. એમાં નાગપંચમીનો દિવસ આવ્યો. ગામડા ગામમાં તો એ ભાઈ જંગલમાં જઈ નાગબાપાને દૂધ પાઈ આવતો. અહીં શહેરમાં સાપ ક્યાંથી મળે?

મકાનમાલિક બહુ જ કઠોર હદ્યનો હતો. વિચાર કરીને આ ભાઈ બાજુમાં આવેલ મકાનમાલિકને ત્યાં ગયો. હાથમાં ગ્લાસ હતો. જેમાં દૂધ હતું : ખાંડ, બદામ નાખેલું. મકાનમાલિકને કહ્યું : લો, સાહેબ ! પીઓ!

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

મકાનમાલિક વિચારમાં પડ્યો : આ ક્યાંક દૂધમાં જેર તો નહિ નાખીને લાવ્યો હોય ને ?

ભાઈએ કહ્યું : સાહેબ ! દૂધ ચોક્કું, સરસ છે. આપ ચિન્તા ન કરો. આરામથી ગટગટાવો !

મકાનમાલિક કહે : પણ આજે જ કેમ ? પેલા ભાઈ મનમાં કહે : સાપ મળ્યો નથી, તો સાપના બાપ જેવો તું છે ને ! એથી તને આજે નાગપાંચમે દૂધ પીવડાવવા આવ્યો છું.

સાપ તો દબાય, ચંપાય, કચડાય તો જ કરડે. અને માણસ.... ?

■ ■ ■

એકવાર અંબાજી બાજુ વિહારયાત્રા ચાલતી હતી. કાચો રસ્તો. માર્ગદર્શક તરીકે સાથે હતા એક આદિવાસી ભાઈ. એમની સાથે પ્રભુની વાતો, એમને યોગ્ય અહિંસા વગેરેની વાતો કરવી હતી; પણ પહેલાં ઘરોબો તો બાંધવો પડે ને !

મેં પૂછ્યું : તમે લોકો જંગલમાં રહો, તો વાધ, સિંહ વગેરેનો ડર નહિ? એ કહે : મહારાજ, જંગલમાં રહેવું અને આ ફૂતરાંથી ગભરાવું તે કેમ બને ? મેં કહ્યું : પણ ક્યારેક આમને-સામને થઈ જવાય તો ? એ કહે : મહારાજ, સાંકડી નેળમાં સામેથી ફૂતરું આવતું દેખાય તો અમે તો હનુમાનજીની જેમ જાડ ઉપર ઠેકી જઈએ. ફૂતરું નીચેથી જતું રહે.

પણ પછી એણો ઉમેર્યું : મહારાજ, જંગલી જનાવરે અમારા જેવા મનેખ કરતાં સારા. મેં પૂછ્યું : શી રીતે ? મને કહે એ ફૂતરું ધરાઈને પડ્યું હોય ત્યારે આપણે બાજુમાંથી પસાર થઈએ તોય એ આપણા તરફ નજર ન નાખે. અને માણસ તો વિના કારણે કોઈને હેરાન કરી નાખે!

■ ■ ■

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

કોમળતાની આ પૃષ્ઠભૂ પર સૂત્રમાં પ્રવેશ કરીએ.

શિષ્યનો પ્રશ્ન છે : ગુરુદેવ ! ક્ષમાપના વડે સાધકને શું મળે ?

ગુરુદેવ કહે છે : ક્ષમાપના વડે મનની પ્રસંગતા મળે છે. તે દ્વારા મैત્રીભાવ મળે. એનાથી ભાવવિશુદ્ધિ. અને એથી નિર્ભયતા.

કેટલો મજાનો કમ !

કમસર એક એક ચરણને જોઈએ.

■ ● ■

પહેલું ચરણ : ક્ષમાપનાથી મનની પ્રસંગતા. કેટલી મજાની વાત ! કોઈના પર ગુસ્સો આવી ગયો, તમે એના પર વરસી પડ્યા. એ તો પીડિત થાય. તમારું મન પણ ભારે, ભારે રહેવાનું જ.

આ ભાર, તાણાની અનુભૂતિ ઓછી-વધતી વરતાતી હોય છે એની પાછળ આપણી સંવેદનાનાં પ્રમાણાનો ફરક હોય છે. સંવેદનશીલ મનુષ્ય ખૂબ જ તાણ અનુભવશે.

અને એથી જ, એવી વ્યક્તિ જ્યારે સામી વ્યક્તિની ક્ષમા માંગે છે ત્યારે એ પોતાની પ્રસંગતા મેળવતો હોય છે.

■ ● ■

ક્ષમાપના...

જૂકવાનો ભાવ.

રવીન્દ્રનાથ ટાગોરનું ગીત છે :

એકટિ નમસ્કારે પ્રભુ,
એકટિ નમસ્કારે.

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

સકલ દેહ લૂટિએ એદુક, તોમાર એ સંસારે...

(પૂરા ંગીતનો ભાવાર્થ :

એક જ નમસ્કાર, પ્રભુ !

એક જ નમસ્કાર...

તારા સંસારમાં બધું લુંટાવી દીધું...

શ્રાવણના મેઘથી ઝૂકેલ, પાણીથી ભરેલ આકાશ જેવો નમસ્કાર...

મનને તારે દ્વારે લુંટાવી દઉં.

બધા સુરો ખોવાઈ જાય

અને નીરવ પારાવાર બચે.)

■ ● ■

મૌની બાબા કરીને એક સંત થયા. લગભગ મૌનમાં જ તેઓ રહેતા. પણ કસમયે કોઈ એમની જગ્યાએ પહોંચી જાય તો ગુસ્સે થઈ જતા. ગુસ્સામાં કંઈક બોલી પણ દે.

ત્યાંના લોકોની એવી શક્તા થઈ ગયેલી કે મૌની બાબાનો ગુસ્સો મળે તો પોતાનું કલ્યાણ થઈ જાય, અને એથી બાબા ન ઈરછે ત્યારે પણ જતા અને બાબાનાં ફટકારને પ્રેમથી જીલતા.

આવું જ પ્રહારી બાબા માટે કહેવાતું. તેઓ કોઈને લાકડી વગેરે લગાવી દે તો પોતાનું કલ્યાણ થાય છે એવું લોકો માનતા, અને આથી તેમનો પ્રહાર પ્રસાદરૂપ લાગતો.

બીજાના પર આપણને ગુસ્સો આવ્યો તો આપણે ક્ષમા માંગી જ લઈશું. પણ કોઈ વ્યક્તિ આપણા પર ગુસ્સે થઈ તો એ વખતે એ

ગ્રબુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

ગુસ્સાને સહન કરવાથી મને નિર્જરારૂપ લાભ માનીએ તો મૌની બાબા
કે પ્રહારી બાબાના પ્રસાદ જેવો એ ગુસ્સો લાગે ને !

આવું ન કરી શકાય ?

શું આપણે આ રીતના સ્વાર્થી માણસ પણ નથી ? સ્વ એટલે
આત્મા..... તેને લાભ થાય એવું ગણિત જેની પાસે હોય તે સ્વાર્થી.

આપણે આવા સ્વાર્થી તો બની જ જઈએ !

■ ● ■

મહાત્મા બુદ્ધ પર એક વ્યક્તિએ પૂરા અર્ધો કલાક સુધી ગુસ્સો
ઠાલવ્યો. બુદ્ધ હસતા જ રહ્યા. પેલો માણસ થાકીને ગયો. પણ શિષ્ય
આનંદને થયું કે ભગવાન કેમ કંઈ બોલ્યા નહિ સામે ? ગુરુની હાજરીમાં
શિષ્ય તરીકે પોતે તો બોલી શકે તેમ ન હતો. બુદ્ધ ભગવાન કેમ ન
બોલ્યા ?

બુદ્ધ કહે છે : આનંદ ! ગુનો એણો કર્યો, સજા હું શા માટે
ભોગવું? અને બીજી વાત એમણે કહી : કિયાની સામે પ્રતિકિયા
(એક્સનની સામે રીએક્સન) આપવાથી વર્તુળ પૂરું થશે, અને એ પછી
પૈડું ચાલવા જ લાગશે.

અર્ધું કપાયેલું ટાયર. ધક્કો મારો તોય ચાલવાનું તો નથી જ. બુદ્ધ કહે
છે : એ વ્યક્તિએ કિયા કરી, મેં પ્રતિકિયા ન આપી. ચક ચાલ્યું નહિ.

■ ● ■

ક્ષમાપનાથી ચિત્તની પ્રસતતા, અને એથી મૈત્રીભાવ.

ક્ષમાપનાએ અહીં દોહરં કાર્ય કર્યું. સાધકને એણે ચિત્ત પ્રસતતા
આપી, અને મૈત્રીભાવ પણ.

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

ચિત્તની પ્રસ્તરતા એટલે જ હદ્યની ઉદારતા. એવી ઉદારતા જ્યાં આખી પૃથ્વી એક કુટુંબ જેવી કે એક પંખીના માળા જેવી લાગે. (વસુધૈવ કુટુંબકમ્ / યત્ર વિશ્વં ભવતિ એકનીડમ્)

ફલિતાર્થ એ થયો કે કોધ એટલે હદ્યની સંકુચિતતા. ક્ષમાપના એટલે હદ્યની ઉદારતા, વિશાળતા.

કોધ કરવાથી પોતાને તો પીડા મળે જ છે. આવો સ્પષ્ટ અનુભવ હોવા છતાં એ ધારા ચાલુ રહે એ અનાદિનો અધ્યાસ જ ને, બીજું શું ?

પ્રભુના વચનો અનાદિના એ અધ્યાસને તોડવાનું બળ આપો !

■ • ■

મૈત્રીભાવથી મળે ભાવશુદ્ધિ.

મૈત્રીભાવનો લય પૂરી ચેતનામાં પ્રવાહિત થાય, ત્યારે ભાવશુદ્ધિનું ચરણ મળે છે.

સંત દાદૂ કહે છે :

દાદૂ કે લાગી તબ જાનિયે, જે કબહુ ધૂટી ન જાઈ;
જીવત યોં લાગી રહે, મુવાં મંજિ સમાઈ...

સબ તજી ગુણ આકાર કે, નિહયલ મન લ્યૌ લાઈ;
આતમ ચેતન પ્રેમ રસ, દાદૂ રહે સમાઈ...

યોં મન તજૈ શરીર કો, જ્યોં જાગત સો જાઈ;
દાદૂ બિસરૈ દેખતાં, સહજિ સદા લ્યૌ લાઈ...

આદિ અંતિ મધિ એક રસ, ટૂટે નહિ ધાગા;
દાદૂ એકે રહે ગયા, તબ જાણો જાગા...

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

લય લાગેલ ત્યારે કહેવાય કે એ કયારેય ન છુટે. પૂરા જીવન પર એ વ્યાપીને રહે.

મન આકૃતિઓની - સ્થૂળની પાછળ દોડે છે, પણ પોતાની ભીતર સ્થિર થતું નથી. મન નિશ્ચલ થાય ત્યારે આત્માના ચૈતન્યમય, પ્રેમમય સ્વરૂપની ઝાંખી થાય છે.

માણસ ઊંઘે છે ત્યારે તેને શરીરનું ભાન, મમત્વ હોતું નથી. એવી જ સ્થિતિ જાગૃતિમાં લાવવાની છે.

અને ત્યારે, આદિ, મધ્ય અને અન્તમાં એક જ આનંદની લહેર હોય છે. એનો તાર કદી તૂટે નહિ. આવા એક તત્ત્વમાં સર્વ ભેદ-વિભેદ ઓગળી જાય ત્યારે જાણવું કે ખરેખર જાગૃતિ મળી.

■ ● ■

મૈત્રીભાવ દ્વારા ભાવવિશુદ્ધિ. ભાવવિશુદ્ધિ એટલે રાગ અને દ્વેષનો વિગમ, વિલય, શિથિલીકરણ.

સાધનામનીધી પૂ. પં. શ્રીભર્દ્રાકરવિજયજી મહારાજસાહેબ લખે છે: “ધર્મ શુભાશયરૂપ છે તેનું કારણ ક્ષાન્ત્યાદિ દશવિધ પ્રકારો છે. અને તે દશવિધ ક્ષાન્ત્યાદિનું કારણ પ્રત્યુપકાર-નિરપેક્ષ (બદલાના ભાવના વિનાની) મૈત્રી છે. ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય’માં કહું છે કે મૈત્રી ભાવના સામ્ય અને દ્વેષોપશમ દ્વારા શુદ્ધોપયોગરૂપ ધર્મમાં ઉપયોગી થાય છે.

મૈત્ર્યાદિ શુદ્ધ વાસના છે, તેના બળથી રાગ-દ્વેષાદિની વાસના નિવૃત્ત થાય છે.

સ્યાદ્વાદકલ્પલતામાં લઘ્યું છે કે મૈત્ર્યાદિ ભાવનાથી ઉપબૃંહિત (પુષ્ટ થયેલ) અનિત્યત્વાદિની અનુગ્રહકાઓના અત્યાસથી પરમ નિર્મમત્વની અને તે દ્વારા પરમ માધ્યસ્થયની પ્રાપ્તિ થાય છે. આ માધ્યસ્થય ચતુર્થ

ભાવનારૂપ નહિ પડો ચારે ભાવનાથી ઉત્પત્ત થયેલ એક ઉચ્ચતમ ચિત્તપ્રસાદાત્મક અવસ્થા છે.

આ ઉપરથી જીવમૈત્રી એ ધર્મકલ્યવૃક્ષનું મૂળ છે એ વાતનું સમર્થન થાય છે.

સમ્યક્તવની ગ્રાફિ વખતે અનન્તાનુભંધી ચારનાં ક્ષય વડે શમ પ્રથમ આવશ્યક છે, જે જીવમૈત્રીસ્વરૂપ છે. પછી દર્શનમોહનીયાદિ ત્રણનો ક્ષયોપશમ પરમેછિ ભક્તિસ્વરૂપ છે. એ રીતે સમ્યક્તવથી પડતી વખતે પ્રથમ અનન્તાનુભંધીનો ઉદ્ય થાય છે, તે જીવમૈત્રીનો વિઘાતક બની પછી દર્શનમોહનીયાદિનો ઉદ્ય પ્રભુભક્તિથી ભ્રષ્ટ કરે છે. એ રીતે પણ જીવમૈત્રી પ્રથમ સાધનરૂપ બને છે અને તે દ્વારા પ્રગટેલી પ્રભુભક્તિ આત્મસાધક બને છે.

■ ■ ■

ભાવવિશુદ્ધિ દ્વારા નિર્ભયતા. નિર્ભયતાનો સામાન્ય અર્થ - ભયનો અભાવ-આપણા ઘ્યાલમાં છે. પૂ. આનન્દધનજી મહારાજે- અભયનો એક વિરોધ અર્થ ત્રીજા સ્તવનમાં બતાવ્યો છે : ‘ભય ચંચળતા હો પરિણામની.’ ચિત્તનું અસ્થૈર્ય, ચંચળતા તે ભય, એટલે અભયનો અર્થ થયો ચિત્તસ્થૈર્ય.

મનોવૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો અભય એટલે પ્રકંપનોનો અભાવ. શરીર અને મનમાં સતત પ્રકંપનો થયા કરતા હોય છે. મનગમતો પદાર્થ સામે આવતાં જીભમાં પ્રકંપન એ હદે થશે કે પાચનરસ ધૂટવા લાગશે. આ જ રીતે મનને અનુકૂળ ઘટના સામે હશે તો રતિના, વિપરીત પરિસ્થિતિમાં અરતિ કે ભયના પ્રકંપનો ઉપજશે.

ધ્યાનમાં આ પ્રકંપનો નથી હોતા અથવા તો બહુ જ ઓછા હોય છે.

ધ્યાનમાં ગયેલ સાધકના મસ્તિષ્ઠ પાસે ઈલેક્ટ્રોઇસ લગાવી આલ્ફા, બીટા આદિ તરંગોને માપી શકનારા યન્ત્રો અત્યારે ઉપલબ્ધ છે. ધ્યાનમાં

પ્રભુના હસ્તાક્ષર ♦ ઉન્મનીકરણ : ચિત્તનો સમભાવમાં લય

બેઠેલ અને વિચારોમાં રહેલ સાધકની બિન્દુ બિન્દુ અવસ્થાઓની તરંગ-
લંબાઈ આદિમાં ઘણો ફરક પડે છે.

તો, અભય એટલે ઘટનાઓથી અપ્રભાવિતતા.

■ ● ■

આ રીતે ક્ષમાપના દ્વારા ચિત્તપ્રસંગતા, મૈત્રીભાવ, ભાવવિશુદ્ધિ અને
અભય મળે છે.

આવા સાધકના ચહેરા પર પ્રભુના ભાવોની અમીટ છાપ વરતાય
જ ને !




આધારસૂખ્ર

અપ્પડિબદ્ધયાએ ણં ભંતે ! જીવે કિં જણયઇ ?
 અપ્પડિબદ્ધયાએ ણં નિસંગત્તં જણયઇ ।
 નિસંગત્તેણ જીવે એગે એગગચિત્તે, દિયા
 ય રાઓ ય અસજમાણે અપ્પડિબદ્ધે યાવિ વિહરઇ ॥ ૨૯/૩૧
 અપ્રતિબદ્ધતા (મનની અનાસક્તિ)થી સાધકને શું મળે ?
 અપ્રતિબદ્ધતાથી તે સાધક અસંગ બને છે. અસંગ દશાથી આત્મા
 એક (રાગ-દ્વેષ રહિત) અને એકાગ્રચિત બને છે. તેવો થયો છતો
 દિવસ અને રાત બાધ્ય સંસરોને છોડતો થકો અપ્રતિબદ્ધતાથી વિચરે
 છે.

સાધનાસૂખ્ર

અપ્રતિબદ્ધતા
 અસંગદશા
 એકત્વ
 એકાગ્રચિતતા
 અહર્નિશ સંસર્-પરતા
 અપ્રતિબદ્ધતા



અપ્રતિબદ્ધ દશા

જર્મન નવલકથાકાર હરમાન હેસે
વૃદ્ધાવસ્થામાં પોતાના મકાનની બહાર
આ જૂની ચીની કવિતા લખેલી : 'જો
કોઈ માણસ વૃદ્ધ થાય અને તેણે પોતાના
કાર્યોનો હિસાબ આપેલ હોય (સમાજ
માટે યથાશક્તિ એણે કાર્યો કરેલ હોય)
તો એકાંતમાં મૃત્યુ સાથે મૈત્રી બાંધવાનો
એને અધિકાર છે.'

હરમાનની જીવનકથાના લેખક વોલ્ટર
સોરેલ તેમના ઘરે ગયેલા, પણ ઉપરની
કવિતા વાંચ્યા પછી પાછા ફરી ગયેલા.

અપ્રતિબદ્ધતા - અનાસંગનું આ આધુનિક દેખાન્ત.

આપણા પૂર્વજોની જીવનકથા તો અપ્રતિબદ્ધતાથી પૂરી પૂરી ભરાયેલી છે. ઉધાનમાં કે ગુફાઓમાં તેઓ રહેતા. મધ્યાળે એકાદવાર લિક્ષા આદિ માટે લોકોના ઘરોમાં પહોંચી જાય. બાકી આખો દિવસ એકાન્તમાં એમની સાધના ચાલ્યા કરે.

ઈલોરાની ગુફાઓના ફોટોગ્રાફ્સ જોયા છે. ત્યાં જૈન ગુફાઓ અને જૈન દહેરાસરો પણ છે. એ ફોટોગ્રાફ્સ જોતાં ઈર્ધા થાય કે કેવી વિજનતામાં મહામુનિવરો પોતાની સાધનાને વિકસાવી રહ્યા હતા.

મધ્યપ્રદેશની વિહારયાત્રા વખતે બાધની ગુફાઓ બાજુમાં છે એ ઘ્યાલ આવ્યો અને અમે થોડાક મુનિઓ- હું, આચાર્ય મુનિચન્દ્રસૂરિજી, વિદ્વદ્ધર્ય પૂજય ધુરનધરવિજય મહારાજ, પં. રાજેશવિજય, પં. ભાગ્યેશવિજય, મુનિ મહાયશવિજય આદિ- ત્યાં ગયેલા. શું મજાનું ત્યાંનું વાતાવરણ ! ખાસ્સા પ્રભાવિત અમે લોકો થયેલા. નદી (એ વખતે પાણી વગરની હતી) ને સામે કાંઠે ગુફાઓ. ત્યાં ગયા. ગુફાઓમાં થોડી વાર બેઠા. થયું : કાશ ! અમને પણ આવી સાધનાસ્થળીઓ મળે !

જો કે અત્યારે તીર્થસ્થાનના રૂપમાં ઘણી સાધનાસ્થળીઓ આપણી પાસે છે.

થોડો સમય પહેલાં હું સુરતમાં બહુ વ્યસ્ત હતો. અને ત્યારે મિત્રવર આચાર્ય શ્રી શીલચન્દ્રસૂરિજીનો પત્ર આવ્યો કે તેઓ અમદાવાદ ચાતુર્માસ પૂર્ણ કરી ૧-૧॥ મહિનો ભોયણી તીર્થના શાન્તપરિસરમાં ભક્તિ, સ્વાધ્યાય માટે જઈ રહ્યા છે. મેં એમને વળતી ટપાલે લખેલું : મને તમારી ઈર્ધા આવે છે.

અપ્રતિબદ્ધતા.

ભાગવતનો સરસ શ્લોક છે :

ન કુર્યાન્ન વદેત् કિચ્છિત्, ન ધ્યાયેત् સાધ્વસાધુ વા ।
આત્મારામોऽનયા વૃત્ત્યા, વિચ્રેજડવન્મુનિઃ ॥

ઉંચકાયેલો, મૌનના જગતમાં પ્રવેશેલ સાધક ન કંઈ કરે, ન કંઈ બોલે, ન કંઈ વિચારે, અને આ રીતે આત્મરમણશીલ બનેલ સાધક (પર પ્રત્યે) પ્રતિભાવવિહોણો હોય. પરની દુનિયામાં ઘણું જ બન્યાં કરતું હોય છે; ન એના પ્રત્યે સાધકને આશ્ર્ય હોય કે ન બીજો કોઈ પ્રતિભાવ હોય. ઘટનાઓના પરપોટા થયા કરે, ફૂટ્યા કરે...

આમાં કોનો સંગ સાધકને હોય ? સાધક તો પોતે પોતામાં જ સ્થિર હોય.

■ ● ■

અપ્રતિબદ્ધતા. અનાકર્ષણ. ડિટેચમેન્ટ.

પરમના તીવ્ર સમ્મોહન, આકર્ષણ સાથે પરના અનાકર્ષણને પંચસૂત્રનું ચતુર્થ સૂત્ર સરસ રીતે સાંકળે છે. ખારું સૂત્ર છે: સ એવં અભિપ્રવ્વઙ્ગ સમાણે, સુવિહિભાવઓ કિરિયાફલેણ જુજ્જાં ।

સાધકને ખારું વિશેષણ અપાયું : અભિપ્રજિત. આમાં ઈંગિત કરાયેલી બે સાધનાઓ આ થશે : અભિપ્રજ્યા, પ્રવ્રજ્યા.

અભિપ્રજ્યા : પરમાત્માની સમ્મુખ જવું. પરમાત્માએ કહેલ આશા પથ પર દોડવું. પ્રવ્રજ્યા : એવું એક તીવ્ર સમ્મોહન પરમાત્મા પ્રત્યેનું કે એમના સિવાયનું બીજું બધું છૂટી જાય.

■ ● ■

અપ્રતિબદ્ધતા, અનાકર્ષણ દશા પરિણમે છે અસંગદશામાં.

અસંગદશાનો નૈશ્વર્યિક સ્તર પરનો દાખિકોણ પૂ. દેવચન્દ્રજી મહારાજ પરમતારક શ્રી અલિનન્દન પ્રભુની સ્તવનામાં સમજાવે છે : ‘દ્રવ્યે દ્રવ્ય મિલે નહિ, ભાવે તે અન્ય અવ્યામ...’ એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે ક્યારેય ભળતું નથી, એનું સ્વતન્ત્ર અસ્તિત્વ અલગ જ રહે છે. આત્મદ્રવ્યોય પરસ્પર બિલકુલ અલગ જ રહેશે. અન્યની વ્યાપી - અસર કોઈ પણ આત્મામાં જીલાશે નહિ. અપ્રભાવિતતા.

અસંગતાનો વ્યવહારું પક્ષ એવો છે કે ત્યાં સંગ હશે તો તે રાગભાવથી જન્ય નહિ હોય, મૈત્રીભાવથી પેદા થયેલ સંગ હશે. મૈત્રીભાવમાં વ્યાપકતા હોવા છતાં સંગને કારણો જે પીડાઓ થતી હોય છે, તે નથી હોતી, અને નિર્મણ હદ્યનો વિકાસ મૈત્રીભાવ દ્વારા થયા કરે છે.

શ્રી દિલીપકુમાર રોયનું પુસ્તક છે : ‘પિલ્ગ્રીમ્સ ઓફ દસ્ટાર્સ.’ તેમાં તેમનાં શિષ્યા ઈન્દ્રિયા દેવીના જીવનની સરસ ઘટનાઓ છે.

એક વાર ઈન્દ્રિયાદેવીએ બગીચામાં ટહેલતાં જોયું કે લાલ રંગની બે બોગનવીલિયાની વચ્ચે એક કેસરી ફૂલની બોગનવીલિયા હતી. રંગની આ મિલાવટ બરોબર ન લાગવાથી તેમણે માળીને કહ્યું કે કેસરી રંગની વેલ કાઢી નાખજે.

સાંજે ઈન્દ્રિયાદેવી ધ્યાનસ્થ હતાં ત્યારે તેમને દેખાયું કે કેસરી બોગનવીલિયાની અંદરથી કેસરી જબલાવાળો છોકરો બહાર આવ્યો અને કહે : મા, મા ! મને કેમ મારી નાખવાનું કહ્યું ? હું તો હજુ સાવ નાનકડો છું.

ઇન્દ્રિયાદેવીએ માળીને ના પાડી કે પીળી વેલ કાઢીશ નહિ.

બીજી વાર ધ્યાનમાં દેખાયું કે લીલા રંગના કપડાવાળાં નાનાં ભૂલકાં રમી રહ્યાં છે. અચાનક તેઓ બૂમ મારવા લાગ્યા. ઇન્દ્રિયા

દેવીએ ઘાસમાં લોહી પડતું જોયું. તરત તેમણે માળીને કહ્યું કે આંબાની ડાળીઓ કાપીશ નહિ.

પરમપાવન આચારાંગ સૂત્રના ‘એ આયા’ સૂત્રનો આ જીવનવ્યાપી અનુવાદ હતો. ‘આત્મા એક છે...’ તેની અનુભૂતિ. બીજાનાં સુખ-દુઃખનું પ્રતિબિભબ તમારી ભીતર જલક્યા કરે.

■ • ■

અસંગતા એકત્વાનુભૂતિમાં પલટાશે.

આનન્દની અનુભૂતિ જ્યારે લક્ષ્ય હશે ત્યારે સાર્વનું આ વચન હૈયાવગું રહેશે જ. ‘ધ અધર ઈજ હેલ.’ (બીજો એ જ નરક.) ‘શાન્તસુધારસ’ની રણજાવનારી પંક્તિ કહેશે : ‘પર: પ્રવિષ્ટ: કુરુતે વિનાશમ...’ પરનો પ્રવેશ જો હદ્યમાં થયો તો વિનાશ જ વિનાશ.

પર તરફની સંપૂર્ણ ઉદાસીનતાની વાત કરતાં ‘શાન્તસુધારસ’ ગ્રન્થ કહે છે : જંગલમાં જઈને કોઈ વ્યક્તિ આંબા પરથી કેરી ચૂંટે કે બીજો કોઈ કેરડાના ઝાડ પરથી કેર ચૂંટે; તારે શું ?

ઉદાસીન દશાનું આ કેવું મજાનું શિખર ત્યાં છે ! : સૂત્રમાં કહેલી વાતને બાજુએ મૂકીને કદાચ કોઈ ઉત્સૂત્ર બોલે; તોય તારે શું? તું એમાં શું કરી શકીશા ? નિર્મળ જળના જરણાની પાસે હોવા છતાં કોઈ વ્યક્તિ ગંદું પાણી પીશે તો તેમાં તારે શું કરવાનું ?

(‘સૂત્રમપાસ્ય જડા ભાષન્તે, કેચન મતમુત્સૂત્રં રે; કિં કુર્મસ્તે પરિહતપયસો, યદિ પિબન્તિ મૂત્રં રે...’)

■ • ■

અસંગદશા દ્વારા એકત્વાનુભૂતિ. ‘બંસી આજે પણ બજે છે’માં ઈન્દ્રિયાદેવી લખે છે :

સાન ફાન્સિસ્કોમાં એક મિત્રે મને પૂછ્યું : સંસારનો સામનો કરવાને બદલે સંસાર છોડી ભાગી જવું એ કાયરતા નથી ?

મેં કહ્યું : ના. સંસારનો સામનો કરવાનું તો સહેલું છે. સંસારના મિત્રો તમને મોં પર તમારા વિષે તેઓ શું ધારે છે એ નહિ કહે. પણ સંસાર છોડ્યા પછી માણસે સર્વાઈથી અને નિષાઠી પોતે પોતાનો સામનો કરવાનો છે, અને એમાં વધારે હિંમત જોઈએ.

પોતાની જાતની સાથે એકાન્ત સેવવું અને પોતે પોતાને જેવો માને છે તેવો નહિ, પણ પોતે ખરેખર જેવો છે તેવો પોતાને જોવો એ સહેલું નથી.

■ ■ ■

એકત્વાનુભૂતિ જ આનંદાનુભૂતિનું બીજું નામ છે.

ચાલો, આત્માની મૂળભૂતદશાનું જ્ઞાન નથી થયું હજું એમ માની લઈએ. પરની જોડે સંગદશાનો અનુભવ તો કર્યો છે ને ? શું મળ્યું એનાથી? ને શું મળી શકે ? પરના અનુભવને કારણે થયેલી પીડા પણ એકત્વાનુભૂતિની દિશા તરફ તમને લઈ જઈ શકે.

મૌનમાં આનંદની અનુભૂતિ જેને પણ હશે; શબ્દોની પીડાનો અનુભવ તેની પાસે હશે જ.

સ્વત્તનો આનંદ જેણો પણ મેળવ્યો છે; એને પરમાં કશી ચમક-દમક કર્યારેય દેખાતી નથી.

ચર્ચિલ એક વાર ભાષણ માટે ગયેલ. હજારો લોકો એમને સાંભળવા માટે ઉત્સુકતાથી રાહ જોતા હતા. ચર્ચિલના મિત્રે તેમને કહ્યું : તમારા નામનો કેવો જાદૂ છે! આટલા બધા લોકો તમારા નામથી ભેગા થયા છે : તમને સાંભળવા માટે.

ચર્ચિલ માટે આવી સભાઓ રોજિંદી ઘટનાના એક ભાગરૂપ હતી. તેથી તેઓ એનાથી પ્રભાવિત ન થયા. તેમણે મિત્રને કહ્યું : આવતીકાલે જો મને અહીં ફાંસીને માંચે ચડાવવાનું થાય તો આથીય વધુ માણસો ભેગા થાય !

લોકો તો કુતૂહલથી પ્રેરાઈ ભેગા થઈ શકે, એનાથી અહેંકારને કઈ રીતે ઉભારી શકાય ?

આઈન્સ્ટાઈન અમેરિકા ગયેલા. ન્યૂયોર્કમાં તેઓ વિમાનીમથકથી ઉતારા તરફ ખુલ્લી ગાડીમાં જઈ રહ્યા હતા. લોકો તેમને જોવા રસ્તાની બેઉ બાજુએ ઊમટી પડેલા. મિત્રે કહ્યું : આવું સ્વાગત તો કોઈ રાજનેતાનું પણ ક્યારેય અહીં જોયું નથી.

એ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકે નમ્રતાથી કહ્યું : આ જ સરક પરથી જો જિરાફ પસાર થવાનું હોય તો આથીય વધુ મેદની હોઈ શકે.

લોકોની વચ્ચે રહેવા છતાં પોતાનું એકાન્ત અહીં અકબંધ રહે છે.

કેવી મજા !

એકાન્તનો વૈભવ તે આનું જ નામ ને !

■ ■ ■

એકત્વાનુભૂતિ દ્વારા એકાગ્રચિતતા. ચિત્ત માત્ર એકમાં પરમાત્મામાં આત્મામાં- લીન બનેલું હોય.

કઠોપનિધદ્દ કહે છે : ‘નૈવ વાચા ન મનસા, પ્રાસું શક્યો ન ચક્ષુષા...’ ન વાણી વડે, ન મન વડે કે ન આંખ વડે આત્માને જોઈ શકાય.

તો આત્માને પામવા શું કરવું ?

‘કશ્ચિત् ધીરઃ પ્રત્યક્ આત્માનં ઐક્ષત । આવૃત્તચક્ષુ: અમૃતત્વं ઇચ્છન् ।

કોઈ ધીર પુરુષે આત્માને જોયો છે, તે દણ્ણિને અંદર વાળનારો અને અમૃતત્વને ઈચ્છનારો હોય છે.

આવૃત્યકૃતા. મીરાં કહે છે : ‘ઉલટ ભઈ મેરી નૈનન કી...’ બહારના જગત પ્રત્યે આંખો બંધ થઈ તો ભીતરનું દેશ્ય ચાલુ!

બહાર તો છે મૃત્યુ જ મૃત્યુ. અંદર છે અમૃતત્વ.

■ • ■

આવૃત્યકૃતા અને અમૃત ભણીની યાત્રા. ચિત્ત હવે માત્ર એકમાં દૂબેલ છે : આત્માને વિષે. આનંદ જ આનંદ.

હવે બહાર નહિ રહી શકાય. અન્દરનો આનંદ થોડો પણ મણાયો છે ને !

અગણિત અતીત કરતાં અહીં ફરક એ પડ્યો કે અહીં વિકલ્પ મળ્યો છે. ભૂતકાળના ઘણાં જન્મોમાં વિકલ્પ નહોતો. માત્ર વિભાવો જ વિભાવો હતા. અને એટલે, રોટલીથી કંટાળો તો ભાખરી પર જાવ; અને એનાથી કંટાળો તો પૂરી પર જાવ આવું બન્યા કરતું, આ વિભાવ છોડીને પેલો વિભાવ લ્યો. પણ આખર તો વિભાવો જ હતા.

આ જન્મમાં પ્રલુની એવી અનરાધાર કૃપા માણવા મળી કે સ્વભાવનો આનંદ સહેજ ચાખવા મળ્યો. ને એ મળતાં જ વિભાવ ધૂટી જાય !

સ્વભાવ તરફની યાત્રા : અમૃતત્વની પ્રાપ્તિ તરફ ભરાતા કદમ. અને એ માટેનું આગળનું ચરણ હતું આવૃત્યકૃતા. પર તરફથી દણ્ણ હટવી.

■ • ■

એકાગ્રચિતાના કારણે રાત અને દિવસ સ્વમાં જ ઝૂબકી લગાવવાનું થયા કરશે. પર ધૂટી જશે. અને સાધક પરથી અપ્રભાવિત થઈને, અપ્રતિબદ્ધ પણે વિહરશે.

॥ પ્રલુના હસ્તાક્ષર ॥

આધારસૂત્ર

જિણવયણે અણુરત્તા, જિણવયણં જે કરંતિ ભાવેણ ।
અમલી અસંકિલિદ્વા, તે હોંતિ પરીત્તસંસારી ॥૩૬/૨૬૦ ॥
જે સાધકો જિનવચનમાં અનુરક્ત છે અને ભાવપૂર્વક જિનવચનને
આરાધે છે, તે સાધકો નિર્મળ અને સંકલેશવિહોણા થયા છતાં અલ્યસંસારી
બને છે.


સાધનાસૂત્ર

અહોભાવ

નિર્મળતા

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રભુનાં ખારાં વચનો

૧૫



પ્રભુનાં ખારાં વચનો

સંત જૈરાવાતી શાકભાજી વેચતા.
પ્રભુના એ અનન્ય ભક્ત હતા.

સૂકી સંતો બહારથી મોચીનું કે
શાકભાજી વેચવાનું કામ કરતા હોય.
કોઈને ઘ્યાલ ન આવે કે આ પહોંચેલ
સાધક છે. કયારેક કો'ક પહોંચેલ સાધક
પાસેથી કોઈ પ્રાર્બિક સાધક સરનામું
લઈને આવે તોય સંત પહેલાં તો વાત
સાંભળે નહિ... પેલો સાધક ખરેખર
મુમુક્ષુ લાગે તો જ તેની વાત એ
સાંભળે, અને માર્ગદર્શન આપે.

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રભુનાં ઘારાં વચ્ચનો

સંત જૈરાવતી આવા પહોંચેલ સાધક હતા. બહારથી કોઈને ખ્યાલ ન આવે કે એ મર્મી સાધક છે.

એક વાર એક ભાઈ શાક લેવા આવ્યાં. ખોટી આઈ આની તેમની પાસે હતી. તે તેમણે સંતને આપી. સંતે જોયું. પ્રેમથી સ્વીકારી આઈ આની, શાક આપ્યું.

પછી તો સિલસિલો ચાલ્યો. જેની પાસે ખોટો સિક્કો હોય તે અહીં આવે અને શાકભાજી લઈ જાય.

લોકોને નવાઈ લાગતી કે શાકભાજીવાળાને (એમને કયાં ખબર હતી કે એ સંત છે !) ખોટા સિક્કાની ખબર પડે છે. માણસ પણ ચાલાક દેખાય છે. તો પછી એ ખોટા સિક્કા સ્વીકારે છે કેમ?

રહસ્ય એક વાર ખૂલ્યું. એક વાર સંત મન્દિરમાં રાત્રે બેઠેલા. તેમને લાગ્યું કે હવે મન્દિરમાં કોઈ નથી. અને એથી એમણે પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ ! હું તો તારો નાચીજ ભક્ત છું. અને છતાં ખોટા સિક્કાને પ્રેમથી સ્વીકારું છું. તો, ખોટા સિક્કા જેવો હું તારે દ્વારે આવેલ છું. તું મને સ્વીકારશે જ એવી પૂરી શ્રદ્ધા છે.

■ ● ■

અહોભાવના લયની આ પ્રાર્થના. હું કશું જ નથી, પ્રભુ ! પણ તું મને સ્વીકાર ! તું મને તારું વરદાન આપ !

નિગૂઢ વાત આટલી જ છે : ભક્ત ખાલી થાય એટલે પરમ ચેતના અને ભરી જ દે.

ભક્તના પક્ષે માત્ર ખાલી થવાનું છે. પરમચેતના અને સદ્ગુરુ ચેતના અને ભરી દે છે.

સંત શાનેશ્વર નવ વર્ષની વયે ગુરુ નિવૃત્તિનાથ પાસે ગયેલ. પહેલી જ વાર ગયા અને તેઓ ભરાઈ ગયા. તેમની અભિવ્યક્તિ કેવી મજાની હતી! : હું પ્રણામ કરવા ગયેલો. અને ઊઠ્યો ત્યારે આત્મબોધ વડે ભરાઈ ગયો હતો. ખાલી ઘડાને નદીમાં દુબાડીએ અને તે ભરાઈને આવે તેમ.

અભિવ્યક્તિનો માર્મિક ભાગ આ છે : નદીના પાણીથી ભરાવા માટે ઘડાએ ખાલી થવું જરૂરી છે.

■ ● ■

મનના ઘડાને ખાલી કોણ કરે?

સદ્ગુરુ કરે.

‘ધ જીરો એકસપીરિયન્સ’માં Amiyo Ruhnu એ લખેલી જેન કથા છે : સુઈબીએ ગુરુ ટાંકાને પૂછ્યું : બધા બુદ્ધોના પ્રશિક્ષક કોણ હતા ?

ટાંકા કહે : લૂછાણિયું લઈ ચિત્તને સાફ કર !

સુઈબીએ ત્રણ પગલાં પાછળ ભર્યા. ટાંકાએ કહ્યું : આ તો મોટી ભૂલ ! સુઈબીએ ત્રણ ડગ આગળ ભર્યા. ટાંકા કહે : આ પણ મોટી ભૂલ. સુઈબીએ પગ પર પગ મૂક્યો. (ભુરશીમાં બેસીને પગ પર પગ મૂકીએ એ રીતે...) ટાંકાએ કહ્યું : તમે બુદ્ધોના પ્રશિક્ષકને શોધી કાઢ્યો! (આગળ, પાછળ ચાલવાનું નહિ, માત્ર બેસવાનું એ માર્ગ થયો. પાછળ ડગલાં, મતલબ જ્લાનિ... સાધકને જ્લાનિ શાની ? આગળ ડગલાં, મતલબ સાધના કર્યાનો અહેંકાર... શો અર્થ અહેંકારનો ?

પગ પર પગ મૂકવાનો અર્થ હતો સ્વીકાર-સર્વ સ્વીકાર એ છે બુદ્ધોનો પ્રશિક્ષક... બુદ્ધોના બુદ્ધત્વનું મૂળ છે સર્વસ્વીકારની સાધના.)

અહીં ગુરુચેતનાએ બે કાર્યો કર્યા. ચિત્તને ખાલી કરવાનું કહ્યું. (માત્ર કહે તેમ જ નહિ, ચિત્તને ખાલી તેઓ કરી દે છે.) અને ભરવાનું પણ કર્યું.

ચિતની ર્લેટ કોરી બન્યા પછી તરત જ સદ્ગુરુ તેના પર જે મન્ત્ર લખે છે તે છે સર્વસ્વીકારનો મન્ત્ર.

ગુરુ તૈયાર છે આપણાને વિભાવોથી ખાલી કરવા. ગુરુ તૈયાર છે આપણાને સ્વભાવદશાથી પરિપૂર્ણ કરવા. પ્રશ્ન આટલો જ છે : આપણે કેટલા અંશે તૈયાર છીએ ?

જો કે, એમાં પણ એક સુવિધા છે. આપણે એ માટે તૈયાર ન હોઈએ, તો ગુરુ આપણાને એ માટે તૈયાર કરી દે છે.

ગુરુ શી રીતે તૈયાર કરે છે ?

સાધક ગુરુના ઉપનિષદ્દમાં જાય છે. તેમના ચહેરા પરથી વરસતા સ્મિતને, આનંદને જુએ છે અને એને સ્પષ્ટ રીતે પ્રતીતિ થાય છે કે પદાર્થો દ્વારા મળતું સુખ આ આનંદ પાસે કેવું તો તુચ્છ છે ! અને એથી, એને એ આનંદ મેળવવા મન થાય છે... અને વિભાવો પ્રત્યેની અનાસ્થા ઉપજે છે. વિભાવો પ્રત્યેની અનાસ્થા એ જ તો તૈયારી છે ને !

‘ધ જીરો એક્સપીરિયન્સ’માં આવેલી જેન કથા છે : સાધક શોસિન ગુરુ ડોગોને કહ્યું : તમે મને જેનના ગ્રન્થો શીખવ્યા નહિ. ડોગો કહે : કેમ ? તું ચા આપે છે ત્યારે એને હું સ્વીકારું છું ને ? તું ભોજન આપે છે ત્યારે તેનેય હું સ્વીકારું છું ને ! આ સ્વીકાર એ તો સાધના છે. તને જેન ગ્રન્થોનું હાઈ મેં શીખવી દીધું.

■ ● ■

સર્વસ્વીકાર ક્યારે જન્મે છે ? જ્યારે પ્રિયતા અને અપ્રિયતા ખતમ થઈ ગયા હોય છે ત્યારે. નહિતર, સામાન્યજન દ્વારામાં ભીંસાયા કરે છે. આ ગમે છે માટે સારું... તો રતિભાવ/રાગ. આ નથી ગમતું માટે ખરાબ... અને તો અરતિ/દેખ...

પ્રિયાપ્રિયતાને મિટાવવા શું કરી શકાય ? અહોભાવનો મતલબ અહીં થાય છે ખુંટીનું બદલાવું. અહેમ વિસ્તરેલું છે ત્યારે હુંની ખુંટી ખોડાયેલી છે. અને ત્યાં પ્રિયતા અને અપ્રિયતા બરોબર પડેલા છે. મને અનુકૂળ તે પ્રિય. મને પ્રતિકૂળ તે અપ્રિય.

અહોભાવમાં ખુંટી બદલાઈ. પરમાત્મા કેન્દ્રબિન્દુ છે. સદ્ગુરુ કેન્દ્રબિન્દુ છે. હવે પ્રિય શું રહેશે? પ્રભુને પ્રિય તે પોતાને પ્રિય. આવી ગયો સર્વસ્વીકાર!

એક પણ વ્યક્તિ પ્રભુચેતના દ્વારા અસ્વીકૃત નથી. તો પોતે એને અસ્વીકૃત કેમ કરી શકે ?

■ ● ■

અહોભાવને ધૂંટવો છે.

ઘારું ગાથા સૂત્ર ઉદ્ભવ અધ્યયનમાં છે.

જિણવયણે અણુરત્તા, જિણવયણં જે કરંતિ ભાવેણ ।

અમલી અસંકિલિદ્વા, તે હોંતિ પરીક્ષસંસારી ॥

ગાથાસૂત્રને એ રીતે અનુપ્રેક્ષીએ કે એક એક શબ્દનો હદ્યસ્પર્શ થયા કરે.

જિણવયણે અણુરત્તા.... સાધકો / ભક્તો છે અનુરક્ત પ્રભુના ઘારા ઘારા શબ્દોમાં.

અનુરક્તતાનો ઘ્યાલ આંખોમાંથી ચૂતાં અશ્રૂબિન્દુઓ કયારેક આપી જાય છે. સદ્ગુરુ કહેતા હોય કે મારા પ્રભુએ આ રીતે કહ્યું છે અને ભક્તની આંખોમાંથી અશ્રૂબિન્દુઓનો ચુવાક થતો હોય.

ઓહ ! મારા ભગવાને મારા માટે કહ્યું છે ! ‘પર્સનલી ફોર મી.’ આ વાત અહોભાવને તીવ્રતાથી ઉભારે છે. આટલા મોટા પ્રભુ... જગત્સાથ અને એ મને યાદ કરીને આ કહે...?

મહાસતી સુલસા પાસે આ જ ભાવધારા હતી ને ! મારા પ્રભુ મને યાદ કરીને 'ધર્મલાભ'ની પ્રસાદી પાઠવે. કેટલી હું બડભાગિની....! અને લાગલી જ આ ભાવધારા પ્રગટે : પ્રભુના આ ઋણમાંથી હું મુક્ત શી રીતે થઈશ ?

■ ■ ■

જિણવયણે અણુરત્તા... પ્રભુના વચ્ચનો પરનો અનુરાગ. બધાથી ચઢી જાય તેવો અનુરાગ. શાંદિલ્ય ઋષિ ભક્તિની વ્યાખ્યા કરતાં કહે છે : સા પરાડનુરક્તિરીશ્વરે. પ્રભુને વિષે શ્રેષ્ઠ અનુરાગ તે ભક્તિ. જિનવચ્ચનો પરના અનુરાગના મૂળમાં તો પ્રભુ પ્રત્યેનો અનુરાગ જ છે.

એક કલ્પના કરવાનું મન થાય : સમવસરણમાં આપણે ગયેલા. પ્રભુનું ભુવનવિમોહન રૂપ આપણી આંખોની સામે હતું, અને કાનો માટે હતા ઘારા, ઘારા પ્રભુના શબ્દો.

મુંજવણ મીઠી હતી : પ્રભુને નીરખવા કે સાંભળવા. એક સાથે બે કિયામાં ઊંડાણથી સરી ન શકાય. કંં તો પ્રભુને નીરખવાનું થાય, કંં તો પ્રભુને સાંભળવાનું થાય.

શું કરવું ?

એ વખતે આંખોનો વિજય થયો. પ્રભુને મન ભરીને નીરખવાનું થયું. ઘારા ઘારા શબ્દો પ્રભુના છૂટી ગયા. અત્યારે પ્રવચન કે વાચનામાં થાય છે એ છૂટેલા શબ્દોનું અનુસન્ધાન.

આંખો બંધ હોય. પ્રવચન સાંભળી રહ્યા હોઈએ અને એ વખતે સમવસરણીય ક્ષણોમાં રૂબવાનું થાય. મનનો પાંખાળો ઘોડો સમવસરણમાં પહોંચી જાય.

આમ પણ, પ્રવચનકાર મુનિ, બોલતી વખતે, એવા અહોભાવના લયમાં હોય છે કે એ પોતે તો હોતા જ નથી. પ્રભુ એમના કંઠેથી પ્રગટતા હોય એવો ભાવ, સાંભળતી વખતે, આપણને ધ્વનિત થાય.

હું પ્રવચન આપીને ઊભો થઉં ત્યારે મારી આંખો લગભગ ભીની રહેતી હોય છે. અને એ આંખોની ભીનાશ પ્રભુને કહેતી હોય છે કે પ્રભુ ! તારી પાસે તો અગણિત સાઉંડ સિસ્ટીમ્સ છે, છતાં તે મારી સાઉંડ સિસ્ટીમ વાપરી. મારે કંઠેથી તું પ્રગટ્યો. પ્રભુ ! તારો હું ખૂબ ખૂબ ઝાણી છું.

■ • ■

સમ્રાટ અકબરે એક વાર તાનસેનનું મળાનું સંગીત સાંભળ્યું. ડેલી ઉઠ્યા બાદશાહ.... એમણે કહ્યું : તાનસેન! અદ્ભુત.

તાનસેનની નમ્ર અભિવ્યક્તિ આ હતી : નામવર ! આપ મારા ગુરુ હરિદાસજીને એક વાર સાંભળો તો મારું સંગીત સાવ જ ફેંકી દેવા જેવું લાગશે.

બાદશાહે કહ્યું : તો એમને માનસહિત રાજસભામાં બોલાવીએ. અને એમનું સંગીત સાંભળીએ.

તાનસેન કહે છે : મહારાજ ! તેઓ ક્યાંય ગાવા માટે જતા નથી. કોઈના માટે પણ ગાતા નથી. યમુનાના કાંઠે આવેલી જૂંપડીમાં તેઓ રહે છે, અને માત્ર પ્રભુને રીજવવા માટે તેઓ ગાય છે.

સંગીતના અનુરાગથી દિલ્હીનો બાદશાહ તાનસેનની સાથે રથમાં બેસી યમુનાને કાંઠે આવે છે. રથમાંથી ઉત્તરી સંત હરિદાસજીની જૂંપડીની પાછળ બેઉ બેઠા.

દિલ્હીનો બાદશાહ રેતીમાં બેઠો. કલાક બે કલાક..ગહન ચુઘી. ત્રણેક કલાક પછી સંત હરિદાસજીએ ભજન શરૂ કર્યું. એક નાનકડું પદ. ત્રણ કલાક તેમણે ધૂંટ્યા કર્યું. અકબર બાદશાહ અત્યંત પ્રભાવિત થયા.

પાછળથી બાદશાહે તાનસેનને પૂછ્યું : તાનસેન ! તારા કંઠમાંથી આવું દિવ્ય સંગીત ન પ્રગટે ? તાનસેને નકારમાં માથું ધુણાવ્યું. એણે

કહ્યું : મહારાજ ! મારા ગુરુ પ્રભુ માટે જ ગાય છે, અને એથી પ્રભુની શક્તિ એમના કંઠમાં ઉઠરે છે.

■ ■ ■

જિણવયણે અણુરત્તા.... પ્રભુના ખારા ખારા શબ્દોમાં દૂબેલો છે ભક્ત. એક એક શબ્દ સાંભળતાં એ જૂમે છે : મારા ભગવાને કેવી અદ્ભુત વાત કહી છે !

પ્રભુના વચનોનો અનુરાગ પ્રભુ વચનોના અમલીકરણમાં ફેરવાય છે. ભક્તને કંઈ કરવું પડતું નથી. અનુરાગ જ અમલીકરણમાં ફેરવાઈ જાય છે.

ભક્ત ભક્તરૂપે જ ન રહે. કરવાનું ક્યાંથી રહેશે ?

મળાની પંક્તિ યાદ આવે : ‘શ્યામ શ્યામ રટત, રાધા શ્યામ ભર્દ, સબ સખિયન સે પૂછન લગી, રાધા કિધર ગઈ ?

શ્યામનું, કૃષ્ણનું રટણ કરતા રાધા પોતે જ શ્યામરૂપ બની ગઈ. હવે પૂછો કે રાધા ક્યાં ગઈ ? રાધા ક્યાં મળો ?

‘ન રહે બાંસ, ન બજે બંસુરી’ તે આનું નામ. ભક્ત જ ન રહ્યો. ભક્તનું કર્તૃત્વ ક્યાંથી રહેશે ?

■ ■ ■

પાતંજલ યોગસૂત્રનું એક ખારું સૂત્ર છે : તીવ્રસંવેગાનામાસનઃ । તીવ્ર અભીપ્સાવાળાઓ માટે યોગમાર્ગ, ભક્તિમાર્ગ એકદમ નજીક છે, સરળ છે.

રામકૃષ્ણ પરમહંસ પાસે એક જિજ્ઞાસુ આવેલ. કહે : પ્રભુનાં દર્શન કરાવો ! સંત એને લઈને તળાવને કાંઠે ગયા. એની બોચી પકડી તળાવમાં એને દુબાડ્યો. થોડી વારમાં ઓક્સિજન વિના એ તરફડવા લાગ્યો. સંતે એને બહાર કાઢીને સમજાવ્યું : આવો તરફડાટ પ્રભુ માટે હોવો જોઈએ.

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રભુનાં ઘારાં વચનો

આમ જુઓ તો એક જ ડગલામાં મિલન થઈ ગયું ને ! તરફડાટ
અને મિલન.

આ જ વાતને એક સંતે મજાના સન્દર્ભમાં કહ્યું : તુમ મિટો તો
મિલના હોય ! તમારું મિટવું, ઓગળી જવું, અને પ્રભુનું મળી જવું.

મહાસતી ચન્દના મિટી ગયાં. પ્રભુને પામી ગયાં. મહાસતી રેવતી
અને સુલસા અહંકાર વિહોણાં બન્યાં અને પ્રભુને પામી ગયાં.

■ ■ ■

અહંકારને ઝડપા માટે છે અનુરાગ. જિણવયણે અણુરત્તા. પ્રભુના
ઘારા ઘારા શબ્દો પરનો અનુરાગ. એવી તીવ્રતા એ અનુરાગમાં હોય
કે અહંકારનો છેદ ઉડી જ જાય.

અનુરાગની પાછળ શ્રદ્ધા છે, અને શ્રદ્ધા હોય ત્યારે મેધા હોય છે.
ન અહંકાર, ન બુદ્ધિ.

ગની દહીવાલાનો સરસ શેર છે :

શ્રદ્ધા લઈ ગઈ મને, ઠેઠ મંજિલ સુધી,
રસ્તો ભૂલી ગયો તો, દિશાઓ બદલાઈ ગઈ.

શ્રદ્ધાનો આ કેવો તો ચમત્કાર ! રસ્તો ભૂલી જવાણો તો દિશાઓ
ફરી ગઈ. અને મંજિલ આ સામે જ રહી !

શ્રીભાણદેવે તેમના એક પુસ્તકમાં સરસ પ્રસંગ લખ્યો છે. કાશીમાં
એક રેંકડી રસ્તા પર. ચાની રેંકડી. લોકો ચા પીવા આવે. રેંકડીવાળો ભક્ત
ચા પીવા આવનારને બાજુની એક રૂમમાં બેસાડી ચા પીવરાવે. કોઈને
ફટાફટ ઉભા ઉભા ચા પીવી હોય તોય વિનંતિ કરી તેને રૂમમાં મોકલે.

શા માટે ?

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રભુનાં ઘારાં વચનો

રહસ્ય સાંજે ખૂલતું. સાંજે તે ભક્ત રૂમભાં જતો. ભક્તોની ચરણ
રજને ભેગી કરી આંખે લગાવતો. શરીરે લગાવતો.

ભક્તોની ચરણરજ ક્યાંથી ? કેવી આ શ્રદ્ધા ! દિવ્ય શ્રદ્ધા !

■ • ■

જિનવચન પ્રત્યેનો અનુરાગ જિનવચનોના અમલીકરણમાં ફેરવાશે.

કો'ક સામાન્ય વ્યક્તિએ તમને ન ગમે તેવું કંઈક કહું. ગુસ્સો
આવું-આવું થઈ રહ્યો છે. અને એ જ વખતે પ્રભુના શબ્દો યાદ આવશે:
કોથ નથી કરવાનો.

અહીં તમે કોના શબ્દોને પ્રધાનતા આપશો ?

પ્રભુ પ્રત્યેનો અનુરાગ કેવો છે એનો સામાન્ય ઘ્યાલ અહીં આવી જાય.

અનુરાગ પ્રભુ જોડેનો એક દિવ્ય સંબંધ આપી શકે. પ્રભુને માતાના
સ્વરૂપમાં સ્થાપી બાળકરૂપે પોતે એની ભક્તિ કરી શકે. મજાનો સંબંધ
સ્થપાઈ જાય, અને મા-બાળકનો સંબંધ થઈ ગયો. પછી બધું જ માએ
કરવાનું. બાળકે કંઈ જ કરવાનું ન રહે.

રાજા ભોજ અને મહાકવિ કાલીદાસ ફરવા ગયેલા. ભૂલા પડ્યા.
એક નાનકડું ગામ. બે-પાંચ ઝૂપડા. એક ઝૂપડા પાસે ગયા. ઝૂપડાવાળો
કહે : તમે કોણ છો ?

ચતુર કાલીદાસે સરસ સંબંધ ઉપજાવી કાઢ્યો. એ કહે : અમારા
રથના પૈડાં બોરડીનાં છે અને તમારા ઘરના આંગણામાં બોરડીનું જાડ
છે. તેથી આપણા વચ્ચે બાદરાયણ સંબંધ થયો. કાલીદાસે આમ કહેલું:
યુષ્માકં બદરીતરુઃ, અસ્માકં બદરી રથઃ, તસ્માદ् આવયો: બાદરાયણ:
સમ્બન્ધઃ....

- પેલાએ મજાની આવ-ભગત કરી.

■ • ■

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રભુનાં ખારાં વચનો

પ્રભુ પ્રત્યેનો અનુરાગ.

પ્રભુના વચનો પ્રત્યેનો અનુરાગ.

વચનોનું ભીતર પ્રવેશવું.

અને તેના કારણો -

નિર્મળ હદ્યની પ્રાપ્તિ.

સંકલેશોનું છૂ થવું.

મુક્તિની દિશામાં સાધકનું પ્રયાણ.

કેવો મજાનો કમ !

લાગે કે આ પાંચ પગથિયાં ચડાય એટલે મોકાને આપણો હાથ
સ્પર્શી રહે !

■ ■ ■

મુક્તિની મજાની વ્યાખ્યા મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે
આપી :

‘કલેશો વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર,
જો વિશુદ્ધ મન-ઘર તમે આવ્યા, તો અમે નવનિધિ ઋષિ પાયા...’

મનમાં રાગ-દ્રેષ્ટાદિ કલેશોનું હોવું તે જ સંસાર. મનમાંથી તેમનું
ખરી જવું તે જ મુક્તિ.

મનમાંથી કલેશો ખરે ક્યારે ?

સરસ જવાબ છી :

પ્રભુ આવે ત્યારે !

કરી પ્રશ્ન થશે.

પ્રભુ ક્યારે મન ઘરમાં આવે ?

પ્રભુને આમંત્રણ આપો ને પ્રભુ પધારે.

પ્રભુના હસ્તાક્ષર ♦ પ્રભુનાં ઘારાં વચનો

એ વિધિની મજાની વાત પરમતારક શ્રી વાસુપૂર્જ્ય ભગવાનની સત્વનામાં મહોપાધ્યાય શ્રી યશોવિજ્ય મહારાજે કરી છે :

‘મન ઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર થોભા,
મન વૈકુંઠ અકુંઠિત ભગતે, જોગી ભાખે અનુભવ જુગતે...’

પ્રભુને આમંત્રણ આપ્યું. પ્રભુ મન ઘરમાં પધાર્યા. અને મનની આખી રોનક બદલાઈ ગઈ. ઝળાંહળાં થઈ ગયું મન.

અને એટલે, ભક્તને કહેવાનું મન થયું કે પ્રભુ ! તમે મારા મન ઘરની શોભા જોઈને ત્યાં જ રહેવાનું પસંદ કરશો.

પ્રશ્ન થાય: પ્રભુ તો મોક્ષમાં, વૈકુંઠમાં રહે.

જવાબ મસ્ત છે : ‘મન વૈકુંઠ અકુંઠિત ભગતે.’ અકુંઠિત ભક્તિથી મન જ વૈકુંઠ જેવું બની ગયું છે. હવે તો પ્રભુ ત્યાં જ રહે ને !

અકુંઠિત ભક્તિ. ભક્તિ માટેની ભક્તિ. બીજા કશા માટે નહિ.

ભક્તે તો ગાયું છે:

‘મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહસું સબળ પ્રતિબંધ લાગ્યો,
ચમક પાણાણ જિમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો.’

મુક્તિ કરતાંય પ્રભુ ! તારી ભક્તિ મને વધુ ગમે છે... લોહચુંબક
લોઢાને ખેંચે તેમ મુક્તિને તમારી ભક્તિ ખેંચશે.



પ.પૂ આચાર્ય ભગવંતશ્રી યશોવિજયસૂરિ મહારાજ દ્વારા લખાયેલ પુસ્તકો

- ‘દરિસન તરસીએ’..... ભા. ૧-૨.
(ભાગવતી સાધનાની સસૂત્ર વ્યાખ્યા)
- ‘બિષ્ણુરત જાયે પ્રાણ’.....
(મહાન સિદ્ધર્થ કૃત જિનસ્તવના પર સંવેદના)
- ‘સો હી ભાવ નિર્ગન્ય’.....
(સમાધિ શતક, કરી : ૧ થી ૩૦ ઉપર વિવેચના)
- આપ હી આપ બુઝાય’.... (દ્વિતીય આવૃત્તિ)
(સમાધિ શતક, કરી : ૩૧ થી ૫૧ ઉપર વિવેચના)
- ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે’.....
(ઉત્તરાધ્યયન સૂત્રના ૧૫મા સભિક્ષુ અધ્યયન ઉપર સંવેદના)
- ‘મેરે અવગુન ચિત્ત ન ધરો’..... (દ્વિતીય આવૃત્તિ)
(કુમારપાળ ભૂપાળ કૃત ‘આત્મનિન્દા દ્વાત્રિંશિકા’ પર સંવેદના)
- ‘અધ્યભ જિનેસર પ્રિતમ માહરો કે’.....
(શ્રી આનંદધનજી મહારાજની સ્તવનાઓ પર સંવેદના) [સ્તવન ૧-૫]
- પ્રભુનો પ્રારો સ્પર્શ
(પરમ પાવન શ્રી દશવૈકાલિક સૂત્ર (૧-૪) પરની વાચનાઓ.)
- આત્માનુભૂતિ
(યોગ પ્રદીપ, શાનસાર, આદિ ગ્રન્થો તથા પૂ. ચિદાનંદજી મહારાજનાં પદોમાં મળતાં સાધના સૂત્રો પર વિશ્લેષણ)
- અસ્તિત્વનું પરોટ
(હદ્યપ્રદીપ ષટ્ટાત્રિંશિકા પર સ્વાધ્યાય)
- અનુભૂતિનું આકાશ
(પૂ. દેવચન્દ્રજી મહારાજની અષ્ટપ્રવચન માતાની સજ્જાય પર અનુપ્રેક્ષા)
- રોમે રોમે પરમસ્પર્શ
(દેવાધિદેવ પ્રભુ મહાવીરની સાડા બાર વરસની લોકોકત્તર સાધનાની આન્તર કથા)

विद्युतिरामागतः यनितरपरांगं
प्रिवृणि समयं ॥३४॥ अकलेव
रंगलिष्ठस्त्रिया निदिग्रामलाक्ष
गच्छनि रंगमंविवद्धु वरं
समयं ॥३५॥ वृषभपरिनि । तु
उव रामगणनगर
दसंजण लनिमगंवद्धु ॥३६॥
ए समयं ग्राममापमाय ॥३७॥
दृ खबस्त्रियामासासित्र चक्रि
यमध्यपत्रवसादित्र रागदंसंवद्धि
यासिदिग्रामगणगो अमृतिविमि
उपतिश्चायद्वायायना ॥३८॥

